





જુલે વર્ણ

કાળ/વિવાહ/૮







સાગર સાગર

૭

જુલે વર્ણ

નિશ્ચિંતા કરીની પાછ આપના જીવન નિશ્ચિંતા

[એ વિદ્યા ઉત્ત પૂર્વનિ પ્રાણીદ્વારા એ વિદ્યા]

ને મણ દ્વારા વિદ્યા - તુલા માનદીદ્વારા

નિશ્ચિંતા

નિશ્ચિંતા

નિશ્ચિંતા

નિશ્ચિંતાદ્વારા જીવને હો

નિશ્ચિંતા

નિશ્ચિંતા હેઠ કાંઈ - નિશ્ચિંતા નિશ્ચિંતા

નિશ્ચિંતા

[નિશ્ચિંતા નિશ્ચિંતા નિશ્ચિંતા એ નિશ્ચિંતા]

[નિશ્ચિંતા એ નિશ્ચિંતા નિશ્ચિંતા] નિશ્ચિંતા નિશ્ચિંતા

[નિશ્ચિંતા નિશ્ચિંતા નિશ્ચિંતા] નિશ્ચિંતા નિશ્ચિંતા

[નિશ્ચિંતા એ નિશ્ચિંતા]

નિશ્ચિંતા

[નિશ્ચિંતા નિશ્ચિંતા નિશ્ચિંતા એ નિશ્ચિંતા]

નિશ્ચિંતા નિશ્ચિંતા

નિશ્ચિંતા

[નિશ્ચિંતા એ નિશ્ચિંતા એ નિશ્ચિંતા]

[નિશ્ચિંતા એ] નિશ્ચિંતા 'ન'

શ્રી મૂળશંકર ભણનાં પુસ્તકો

સાહસકથાએ

[અરધી સહી પહેલાં કલ્પેલી આ વૈજ્ઞાનિક વાતાં
આને તો સત્યસ્વદિમાં છતરેલી જેઈ શકાય છે.]

સાહસિકોની સૃષ્ટિ	મૂળ લેખક જુલે વર્ણ
સાગરસાટ	"
પાતાળપ્રવેશ	"
ચંદ્રલોકમાં	"
૮૦ દિવસમાં પૃથ્વીપ્રદક્ષિણા	"
ગગનરાજ	"
ખણનાની શોધમાં	રોખટ હુઈ સ્વીવન્સન

પ્રવાસકથાએ

[ક્ષિતિજની ઐવે પારતું લાણવાની જિજાસા ગ્રેરે તેવા]
મહાન મુસાફરો [ભારતના અને અન્ય દેશોના]
ધરતીને મથાળે [રશિયન પ્રવાસીઓની કથા]
નાનસેન [નોર્વેનો મહાન સાગરઘેડુ]

નાટક

[પ્રથમાત વિચારક ટોલ્સ્ટોયના નાટકતું ઇપાંતર]
અંધારાના સીમાડા

નવલકથા

[પ્રથમાત ડેન્ચ નવલકથાકાર વિકટર ડૂગેન્ટ]
લા' મિઝરેખલ [એ ભાગમાં]

સાગરસભા

બાબદેહની પ્રાચીન વિજ્ઞાન

૧૯૨૧

૧૯૨૮

મુળ લેખક

જુલે વન્દ



સંક્ષિપ્ત કરનાર

મૂળશંકર મો. લલ

અધ્યક્ષ : ડા.

અ-સ્ટ્રી. એ. પટેલ



આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિકેતા

મુખ્ય રૂ. ૪૦૦૦૦૨ : અમદાવાદ ૩૫૦૦૦૧

VERNE, Jules
SAGARSAMRAT, Adventures

R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1982
823

માર્ક રૂપ

① માર્કશિકના.

સુદ્રણો.

સાતમું : માર્ચ ૧૯૬૧

આઠમું : ફેબ્રુઆરી ૧૯૬૨

નવમું : જાન્યુઆરી ૧૯૬૪

દસમું : જુલાઈ ૧૯૭૮

અગિયારમું : જાન્યુઆરી ૧૯૮૨

પ્રતિ : ૧૧૫૦

મૂલ્ય રૂ. ૧૨-૫૦

માર્કશિક

લગતસાઈ લુરાલાલ શેડ, આર. આર. શેઠની કંપની
મુખ્ય ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧



સુદ્રક

નુગલદાસ સી. મહેતા, પ્રણીણ પ્રિન્ટરી

લગતવાડી, સૌનગઢ ૩૬૪૨૫૦

થાંચેક વર્ષો પહેલાં પ્રસિદ્ધ ફેન્ચ લેખક જુલે વર્ના
 'ચંદ્રની મુસાફરી'* નામની સંક્ષિપ્ત ચોપડા મેં વાંચી ત્યારથી
 જુલે વર્ણ ઉપર હું સુચંદ્ર થયો.

મારી છેલ્લી માંદળીમાં મને જુલે વર્ણ સાંભર્યો અને મેં તેનાં એ-ચાર પુસ્તકો સાંભળીને વાંચ્યાં. એકેએક પુસ્તક ઉપર હું આફ્રોન બનતો ગયો; એકેએક પુસ્તક મને અજેડ લાગ્યું. પણ એમાં યે ને ડાઈ પુસ્તક તરફ મારે પક્ષપાત કરવાનો હોય, મારે કુમ આપવાનો હોય તો હું પહેલી જગ્યાએ આ 'સાગરસાટ' ને ભૂકું.

આ પુસ્તક જુદે વર્ણની અદ્ભુત છતાં અત્યંત શાખીય કદ્વપનાનું સર્વોત્તમ ઇણ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ ‘નોટિલસ’ની કદ્વપના જુદે વર્ણે કરી. એ કદ્વપના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મુકાયેલી છે કે લોકોને કખૂલ ડર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જુદે વર્ણની પાતાલસ્પર્શી કદ્વપનાને અડણી છે.

તરંગ અને કદ્વપના બંને ભનેવિહારનાં જુદાં જુદાં સ્વરૂપો છે. તરંગને પાયો અધ્યર છે, શૃંખ્લમાં છે. પોકળતામાં છે, મગજની આવ્યવસ્થામાં છે. કદ્વપનાનો પાયો વાસ્તવિક્તામાં છે. ને માણુસ

* A Voyage to the Moon અને Around the Moon.

× Twenty Thousand Leagues Under the Sea.

જગતના સ્થળ અને સૂક્ષ્મ તરવેને તેના સત્ય સ્વરૂપમાં નેઈ શકતો નથી પણ તેને બદલે સ્વવાંચિત સ્વરૂપોને કહ્યે છે. તે તરંગની પાંજે ઊડીને પછડાય છે. જે માણુસ જગતનાં સ્થળ-સૂક્ષ્મ તરવેનાં આંતર રહસ્યોને અંતઃસ્કુરણુથી પામી શકે છે, તે માણુસને કલ્પના વરે છે અને તેને વરેલી કલ્પના તેને વર્ત્માનમાંથી ભવિષ્ય ભાગતો બનાવે છે. જુદે વર્ણ ખીંચ પ્રકારનો કલ્પન છે, ભનિષ્યવેતા છે, આર્થ દાખિલાળા છે.

સિદ્ધાંતનું સર્જન વાંચનારને આનંદદાયક છે, વૈજ્ઞાનિકને જિજાસા તમ કરનારું છે, શાખાને દિશાસૂચક છે, ડેળવણીકારને કલ્પનાનું—શુદ્ધ કલ્પનાનું સાહિત્ય આપનારું છે. કલ્પનાનાં પુસ્તકોમાં આ પુસ્તક અગ્રસ્થાને મિરાજનારું હોઈ જુવાન હુદ્દયને ઉત્સાહ આપનારું અને પ્રેરક છે. જુવાની નવલક્ષ્યાચ્ચા માગે છે. અખૂજ લોડા તરંગપ્રધાન વાતો જુવાનોને ખાણ ધરી તેમને તરંગી, અહિય, નિવાર્ય અને નિષ્ઠળ કરે છે. ડાઢા લોડા જુવાનોને એવી કૃથા-એની સેટ ધરે છે કે જે તેમની જીછળતી સાહસિક વૃત્તિને, તેમની સંશોધક વૃત્તિને પોષે છે અને તેમની પાસે એવા જ ઉત્સાહભર્યાં પરાફુમો કરાવવાને પ્રેરણું આપી તેમને જીબા કરે છે. જુદે વર્ણ ખીંચ પ્રકારના લેખક છે.

નવલક્ષ્યાચ્ચા મનરંજન કરે છે. માટે વાંચનારનું મન તે હરી શકે છે. જુવાનોને એટલા જ માટે નવલક્ષ્યાચ્ચા ઉપર બહુ પ્રેમ છે. માત્ર ઉપલબ્ધ રંગવાળા અને નિષ્ઠળ પુજલી ઉત્પન્ન કરનારી આવી નવલક્ષ્યાચ્ચા આપર જુવાનોના શાપને પામે છે; પણ જે નવલક્ષ્યાચ્ચા તેમને આદર્શ આપે છે, તેમની સામે જીવનના નવા માર્ગો, યુદ્ધનાં નવાં ક્ષેત્રો, કલ્પનાનાં નવાં ઉદ્ઘ્યનો ઉધાડાં કરે છે, તે નવલક્ષ્યાચ્ચાને જુવાનો અનન્ય પ્રેમથી પૂજે છે અને તેને તેમની ગ્રાણુપ્રેરક માને છે. જુદે વર્ણની એકેએક નવલક્ષ્યા જુવાન વાંચેકાનું અખૂટ પ્રેરણુથાળ છે, આદર્શદાત્રી છે.

ચોપડીનું અંગળ નામ 'દરિયા નીચે વીશ હજર લીગ' એવું છે. અંગળ નામ ચોપડીની વૈજ્ઞાનિક કિંમત સૂચયે છે. અને સાચે જ ચોપડી વૈજ્ઞાનિક દાખિયે મહામૂલ્ય છે. સહેલે જ ચોપડી વાંચતાં સાગરનું પેટ ડેટલું વિશાળ છે, તેમાં ડેટલી ડેટલી વિવિધ અને અદ્ભુત સામગ્રીઓ છે, પાણીની સપાઈ નીચે કુદરતની લીલા ડેવી અપૂર્વ અને ભલ્ય છે તેનો ઝ્યાલ આપણું આવે છે. પૃથ્વી ઉપરની નિસર્ગસૂચિનો મહિમા અદ્વિતીય છે, અને પૃથ્વી ઉપરની સૂચિ રચી ઇશ્વરે હાથ ધોઈ નાખ્યા છે. એમ કહેનારાઓને પૃથ્વીના પેટ ઉપર પથરાયેલ સાગરમાં આવેલું અપૂર્વ સૌદર્યસર્જન જેતાં અભિમાનને નીચું કરવું પડે અને કિરતાર વિષેના પોતે કરેલા દરિદ્ર ઝ્યાલ માટે શરમાવું પડે. આ દાખિ જુલે વર્ણની વાર્તાઓ આપણું આપે છે.

માછલીઓના અભ્યાસીઓને માટે કે સાગરમાં થતી વન્સપતિઓ, મોતી, વગેરે વગેરેના અભ્યાસીઓ માટે આ પુસ્તક પ્રમાણુંથી ન હોય; પરંતુ પ્રમાણુંથી ડેવા હોવા જેઈએ તેના ધોરણુંપ છે—વૈજ્ઞાનિક સમાચિનો ડેવી રીત અભ્યાસ કરવો જેઈએ તેનું દિશાસૂચક છે.

ચોપડીના અંગળ નામ કરતાં યે મને 'સાગરસમાટ' નામ વધારે ગમે છે. નોટિલસ અને તેનો કહાના નેમો બેમાં સાગરસમાટ ડાણું તે કહેવું મુશ્કેલીભર્યું છે; જ્તાં બન્ને સાગરસમાટ છે; અને બન્નેને આ ચોપડીનું નામ અર્પણું થઈ શકે છે. નોટિલસ ડેટલું ચુંદર અને ખુશનુમા કલ્પનાસ્વમ છે. કલ્પનાની નોટિલસ વાયકને હૂબૂહ પળેપળે જીવંત લાગે છે અને વાંચનાર નેમો, નેડ, એરોના અને ડોન્સીલની સાથે પોતે પણ પ્રવાસમાં હોય એમ તેને લાગે છે. સાચે જ જાગે કે આપણે નોટિલસમાં બેસીને દરિયામાં વિવિધ પાણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ, નેડ તેમ જ પ્રાઇસર એરોનાની વાતો સાંલળાએ છીએ, નેમોના અભ્યાસના ઓરડામાં બેઢા બેઢા ડેટલી યે શાખીય હક્કીકતોનો અભ્યાસ કરીએ

ધીએ, અને નોટિલસના તૂતક ઉપર બીલા બીલા દુરમનવહાળેને
ઝુયાં જેઠાં ધીએ, એવું વાંચતાં વાંચતાં સ્પષ્ટ લાગ્યા કરે
છે. નોટિલસનો બનાવનાર ડેપ્ટન નેમે અને નોટિલસ પોતે કલ્પ-
નાની સૃષ્ટિ હોય એવું વાંચતાં ભૂલી જવાય છે, અને નોટિલસ અને
નેમે સાથે આપણે સંબંધ બંધાઈ જય છે. મિત્ર જેમ સુખદુઃખમાં
આપણે તેની સાથે રહીએ ધીએ, અને અંતે પણ આપણે તેનાથી
શ્રદ્ધા પડતાં ખરા વિયોગનું દુઃખ લોગવીએ ધીએ. જુલે વર્નાની
કલમની શક્તિની આ વિરોધતા છે.

ડેપ્ટન નેમે ચીતરીને જુલે વર્ના કમાલ કરી છે. વહાણવરી, ઉત્તમ
વિદ્યાભ્યાસંગી, સંસ્કારી કલારસિક, ખુદ્દિશાળી ધજનેર, હિંમતવાન
અને દઢ બહારવટિયો, પ્રેમ શૌર્ય અને આર્દ્રતાથી ભરેલો દેશનુરાગી
ડેપ્ટન નેમે જુલે વર્નાની અપ્રતિમ કલ્પનાસૃષ્ટિ છે. હું ડેપ્ટન નેમે
ઉપર વારી જાડં છું : એટલો જ બહારુર અને છતાં એટલો જ ઉદાર,
એટલો જ નિઝૂર ને છતાં એટલો જ સુકોમાગ, એટલો જ જુદ્ધ
પ્રવાન અને એટલો જ કલાક્ષેવિદ, એટલો જ વૈજ્ઞાનિક અને છતાં
એટલો જ ધર્મકતા અંતઃકરણુવાળો સાદો સરળ મનુષ્ય !

વાંચનાર જળુવાનો નથી કે ડેપ્ટન નેમે કયા દેશનો અને ક્યા
કુળનો છે. જુલે વર્નાં તે હકીકત પાત્રાદેખનમાં કુશળતાથી આદેખ્યા
છે, અને શ્રીપી છતાં ચતુર વાચકને તે જરૂર તેવી છે. જુલે વર્ના દુનિ-
યાનાં મતુષ્યોથી વાકેદ હતો. દુનિયાના રાગદેષેનાં દુષ્ટ પરિણિમાથી
તે દુલાયેલો હતો. છળ, પ્રપંચ અને નાદારીથી પણ હિંમત નહિ હારે
તેવા, સહૈવ ઈશ્વર અને માતૃકુમિ ઉપર વિશ્વાસ રાખનાર પૃથ્વીના
પડતી ડાઈ પ્રજના પોતાના પુત્રને સામે રાખ્યા તેણું નેમાને ચીતરો
છે. જુલે વર્નાની ડાઈ ચોપડીમાંથી આ નેમે કચાંનો છે તે વાચક
શોધી કાઢશો.

આ ડેપ્ટન નેમે દુનિયાના સાહસિક વીરોનો આદર્શ થાઓ.
અસાધારણું મુશ્કેલીમાંથી પણ પસાર થવાની તેમનામાં તે ખુદ્ધિ સુઆડો,

દુષ્મનને પણ ઉદ્ધરતાથી સમજવાની તેમનામાં શક્તિ આપો, અને કહી પણ હિંમત હાર્યા વિના આદર્શને ટેક્થી વળગી રહેવાની દફ્તા આપો. ડેપ્ટન નેમોનું ચરિત્ર દુનિયાના સૌ વિરોને ઉદ્ધાર એવું, આદર્શ માટે દુઃખી જીવન પણ ટકાવી રાખવાની અને ભરતાં ભરતાં પણ અચલ શ્રદ્ધાયુક્ત રહેવાની દીક્ષા આપે છે.

ડેપ્ટન નેમોના મૃત્યુ વખતના ઉદ્ગારામાંથી તેનો આપો આત્મા પ્રગટ થાય છે. તે જણુવવા માટે ભાઈ મૂળશંકરે જુલે વર્નનાં ખીણાં પુસ્તકોનું ભાષાંતર કરવું પડશે. ભાઈ મૂળશંકરને આ પુસ્તક ગુજરાતીમાં ઉતારવા માટે અભિનંદન ધરે છે. અંગ્રેજ ચોપડી વાંચતાં જે પ્રસંગતાનો અનુભવ થાય છે તે પ્રસંગતાનો ભાઈ મૂળશંકરને સારો અભ્યાસ જણ્યાય છે. તેના હાથમાં ગુજરાતી લાખા સરલતાથી વહેતી હેખાય છે અને ગુજરાતીમાં પણ તે જુલે વર્નની કલ્પનાસૃષ્ટિ તાદ્શ કરવામાં પાછી પડતી નથી. આથી જ ગુજરાત ભાઈ મૂળશંકર પાસે આવાં વધારે પુસ્તકો માગવાને હજુદાર થશે અને મૂળશંકરે તેનો જવાબ આપવો જેઈશે.

ભાઈ મૂળશંકર શ્રીદક્ષિણામૂર્તિના માત્ર ગૃહપતિ છે માટે સાહિત્ય-કલા તેની કલમ ઉપર આવીને બેગી નથી. પણ ભાઈ મૂળશંકર તો કલાધર છે; તે સુંદર સંગીતજ્ઞ છે. ને આંગળાઓથી તે સિતારના તાર ઉપર સંગીત રેલાવે છે, એ જ આંગળાઓથી ચોપડીનાં પાનાં ઉપર તેણે સાહિત્યને વધારે ને વધારે કેમ ન રેલાવવું? એક એક કલા એક એક પુદાઈ બ્યક્ષિશ છે. મૂળશંકરમાં એ કલાનો સુમેળ ખુદાની મહેરબાની છે. એ મહેરબાની તેના ઉપર કાયમ રહેલા, અને શ્રીદક્ષિણામૂર્તિ તે દારા સાહિત્ય અને કલાની વધારે અને વધારે સેવા કરવા શક્તિમાન થાયો.

અમારા શત્રાદ્યમાં રાત્રે પ્રાર્થના ને હાજરી પૂરી થયા પછી
લગભગ રોજ વિદ્યાર્થીઓ ‘વાર્તા! વાર્તા!’ છુણીને ગૃહપતિઓને
બારે પણ્યે છે. રોજ વાર્તા કચાંથી કાઢવી? કદાચ એકાદ વાર્તા
કચાંદીકથી વાંચી કાઢીને તૈયાર થઈને કહેવા માંડાયે ત્યાં તો વિદ્યાર્થી
ઓ આવી જાતે : ‘એ તો સાંભળ્યો છે, એ તો સાંભળ્યો છે; બીજુ કહે.’
ગૃહપતિઓના કરતાં વિદ્યાર્થીઓએ વધારે વાર્તાઓ વાંચી છે એનું
મને લાન થવા માંડયું, અને વિદ્યાર્થીઓથી યુસ એવો ડોછ ખજનો
હું શોધવા માંડયો. અચાનક જુલે વર્ન જ મારી સામે આવીને
ઓબો. જેમ જેમ હું તેની ચોપડીઓ વાંચ્યેતો ગયો, તેમ તેમ હું જ
વાર્તા કહેનારને બદલે વાર્તા સાંભળનાર બની ગયો, જીબે જુલે વર્નનાં
પાત્રા પોતાની વાતો સંભળાવતાં અને હું તેમાં તલ્લીન બની
જતો. હવે મને વિદ્યાર્થીઓને શું કહેવું તેની સુશકેવી નહોતી; પણ
મેં વાંચેલી વાર્તા હું તેમને કચારે કહું તેની મને અધીરાઈ થતી;
વિદ્યાર્થીઓ પણ જેમ જેમ એ વાતાઓ સાંભગતા ગયા તેમ તેમ
‘પછી એનું શું થયું?’ ‘પછી એનું શું થશે?’ વજેરે સવાલો
રોજ મને પછવા લાગ્યા.

જુલે વર્ણ હૈન્ચ છતાં દુનિયા આપીના કિશોરોનો—વિદ્યાર્થીઓનો મિત્ર છે, બધાને તેની વાર્તા ગમે છે. જુલે વર્ણની વાર્તાએ માંથી

આ એક ગુજરાતીમાં ઉતારેલી વાર્તા છે. જુલે વર્નના મૂળ પુસ્તકનું આ શંદરઃ સંધાંતર નથી; એમાંથી મેં ધણું ધણું છોડી દીધું છે. માછબાંનું શાખ, નનસ્પતિતું શાખ વગેરેની માહિતી મેં લગભગ સાવ છોડી દીધી છે; ભૂગોળની પણ અમુક માહિતીઓ મૂકી દીધી છે. આવી જતની વાર્તાએનો જ રસ હજુ આપણે ત્યાં ડેળવાયેલ નથી ત્યાં આવાં નહીન શાશ્વોની માહિતીનો રસ જિમો કરવાનો પ્રયત્ન કરવો એ વધારે પડતું લાગવાથી જ એ ભાગો છોડી દીવા છે. બાકી એ વિષયોની ઉપયોગિતા ઓછી છે એમ નથી. વાર્તાની અંદરના સંવાદોમાં અને વાત મુકવાની રીતમાં પણ મૂળ પુસ્તક જેણે વાંચ્યું હશે તેને ખૂબ ફેરફાર દેખાશે. પણ જુલે વર્નને અન્યાય ન થાય એવું કરવાનો મેં પ્રયત્ન કર્યો છે, એમ મારે કહેવું બીજીએ.

મારા મુરઘ્યી મિત્રો શ્રી ગોપાળભાઈ વગેરેએ મને જો ઉત્સાહ ન આપ્યો હેઠત તો આ વાર્તા અમારા છાત્રાલયના વિદ્યાર્થીઓની બંડાર નીકળત ડે ડેમ તે શંકા છે.

મારા કિશોરમિત્રો આ વાર્તા વાંચીને રાત્રે તેનાં સ્વર્પાં સેવશે તો ય મને કૃતાર્થતા લાગશે. સ્વર્પાં હશે તો સિદ્ધિ ડેઈઝ કાળે ય થશે.

શાદક્ષિણામૂર્તિ ગૃહ

૩૧-૧૦-'૩૩

મુળશંકર મોહનદાલ લઙ્ડ

કુમણું રજુ હોવેલું હી જીવ નાર્કાટ જન્મિત્રાણ એવું જીવ
 જી હું હિંદુ હું હિંદુ નિઃસ્વાર્પ હું હિંદુ જાતીય જીવનાં જીવ
 જીવનાં નિઃસ્વાર્પ હું હિંદુ જીવ હું હિંદુ જીવનાં જીવનાં
 જીવ હું હિંદુ જીવનાં જીવ હું હિંદુ જીવ હું હિંદુ જીવ
 વિચિત્ર જગથર ૧ / જુઓ હેખા...યા ૫ / જીવ હું હિંદુ જીવ
 હું હિંદુ ૬ / કેદ પકડાયા ૧૪ / સાયમરીન ૧૬ / જીવ હું હિંદુ
 ભૂખના માર્યા ૨૩ / કેપ્ટન નેમો ૨૬ / જીવ હું ૧૯૯૪ હું હિંદુ
 નોટિલસ ૩૧ / શિકારનું આમંત્રણુ ૩૮ / જીવ હું હિંદુ જીવ
 મહાસાગરને તળિયે ૪૪ / લેખદે ભરાયા ૫૧ / જીવ હું હિંદુ જીવ
 નેમોનું જવું ૫૭ ૫૬ / કારસ્તાનમાં ૬૫ / જીવ હું હિંદુ જીવ
 સાચાં મોતી ૭૧ / સુઅેજની છૂપી નહેર ૭૭ / જીવ હું હિંદુ જીવ
 ભૂમધ્ય સમુદ્રમાં ૮૪ / દૂધી ગયેલા હેશની ૮૦૦૯૯ જીવ
 શાધ ૮૦ / જ્વાળામુખીના ગલભાં ૮૮ / જીવ હું હિંદુ જીવ
 નેડની અકળામણુ ૧૦૩ / બરઝની દીવાલ ૧૦૮ / જીવ હું હિંદુ જીવ
 દક્ષિણ ધ્રુવ ઉપર ૧૧૭ / બરઝમાં પુરાયા ૧૨૧ / જીવનીકી ૧૨૫
 છટચા ૧૨૬ / નેમોની આંખે આંસુ ૧૩૩ / જીવ હું હિંદુ જીવ
 રણ નહિ મળી શકે ૧૩૮ / નેમોનું રૌદ્ર જીવ હું હિંદુ જીવ
 સ્વરૂપ ૧૪૪ / વમળમાં ૧૫૦ / છેવટ ૧૫૮

એક વિચિત્ર જગયર

૧૮૬૬ની સાલમાં એક અવેં બનાવ બન્યો કે જેના સમાચારથી અમેરિકા અને યુરોપની દરિયાકાંડા ઉપર રહેતી વસ્તીમાં ભારે ખળખળાઈ ભયી ગયો. અમાંયે મોટા મોટા દરિયાના વેપારીઓ અને ખલાસીઓ તો ગલરાઈ ભઠક્યા હતા. વહાણુના કેપ્ટને પણ આ બનાવને લીધે પોતાની સ્થીમરો ઉપાડતાં ઝણુ વિચારમાં પડી જતા. અને આને પરિણામે મોટાં મોટાં રાજ્યો ઉપર પણ તેની ભારે અસર થઈ.

રાતદિવસ દુર્નિયા ઉપરના ગમે તે લાગમાં નિર્ભયપણે પોતાનાં વહાણે હાંકનારા ખલાસીએ એક એવી વાત લાવ્યા કે દરિયામાં એક ભારે ચ્યામટકારિક વસ્તુ દૈખાય છે. અત્યાર સુધીમાં આવું વિચિત્ર પ્રાણી દીકામાં કે સાંભળવામાં કદી આવ્યું નથી.

જુદાં જુદાં છાપાંઓમાં આ સંબંધી જતાજતના ખથરો છપાવા માંડયા. બધા ઉપરથી એટલી વાત તો સાચી લાગતી હતી કે દરિયામાં વિચિત્ર જતનું જળાયર જુદીજુદી જગ્યાએ હેખા હે છે. એને આકાર શાળના કાંઠલાના ધારનો છે; એની લંબાઈ લગભગ અઢીસોથી ત્રણુસે. ફૂટની છે; એની અંદરથી ડોઈ ડોઈ વાર વીજળાના જેવે પ્રકાશ નીકળે છે, અને તે ખૂબ ઝડપથી તરે છે.

આ વાત છાપાંઓમાં આવી એટલે દરેક દેશના મોટાં મોટાં ભેણવાળાઓ આ શું હશે તેની અટકળો બાંધવા લાગ્યા. આવી જતનું પ્રાણી હજુ ખુલ્હી ડેઢિએ જેથું હોય એમ જણુમાં ન હતું. પ્રાણીશાસ્ત્ર ઉપરનાં બધાં પુસ્તકો ખૂંધી વલ્યા છતાં કચાંયે આવા. પ્રાણીનો પતો ન મળ્યો.

આ ખાદ્યર પહેલવહેલા ખાદ્યર આંધ્યા ત્યારથી છાપાંઓની કમાળી

વધી પડી; નવરા લોકોને વાત કરવાનું સાધન મળ્યું; પ્રાણીશાસ્ત્રીઓને ભગજ કસવાનું કામ મળ્યું; અને માછલીના શિકારીઓના હાથમાં ચળ આવવા લાગી. ગામડિયાઓ આને હૈવી ચમત્કાર માનવા લાગ્યા પણ જેમ બધી વાતનું બને છે તેમ આ વાત પણ ચાર-પાંચ મહિને વિસારે પડી. પેલું પ્રાણી પણ હેખાતું બંધ થઈ ગયું હતું.

પણ છેદેક મહિના પછી વળી એ પ્રાણીની વાત એકાએક ઝીરી વખત બહાર આવી. બન્યું એમ કે ૧૮૬૭ની પાંચમી માર્ચ 'મારોવીઅન' નામનું એક મોટું જહાજ દરિયામાં ફરતું ફરતું એક ખડક સાથે અથડાયું. સ્ટીમરનો કોપ્ટન આ જગ્યાએથી ધણી વાર પસાર થઈ ગયો હતો; ત્યાં આગળ ખડક કે એવું કાંઈ હોય તેમ ડોઈપણું નકશામાં નોંધાયું ન હતું. ત્યારે આમ કેમ થયું? વહેલા મળસક્કામાં વહાણુને આ અકસ્માત નહોયો. વહાણુનો કોપ્ટન તરત જ પેતાની કેબિનમાંથી બહાર આવીને તુતક ઉપરથી જોવા લાગ્યો તો તેની નજરે ત્રણોક ફર્લાંગને અંતરે ખૂબ જોરથી ઉણાણ મારતું એક પ્રાણી હેખાયું. વધારે કશું જોઈ શકાયું નહિ. વહાણું જો ખૂબ મજબૂત ન હોત તો ત્યાં ને ત્યાં જ તે તળિયે બેસી ગયું હોત!

આ બનાવ પણ કદાચ લોકો ભૂલી જત, પણ ત્યાં તો ત્યાર પછી ત્રણ અડવાડિયે જ એક બીજે બનાવ બન્યો. 'સ્કોટીઓ' નામની એક સ્ટીમર બિચારી આટલાંટિક મહાસાગર ઉપર રમતી રમતી જતી હતી, તેવામાં એકાએક આખી સ્ટીમરને ધક્કો લાગ્યો. સ્ટીમરના બધા માણુસો જમતાહતા, તેમનાં ભાણુંઓ ટેબલ ઉપરથી નીચે પડી ગયાં અને થાડી જ વારમાં 'સ્ટીમર રૂએ છે, રૂએ છે!' એવી ખૂમ નીચેના ઓરડામાંથી આવી. બધાના હોશકોશ જીડી ગયા. કોપ્ટન ખૂબ કુશળ હતો, સ્ટીમરની નીચે એક કાણું પડી ગયું હતું; તે કાણુંમાંથી દરિયાનું પાણી ઘોધમાર કરતું સ્ટીમરના તે ઓરડામાં આવતું હતું. કોપ્ટને તે પાણી આગળ ન વધે તે માટે ખૂબ ચાંપતા ઉપાયો લીધા અને સ્ટીમરને માંડમાંડ બારા લેગી કરી. સ્ટીમરને

બારામાં લાણી બધાએ પેલું કાણું તપાસું. જાળે ડોઈ મોટી ગોળ શારડીથી માપોને કાણું પાડ્યું હોય એવું તે દેખાતું હતું. લગભગ ત્રણ કૂટના વેરાવાવાળું તે કાણું હતું.

આ બનાવ જ્યારે છાપાંઓમાં આવ્યો ત્યારે બધે ગભરાટ ફેલાઈ ગયો. હવે તો આ પ્રાણીને શોધી કાઢવું એટલું જ નહિ, પણ ડોઈ પણ રીતે પૂરું કરવું એમ બધાને લાગવા માંડ્યું. મોટાં મોટાં રાજ્યોને પણ આ જોખમ સમજવા લાગ્યું. આ પ્રાણીને કઈ રીતે પહોંચી વળવું તે માટે ચોજનાએ પણ ઘડાવા લાગી. પણ આ ખીંડું કાણું જરૂરે?

આ બધી હોહા જ્યારે ચાલતી હતી ત્યારે હું અમેરિકામાં હતો. પ્રાણીશાખનો અભ્યાસ કરવા માટે હું નેથાસ્કાના પ્રદેશમાં ખૂબ ફરીને ત્યાંથી પછી ન્યૂયોર્કમાં આવ્યો હતો. અહીંથી હું ભારત વતન ફ્રાન્સમાં જવા માટેની તૈયારી કર્યો હતો. વિજાનશાખી તરીકે હું ફ્રાન્સમાં જ નહિ પણ અમેરિકામાં સુધ્યાં ડીક ડીક જાણીતો હતો. હું ન્યૂયોર્કમાં શું એમ છાપાંવાળાઓને ખબર પડી એટલે મારે ત્યાં ખબરપત્રીઓનું ક્રાઇટારું જિલ્સાયું. આ રાક્ષસી માયા સંબંધેની વાતો હું ખૂબ રસ્થી સંબળતો હતો અને વાંચતો પણ હતો. મને પણ એ શું હશે તે પ્રશ્નનો નિકાલ મળ્યો ન હતો. તો પણ મેં એમ જાહેર કર્યું કે ' દરિયામાં દેખાતી આ વસ્તુ કાં તો ડોઈ નવીન જતનું ભયંકર દરિયાઈ પ્રાણી હોય, અથવા તો દરિયાની અંદર ચાલે તેવું વહાણ હોય. પણ આવી જતનું વહાણ દુનિયા ઉપરના ડોઈ પણ રાજ્યમાં કે ખાનગી કારખાનામાં તૈયાર થયું હોય તો તે ખાંડાર પડ્યા વગર રહે જ નહિ; તેમ એવી જતનું વહાણ ડોઈના લેજમાંથી પણ હજુ સુધી નીકળ્યું નહોતું. એટલે એ વસ્તુ ડોઈ ભયંકર દરિયાઈ પ્રાણી જ હોઈ શકે. દરિયાની અંદર ' નારવહેલ ' નામની માછલી અથવા સુધીમાં સૌથી મોટામાં મોટી માછલી તરીકે જાણીતી છે. આ માછલીને તલવારની ધાર જેવી સૂંદ હોય છે, અને તેનાથી તે મોટી મોટી વહેલ માછલીઓને ચીરી નાખે છે. આના ઉપરથી એવું અનુમાન બાંધી

શક્તિ કે એ માછલીથી દસગળું વધારે શક્તિવાળા માછલી દરિયામાં હોઈ શકે. આવી માછલીએ આખી દુનિયાના સમુદ્ર ઉપર કદાચ બહુ જ થાડી સંઘયામાં હોય; પણ ન જ હોઈ શકે એમ માનવાનો કાંઈ કારણ નથી.''

મારા આ ખુલાસો જ્યારે ભાપાંઓમાં પ્રસિદ્ધ થયો ત્યારે વળા લોકામાં હોઢા મચી ગઈ. હવે તો એમ નક્કી જ થયું કે આ કોઈ રાક્ષસી પ્રાણી છે, અને તેને કોઈ પણ રીતે શોધી કાઢીને મારવું એ એક મોટામાં મેટું પરોપકારતું કામ છે.

ખીને દિવસે ભાપાંઓમાં ખખર આવ્યા કે અમેરિકાની સરકારે ચોવીસ કલાકમાં જ 'અખાહમ લિંકન' નામની સ્ટીમરના કેટનને તે પ્રાણીની શોધમાં નીકળવા માટે તૈયાર થવાની તાકીદ આપી છે. તે સાથે રાજ્ય તરફથી તે પ્રાણીના શિકાર માટે તૈયાર થયેલા માણુસને પણ સ્ટીમરમાં જિપડવા માટે કહેવામાં આવ્યું છે.

સ્ટીમર જિપડવાને ત્રણ કલાકની વાર હતી. હું મારા ઓરડામાં બેડો બેડો વાંચ્યતો હતો, ત્યાં તો મારા નેકરે મારા હાથમાં એક ચિહ્ની મૂકી. અંદર લખ્યું હતું :

"મહેરથાન સાહેબ !

અમેરિકાના સંયુક્ત રાજ્ય તરફથી જિપડનારી 'અખાહમ લિંકન' સ્ટીમરના આ બહુ જ અગત્યના પ્રવાસમાં સાથે જવા માટે આપને હું વિનંતી કરું છું. અને એ રીતે આખી દુનિયા પર આકાશઃપ ગણ્યાય એવા આ લયંકર પ્રાણીનો નાશ કરવામાં ફાન્સના પ્રતિનિધિ તરીકે આપ સહકાર આપશો. એવી આશા રાખું છું. આપ ના નહિ પાડો એમ માનીને આપને માટે સ્ટીમરમાં ડેઝિન પણ તૈયાર રખાવી છે. લિ. આપનો વિશ્વાસુ, કે. બી. હોઠસન દરિયાખાતાના મંત્રી

જુએં હેણ !

આ આમંત્રણ સીકારવું કે નહિ તેનો વિચાર કરવાનો પણ મારે માટે અહુ થાડા વખત હતો. એ જ ક્ષણમાં મેં વિચાર કરી લીધો. એ લયંકર પ્રાણીને નજરોનજર જોગાની તક ઘેરખેડાં મળે છે તો જતી શા માટે કરવી ? જપદવાનો મેં નિશ્ચય કરી લીધો અને ધંટડી મારીને મેં મારા નોકરને બોલાવ્યો. મારો નોકર ડાન્સીલ અહુ જ વિચિત્ર હતો; પણ મને તની વિચિત્રતા એવી ગમતી હતી કે મેં તેને મારો મિત્ર જ અત્યાર્થી હતો. અને ખરેખર, તે મારા મિત્ર કરતાં પણ વધારે હતો. મારી લાંબી અને કંટાળાભરેલી સુસાઝીમાં મને વડીલ જેમ એક ભાગકને સાચવે તેમ તે સાચવતો; જે કે ઉંમરમાં તે મારાથી નાનો હતો. મારો કાઈ પણ વિચિત્ર હુકમ સાંભળીને તે જરાય કરવું મોઢું કરતો નહિ તેમ નવાઈ પણ પામતો નહિ. મારી સાથેના સહવાસથી તે થાડુંધણું પ્રાણીશાખ જણુતો થઈ ગયો હતો. પણ તેને એક ભારે કુટેવ હતી. મારી સાથે વાત કરતી વખતે તે મને ‘આપ’ કહીને બોલાવતો; ‘તમે’ કહીને ડાઈ દ્વિક્ષ ન બેલાવતો. મેં તેને ધણુંધણું સમજાવ્યો પણ તની એ ટેવ ગઈ જ નહિ.

ડાન્સીલને તાખડોખ સુસાઝીનો સામાન તૈયાર કરવાનું કહી શિથું. કચાં જવાનું છે, શું કરવાનું છે, વગેરે કશું પૂછચા સિવાય ‘નેવો આપનો હુકમ.’ એમ કહીને તે સામાન બાંધવા મંડી પડ્યો. મેં મારી સાથેના વધારાના સામાનને હોટેલના મેનેજર મારફત ફાન્સ મોકલાવી હેવાની વ્યવસ્થા કરી દીધી.

થાડી વારનાં બધી તૈયારી થઈ ચૂકી. હોટેલ પાસેથી પસાર થતી

એક ગાડીને જિભી રાખી અમે બંને તેમાં સામાન સહિત ચડી એઠાં ગાડી બંદર તરફે પૂરપાટ જિપડી.

અમે બંદરે પહોંચ્યાત્યાં અથાહમ લિંકન પોતાનું લંગર ઉપાડીને જિપડવાનીતૈયારી જ કરતી હતી. લોડેનું મોડું ટોળું ત્યાં જીલું હતું. તેની વચ્ચેથી માંડમાંડ જગ્યા કરીને અમે સ્ટીમર આગળ પિહોંચ્યા. મારા આવવાની અભર પડતાં જ સ્ટીમરનો કેપ્ટન કેન્ઝિનમાંથી બહાર આવીને મને લેવા સામેના આવ્યો, અને થોડી વારમાં જ અમે બંને મિત્રો ખણી ગયા. ડાન્સીલે મારો સામાન મારા માટેની ઓરડીમાં ગોઠની દીધેા.

સ્ટીમર જિપડી. ત્યાં જીલેલા લોડેના ટોળાએ મોટેથી સ્ટીમરની અને અમેરિકાના રાજ્યની જ્ય બોલાવી. સ્ટીમર ઉપર ઉદ્તારાના ચિહ્નવાળો મોટો વાવટો ફરકવા લાગ્યો. સ્ટીમર ઉપરના ખલાસીઓ તથા અમે બધા કેટલીય વાર સુધી લોડેના ટોળા તરફ જેઈ રહ્યા. ફરી વાર આ બધું જેઈશું કે નહિ તેની શંકા સહુના મનમાં હતી. સ્ટીમરના પેટમાં મશીનનો લયંકર ધરધરાટ ચાલુ થઈ ગયો, અને સ્ટીમર ધીમે ધીમે બારામાંથી આગળ વધવા લાગી. જેમ જેમ સ્ટીમર આગળ વધતી ગઈ તેમ તેમ તેની ઊપર પણ વધવા લાગી; જેતનેતામાં અમેરિકાનો કિનારો હેખાતો બંધ થવા લાગ્યો. અને આટલાંટિક મહાસાગરનાં કાળાં પાણી અમારી સ્ટીમરને ઘેરી વળ્યાં. આથાહમ લિંકન ઉપર ચાળાસથી પચાસ માણુસો હતા; તેમાંના મોટો લાગ તો સ્ટીમરના ખલાસીઓ તથા ઓંજિનિયરોનો હતો. પણ આ બધાથી જુદો તરી આવે એવો એક માણુસ અમારી સાથે હતો. તેનું નામ નેડલેન્ડ. અમેરિકામાં હેલ માછલીઓના શિકારીઓનો તે 'રાજ' ગણ્યાતો. અમેરિકાના રાજ્યે આ પ્રસંગને માટે જ કેનેડાથી ખાસ આમંત્રય આપીને તેને બોલાવ્યો હતો; અને નેડલેન્ડ પણ શિકાર કરવાનો આવે અવસર જવા હેએવો ન હતો. સ્ટીમરના કેપ્ટન મારફત તેની સાથે ઓળખાણ થઈ ન જોતનેતામાં અમે મિત્રો ખણી ગયા. નેડલેન્ડનું શરીર જેઈને મને તેની ઈર્ષા આવી. પૂરા છ કૂટની

તેની જાંચાઈ હતી. તેનું સનાયુઅદ્ધ શરીર, મોટી તેજસ્વી આંખો અને જપસેલાં હાડકાંવાળાં જડાં જેઠને બિચારી ઠહેલ માછલી પણ ડરી જથું એવું હતું! અમે આજો દિવસ કેટની કેબિનમાં બેઠાં બેઠાં દરિયાની જ વાતો કર્યા કરતા હતા. નેડલેન્ડ પોતાના શિકારનાં સાહસોની વાતો જ્યારે લડાવીને કહેતો હતો ત્યારે અમારાં રોમાંચ પણ ખડાં થતાં. અને સાચેસાચ ઠહેલ માછલી અમારી સામે આવીને જીભી હોય એમ લાગતું. નેડલેન્ડ ઉપરની મારી શ્રદ્ધા ધીમે ધીમે વધતી ગઈ.

પણ નેડલેન્ડમાં એક ભારે કુટેવ હતી. વાતવાતમાં તે બહુ તરી જતો અને વાતવાતમાં શાંત પણ થઈ જતો. તે એમ માનતો કે દુનિયામાં ઠહેલથી મોટી માછલી થઈ નથી, અને થશે જ નહિ! પણ એક વાર મારી અને તેની વચ્ચે આ બાબતમાં ખૂબ ચર્ચા થઈ. મેં તેને એક પછી એક દલીલોથી મહુત કરવા માંડ્યો. તેની પાસે સામે દલીલ નહોતી, પણ તે માત્ર ના જ પાડચા કરતો. તે એમ જ કહેતો કે આવી મોટી સ્ટીમરને ગાંધું પાડી હે એટલું બળ માછલીમાં હોય જ નહિ. મેં તેને સમજાવ્યો કે 'ને પ્રાણી દરિયાની નીચે હુઠ તળિયા સુધી એટલે લગભગ ૩૦,૦૦૦ કૂટ જાઉં' જઈ શકે તે પ્રાણીની ચામડી લગભગ ૮ કરોડ રતલ વજન અમ્ભી શકે તેટલી મજબૂત હોય, તો જ તે જીવી શકે, ને પ્રાણી આટલું વજન આલી શકે તે પ્રાણી એક સ્ટીમરને ઉડાડી હે એમાં નવાઈ શી છે?' આ દલીલથી તે મુંગો થઈ ગયો, પણ પોતે કખૂલ થયો છે એમ તેણે ન કહ્યું અને પછી તા મેં તેને વધારે ચીડવું છોડી દીધું.

સ્ટીમર જપાટાણ્ય આગળ ચાલી જતી હતી. ત્રીજે દિવસે કેટને એમ જહેર કર્યું કે આ સ્ટીમરમાંથી પહેલો ને એ પ્રાણીને બતાવશે તેને એ હજર ડોકર ધનામ મળશે. આજો દિવસ સ્ટીમરના કડેડા ઉપર ખલાસીએ. તથા અમે પેલા પ્રાણીના દેખાવાની રાહ જેતાં બેસી રહેતા. દરેકને મનમાં હતું કે એ હજર ડોકર પોતાને જ મળશે. ખલા-

સીઓ પોતાના કામમાંથી ગાપયી મારીને પણ તેક ઉપર છાનામાના જિલ્લા રહેતા. આખી સ્ટીમર ઉપર ધમાલ મય્યી રહેતી. દિવસોના દિવસો આ પ્રમાણે બોટી રાહ જેવામાં ચાલ્યા ગયા, અને ધીમે ધીમે સહુ ઠંડળવા લાગ્યા. સ્ટીમર પણ અમેરિકાની દક્ષિણે થઈને પાસિંકિંગ મહાસાગરમાં આવી પહેંચ્યી. આવડા મોટા દરિયામાં ફૂલત અસો ઝૂટ જગ્યા રોકનારું પ્રાણી શોધી કાઢવું તેમાં ધીરજની ખરી ક્ષેત્રાટી હતી. સ્ટીમર ધીમે ધીમે જપાન તરફ આગળ જતી હતી. લગભગ અસો માઈલને છેટે જપાનનો કિનારો હતો.

એક દિવસ સાંજનો વખત હતો. ધીમે ધીમે દરિયાનાં ભૂરાં પાણી ઉપર કાળો અંધકાર છવાતો જતો હતો. હું તથા મારો નોકર તુતક ઉપર ખુરશી નાખીને દરિયાની ઠંડી હવા લેતા હતા. ડોન્સીલની નજર ક્ષિતિજ ઉપર ચોટેલી હતી; તેની આંખો વધતા જતા અંધકારમાં પેલા પ્રાણીને શોધવા મથતી હતી. મેં ડોન્સીલને કહ્યું : ‘એ હજર ડાલર માટે તને ટીક તાલાવેલી થઈ લાગે છે !’

‘ આપને જે લાગે તે ખરું ; બાકી આ સ્ટીમર ઉપર મારા જેવા એ હજર ડાલરની વાટ જેનાર ડોણું નહિ હોય એ જ સવાલ છે । ’ ડોન્સીલે કહ્યું :

‘ આ અંધારું થવા માંડયું, તે બરાબર ન થયું. જ્યાં સુધી પેલું પ્રાણી ન જરે ત્યાં સુધી સૂરજ ન આથમે એવી ડોઈ વ્યવસ્થા થઈ શકે તો બહુ સારું ! ’ મેં હસતાં હસતાં કહ્યું :

‘ એ આપના જેવા વિજાનશાસ્કીઓનું કામ છે. કદાચ એટલા માટે જ અમેરિકાના રાજ્યે આપને આ સ્ટીમરમાં સાથે જવા...’

ડોન્સીલનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ નેડલેન્ડની ગજર્નાથી આખી સ્ટીમર ગાળ જાડી : ‘ જુઓ દેખા...ય ! ’

નિર્મિત કાર્ય સાથી નિર્મિત કર્યાયા નાર્ય નિર્મિત નિર્મિત
નિર્મિત નિર્મિત નિર્મિત નિર્મિત નિર્મિત નિર્મિત નિર્મિત નિર્મિત

૩
હુમલો

તો હું કાંઈ કરી નાથી હું માર્ગદર્શિકા હું હૃદાનું ન
સુધીનું નિયમનું નાથી હું હું કાંઈ કરી નાથી હું હું ન
સુધીનું નાથી હું હું નિયમનું નાથી હું હું નિયમનું ન
સુધીનું નાથી હું હું નિયમદ્વારા નિયમ નિયમનું નાથી હું હું

બૂમ પડતાંની સાથે જ સ્ટીમરને એકએક ખૂબુથી લોડા હોડતાં
હોડતાં આવીને નેડલેન્ડ કરતા ફરી વળ્યા. ઐએલરમાં ડોલસા નાખનાર
મજૂરો હાથમાં પાવડો લઈને ઉપર હોડી આવ્યા; રસોડામાં વાસણો
સાંક કરતા છોકરાઓ પણ ઠમડાં પડતાં મૂકીને હોડી આવ્યા.
સ્ટીમરનો ડેપ્ટન તથા અમે પણ નેડલેન્ડ પાસે આવીને જીભા રહ્યા,
નેડલેન્ડની બાજ જેવી આંખો દૂર ચોંટ્યો હતી. બધાની નજર તે
ખાજુ વળેલી હતી. લગભગ હોઢેક માઈલને અંતરે દરિયાની અંદરથી
‘સર્ચ લાઈટ’ જેવો પ્રકાશ પાણીને વીધીને બહાર આવતો હતો.
અમે બધા આશ્રયથી સ્તરથી થઈને જીભા રહ્યા। મેં એ પ્રકાશને
અરાધર તપાસ્યો, તો તે પ્રકાશ વીજળાનો લાગ્યો. વીજળાના પ્રકાશ-
વાળું પ્રાણી ડેલું અદ્ભુત હશે એનો હું વિચાર કરતો હતો તેવામાં
તો તે પ્રકાશ હલવા લાગ્યો. ‘જુઓ, જુઓ; આ તો પેલું પ્રાણી
આપણું તરફ જ આવે છે !’

‘ચલાવો! એન્જિનને ખૂબ જેરમાં ચાલુ કરી હો, અને
સ્ટીમરને પાછી ફેરવો.’ ડેપ્ટને હુકમ છોડ્યો।

નેતજેતામાં પેલું પ્રાણી અમારી પાસે ને પાસે આવતું લાગ્યું.
અમારી સ્ટીમર પોતાની વધારેમાં વધારે ઝડપથી પાંછી ફરતી હતી;
તેને તે પ્રાણી પહેંચી વળ્યું; એટલું જ નહિ પણ તેનાથી આગળ
નીછળા જઈ એક ચક્કાવો મારીને સ્ટીમરની તદ્દન પડ્યે આવીને
જિલ્લા રહ્યું. ગાઢ અંધકારની અંદર દરિયાનાં પાણી ઉપર ઝગ્ગાટ
કરતો પ્રકાશનો લાંખો પછો જેવામાં જો અમારા મનમાં લય ન
હોતો તો હેઠલી મન પડતું.

તે પ્રાણી પણ અમારી ખીકની જણે વિડંઘના કરતું હતું. ધડીક તે હેખાતું સાવ બંધ થઈ જતું હતું, તો ધડીક વળી અમારી સ્ટીમરને ખીજે પડ્યે આવીને બલું રહેતું. સ્ટીમરનો કોઈન ખરેખર ગભરાયો. કઈ ધડીએ તે પ્રાણી સ્ટીમરને ધક્કો મારશે તે છહેવાય એમ ન હતું. લગભગ રાતના બાર વાગ્યા સુધી આ પ્રમાણે તે પ્રાણીએ અમને હેરાન કર્યા; તે પછી તે હેખાતું બંધ થઈ ગયું. સ્ટીમરના મોટા લાગના માણુસો ખડે પગે અને થરથરતે હૈયે સ્ટીમરના કંડેઢ ઉપર જિભા રહ્યા હતા. નેડલેન્ડના ક્રોધનો પાર નહોંતો. આ પ્રાણીનો શિકાર નેડલેન્ડ સિવાય બીજું કોઈ કરી શકે તેમ ન હતું. વારે વારે બધા નેડલેન્ડને તેનો શિકાર કરવાતું કહ્યા કરતા હતા, પણ તે પ્રાણી કોઈ રીતે શિકારના લાગમાં આવતું નહોંતું; બિલદું જરા દુધવાટા કરીને જણે નેડલેન્ડને ચીડવતું હતું.

બાર વાગે પ્રાણી હેખાતું બંધ થયા પછી પાછું કેઢ એવાગે લગભગ પાંચ માઈલને અંતરે તે હેખાયું. આટલે દૂરથી પણ તેનો આસાચ્છવાસ સંભળાતો હતો : જણે કોઈ મોટું એંજિન વરાળ છોડતું હોય !

દ્વિસ જિગતાં સુધી સ્ટીમર ઉપર ચેલા પ્રાણીના શિકારની તૈયારીએ થવા લાગી. નેડલેન્ડ એકલો બેડો બેડો દાંત ભીંસીને ચેતાતું વજ જેયું હારપૂન ધસી રહ્યો. સવાર પડી. સ્ટીમરની આસપાસ ચારે તરફ ધાડું દુર્મસની છવાઈ રહ્યું હતું; તેને બીંધીને બધાની નજર પેલા પ્રાણીને શોધવાનો પ્રયત્ન કરતી હતી. વળી માછો નેડલેન્ડ ગાળ જિડ્યો : ‘જુયો હેખા...ય !’

આસરતા જતા દુર્મસની અંદર લગભગ હોઢેક માઈલને છેટે એક મોટા કાળા પદાર્થ દરિયાની સપાઠીથી જાંચે લગભગ ત્રણેક ફૂટ બહાર હેખાતો હતો. તેની પૂંછડીના લાગ પાસે દરયાનાં પાણી ખળ-લળી રહ્યાં હતાં. સ્ટીમર છાતીમાની તે પ્રાણીની નજીક જઈ પહોંચ્યો. મેં પાસે જઈને જેયું તા તે વિચિત્ર જગયરની લંબાઈ હોઢ્યો.

કુટથા વધારે નહેતી. હું તેને જોઈ રહ્યો હતો. અમે લગભગ અર્ધા ફ્રેંચને છેટે હશું ત્યાં સુધી તેના છાંટા અમને જિડતા હતા. કેપ્ટને તે પ્રાણીને બરાબર જોઈને હુકમ છાડ્યો : 'એંજિન જેસમાં ચાલુ કરો. અને ઝડપ મૂકી શકાય તેટલી મૂડો.' આપી સ્ટીમર ઉપર હર્ષના પોકારો જિડચા. સ્ટીમરના મોટા લુંગળામાંથી દુમાડાના ગોટેણાટ નીકળવા માંડચા. સ્ટીમરે તે પ્રાણી ઉપર ધસારો કર્યો.

કેપ્ટને નેડલેન્ડને કહ્યું : 'હવે તો એ પ્રાણી કોઈ પણ રીતે પકડાવું જોઈએ. તમે કહો તો સ્ટીમર ઉપરથી શિકારને માટે નાની હોડીએ ઉતારું.'

નેડલેન્ડ કહ્યું : 'કેપ્ટન સાહેબ! એની કશી જરૂર નથી; કારણ કે એ પ્રાણીને એની મરજી હશે તો જ આપણે પકડી શકશું એમ લાગે છે. તાપણું તમે નિરાશ ન થતા. હું મારી બધી શક્તિ વાપરીને તેને માત કરવાનો પ્રયત્ન કરીશ. આપણી સ્ટીમર તેની સાવ નજીક પહોંચશે તે દરમિયાન હું સ્ટીમરના લંગરવાળા લાગ ઉપર જઈને બેસું છું. ત્યાંથી લાગ જોઈને મારું નિશાન તાકીશ. તમે તે દરમિયાન સ્ટીમર જેટલી વધારેમાં વધારે ઝડપ લઈ શકે તેટલી ઝડપમાં મૂકી દો.'

વળા કેપ્ટને એંજિનિયરને ઝડપ વધારવા કહ્યું. એંજિનનું એક-એક ધણુંધણી જિડયું. સ્ટીમર કલાકના સાડા અઢાર માઈલની ઝડપે જતી હતી, છતાં તે પ્રાણી અને સ્ટીમર વચ્ચેનું અંતર એટલું ને એટલું જ રહેતું હતું. કેપ્ટન અકળાયો. અમેરિકાની સૌથી વધારેમાં વધારે ઝડપવાળા સ્ટીમરના કેપ્ટનની આખર આમ એક માણલું લઈ લે, એ તેને મન મરવા જેવું થઈ પડ્યું. સ્ટીમર ઉપરના ખલાસીએ પણ પગ પણાડના લાગ્યા. ફરી પાછો કેપ્ટને એંજિનિયરને બોલાવી ધમકાવ્યો : 'હજુ વધારે ઝડપ વધારો. પોઠિલર અને સ્ટીમર ફાઠી ન જય ત્યાં સુધી ઝડપ મૂડો !'

ઝડપ વધી. મેનોમિટર દસ ડિગ્રીએ આવીને જેસું રહ્યું; કલાકના

ઓગણીશ માઈલની ઝડપે સ્ટીમર ચાલવા માંડી છતાં પણ તે પ્રાણી અને સ્ટીમર વચ્ચેનું અંતર એતનું એ જ રહેતું હતું !

હવે શું કરવું ? પ્રાણી પણ ખરેખર જાણે અમને ચીડવવા જ માગતું હતું ! ડોઈ ડોઈ વાર તો અમારી સાવ નજીક આવી જતું હતું, અને નેડલેન્ડ પોતાનું હારપૂન તાકે ન તાકે ત્યાં પાછું દૂર નીકળી જતું હતું !

આ પ્રમાણે આજો દ્વિસ તેની અને અમારી વચ્ચે શરત ચાલી. અમને થયું કે હવે તે પ્રાણી થાકું જોઈએ; પણ સાંજ સુધી તેની અને અમારી વચ્ચેનું અંતર જરાયે ઘટયું નહિ. અથાહમ લિંકને પણ આજો રંગ રાખ્યો. તેના કોટને સ્ટીમરને આજો બરાબર કામમાં લીધી. આજો દ્વિસ કોટન ધૂંવાંપૂંવાં થઈ સ્ટીમરના તેક ઉપર ફર્યા કરતો હતો. જ્યારે તે પ્રાણીને પહોંચી વગવાનો સંભવ ઓછા હેખાયો. ત્યારે તેને એક બીજો વિચાર આવ્યો. બપોરના લગસગ બેથયા હતા. કોટને તે પ્રાણીને જવતું પકડવાનો વિચાર ઓડી દઈને તેને તોપને ગોળે ઉડાડી મૂકવાનો નિશ્ચય કર્યો. નિશ્ચય થયા પણ તેનો અમલ કરતાં તે વાર લગાડે એમ ન હતું. એકએક સ્ટીમર ઉપર તોપનો ધડકો થયો. અને એમાંથી દ્રુટેલો ગોળા તે પ્રાણીથી પણ થોડે વધારે દૂર પાણીમાં જઈ પડ્યો. કોટન વધારે ખિંજ્યો. એક બુઢો ખલાસી બહાર પડ્યો. તેણે તે પ્રાણીને વીધી નાખવાનું માયે લીધું. તોપનું મોઢું બરાબર તે પ્રાણી ઉપર તાકીને તોપ ફેડી. નિશાન બરાબર તેના સ્થાને પહોંચ્યું. બધા હર્ષનો પોકાર કરી જઠચા, પણ બીજી જ ક્ષણે તેમણે જોવું તો તોપનો ગોળા પેલા પ્રાણીની પીડ ઉપર અથડાઈને પાછો પાણીમાં પડ્યો હતો, અને પ્રાણીની ગતિમાં કશો ફેર પડ્યો નહોતો. બધાના આશર્થનો પાર ન રહ્યો. આટલો જોસથી દ્રુટેલો તોપનો ગોળા પણ ને પ્રાણીને કાંઈ ન કરી શક્યો તે પ્રાણીનું ચામડું કઈ ધાતુનું હશે ?

રાત પડી અને પેલું પ્રાણી હેખાતું બંધ થયું. અમે નિરાશ થઈ ગયા. અમારી એ દ્વિસની મહેનત છેવટે બરાબાદ થઈ ગઈ, એમ અમને

લાગ્યું; પણ તેમાં અમારી ભૂલ હતી. ફરી લગભગ રાતના અગિયાર વાગે ત્રણેક માઈલને અંતરે વીજળીનો પ્રકાશ દેખાયો. અત્યારે તે પ્રાણી સ્થિર હતું. કદાચ આએના દિવસ લાગેલા થાકથી થાકી ગયું હશે. આ ક્ષણે શિકારનો બરાબર લાગ હતો. કોઈને સ્ટીમર અવાજ ન કરે એ રીતે ધીમે ધીમે તે પ્રાણી તરફ હંકારી. નેડલેન્ડ લંગર પાસેની પોતાની જગ્યાએ હારપૂન લઈને બેસી ગયો. સ્ટીમર ઉપર લયાનક શાંતિ ફેલાઈ ગઈ. તે પ્રાણીમાંથી નીકળતા પ્રકાશથી અમારી આંખો અંભઈ જતી હતી. જેતનેતામાં સ્ટીમર ને પ્રાણી વર્ચે માંડ વીશ ફૂટનું અંતર રહ્યું. પ્રાણી હજુ જિંધતું જ હતું. નેડલેન્ડ જરાક જિંચો થયો. અને તાકીને પોતાનું હારપૂન તે પ્રાણીની ઉપર જેરથી ફેંકયું. હારપૂન જાણે કોઈ ધારુ સાથે અથડાયું હોય એવો અવાજ થયો. પણ તુરત પ્રાણીમાંથી નીકળતો પ્રકાશ એકદમ બંધ થઈ ગયો. અને પ્રાણીના એ મોટા કુવારા જેસથંધ અંદરથી છૂટચા. જેતનેતામાં સ્ટીમરનું તૂતક અને તેની ઉપરના બધા માણસોનું તરબેણ થઈ ગયા. બીજી જ ક્ષણે એક ધક્કો લાયો. હું કઠેડા પર પગ મૂકાને જિમો હતો; પડ્યેનું હો઱્યું પકડી લઈ તે પહેલાં તો એ ધક્કાના જેરે હું દરિયામાં પડ્યો।

‘નિર્માણ પ્રાર્થના’

‘નિર્માણ પ્રાર્થના’

‘નિર્માણ પ્રાર્થના’

જાણીએ જીતાં રહોયે હું, મિશ્ર મારુ નિયમ કેવી હતું? હું એ
નિયમ પરિપાડ રહોક રહીયાએ કેવી રીતે ફિલ્માં રહીએ હીં એ
એ જીતાં રહોયે હું એવી નિયમ કેવી? હું જેવી નિયમ
કેવ પકડાયા?

હું દરિયામાં પડચો પણ મારું ભાન ન ભૂલ્યો. પડતાંની સાથે
જ હું દસ-પંદર કૂટ જાંડો જીતરી ગયો પણ પાછો તરત જ હાથનાં
હુલેસાં મારીને સપાઈ ઉપર આવી પહોંચ્યો. હું તરવામાં ખૂબ
હેશિયાર હતો એટલે હિંમત હાર્યો નહિં. મેં તરતાં તરતાં ચારે
બાજુ નજર નાખી પણ આસપાસ કચાંયે વહાણું હેખાયું નહિં.
દૂર પૂર્વમાં કંઈક જાંચો. પ્રકાશ ધીમે ધીમે અદશ્ય થતો હેખાતો
હતો. મેં મોટેથી ખૂબ પાડી : ‘મદદ, મદદ! ’ એ અમારું જ વહાણું
હતું. હું તે દિશામાં જોરથી હાથ વીંઝતો તરવા લાગ્યો; પણ મારાં
કપડાંએ મને ખૂબ હેરાન કરવા માંડચો. ભીનાં કપડાં ભારા શરીર
સાથે ચોંઠી ગયાં હતાં, અને તેનું વજન અત્યારે ઉપાડવું એ એક
ખીજ માણુસને ઉપાડવા કરતાંય વધારે લાગતું હતું. મારું તરવાનું
કામ સાવ અશક્ય બની ગયું. હું દૂધવા લાગ્યો. મેં છેલ્લી ખૂબ
મારી : ‘મદદ! ’ ભારા મેંમાં પાણી ભરાઈ ગયું; મેં જીવનની છેલ્લી
ક્ષણું અનુભવી. ત્યાં એકાએક જણે ક્ષાઈએ મારાં કપડાં પકડીને મને
જાંચો કર્યો હોય એમ લાગ્યું. હું પાછો સપાઈ ઉપર આવ્યો. મારા
કાન પર કંઈક અવાજ આવ્યો : ‘આપને જે ખાસ વાંધો ન હોય
તો મારા ખલા ઉપર ટેકો આપો, એટલે આપને તરવું સુગમ પડશો.’

એ મારો નોકર — ભિત્ર કોન્સીલ જ હતો. મારામાં નવો પ્રાણ
આવ્યો. ‘કોણું, તું કોન્સીલ?’

‘હા જ. આપની સેવામાં.’

‘તું પણ મારી જેમ જ દરિયામાં પડી ગયો હતો કે?’

‘ના જ, આપને પડેલા જોયા એટલે હું આપની પાસે હાજર

રહેવા પાછળ પડચો.’

‘સ્ટીમરનું શું થયું ?’ મેં પૂછ્યું.

‘હવે સ્ટીમરનો તો વિચાર જ ન કરતા, કારણ કે હું આપની પાછળ પડચો કે તરત જ મેં અવાજ સંબંધ્યો : ‘સ્ટીમર રૂએ છે, સ્ટીમર રૂએ છે !’

‘ત્યારે તો આપણું આવી બન્યું !’ મેં નિરાશ થઈને કહ્યું.

‘કદાચ એમ પણ હોય. પણ આપણે રૂખી ભરીએ ત્યાં સુધી હાથ તો હલાવ્યા જ કરવા, એમ મને લાગે છે.’

ડેન્સીલના શરીરમાં અજલ નેર હતું. તેને ટેક તરવામાં મને જરાયે અમ નહોતા. પડતો. ડેન્સીલે એક હાથે પોતાના બિસ્સામાંથી ચાપું કાઢીને દાંતથી તે ઘોકી નાખી મારાં કપડાં ચીરી નાખ્યાં. મારા શરીર પરનું વજન સાવ હલકું થઈ ગયું. મેં પણ તે જ પ્રમાણે તેનાં કપડાંનું કહ્યું. અમને તરવામાં હવે વધારે અનુકૂળતા મળી.

એ હલાક સુધી અમે સતત તર્યાં કહ્યું. મારી શક્તિની હવે હુદ આવી ગઈ. ડેન્સીલને હવે મને ઊંઘકવો જ પડચો. મારા હાથપગ જાળે ટીકરું થઈ ગયા હતા. હું કચારે બેલાન થઈ જઈશ તે કહેવાય એમ નહોતું. ડેન્સીલ પણ હવે ખૂબ નોરથી હાંઝીતો હતો. મેં તેને કહ્યું : ‘તું મને છોડી હો; તું તારે એકલો એકલો તરવા માંડ.’

‘આપ શી વાત કરો છો ? એ તે બને ?’

અંખો ચંદ્ર આકાશમાં ડાર કાઢીને બેલો. તેનાં કિરણો દરિયામાં મોંઝ ઉપર રમતાં હતાં. મેં આસપાસ કરુણ દશ્ટ ફેરવી મદદ માગી. મોઢેથી બોલવાની તો તાકાત જ કચાં હતી ? ડેન્સીલ પણ મહામહેનતે ખૂબ પાડી શક્યા : ‘મદદ, મદદ !’ સામેથી કાંઈ જવાબ મળવાની આશાએ અમે થોડી વારે તરવું બંધ રાખ્યું. કાંઈક અવાજ આવ્યો હોય એમ પણ લાગ્યું. ડેન્સીલે ફરી ખૂબ પાડી; સામેથી માણુસનો અવાજ આવતો હોય એમ સ્પષ્ટ લાગ્યું. ‘આ તે કાંઈ ભૂમ હશે ?’ ડેન્સીલે પોતાનું બધું નેર અજમાવ્યું;

પાણીમાંથી અરદ્ધો જાંચો થઈને તેણે સાદ ક્ષાઈ જય એવી ખૂસ મારી.
હું મારું ભાન ગુમાવતો જતો હતો. મારું આખું શરીર હુંડવાઈ
ગયું. મારી ઉપર દરિયાનું પાણી ફરી વળ્યું. હું અંદર જિતરવા લાગ્યો.

એટલામાં એકાએક મારા પગ સાથે કંઈક કંઈક વસ્તુ
અથડાઈ. આવેશમાં ને આવેશમાં હું તને વળગી પડ્યો. જણે
ક્ષાઈક મને ઉપર એંચી લાખ્યું હોથ એમ લાખ્યું. હું મૂર્છિત થઈ
ગયો. થોડીવારે હું ભાનમાં આવ્યો હોઈશ. મેં આંખો ઉધાડી
ત્યારે ડ્રાઇવિંગ મારા શરીરને જેરથી ધસી રહ્યો હતો. ચંદ્રના
જાંખા પ્રકાશમાં મેં ડ્રાઇવિંગની પડ્યે એક બીજી માણુસને જોખેલો
જેથો. જરા સ્વસ્થ થયા પછી જેખું તો તે બીજે ડ્રાઈ નહિ પણ.
નેડલેન્ડ જ હતો!

‘ક્ષાણુ નેડ ? તું કચાંથી ?’

‘હાસ્તો. મારા શિકારની પાછળ પાછળ.’

‘તું પણ મારી જેમ દરિયામાં પડી ગયો હતો ?’

‘હા. પણ સાવ તમારી પેટે નહિ. હું તો પડ્યો કે તરત જ
તરતા બેટ ઉપર આવી પહેંચ્યો.’

‘તરતો બેટ ?’

‘હા, તમે જેને રાક્ષસી માછલી કઢો છો તો.’

‘એટલે ? હું સમજ્યો નહિ.’

એટલે એમ કે મેં જેવું હારપૂન તાડીને તમારા રાક્ષસી પ્રાણી
ઉપર ઝેંક્યું, તેવું જ અથડાઈને એટકી ગયું.’

‘એમ કેમ ?’

‘તે પ્રાણી લોઢાનાં મજખૂત પતરાંતું બનાવેલું છે તેથી. અત્યારે
આપણું એના ઉપર જ ઊભા ધીઓ.’

હવે જ મને ખખર પડી કે એમે બધા ડ્રાઈક ચીજ ઉપર ઊભા
છીએ. મેં મારો પગ પછડાયો. અમે બધા ડ્રાઈક ચીજ ઉપર ઊભા
હતો; તે વસ્તુ અતિશય કંઈક હતી. દુનિયામાં ડ્રાઈ પણ પ્રાણીની

ચામડી આવી કઠળું ન હોઈ શકે. આ તે શું હશે ? મારા આશર્થનો પાર નહોતો. આ ડેઈ દરિયાઈ પ્રાણી નથી એ તો નક્કી જ થયું. પણ એથી તો જીલ્લાનું મને વધારે આશર્થ થયું. દુનિયામાં કયો મનુષ્ય આવી અહસુત વસ્તુ ઉપજલી શક્કો હશે ? ઈશ્વરની રચના કરતાં એ વધારે આશર્થ ઉપજલે એવી આ રચના હતી.

અમે એક દરિયાની અંદર ચાલી શકે એવા વહાણું ઉપર જીબેલા હતા. વહાણુનો આકાર માછલી જેવો હતો. તેના ઉપર મજા-ખૂન લોઢું જડેલું હતું. જે વાત નેડ્લેન્ડ કહેતો હતો તે હવે અમારે માનવી પડી. પણ એક મને શાંકા થઈ કે જે આ ડેઈ વહાણું હોય તો તેની અંદર થંત્રો અને માણુસો હોવાં જોઈએ. પણ હજુ સુધી આ વહાણુમાં ડેઈ હોય તેવું ચિહ્ન જણાયું ન હતું. આ વહાણુની ઝડપ તથા શક્તિનો પરચો તો અમે સ્ટીમરમાં હતા ત્યારે જ અમને તણે બતાવી દીધો હતો. અત્યારે તો તે નિરાંતે દરિયાનાં મોખાં ઉપર પડ્યું પડ્યું જૂલાનું હતું. વહાણુનો ઉપરનો ભાગ દરિયાની સપાઈ ઉપર લગલગ એક ઝૂટ બહાર હતો; અને એના ઉપર જ અમે નિરાંતે બેઠા હતા. પણ જે વહાણું પાણીમાં એકએક ઝૂલ્ફી મારી જય તો અમારી શી દશા થાય ? ડેઈ પણ રીતે અંદરના માણુસોને અમારી ખખર પડે એમ કરવું જોઈએ. પણ તે કઈ રીતે ? મેં તેની અંદર જવા માટેના રસ્તાની તપાસ કરવા માંડી, પણ બધેય લોઢાનાં પતરાંમાં મોટા મોટા બોલ્ટ જડી દીધેલા હતા. અંધારામાં વધારે તપાસ પણ થઈ શકે તેમ નહોતું. અમારે સવાર સુધી રાહ જોયા સિવાય ખીજે ઉપાય નહોતો.

એકાએક વહાણું ચાલવા માંડ્યું. અમે એકખીજને પછીને બરાબર જીલા રહ્યા. દરિયાનાં મોખાં અમારા ઉપર જોરથી અથડાતાં હતાં. વહાણુની ઝડપ લગલગ કલાકના બાર માઈલની હોવાનું મેં અનુમાન બાંધ્યું.

આખરે તે લાંબી અને લયંકર રાત પૂરી થઈ. આ બેઠી સા. ૨

વહાણુમાં શું હશે તે જાણવાની કેટલી આતુરતા અમને થઈ હશે। સવારના પ્રકાશમાં અમે વહાણુનો આકાર ખરાળર જેઈ શકયા. હું તે વહાણુની પીઠ ખરાળર તપાસસ્તો હતો, ત્યાં વહાણ એકાએક અંદર જિતરવા લાગ્યું. અમે ગલરાયા; નેડલેન્ડના ડોધનો પાર ન રહ્યો. ‘હરામખારો ! ઉધાડો.’ તેણે જોરથી પગ પણાડીને ભૂમ મારી. અમારા સદ્ગ્લાંઘે તે ભૂમની અસર થઈ. વહાણ દૂષ્ટું અટકી ગયું. એકાએક લોઢાની ભોગળો જિધડતી હોય એવા અવાજ થયો. લોઢાનું એક મોઢું બારણું જોગ જિધડયું અને એક માણુસનું ડોડું ખહાર હેખાયું. તેણે અમને જેઈને ચીસ પાડી ને બારણું પાછું દ્વારાઈ ગયું. અમે બાધાની જેમ જિભા રહ્યા !

પાછું થોડી વારે પતરાનું બારણું ફરી જાંચું થયું અને તેમાંથી આઠ મજબૂત ઝુરખાવળા માણુસો બહાર આવ્યા; અને અમે હજુ વિચાર કરીએ તે પહેલાં તો ટ્સડીને અમને અંદર એંચી ગયા! અમારી પાછળ બારણું બંધ થઈ ગયું.

૪

સંયમરીન

આ બધું વીજળીની જડપથી બની ગયું. મારા મનમાંથી ભયનો એક ચ્યામડારો પસાર થઈ ગયો. બધી અંધારું હતું. સાંકડી સીડી ઉપરથી અમને નીચે ઉતારવામાં આવ્યા. એક બારણું જેખડચાનો અવાજ આવ્યો. અને અમને તે બારણુની અંદર પેલા માણુસો લઈગયા, અને ત્યાં મૂકીને બારણું બંધ કરીને ચાહ્યા ગયા. આ બધું એટલી જડપથી બન્યું કે ઓરડામાં પુરાયા પછી જ અમને અમારા શરીરનું લાન આપ્યું. અમે ડોઈ ઓરડામાં ધીએ એની ખાતરી કરવાનું સાધન અમારા હાથ જ હતા. ઓરડામાં એટલું બધું અંધારું હતું કે તેનો જ્યાલ અમને અત્યારે પણ આવી શકતો નથી. થોડીવાર પછી અમે લેગા મળી વિચાર કરવા લાગ્યા : આ બધું શું હશે ? આપણુને પકડનાર માણુસો જંગલી માણુસખાઉ માણુસો હશે, કે ડોઈ લેદી બહારવટિયા હશે, કે ડોઈ ચ્યમડકારિક જદુગરો હશે ? અમે કશું નક્કી કરી શક્યા નહિ.

નેડલેન્ડ તો નક્કી જ કરી રાખ્યું હતું કે લલે જન જ્યા તોપણું આ માણુસોને આપણું બણ બતાવી હેવું. પણ અહીં અમારું કાંઈ ચાલે તેમ નહોતું. બેદી અંધકારથી ભરેલા વીસ ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા ઓરડામાં કથા હથિયાર વગર અને ભૂખથા પીડાતા અમે પડ્યા હતા. અમારો બચવાનો આધાર અમને ડેઢ કરનાર માણુસો જ હતા.

અરધો કલાક આમ ને આમ પસાર થઈ ગયો. એવામાં એકાએક પ્રકાશનો જાણે મોટા ધોધ ઉપરના લાગમાંથી છૂટચો. આખા ઓરડામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો ! આટલા વખત સુધી

અંધારામાં રહેલી આંખો આ પ્રકાશના મારથી થોડીક ક્ષણ તો આંધળી-
ભીત થઈ ગઈ. પછી અમે નજર નાખી તો ઓરડાની છતમાં વીજ-
જાનો મોટા પોતા મુક્કેલો હેખાયો. તેમાંથી જ આ પ્રકાશ આવતો હતો.

‘હાશ ! આપરે ખીજું કાંઈ નહિ તોપણ અજવાળું તો
આવ્યું ।’ ડેન્સીલ બાલ્યો.

નેડલેન્ડ તો પોતાના જિસ્સામાંથી મોટું ધરવાળું ચપુ બહાર
કાઢીને બારણું જિધડવાની રાહ જોતો જ જિભો રહ્યો. મેં ચારે તરફ
નજર નાખી તો ઓરડામાં વચ્ચે એક ટેબલ ને ચાર પાંચ ખુરશીઓ
પડી હતી. ઓરડાની દીવાલો લોઢાનાં પતરાંની લાગતી હતી. પ્રકાશ
થથા પછી લગભગ પાંચેક મિનિટ બારણું જિધડયું, અને એ માણુસો
અંદર આવ્યા. તેમાંનો એક માણુસ સાદા નેકર જીવો લાગતો હતો
અને ખીલે બંચો અને પ્રભાવ પાડે તેવો માણુસ મોતા અધિકારી
હોય એમ જણાતું હતું. તેનું પડછંદ શરીર, વિશાળ કપાળ અને ઝીણી
કાળી એ આંખો તેનામાં રહેલી શક્તિ બતાવતાં હતાં. નેડલેન્ડનું શરીર
પણ તેની પાસે નાનું લાગતું હતું. તેની ઝીણી આંખો અમને વીધી
નાખશે એવું લાગતું હતું. તેમણે બંનેએ પહેરેલાં કપડાં ખાસ ધ્યાન
ઘંચે તેવાં હતાં. તે દરિયાની વનસ્પતિના રેસાઓમાંથી બનાવેલાં હતાં.
ઓરડામાં પેસીને બંનેએ પ્રથમ અંદર અંદર કાંઈક વિચિત્ર ભાષામાં
વાત કરી. પછી તે અધિકારી લાગતી માણુસે મારા સામે જોઈને
મને જણે કાંઈ પૂછતો હોય એવો અભિનય કર્યો. મેં તેને હૈંય ભાષામાં
અમારી વીતકક્ષા મારાથી બની શકે તેટલી સ્પષ્ટતાથી અને કરુણ
રિતે કહી સંભળાવી; તે એકધ્યાને સંભળતો જિભો રહ્યો. મારું કહેવું
તે સમજ્યો. હોય એમ તેના મોઢા ઉપરથી લાગ્યું નહિ. મેં મારી
વાત પૂરી કરી પણ તે એમ ને એમ ને જ જિભો રહ્યો. મને લાગ્યું
કે તે હૈંય ભાષા સમજતો નથી. એટલે મેં નેડલેન્ડને અમારી
હકીકત અંગ્રેજ ભાષામાં કહી સંભળાવવા કર્યું. નેડલેન્ડ તો તૈયાર
જ હતો. એની એ વાત તેણે અંગ્રેજમાં કહી, અને વધારામાં ઉમેયું

કે અમે ભૂખથી અધમૂઆ થઈ ગયા છીએ. નેડલેન્ડના બોલવાની પણ મારા જેવી જ અસર થઈ. હવે શું કરવું તેને હું વિચાર કરવા લાગ્યો. ત્યાં તો ડૉન્સીલે એની એ વાત ભાંગીતૂટી જર્મન ભાષામાં શરૂ કરી દીધી. ડૉન્સીલની વાત પણ તેને સમજી હોય એમ લાગ્યું નહિ. છેવટે મેં ભાંગીતૂટી લેટિન ભાષામાં એક ડોઠ નિશાળિયાની જેમ બોલવા માંડયું. એ પણ નકારું ગયું. અમે નિરાશ થઈ ગયા. પેલા એ જણા તો અંદર અંદર કાંઈક ગુસ્પુસ કરીને ચાલ્યા ગયા, અને બડારથી બારણું બંધ કરતા ગયા.

‘આ તે શો જુલમ ! દુનિયાની બધી ભાષામાં આપણે તેમને વાત કહી તો પણ હરામખોરા આપણુને જવાબ આપવા યે નવરા નથી !’ નેડલેન્ડ પોતાનો ચ્યપુ હવામાં ઉછાજ્યો.

‘તું જરા ટાઢો પડ. ગુર્સે થઈશ તેમ વધારે હેરાન થઈશ.’
મેં કહ્યું.

‘પ્રોફૈસર સાહેય ! અહીં આમ ને આમ ભૂખના માર્યા કમેતે ભરી જશું, તોય આ બદમાસો આપણા સામે જુઓ એમ લાગતું નથી !’ નેડ કહ્યું.

‘તો પછી આપણે આપણુથી અની શકે ત્યાં સુધી તત્ત્વ-શાની ચર્ચા કરીને વખત કાઢીએ.’ ડૉન્સીલે કહ્યું.

હું એ વિચાર કરતો હતો કે આ માણુસો કયા દેશના હશે ? એમના શરીર ઉપરથી કે એમની ભાષા ઉપરથી કંઈ પણ અનુમાન બાંધી શકાય એમ નહોતું. નેડલેન્ડ તો ભૂખ્યા વરુની જેમ બૂમે પાડયા કરતો હતો, અને જેર જેરથી બારણું ઉપર પાટાં મારીને ‘ખાવાનું લાવો ! ખાવાનું લાવો !’ એમ બરાડતો હતો.

શાડી વારે ક્ષરી બારણું જીવડયું, અને એક માણુસ અંદર આવ્યો. તેના ખલા ઉપર અમારે માટે આણેલ કપડાં હતાં, અને તેના હાથમાં માટો થાળ હતો. નેડ તો તરત તે માણુસ તરફ થસ્યો, અને તેના હાથમાંથી થાળ ઝુંટવી લીધો. પેલો માણુસ પણ

કપડાં નીચે મુક્કીને ઝડપથી ચાલ્યો ગયો, અને બારણું બહારથી દેખાઈ ગયું.

કપડાં પહેરવાનું કામ ભાધા પહેલાં ડોઈ કરે તેમ નહોતું. પહેલાં અમે ત્રણે જણું લોજન ઉપર તૂંઠી પડ્યા, વાનીઓ બફુ વિચિત્ર પ્રકારની હતી. દરિયાની જલજલતની માછલીઓની તે ભનાવવામાં આવી હતી. સ્વાદમાં તે ડોઈ પણ રિતે જિતરે તેવી નહોતી. દરેક વાની તથા રકાખી અને વાસણું ઉપર અંગ્રેજું ‘એન’ (N) લખેલું હતું. નેડ અને ડોન્સીલનું ધ્યાન આ અક્ષર ઉપર નહોતું ગયું, કારણું કે તેઓ ભાવામાં મશગૂલ હતા. ખાઈને જડ્યા પઢી અત્યાર સુધીનો થાક બડાર આવત૊ લાગ્યો. મારા બંને સાથીઓ તો ખાઈને તરત જ નીચે પડેલી સાદ્દી ઉપર બંધી ગયા. મને પણ થાડી વારમાં જિંધ આવી ગઈ.

૬

ભૂખના માર્યા

અમે કૃષ્ણાં જીંધા તની મને અખર નહોતી. પણ મને લાગે છે કે અમે બારથી પંદર કલાક જીંધા હઈશું. મારો બધો થાક જિતરી ગયો હતો. હું જિથો ત્યારે પણ મારા સાથીઓ તો વેરતા જ હતા.

મેં જીને આસપાસ જેયું. બધું એમનું એમ જ હતું. ફક્ત અમારાં ખાવાનાં વાસણે ત્યાંથી જપડી ગયાં હતાં. અમે હજુ પાંજરામાં જ પુરાયેલા હતા. લેકે મારો થાક જિતરી ગયો હતો, પણ મારી છતી ભારે લાગતી હતી. શાસ મુશ્કેલીથી બેવાતો હતો. તેનું કારણ તપાસતાં મને એમ જણ્ણાયું કે આરડામાં રહેયો ઓકિસજન (પ્રાણુવાયુ) ખૂટવા આવ્યો હતો. એક માણુસ એક કલાકમાં ૧૭૬ પિંટ જેટલો ઓકિસજન હવામાથી લે છે. જ્યારે એ હવામાં એટલો જ કાળેનિક એસિડ થાય ત્યારે શાસ દેવો મુશ્કેલ થઈ પડે છે. અને થોડા જ વખતમાં માણુસ ગૂંગળાઈ મરે છે. અથાત જે થોડા વખતમાં અમારા આરડામાં નવી તાજી હવા ન આવે તો અમારે કમેતે મરવાનું હતું. પણ મને એક નિરાંત હતી. આ વહાણુનો કેપ્ટન અમને આમ કમેતે મારે એવો સંભવ નહોતો. કારણ કે નહિ તો તે અમને ખાવાનું ને કપડાં ન મોકલત, વળી જેમ અમારા આરડામાં નવી હવાની જરૂર હતી તેમ આખા વહાણુમાં પણ તેની જરૂર હશે; એટથે જે આખા વહાણુનું થશે તે અમારું થશે એમ વિચારીને મેં સંતોષ માન્યો. આ વહાણુનો કેપ્ટન કઈ રીતે આ બધી વ્યવસ્થા કરતો હશે તેનો હું વિચાર કરતો હતો, તેવામાં એકાએક નવી તાજી હવાથી આખો આરડો ભરાઈ ગયો. તે હવામાં દરિયાના તાંલ પવનની સુગંધ હતી. મારું શરીર અને મન

પ્રકુલ્પિત થઈ ગયાં. આ નવી હવાના પ્રલાવથી મારા બંને સાથીઓ પણ આગસ મરડીને એકા થયા અને આંખો ચોળતા જીભા થઈ ગયા. નેડલેન્ડ જિહ્તાંવેંત જ બોલી જિહ્યો : ‘ દરિયાની હવા આવતી હોય એમ લાગે છે.’ નેડલેન્ડનું કહેવું સાચું હતું. એરડીની ઉપર એક નાનું જળિયું હતું તેમાંથી આ હવા આવતી હતી. અને વહાણુમાંથી જાણું ડોઈ મેટું પ્રાણી શાસ લેતું હોય તેવો અવાજ પણ આવતો હતો. અમે દરિયાની સપાઠી ઉપર હતા એમ લાણ્યું.

નેડલેન્ડ જિહ્તાંવેંત ભૂખ્યો થઈ ગયો હતો. તેણે કહ્યું : ‘ પ્રોફૈસર સાહેબ ! હવે નાસ્તો આવે તો ખાસ વાંધો નથી.’

‘ મારે તો નાસ્તો કે ભોજન ગમે તે આવે તોયે વાંધો નથી.’ ડોન્સીલે કહ્યું.

‘ એમાં આપણે વાંધો હોય કે ન હોય તે બંને સરખું જ છે. એ તો એમનો ભોજનનો વખત થશે ત્યારે જ આપણે માટે ભોજનનો સમય થયો સમજવો. ત્યાં સુધી બારણું જિવડવાની રાહ જેતા આપણે બેસી રહેવાનું છે.’ મેં કહ્યું.

ડોન્સીલે ખાવામાંથી મનને હટાવવા ખીજ વાતો કાઢવા માંડી. તેણે પૂછ્યું : ‘ આપણું અહીં શું થશે ? આપણુને ડેદ કરનાર આ માણુસો ડાણું હશે ? તે સંબંધી આપનો શો અલિપ્રાય છે ? ’

હું એને જવાય આપું તે પહેલાં નેડલેન્ડ બોલી જિહ્યો : ‘ મને તો ખાતરી છે કે આપણે બધાંકર રાક્ષસી માણુસોના પંજમાં આવી પડચા છીએ. તેઓ આપણુને ખાવાનું આપે છે, તે પણ આપણુને જડા કરીને પછી મારી નાખવા માટે ! મેં તો નક્કી જ કર્યું છે કે મરણું તોપણું આમાંથી થોડાકને મારીને જ મરણું.’

મેં કહ્યું : ‘ નેડ ! તારી ધારણું ! સાવ ખોટી છે. હું માનું છું કે જે માણુસમાં આવું ચ્યંતકારિક વહાણું બનાવવાની અને ચલાવવાની શક્તિ હશે, તે માણુસ રાક્ષસ હોય જ નહીં. તે આપણુને અહીં રાખીને આપણું શું કરવા માગે છે તે હજુ મને સમજયું નથી;

પણ મને લાગે છે કે કદાચ તે થોડા વખત પણી આપણુને કંઈક દૂર જમીન ઉપર છોડી દેશે. મારી એવી સૂચના છે કે જે થાય તે જેથા કરવું અહીંથી નાસી જવાનો પ્રયત્ન કરવો એ એટાં ઇંકાં છે; ને એમાં આપણે પકડાઈ ગયા તો વધારે હેરાન થશું. જે આકળા થઈને ડાઈકના ઉપર હુમલો કરશું તો આપણે એમને પહોંચી શકવાના નથી; જીલા આપણે જીવ જોખમાં નાખશું. નેડ! મને તો તારી જ ખીક લાગે છે કે તું કંઈક આકુંઘળું કરી બેસરો.'

નેડ શાંત રહેવાતું વચન તો આપ્યું પણ તેના ધૂંધવાટનો પાર નહોતો. તેના જેવા ધડીકે નવરા ન બેસી શકે તેવા માણુસને આ લોઢાની મજબૂત દીવાલોની અંદર ભૂખે પેટ બેસી રહેવું પડે એ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. ઓરડામાં બખડતો બખડતો તે જોરથી આંટા મારવા લાગ્યો. કલાક ઉપર કલાક વીતવા લાગ્યા. મારી ધીરજ પણ ખૂટવા આવી, ત્યાં નેડલેન્ડની શી સ્થિતિ થઈ હો? પાંજરામાં પુરાયેલા સિંહની જેમ તે ધૂરકતો હતો : ઓરડાના ખારણું ઉપર સુઝી તથા લાતો લગાવતો હતો; વર્ષે વર્ષે જોરથી ખૂમ પાડતો હતો; પણ લોઢાની બહેરી દીવાલો ઉપર તેની કશી અસર થતી નહોતી. આ વહાણુના ડેપ્ટનને વિષે પહેલી વાર મારા પર જે સારી છાપ પડી હતી તે પણ ભૂંસવા લાગ્યી. તે માણુસ હું મને કૂર લાગવા માંડ્યો; અમને રિખાવી રિખાવીને મારવા એ જ એનો ઉદેશ હોય એમ મને લાગ્યું.

આખરે બારણું જિધડયું અને નોકર દેખાયો. હું નેડને વારું તે પહેલાં તો નેડ પેલા નોકર તરફ કૂદ્યો અને તેને ગળે વળગી પડ્યો. નોકરની આંખો અધ્યર ચડી ગઈ. હું અને ડાન્સીલ બંને જણ નેડલેન્ડના પંનમાંથી પેલા નોકરને છોડાવવાનો પ્રયત્ન કરતા હતા. તેવામાં પાણથી ફેન્ચ લાષામાં નીચેના શબ્દો અમારા કાન પર પડ્યા : 'મિસ્ટર લેન્ડ ! જરા ધીરા પડો. અને પ્રોફેસર સાહેબ ! મારે તમને કંઈક કહેવું છે તે સંભળશો ?'

૭

કેપ્ટન નેમો

એ શબ્દો ખોલનાર આ વહાણુનો ઉપરી હતો. નેડ પણ આ શબ્દો સંભળતાં જ ચમકીને જોણો થઈ ગયો, એટલો તેના શબ્દોમાં સત્તાનો પ્રલાવ પડતો હતો. નેડના પંજમાંથી છૂટેલો ગેયો. નેડાર કેપ્ટનના ઠથારાથી બહાર ચાલ્યો ગયો. નેડલેન્ડના આ તાજાનનું શું પરિણામ આવશે તેની રાહ જેતા અમે જોણા. કેપ્ટન પણ અમારા ટેબલ પર એક હાથ મૂકીને અમારી સામે શાંત નજરે જેતો જોણો રહ્યો. થાડી વાર સુધી શાંતિ ઇલાઈ; પછી શાંત અને ગંભીર અવાજથી કેપ્ટન ખોલ્યો : ‘ગૃહસ્થો! હું બધી લાખાઓ સારી રીતે ખોલી શકું છું. મેં પહેલી વખતે તમારી સાથે જાણી જોઈને વાત-ચીત નહોતી કરી. ઇકત તમારા નણેના મોઢે તમારો વૃત્તાંત બરાબર સાંભળ્યા લીધ્યો. પ્રોફેસર સાહેબ જેવા વિદ્યાન અને નેડલેન્ડ જેવા ઉત્તમ શિક્ષારીને અકુસ્માત મારા વહાણુમાં આવી ચેતેલા જોઈને મને આનંદ થાય છે. પહેલી વાર તમને મળ્યા પછી તમારું શું કરવું તનો વિચાર હું કરતો હતો. તમે નસીબનેગે એક એવા માણુસ પાસે આવી પહોંચ્યા છો કે જેણે દુનિયા સાથેનો પોતાનો સંબંધ ધણું વરસોથી સાવ તોડી નાખ્યો છો. હું જાણું છું કે તમારો ધરાદો અમારો નાશ કરવાનો હતો...’

‘નહિ, કેપ્ટન સાહેબ! તમારી ભૂલ થાય છે. અમારો વિચાર ધરાદાપૂર્વક તમારો નાશ કરવાનો નહોતો. તમને અખર નથી કે તમે આખી દુનિયામાં ડેવો હાહાકાર મયારી દીધ્યો છે; તમારા વહાણુને એઠ મોટું રાક્ષસી દરિયાઈ પ્રાણી સમજુને અમે તેના શિકારે નીકળ્યા હતા. ’ મેં ખુલાસો કર્યેં. જરૂરિયાં કરું હું કરેં. જીવન કરું

કેપ્ટનના હોઠ ઉપર એક અંધું હાસ્ય ફરજું. ધીમેથી પણ વીંધી નાખે તેવા અવાજમાં તે બોલ્યો : ‘પ્રોફેસર સાહેબ, મારો કે તમને ખબર હોત કે આ વહાણું જ છે; તો તમે તેના ઉપર હુમદ્રો ન કરત, કેમ?’

આનો મારી પાસે ઉત્તર નહોતો. મને લાગે છે કેપ્ટનનું માનવું સાચું હતું.

કેપ્ટને વળી આગળ ચલાવ્યું : ‘તમારી સાથે શત્રુઓના જેવું વર્તન ચલાવવાનો મને હક્ક છે. તમને કાઈ પણ જીતની સગવડ આપવા માટે હું બંધાયેદે. નથી. હું તમને પાછો દરિયા ઉપર તરતા મૂકીને ચાલ્યો જાઉં તો પણ મને તેમાં કાઈ બોટું લાગતું નથી. તમે કદાચ મને જંગલી કહેશો, પણ મને તેમાંથે વાંચો નથી. હું સુધરેલો રહેવા માગતો નથી, અને સુધરેલી દુનિયા સાથે મારે કશો સંબંધ પણ નથી. સુધરેલી દુનિયાના કાયદાઓ મને લાગુ પડતા નથી. તમારી સુધરેલી દુનિયાની એક પણ વાત મને કરવાની જરૂર નથી.’

કેપ્ટનની આંખમાંથી જણે આગ ઝરતી હતી. દુનિયાનો આવો કરૂર વેરી અમારી સામે જિભો છે અને અમે તેના હાથમાં ડેઢી છીએ, એનો ઘ્યાલ આવતાં હું થરથરી ડાડ્યો. આની પાસેથી બચવું એ તેના હાથની જ વાત હતી. થાડી વાર પણી પાછો કેપ્ટન બોલ્યો : ‘પણ મારો વિચાર તમને મારવાનો નથી. તમે આ વહાણુમાં રહો. તમારે કચાં સુંધી અહીં રહેવું તે હું કદી શકતો નથી. કદાચ જિંદગીબર રહેવું પડે. તમે અહીં શૂટથી હરીકુરી શકશો. ફક્ત એક જ શરત કે તમને થાડા દિવસો પૂરી રાખવામાં આવે તો તેમાં તમારે કશો વિરોધ કરવો નહિં. તમને આ વહાણુમાંનો ડેટલો ભાગ જોવા હેવો તે મારે નક્કી કરવાનું છે.’

મેં વચ્ચે પૂછ્યું : ‘પણ આ તો એક ડેઢીને અપાય એટલી જ સ્વતંત્રતા થઈ! એ પૂરતી નથી.’

‘તો તમારે તે પૂરતી છે એમ માની લેવું પડશો.’ કેપ્ટને કહ્યું.

‘એને અર્થે એમ જ ના, કે અમારે પણ દુનિયા સાથેનો અને અમારાં સગાંવહાલાં સાથેનો સંબંધ પૂરો થયો સમજુ લેવો ?’ મેં પૂછ્યું.
‘હા જ, એમ જ. મને લાગે છે કે એમાં બહુ દુઃખ પામવા જેવું નથી.’

‘હું જહેર કરું છું,’ નેતૃ હાથ ભાંચો કરીને કહ્યું, ‘કે હું નાસી જવાનો પ્રયત્ન નહિ કરું એવું વચ્ચન નહિ આપું.’

‘મિ. લેન્ડ ! મેં તમને આવું વચ્ચન આપવાનું કહ્યું જ નથી.’
નેતૃ ચૂપ થઈ ગયો.

‘ડેપ્ટન સાહેબ ! તમે અમારી દ્વામણી સ્થિતિ નેઈને અમારા ઉપર જુલમ કરો છો.’ મેં કહ્યું:

‘ના સાહેબ ! તમે જૂદો છો. હું તો તમારા તરફ જિસી દ્વારા ખું છું. ખરું જેતાં તો તમે મારા યુદ્ધના ડેઢી છો. હું ધારું ત્યારે દરિયાને તળિયે તમને દુલાણી દઈ શકું છું. તમે મારા ઉપર હુમલો કર્યો છે એટલું જ નહિ, પણ દુનિયામાં હું જે વસ્તુની ડોર્ધ માણુસને ખર્યર પડવા હેવાનો નહોતો. તે વસ્તુ તમે જાણી ગયા છો. હવે તમને ડેઢ પૂરી રાખવા એ એક જ રસ્તો મારી પાસે ખુલ્દો છે. એમાં ખીજું કાંઈ થઈ શકે તેમ નથી.’

થાડી વાર શાંતિ પથરાઈ ગઈ. થાડી ક્ષણું પછી તે બોલ્યો :
‘પ્રોફેસર સાહેબ ! તમને તથા તમારા સાથીઓને અહીંથી નાસી જવા સિવાયની ખીજુ દરેક સ્વતંત્રતા મળે છે. તમારા સાથીઓને વિષે હું નથી કહી શકતો, પણ તમને તો જરૂર કહી શકું કે તમારા જેવા વિજાનશાસ્કીને મારી સાથે રહેવામાં જરાયે શુમાવવાપણું નથી; જીલ્દું દુનિયા ઉપર વિજાનશાસ્કીએ કહી નહિ જેયેલાં અને નહિ કદ્દેલાં દશ્યે. જેવાની તમને તક મળશે.’

ડેપ્ટનના આ શણદોએ મારા ઉપર ખૂબ અસર કરી. દરિયાની અંદર રહેલી સૃષ્ટિનો અનુભવ થશે એ વિચારથી મારું મન પ્રકૃતિલિકત થયું.

‘આપને મારે કયે નામે બોલાવવા ?’ મેં પૂછ્યું.

‘કેપ્ટન નેમાને નામે બોલાવશો તો ચાલશો.’ કેપ્ટને કહ્યું.

આ પછી તરત જ મારા સાથીએ તરફ કૃતિને બોલ્યો : ‘તમારે માટે તમારી ઓરડીમાં લોજન તૈયાર છે. આ માણુસ તમારી સાથે આવશે. અને પ્રાઇસર સાહેબ ! તમે નાસ્તા માટે મારી સાથે ચાલો.’

‘હું કેપ્ટન નેમાની સાથે ચાલ્યો. સાંક્રાન્તી એવી આસરી ઉપર થઈને થોડી વારમાં અમે લોજનના ઓરડામાં આવી પહોંચ્યા. વીજળીની બતીથી આએં ઓરડો પ્રકાશિત હતો. ઓરડાની અલરાઈએં ઉપર જીતજતનાં ચક્કાંકિત વાસણો ચળકાટ મારતાં હતાં. ઓરડાની વર્ચયે કિંમતી ટેચલ હતું ને તેના ઉપર નાસ્તાનો થાળ મૂકેલો હતો. અમે નાસ્તો શરૂ કર્યો.

નાસ્તામાં શી શી ચીન્લે છે તે હું પૂછું તે પહેલાં જ કેપ્ટન બોલી બઠ્યો : ‘તમે આ બધાથી અનણ્યા હશો, પણ આ બધી વાનીએં મને સમુક્રમાંથી મળી છે. દરિયો મને ને જોઈએ તે પૂરું પાડે છે. ડોઈ ડોઈ વાર હું દરિયાની અંદરનાં જગલોમાં જઈને શિકાર પણ કરી લાવું છું. મને સમુક્ર ખાવાતું આપે છે, એટલું જ નહિ પણ કપડાંએ પણ મને તેમાંથી જ મળી રહે છે. આ તમે પહેરેલાં કપડાં પણ દરિયાની અંદર થતા એક પ્રકારના ધાસના રેસાઓમાંથી થયેલાં છે. દરિયામાં અત્તર પણ મળે છે. તમારી પથારોનું ગાઢલું પણ દરિયાના એક પ્રકારના ધાસમાંથી જ બનાવેલું છે. હોલ્ડર પણ વહેલ માછલીના હાડકામાથી બનાવેલું છે. શાહી પણ ડેલેમારી નામની માછલીમાંથી નીકળતા પદ્ધાર્થની બનાવેલી છે. મને બધું દરિયામાંથી મળી રહે છે. અને એક દિવસ એવો પણ આવશેક જ્યારે આ બધું પાછું દરિયામાં જ મળી જશે.’

‘તમને દરિયા ઉપર ભૂઅ પ્રેમ લાગે છે !’ મેં કહ્યું.

‘પ્રેમ તો થું, દરિયો એ મારું સર્વસ્વ છે. દરિયામાંથી હું મારું જીવન મેળવું છું. દરિયા ઉપર મનુષ્યો સત્તા મેળવવા ભલે સામસામા કપાઈ ભરે, પણ દરિયાની નીચે તેમનું બળ નકારું છે.

ત્યાં આગળ સત્તા જેવી વસ્તુ જ નથી, ત્યાં હું સ્વતંત્ર હું.'
 આમ બોલતાં બોલતાં તે જણે અને ભૂલી ગયે હોય એમ
 દાખ્યું. થાડી વારે પાછા તે સ્વસ્થ થયે અને બોલ્યો : 'પ્રોફીસર
 સાહેખ ! તમારી ધર્યા હોય તો આપણે હવે આ મારું "નોટિલસ"
 વહાણ જેવા જઈએ.'

જાણતો હિન્હ કરું પડ્યાંનાંનો માનવી રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું
જાણતો હિન્હ : 'જુદું જેઠાં તાણી હું રીતું જીએ જીએ રહ્યું
રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું
રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું
રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું રહ્યું
નોટિલસ

અમે જીબા થયા. તે આરડામાંથી તેની પડ્યેના ખીજ આર-
ડામાં કેપ્ટન નેમો મને લઈ ગયો. તે આરડો પુસ્તકાલયનો હતો.
મોટા બીંચા બોડીઓ ઉપર એકસરખી બાંધણીનાં પુસ્તકોની કઠાર
લાગી ગઈ હતી. ચારે બીંંતો પુસ્તકોથી ભરી હતી. બોડા ઉપર
ચડવા માટે વચ્ચે નાની નાની સીડીઓ, અને આરડાની વચ્ચે ટેબ્લે
અને ખુરશીઓ પડવાં હતાં. તેના ઉપર થોડાંએક છાપાંઓ પણ
હતાં. છાપાંઓ છેક જ જૂનાં હતાં. ચાર વીજળાની બતીઓથી
આખો આરડો પ્રકાશિત હતો. હું આ બધું જોઈને આસો જ બની
ગયો. મને આ બધું સ્વપ્ન જેવું લાગ્યું. થોડી વારે હું બોલ્યો :
'કેપ્ટન સાહેબ! દુનિયાના ડેઈ પણ રાજમહેલના પુસ્તકાલયને
શરમાવે એવું આ પુસ્તકાલય જોઈને મને નવાઈ લાગ છે.'

'પ્રોફેસર! દરિયાની આવી અગાધ શાંતિમાં અને એકાંતમાં
અભ્યાસ કરવાની તમારા જેવાને ખૂબ મન આવે. આ પુસ્તકા-
લયમાં ઓછામાં ઓછાં દસથી બાર હંજર પુસ્તકો છે. દુનિયા સાથેનો
મારો જુનો સંખ્યાં આ પુસ્તકોમાં જ રહ્યો છે. મેં મારું આ
વહાણું જ્યારે દુનિયાથી જુદું પાડીને સમુક્કમાં હંકાર્યું, તે દિવસે
મારી સાથે આ મારાં પુસ્તકો અને આ છાપાંઓ હતાં, અને અત્યારે
પણ છે. અને અત્યારની દુનિયામાં ખીજું કાંઈ લાભાયું છે એમ માનવાની
મારી ધ્રણા નથી. આ પુસ્તકોનો તમે કૃષ્ણા ઉપયોગ કરી શકશો.'

મેં કેપ્ટન નેમોનો આભાર ભાનીને બધાંથી પુસ્તકો જેવા
માંડાંઓ. દુનિયાની દરેકદરેક પ્રસિદ્ધ ભાષાઓનાં અને દરેક મોટા
વિષયોનાં પુસ્તકો રીતસર વર્ગવાર જોડવેલાં ત્યાં જોયાં. હું બધું જોતો

હતો તે દરમિયાન કેપ્ટને પોતાના બિસ્સામાંથી એક મોટી સિગાર કાઢીને મારી સામે ધરી. મેં સિગાર હાથમાં લઈને કહ્યું : ‘આ સિગાર પૂરતા તો તમારે દુનિયા સાથે સંબંધ રાખવો જ પડતો હશે.’

‘ના ના, સિગાર પણ મને સુમુદ્રમાંથી જ ભળા રહે છે. આની તમાકુ એક જીતના દરિયાઈ ઘાસમાંથી થાય છે. જોકે તે બહુ થોડા પ્રમાણુમાં થાય છે, પણ તમે તો છૂટથી વાપરી શકશો.’

ત્યાંથી અમે ખીજ ઓરડામાં પેડા. આ ઓરડામાં લીંતો ઉપર બધું મોટાં મોટાં ચિત્રો ટાંગેલાં હતાં. ડેટલાંક ચિત્રો યુરોપના પ્રસિદ્ધ ચિત્રકારોનાં હતાં; ડેટલાંક ચિત્ર કેપ્ટન નેમાનાં પોતાનાં ચીતરેલાં હતાં. ડેટલાંક યુરોપના પ્રસિદ્ધ સંગીતશાસ્ક્રિપ્ટોનાં હતાં.

ત્યાંથી અમે ત્રીજ ઓરડામાં પેડા. આ ઓરડા જોઈને મારા આનંદનો ને આશ્ર્યનો પાર ન રહ્યો. ચારે બાજુ કાચના મોટા મોટા કુઝાટામાં દરિયાની જીતજીતની નવાઈએ ભરેલી હતી. ખાસ કરીને છીપલીએ, છોડવાએ અને નાની માછલીએ એમાં હતી. બધું વ્યવસ્થિત ગોડવેલું હતું; દરેક ઉપર નાની નાની ચિહ્નો ચોડેલી હતી, ને તેમાં તે વસ્તુનું નામ ને દૂંકી વિગત લખેલી હતી. એક જગ્યાએ જીતજીતના રંગવાળાં મોતા ગોડવેલાં હતાં. થોડાંક મોતી કષ્ણૂતરના ઈંડાં કરતાં પણ મોટાં હતાં; તેમની કિમંત વીસથી પચીસ લાખની આંકી શકાય. કેપ્ટન બહુ આનંદથી અને ઉત્સાહથી મને બધું બતાવતો હતો, અને સમજવતો હતો. હું આ બધું જોતાં ધરાતો જ નહોતો. ત્યાંથી અમે કેપ્ટનના પોતાના ઓરડામાં ગથા. ઓરડા સાવ સાંદ્રા હતો. એક લોઢાનો ખારદો, એક નાનું ટેફલ, ખુરશી ને થોડાંએક કપડાં, એટલું જ તેમાં હતું. ઓરડાની છતમાં થોડાએક થંત્રો નજરે પડતાં હતાં. મેં કુતૂહલથી તેના તરફ જોયું. કેપ્ટનને હું પૂછું તે પહેલાં જ તેણે કહેવા માંડ્યું : ‘તમે બેસો. તમને હું બધું સમજવું. સામે ને થંત્રો તમને હેખાય છે તેના વડે આ મારું વહાણ આલે છે. અહીં બેડા બેડા હું વહાણ કર્દ બાજુ હાંકવું તેની સૂચના

આપી શકું છું ને વહાણુની દિશા નક્કી કરી શકું છું. તમે થોડું ધણું તો આમાંથી સમજ શકશો. જે આ ઘડિયાળ જેવું હેખાય છે તે મેનો મિટર છે. બહારના પાણી સાથે તેનો સંબંધ જોડલો છે, એટલે તેના વડે વહાણું ઉપર પાણીનું ડેટલું દ્યાણ છે, અને વહાણ ડેટલે જીંતે છે તે માપી શકાય છે. તેની પડખે જ જે ખીજું યંત્ર હેખાય છે તે થર્મામિટર છે. તેના વડે પાણીની અંદરની ગરમીનું માપ કાઢી શકાય છે અને તેની પાસેનાં આ જે ખીજાં યંત્રો હેખાય છે તેના ઉપર તો આ આખા વહાણુનો આધાર છે; તે આ વહાણુનો આત્મા છે. તેમાં એક જ શક્તિ રહેલી છે : ‘વીજળી.’

‘હા, કેપ્ટન સાહેબ ! એ વાત સાચી; એ વીજળાને લિધે જ તમારા વહાણુની તમે આટલી ગતિ રાખી શકો છો. પણ મને લાગે છે કે આ વીજળા ઉત્પન્ન કરવા માટે તો તમારે પૃથ્વી ઉપરની જસ્ત વગેરે ધાતુઓનો ઉપયોગ કરવો જ પડતો હશે.’ મેં કહ્યું.

‘તેને પણ જવાય મારી પાસે તૈથાર છે. પહેલાં તો જાણે એ વાત – કે દરિયાને તળિયે જસ્ત, લોદું, રસું, સોનું વગેરે ધાતુઓની ખાણા હોય છે. પણ મારે તેની જરૂર નથી પડતી. મેં તા એક ખીજે સાહો રસ્તો શોધી કાઢ્યો છે. તમે જાણો છો કે દરિયાના પાણીમાં સોડિયમ ધણા પ્રમાણમાં હોય છે. એ સોડિયમને પારા સાથે મેળવવાથી ઓંક (જસ્ત) જેવો જ પદાર્થ ઉત્પન્ન થાય છે. હું પાણીમાંથી સોડિયમનાં તત્ત્વાને ખેંચી કાઢી તેમાં પારો મેળવું છું. પારો કોઈ દિવસ નાશ પામતો નથી. સોડિયમ જ્યારે ખૂટી જ્યારે દરિયા પાસેથી મેળવી લઇ છું. આનાથી ઉત્પન્ન થતો વીજળાનો પ્રવાહ જસ્તના કરતાં પણ ખૂબ તેજસ્વી હોય છે.’

‘હું સમજ્યો, વીજળા તો તમે ઉત્પન્ન કરી. અને વીજળાથી તમે વહાણુમાં જવન પણ પૂરી કરો છો; પણ વીજળાથી કાંઈ તમે હવા ન લઈ શકો.’

‘તે પણ તમને સમજવું’ મારા પૂરતી તો હવા ઉત્પન્ન કરવાનાં પણ મારી પાસે યંત્રો છે; પરંતુ તેનો ઉપયોગ કરવાની જરૂર જ નથી, ડારણ કે મારી ભરળ પડે ત્યારે હવા માટે હું મારા વહાણુને દરિયાની સપાઈ પર લઈ જઈ શકું છું. અને મારી વીજળી લદે મને હવા ન આપી શકતી હોય, પણ તે વીજળાના પંખ વડે હું હવાને તેને માટે ખાસ બનાવેલી ટાંકીઓમાં ભરી રાખી શકું છું. સમુદ્રને તળિયે ઘણા લાંબા વખત સુધી એમાંથી હવા મળ્યા કરે છે.’

‘કેપ્ટન! તમારી બુદ્ધિ ઉપર ફિદા થઈ જવાય છે। દુનિયાને જ શાખતાં વર્ષો લાગશે તેનો તમે અત્યારે ઉપયોગ કરી રહ્યા છો. પણ દુઃખની વાત એક જ છે કે દુનિયા તમારી શાખ જાણી શકશે નહિ. દુનિયાને આ શાખનો લાલ મળે તો કેવું સારું! ઐશક, તે બધો આધાર તો તમારા ઉપર જ છે.’ મેં કહ્યું.

‘એ બધી વાત પછી કરીશું. તેમાં મારો નિર્ણય ફરી શકે તેમ નથી. પણ અત્યારે તો આપણે આ વહાણુનાં યંત્રો જેઈશું. જુઓ આ ઘડિયાળ. તે વીજળાની શક્તિથી જ ચાલે છે. અની ગતિમાં એક ક્ષણનો પણ ફેર પડતો નથી. જ આ ગોળ ચગ્દું હેખાય છે, તે વહાણુની ગતિ માપવાનું યંત્ર છે. જુઓ, અત્યારે આપણું વહાણ કલાકના પંદર માર્દલની ગતિએ ચાલે છે.’

અહીંથી અમે વહાણુના પાછળના ભાગમાં ગયા, ત્યાંથી એક લોઢાની સીડીએ થઈને ઉપર ચડચા.

મેં પૂછ્યું, ‘અહીંથી કચાં જવાય છે?’

કેપ્ટન નેમાંએ કહ્યું: ‘આ વહાણુની સાથે અમે એક આ નાની હોડી રાખી છે. આ હોડી કદી ઝૂએ નહિતેવી છે, અને ઝૂબું હલકી છે. આ હોડીમાં બેસીને હું કોઈકાઈ વાર દરિયાની સપાઈ ઉપર ફરવા નીકળું છું. તમને થશે કે એ હોડી પાણીની સપાઈ ઉપર કઈ રીતે આપતી હશે? પણ તેમાં બહુ કારીગરી નથી. જેવી

રીતે હું દરિયાનો પોશાક પહેરીને પાણીમાં જિતરી શકું છું, તેવી જ રીતે મારી હોડી પણ આ વહાણુની ખાડાર તેના ખાસ પોશાક વડે નીકળી શકે છે.'

એ લોઢાના દાદરની પડ્યે વહાણુનું રસોઝું હતું. રસોડામાં ચૂલ્હાએ વીજળાથી ચાલતા હતા. પડ્યે નહાવાની ઓરડાઓમાં વીજળાથી ગરમ થતું પાણી નળ વાટે આવતું હતું. પીવાનું પાણી પણ દરિયાના ખારા પાણીને વીજળાનાં ધંત્રો દારા શુદ્ધ કરીને વાપરવામાં આવતું હતું. રસોડાની પડ્યે વહાણુના ખલાસીઓને રહેવા માટેનો ઓરડો હતો, પણ તે બંધ હતો. એટલે તેમાં શી સગવડ છે અને ડેટલા માણુસોનો સમાસ થઈ શકે તેવું છે, તે હું જોઈ શક્યો નહિ. મને લાગ્યું કે આ વહાણું ઉપર ડેટલા માણુસો છે તે અમે ન જાણીએ, તે માટે ડેપ્ટન બહુ સંભાળ રાખતો હતો.

અહીંથી અમે વહાણુના એંજિનના ઓરડામાં ગયા. આખો ઓરડો પ્રકાશિત હતો. ઓરડો લગલગ ૬૫ કૂટ ધેરાવાવાળો હતો. તેના એ ભાગ હતા; એક ભાગમાં ક્રક્ષત વીજળા ઉત્પન્ન કરવાનું જ કામ ચાલતું હતું, અને ખીંચ ભાગમાં તે વીજળાના બળથી પંખો ચલાવવાનું કામ ચાલતું. સોડિયમને લીધે તેમાંથી નીકળતા ગેસની વિચિત્ર વાસ ઓરડામાં આવતી હતી. ડેપ્ટનના કહેવા પ્રમાણે આ વાસ દૂર કરવા માટે રોજ સવારમાં આખું વહાણું ધેરાવામાં આવતું હતું. વહાણુનાં ધંત્રો જેવામાં મને રસ પડ્યો, તેણે મને પંખો બતાવ્યો. ઓગણીસ કૂટના ધેરાવાવાળો આ પંખો સેકન્ડમાં ૧૨૦ ચક્કર દેતો હતો.

મેં ડેપ્ટનને પૂછ્યું: 'આ પંખાને લીધે તમે વહાણુની ડેટલી ઝડપ રાખી શકો છો?'

ડેપ્ટને કહ્યું: 'કલાકના વધારેમાં વધારે પસાસ માઈલ.'

પાણીમાં આટલી ઝડપથી વહાણ ચલાવતું એ કઈ રીતે બનતું હશે તે મને સમજયું નહિ. ખીજુ શંકા મને એ થઈ કે આ વહાણું

દરિયાને તળિયે કઈ રીતે પહોંચતું હશે? દરિયાને માટે કોઈ વિધાન નથી. આપણે ઘણું ખરું તો જેઈ લાખું: હજુ જે જેવાનું બાકી છે તે માટે આપણું માસે મિશ્કળ વખત છે, કારણું કે આપણે અંને કઢી આ વહાણું છીડીને જવાના જ નથી. ચાલો, હવે આપણે ભારા ઓરડામાં પેસીએ.'

અમે એક મોટા ટેચુલ પાસે ખુરથીઓ પર બેડા. કોઈને ટેચુલ ઉપર વહાણુનો પોતે હારેસો નકશો પાથર્યો, અને સિગાર પીતાં પીતાં તેણે આગળ ચલાવ્યું: 'જુએ, આ વહાણુની લંબાઈ ૨૩૨ ફુટની છે. તેતી વધારેમાં વધારે પહોળાઈ ૨૬ ફુટની છે. તેનું વજન ૧૫૦૦ ટન છે, અને તે કુલ ૫૦૦૦ ઘનફુટ જગ્યા રોકે છે. આ વહાણુની રૂચના એવી જિતની છે કે જ્યારે તે સામાન્ય રીતે તરતું હોય ત્યારે તેને ૬/૧૦ લાગ પાણીની અંદર રહે જને ૧/૧૦ લાગ જ બદાર રહે. આ વહાણુની ભજભૂતી માટે તેના ઉપર પતરાંનાં એ પડ જડવામાં આવ્યા છે અને તેને એવી ભજભૂત રીતે રિવેટ મારવામાં આવ્યા છે કે દરિયાના ગમે તેવા તોઝનમાં તેને જરાયે આંચ ન આવે. હવે જ્યારે આ વહાણુને મારે સાચ સપાઠી ઉપરથી નીચે લઈ જવું હોય ત્યારે આ વહાણુની નીચે રાખેલું એક પાણીનું ટાંકું હું બોલી દઉં છું, અને એ ટાંકાંમાં પાણી ભરવાથી વહાણું થોડું કંઈ નીચે જિતરે છે. આ જ પ્રમાણે જ્યારે મારે વહાણુને વધારે નીચે ઉત્તારવું હોય છે, એટલે કે કેઠ દરિયાના તળિયા સુધી લઈ જવાનું હોય છે, ત્યારે બીજાં રાખેલાં ટાંકાંએ હું પાણીથી લરી દઉં છું અને જ્યારે પાછું ઉપર આવવું હોય છે ત્યારે વીજળાના પંપથી એ બધાં ટાંકાંએ ઉદેચી નાખું છું. વહાણુનું વજન ઉલ્કું થવાથી વહાણું તરત ઉપર આવે છે.'

કોઈને ખુદી ઉપર શાખાશી આપ્યા સિવાય રહેવાય તેવું ના હતું. કેષને તો ચાલુ જ રાયું: 'વળી વહાણુનો સુકાની પોતાનું

શુક્રાન લઈને વહાણુના ઉપરના ભાગમાં કાચની બનાવેલી એક નાની એવી આરડીમાં બેસે છે. પાણીના ગમે તેવા દાખાણુમાં ન તૂટે તેવો એ કાચ છે. એવા જડા કાચમાંથી પાણીમાં સ્પષ્ટ ન જોઈ શકાય; એટલા માટે તેની સાથે એક ખૂબું પ્રકાશિત વીજળાની બૃતી મૂકવામાં આવી છે, જેનો પ્રકાશ પાણીમાં અરધા માર્ઠલ સુધી પડે છે.'

‘કોટન સાહેબ! ખરેખર, તમારું વહાણુ અહલુત છે!’
મેં કહ્યું.

‘હા, પ્રોફેસર સાહેબ! અને તેને હું મારા જીવની જેમ ચાહું છું. આ જ મારો આશ્રય છે, આ જ મારો સાથી છે; દુનિયાનાં ઉત્તમમાં ઉત્તમ વહાણો કરતાં પણ મારું વહાણુ ઉત્તમ છે. દુનિયામાં ડોઈ તેને આંગળી અડાડી શકે તેમ નથી. એને આંગળી અડાડવાનું પરિણુંમ શું આવે છે તેની તમારી સ્ટીમર અચ્છાહમ લિંકને એને તમને પણ ખરે પડી ગઈ છે. મારા વહાણુમાં મને અપાર શક્ષ છે. હું તેનો માલિક છું, તેનો અનાવનાર છું, એને તેનો કોટન છું.’ ઐલતાં ઐલતાં કોટનની આંખો પ્રકાશી જઈ. એક પિતાનો પેતાના આગક ઉપરનો પ્રેમ તેના ચહેરા ઉપર બેલરાતો હતો.

‘પણ આવડું મેડું વહાણુ તમે છૂંબી રીતે કઈ રીતે બનાવી શક્યા?’

‘મેં આ વહાણુના જુદા જુદા ભાગો જુદાં જુદાં કારખાનાં-આમાં બનાવરાવ્યા હતા. દરેક કારખાનામાં મેં જુદા જુદા નામથી એ ભાગો બનાવવાનો ઓર્ડર આપેથે હતો. પણી સમુદ્રના એક ઉજાજડ બેટ ઉપર મેં નાનું એવું કારખાનું ઘોલ્યું, મારા ખાસ વિશ્વાસુ માણુસો જે જીવનપર્યાંત મારા સાથીઓ છે, તમને સાથે રાખીને આ બધા જુદા જુદા ભાગો મેં બંધખેસતા કર્યો. જ્યારે વહાણુ સંપૂર્ણ બૃતી ગયું ત્યારે એ બેટ ઉપરના કારખાનાના મકાનને મેં આગ મૂકી દીધી. માણુસની વસ્તીનું કંઈ પણ ચિહ્ન ત્યાં ન રહે માટે કુકત

આખો એટ ઉડાડી મૂકવા સિવાયનો દરેક દરેક ઉપાય મેં લીધો હતો.'

‘આ વહાણુની તમને લગભગ ડેટલી કિંમત પડી ?’

‘બધું થઈને લગભગ એ લાખ પૌંડ થયા હશે.’

‘ત્યારે તો તમે બધા ખૂબ ચૈસાદાર હશે ?’

‘ખૂબ જ. જો હું ધારું તો ઈંગલાંડ આખાતું હેઠું પતાવી દઉં.’

કોટન મારા સામું જોઈને જરાક હસ્યો.

તેના એ હાસ્યમાં ડેટલો તિરસ્કાર ભરેલો હતો !

૮

શિકારનું ચોમંત્રણ

પાસિફિક મહાસાગર ઠેઠ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી અને અશિયાના પૂર્વ કિનારાથી અમેરિકાના પશ્ચિમ કિનારા સુધી પથરાઈ પડ્યો છે. બધા સમુદ્રોમાં તે સૌથી શાંત છે, તેના પ્રવાહો વિશાળ અને ભંડ છે. તેની લરતી પણ શાંત હોય છે. તેમાં વરસાહો પુષ્ટ પ્રમાણુમાં વરસે છે. બહુ વિચિત્ર સંનેગોમાં આ મહાસાગરની અંદર અમારે ફરવાનું થયું.

‘પ્રાઇસર! આપણી મુસાફરી અહીંથી શર થાગ છે. જુઓ, ચોખ્યાખાર થવા આવ્યા છે. હવે હું વહાણુને દરિયાની સપાઠી ઉપર લઈ જાઉં છું.’

એટલું બોલીને કેપ્ટન નેમોએ વીજળાની ટોકરી ત્રણ વાર વગાડી કે પંચો ચાલુ થઈ ગયા. પાણીનાં ટાંકાંઓમાંથી પંચ વડે પાણી ઉલેચાવા લાગ્યું. સાથે મેનોમિટરની સોાય વહાણુની ઉપર જતી ગતિ માપવા લાગી. થાડી વારમાં વહાણું દરિયાની સપાઠી ઉપર આવી પહોંચ્યું. અમે વહાણુની બરાબર વચ્ચે આવેલી સીડી ઉપર ચડ્યા અને વહાણુના તૂતક ઉપર આવી પહોંચ્યા. ઉપર ચડીને જેખું તો બરાબર શાળાના કાંઠલા જેવો વહાણુનો આઢાર સ્પષ્ટ હેખાતો. હતો. દૂરથી આ વહાણુને જેઠીને ફોઈ તેને દરિયાઈ પ્રાણી ધારે એમાં શી નવાઈ?

તૂતકની પડ્યે જ એક નાની એવી હોડી તરતી હેખાઈ. વહાણુને બંને છેડે બે પાંજરાં જેવી આરડીઓ હતી. કાચની દીવાદોથી તે મહેલી હતી. એકમાં સુકાની બેસતો હતો, અને બીજમાં સર્વલાઈટ મૂકવામાં આવી હતી.

સમુક્ત ખૂબ સુંદર હેખાતો હતો. આકાશ સ્વરં હતું. ચારે બાજુ ક્ષિતિજમાં પાણી સિંહાય કથું હેખાતું નહોતું. ડેપ્ટને આકાશમાં મધ્ય ભાગે આ વેલા સ્રૂય ઉપરથી માપ કાઢીને નક્કી કર્યું કે અમારું વહાણું અત્યારે પારિસના રેખાંશને ધોરણે ૮૫° ૧૫" પશ્ચિમ રેખાંશ અને ૩૦° ૭" ઉત્તર અક્ષાંશ એટલે કે જપાનના કિનારાથી ૩૦૦ માઈલને અંતરે છે. બરોયર આડમી નવેમ્બરે અપોરે અમારી મુસાફરી શરૂ થઈ.

ડેપ્ટન ત્યાંથી મને એક ઓરડામાં લઈ ગયો. પુસ્તકાલયના પુસ્તકો તથા નકશાઓ વગેરે બંધું મને વાપરવા માટે ભારા કળખમાં મહુંદું અને ચાલ્યો ગયો. અમારું વહાણું પાણું સમુક્તની સપાઈથી ૪૦ વામ નીચે જનરીને તરવા લાગ્યું.

હું એકદેા પડ્યો. ભારા મનમાં ડેપ્ટન નેમેના જ વિચારો ધોળાયા કરતા હતા. તેનું પ્રયંડ શરીર ભારી આંખ આગળથી ઘડી પણ દૂર નહોતું થતું. તેના શર્ખદા ભારા કાનમાં ચુંઝયા જ કરતા હતા. મનુષ્યભૂતિ તરફનો તેનો આદલો બધો તિરસ્કાર મને સમજતો નહોતો, કલાકો સુધી આ જ વિચારો ભારા મનમાં ચાલ્યા કર્યા.

‘બ્લેક રિવર’ને નામે ઓળખાતો પાસિસ્ક્રિપ્ટ ભાગસાગરના ગરમ પ્રવાહ બંગાળના ઉપસાગરમાંથી નીકળી, મલાક્કાની સામુરંધુની વીંધી એશિયાને કિનારે કિનારે ચેતે છે, અને ત્યાંથી ઉત્તર પાસિસ્ક્રિપ્ટમાં પ્રવેશ કરે છે. અનેક જલતની વિધવિધ ગનસ્પતિઓનાં અને કપૂરનાં આડનાં મોટાં મોટાં થડાને તે પોતાની સાથે ફેરવે છે. અમારું વહાણું પણ આ પ્રવાહની સાથે જ આગળ વધવા લાગ્યું. હું આ જોતો હતો ત્યાં નેડ અને ડ્રાન્સીલ ભારા ઓરડામાં આવ્યા. ભારી જેમ તેઓ પણ આ વહાણનું અદ્ભુત દસ્ય જોઈને તાજું થઈ ગયા હતા. તેમને મેં ડેપ્ટન નેમેસા સાથેની ભારી વાતચીત તથા વહાણુંમાં મેં જે કાંઈ જેણું હતું તે બધું કહી સંભગાયું. નેડને વહાણના વર્ણનમાં બહુ રસન પડ્યો; તેણે તો ડેપ્ટન નેમો ડોણ છે, તે આપણું ને છચાં લઈ જવા ભાગે છે, આપણું શું થવાનું છે,

એવા જ પશો મને પૂછવા માંડચા. મેં ભારાથી આપી શકાય એવા ખુલાસા આપ્યા; પણ તેથી કાઈ તેને સંતોષ થાય?

અમે વાતો કરતા હતા તેવામાં એકએક ઓરડામાં અંધારું થઈ ગયું. અમે ગભરાયા. ઓરડાની છત ઉપર ને બારી હતી તે બંધ થઈ ગઈ, પણ થોડી જ વારમાં પાછું ઓરડામાં અજવાળું આવ્યું. ઓરડાની આજુની લાંતે એ લંગ્યોરસ બારીઓ અમે જોઈ. બારીઓ જડા કાચની હતી. તેમાંથી વહાણુની અહારનો દેખાવ જોઈ શકતો હતો. વહાણુની એક મોટી વીજળાની અતીથી દરિયાની અંદર લગભગ એક માઈલ સુંધી પ્રકાશ પડતો હતો. આ દશ્ય ખૂબ અદ્ભુત હતું. દરિયાનું પાણી મીઠા પાણી કરતાં વધારે સ્વરૂપ અને પારદર્શક હોય છે. કાઈ કોઈ જગ્યાએ તો પંચોતેર વામ સુંધી દરિયાનું તળિયું સ્પષ્ટ જોઈ શકાય છે, અને સૂર્યનાં કિરણો ૧૫૦ વામ સુંધી પહેંચી શકે છે, વીજળાનો અગહણતો પ્રકાશ આ પાણી સાથે એવો ભળી ગયો હતો કે જણે વીજળાનો પ્રકાશ જ પ્રવાહી ઇપમાં ફેરવાઈ ન ગયો હોય!

આ પ્રકાશમાં દરિયામાં અદ્ભુત સુષ્ઠિ જોવાનો પહેલો પ્રસંગ મળ્યો. જતની માછલીઓ વહાણુની આસપાસ જેવી કરતી હતી. કેટલીક આ નિયિત્ર પ્રાણી જોવા વહાણુને જોઈને નાસી જતી હતી. મને અને ડેન્સિલને આ માછલીઓનો થાડોધણો અભ્યાસ હોવાથી એમાં ખૂબ રસ પડવા માંડયો. પણ નેડને તો એ માછલીઓમાં શિકાર પૂરતો જ રસ હતો; તેને રસ અહીં પોથાય તેવું નહોતું, એટલે તે મૂંગા મૂંગા બેડો હતો. પણ ડેન્સિલ તેને બેસવા હે તેમ નહોતું. માછલીઓ વિષેતું પોતાનું જાન તે નેડ પાસે ડાલવવા માંડયો! હું તો એ માછલીઓ જોવામાં તલ્લીન હતો.

સાંજ પડી. એકએક બંને બારીઓ અંધ થઈ ગઈ. ઓરડાની ઉપરના ભાગમાંથી પાછો પ્રકાશ આવવા માંડયો. સમુદ્રનું દશ્ય એકએક અંધ થયું ત્યારે તો મને લાગ્યું કે હું સ્વઘનમાંથી

ભગ્યો છું. ઉપર થંત્રોમાં જેયું તો કર્મપાસ (હોકાયંત્ર) ઉપરથી માલૂમ પડયું કે વહાણું ઈશાન ખૂણું તરફ જય છે; મેનોમિટર તરફ જેયું તો વહાણું ઉપર પાંચ વાતાવરણુનો ભાર હતો, એટલે લગભગ ૧૦૦ વામની બાંચાઈએ વહાણું ચાલતું હતું; અને વહાણુની ઝડપ કલાકના પંદર માઈલની હતી. મને હતું કે હમણાં કેટન નેમો આવશે પણ તે હેખાયો નહિં. નેડ અને ડેન્સીલ પોતાના ઓરડામાં ગયા. ત્યાં ખાવાનું તૈયાર હતું. લોજન કરીને થાડી વાર મેં લખવાન્યવાનું કામ કર્યું અને પછી સુધી ગયા.

લગભગ ૧૨ કલાકની ઘસઘસાટ બાંધ પછી બીજે દિવસે હું જગ્યો. ડેન્સીલ પોતાની ટેવ મુજબ મારી તખિયતના સમાચાર પૂછી ગયો. નેડ તો હજુ ઘોરતો જ હતો. જીણે મેં કપડાં પહેર્યાં અને સલૂનમાં ગયો. મેં ધાર્યું હતું કે કેટન નેમો ત્યાં હશે પણ તે ખાલી હતો. સલૂનની દરિયામાં પડતી બાસીએ પણ બાંધ હતી, એટલે દરિયાની અંદર કાંઈ જોઈ શકાય તેમ ન હતું. વહાણું તો પોતાની સાધારણ ગતિએ મૂળ દિશામાં જ ચાલ્યું જતું હતું. મારો બીજો દિવસ પણ આ પ્રમાણે પસાર થઈ ગયો. અમારી સરભરા બરાબર કરવામાં આવતી હતી. ખાવાનું પણ બરાબર નિયમિત આવ્યા કરતું હતું; પણ મારા મનમાં જોઈએ તેવો આનંદ નહોતો રહેતો. આખરે અમે કેઢી હતા! હું નવરો પડતો ત્યારે વાંચવા લખવાનું અને નોંધા કરવાનું કર્યા કરતો હતો.

અગિયારમી નવેમ્બરની સવારે એકાએક આખા વહાણમાં તાજી હવા ફેલાઈ ગઈ. અમારું વહાણું તાજી હવા લેવા માટે દરિયાની સપાઈ ઉપર આવ્યું. હું દરિયાનાં દર્શિન કરવા માટે વહાણુના રૂતક ઉપર ચડ્યો. સવારના છ થયા હતા. આકાશમાં વાંદળાં હતાં, દરિયો શાંત હતો. મને હતું કે કેટન અહીં મળશે, પણ મેં પેલા કાચના પાંજરામાં ફૂલ સુઠાન સાચવીને બેઠેલા માણુસને જ જોયો. હું તો બેડો બેડો દરિયાની ખુશ્નુમા હવા ધરાઈ ધરાઈને પીવા લાગ્યો. થાડીવારે આછાં વાંદળાંઓને

ચીરીને સ્વર્ણનાં બાલકિરણો પાણી ઉપર નાચવા લાગ્યાં. એટલામાં એક માણુસ ઉપર આવ્યો. મને જણે જેણો જ ન હોય તેમ મારી પડણે જીબા રહીને દૂરભીન માંડીને તણે આસપાસ નજર નાખી અને પછી કાંઈક વિચિત્ર ભાષામાં તે એક વાક્ય બોલ્યો. એ વાક્ય જોકે પછી તો હું રોજ સાંભળતો; પણ હજુ સુધી તેનો અર્થ હું સમજ શક્યો નથી. પેલો માણુસ નીચે ચાલ્યો ગયો. હું પણ મારા ઓરડામાં ગયો. પાંચ દિવસ આ પ્રમાણે પસાર થઈ ગયા. રોજ અમારો વખત કંદળાભરેલી રીત પસાર થતો. કેપ્ટન નેમો મને ક્યાંયે દેખાયો નહિ. હવે તો મારે જ તેને ભળવા જવું એમ મેં નક્કી કર્યું. ત્યાં એક દિવસે ૧૬મી નવેમ્બરે મારા ઓરડામાં દાખલ થતાં જ મેં ટેબ્લ ઉપર એક ચિહ્ની પડેલી જેઠ. મેં તે ખાલી. ચિહ્ની મોટા અને ચોપખા અક્ષરે લખેલી હતી :

“ પ્રોફેસર એરોના !

આવતી કાલે સવારે કેસ્પોના બેટમાં આવેલા જંગલની અંદર શિકાર કરવા માટે કેપ્ટન નમેં આપને આમંત્રણ આપે છે; અને આચા છે કે તેમાં આપને વાંધા નહિ હોય. આપના સાથીઓ પણ જે આપની સાથે આવશે તો વિશેષ આનંદ થશે.”

૧૦

મહાસાગરને તળિયે કેવા હન ન આપાં એવી છાંદો
 આપણાં આપણાં જીવાન કરું ચાહેલું હતું તેથી મને ખૂબ નવાઈ
 લાગી. કેપ્ટન કહેતો હતો કે જમીન સાથેનો બધો સંબંધ તેણે છોડી
 દીધો છે, એ વાત મને ઘાટી લાગી. શિકારની વાતથી નેડને એ
 રીતે આનંદ થયો; એક તો, ધ્યે વખતે જમીન ઉપર પગ મૂકવાનો
 વખત આવ્યો હતો, અને બીજું એક વાર જમીન ઉપર પગ મૂક્યા
 પછી આ કયંકર માણુસના પંજમાંથી છટકવું સહેલું બને તેવું
 તને લાગતું હતું.

મેં નકશામાં જેયું તો એમાં એક નાનો અવો બેટ અભિ
 ખૂબુંમાં આવેલો જેયો. બેટ સાવ ઉજજડ હોવો જેઠું એમ
 નકશા ઉપરથી જેઠું શકાતું હતું. રાત પડી. મને જિંદગી આવી
 ગઈ પણ જિંદગાં શિકારનાં જ સ્વર્ણાં આવવા લાગ્યાં. સવારે વહેલો
 જીને કપડાં પહેરી હું દીવાનખાનામાં પહેંચી ગયો. કેપ્ટન નમો
 ત્યાં મારી વાટ જેતો જ બેઠો હતો.

‘કેમ મારી સાથે આવવા તૈયાર છો ને?’ કેપ્ટને એક ખુરશી
 આપતાં આપતાં પૂછ્યું.

‘હા.’ મેં કહ્યું, ‘મારે કશો વાંધો જ નથી. વાંધો તો તમારે
 હોવો જેઠું.

‘મારે શો વાંધો હોય?’ કેપ્ટને આશ્રયથી પૂછ્યું.

‘કેમ, તમે જમીન ઉપર પગ નથી મૂકતા ને?’

‘ના, એવું નથી. જરૂર પડે તો મૂકું પણ ખરો. પણ આજે
 તો નથી મૂકવાનો.’

‘તો પછી શિકાર કઈ રીતે કરશો?’

‘તમે હજુ નથી સમજ્યા. આજે આપણે જમીન ઉપરના જંગલમાં શિકાર કરવા નથી જવાના.’

‘ત્યારે?’

‘સમુદ્રને તળિયે જંગલમાં જવાના છીએ.’

‘હું! ત્યારે તો મને કુખ્યાવવાની વાત લાગે છે. મારાથી બોલી જવાયું?’

‘ના. તમારા શરીરને પાણીનું એક ટીપું પણ ન અડે એવી રીતે તમને હું લઈ જવાનો છું?’

‘અને શિકાર શાનાથી કરશો?’

‘શાનાથી કેમ? બંધુકથી.’

મને થયું કે કુપ્ટનતું મગજ ભર્મી ગયું છે. પણ એમ કંઈ તેને કહેવાય ખરું? એમ કહેવામાં તો મારા જીવનું જોખમ હતું. તેણે મને નાસ્તો કરીને તૈયાર થઈ જવા માટે કહ્યું. એક કલાકમાં હું નાસ્તો કરીને તૈયાર થઈ ગયો; મારા મિત્રો પણ તૈયાર થઈ ગયા હતા. કુપ્ટન નેમો આવીને મને એક ઓરડામાં લઈ ગયો. એ ઓરડામાં વિચિત્ર જાતના કેટલાક પોશાકો ટાંગેલા હતા. કુપ્ટને એ પોશાકો ખતાવીને કહ્યું: ‘ગ્રાહેસર, તમને એમ લાગ્યું હશે કે આ માણુસ ગાંડો થઈ ગયો છે. પણ તમે જરાક વધારે વિચાર કર્યો હોત તો તમને એમ ન લાગત. તમે જાણો છો કે માણુસને પેતાની પાસે હવા લેવાનું સાધન હોય તો તે પાણીની નીચે પણ જીવી શકે છે. તમારા જ દેશના એ માણુસોએ પાણીની અંદર હવા લેવાનું યંત્ર શોધી કાઢ્યું હતું. મેં તેમાં ચોડાક સુવારા-વધારા કરીને તેને મારા ઉપરોગમાં લીધું છે. જડા લેઢાના પતરાની નાની એવી પેટીમાં હું હવા લરું છું. એ પેટી પાડ ઉપર બાંધી હેવામાં આવે છે. અને એ નાની રૂપરની નળાએ નાક સાથે ન મોઢા સાથે જોડેલી હોય છે; એક નળામાંથી તાજુ હવા નાકમાં આવે છે, અને બીજુ નળામાં થઈ ને મોઢા વાટે જેરી હવા બડાર નીકળી જય છે. આપા શરીર ઉપર

પહેરવા માટે પણ મજબૂત રજારનો। પોશાક અમે વાપરીએ છીએ.
તમને શંકા એ થશે કે પાણીમાં રસ્તો કઈ રીતે દેખાતો હશે? તને
માટે મેં વીજળાની બતીએ તૈયાર કરી છે.'

' એ તો હીક, પણ પાણીમાં તમે બંદુક કઈ રીતે ફોડો છો? ' મેં પૂછ્યું.

' હા, તે પણ હું કહેવાનો જ હતો. હું કાંઈ સાધારણ બંદુકમાં
વપરાતી ગોળાએ નથી વાપરતો. મારી બંદુકની અંદરથી વીજળાના
ખળને લીધે સીસાની ગોળાએ એવા જોસથી છૂટે છે કે પ્રાણી ગમે
તેવું ખળવાન હોય તો પણ તને તે વીધી નાખે છે.'

' બસ, હવે હું તૈયાર છું: તમે જ્યાં જરો ત્યાં હું તમારી
સાથે આવીશ.' મેં કહ્યું.

' પણ આ તમારા સાથીએ? ' કોટને પૂછ્યું.

' અમે તો નશેય સાથે જ હોઈએ ને! ' ડોન્સીને તરત જ કહ્યું.
નેડ બિયારો નિરાશ થયો. જમીન ઉપરથી નાસી છૂટવા માટે
મગજમાં ઘડેલી એની યોજનાએ ધૂળવાણી થઈ ગઈ! છતાં એ
પણ અમારી સાથે આવવા માટે તૈયાર થયો.

પોશાક પહેરવાનું કામ શર થયું. કોટના હુકમથી એક માણુસે
બધાને પોશાક પહેરાવ્યા. અમને દરેકને એકએક બંદુક પણ આપી.
કારતૂસનો એકએક પઢો પણ અમારે ખબે અંધવામાં આવ્યો. કપડાં
પહેર્યાં હતાં છતાં અમારું શરીર છૂટથી હરીકી શકતું હતું. અમારા
હાથમાં એક એક અતી પણ આપવામાં આવી.

પોશાકમાં સંજ થયા એટલે અમે એ ઓરડામાંથી નીચેના
ભાગમાં એક ટાંકા જેવા ઓરડામાં જતર્યા. તરત જ તે ઓરડો
ઉપરથી બંધ થઈ ગયો અને થાડી વારમાં તો એક મોટા નળમાં
થઈને સમુદ્રનું પાણી તે આખા ઓરડામાં ફરી વલ્યું; અમે પાણીની
અંદર જ હતા. ઓરડો પાણીથી ભરાઈ જતાં નીચેતું બીજું બારણું
જિવડ્યું; એક જાંખો પ્રકાશ દેખાયો, અને બીજી જ ક્ષાળે અમારા

પગ દરિયાના તળિયે અડચા ।

દરિયાની સપાઈથી નીચે પાંચ વામ આવેલા ભાગ ઉપર જિંદગીમાં પહેલવહેલો મારો પગ અડચો ત્યારે મારા મનમાં શું શું થયું હશે તેની કહેપના તમે જ કરી ખેલો. મારી કલમ તેતું વર્ણન કરવા સમર્થ નથી.

કેપ્ટન નેમો અમારા બ્યાનાની આગળ ચાલતો હતો. હું અને ડ્રાન્સિલ બંને સાથે સાથે ચાલતા હતા. વીજળાના પ્રકાશથી હું લગભગ ૧૦૦ વામ સુધી જેઈ શકતો હતો. મારી આસપાસનું પાણી મને પાણી જેવું નહોટું લાગતું પણ હવાનું ઘણું વાતાવરણ જ લાગતું હતું. અમારા પગ નીચે સુંદર સુંવાળી રેતી હતી. સુર્યનાં કિરણો અહીં સુધી પહોંચવાનો પ્રથતન કરતાં હતાં.

અહીં કેપ્ટન નેમો અટક્યો. હું તેની પાસે આવી પહોંચ્યો. તેણે મને દૂર આંગળી ચીંધીને ફાંઈક અતાવ્યું. દૂર દૂર જાંખા કાળા પડદા જેવું હેખાતું હતું. ‘આ જ કેસ્પો બેટનું જંગલ લાગે છે.’ મેં વિચાર કર્યો.

અમે જંગલની સરહદ ઉપર આવી પહોંચ્યા હતા. અહીં કેપ્ટન નેમોનું સામ્રાજ્ય હતું. અહીં ડ્રાઈ તેના રાજ્ય ઉપર ચાઈ કરવા આવે તેમ નહોટું. કેપ્ટન નેમો રાજની જેમ પોતાના માણુસો સાથે આ જંગલમાં પેડો. અમે તેની પાછળ જ હતા. અમારા રસ્તાની બંને બાજુએ સીધા સોટા જેવા મોટા મોટા છાડાની હાર લાગી ગઈ હતી. નીચે ગાલીયાની જેમ ઘાસ પથરાઈ ગયું હતું; એ ઘાસની નાની નાની સળાઓ પણ જિભી જ રહેતી હતી. ખૂબી તો એ હતી કે છોડ કે ઘાસને મૂળ જ નહોટાં! વળી આ વનસ્પતિ અને તેની પાસે જ સંખ્યાખંધ પડેલાં નાનાં મોટાં જીવજંતુઓ એવી વિચિત્ર રીતે પથરાયેલાં હતાં કે કઈ વનસ્પતિ છે અને કહું જંતુ છે તેની ખખર જ ન પડે.

લગભગ એક વાગે કેપ્ટન નેમોએ અમને બ્યાને અટકાવ્યા,

અમે ત્યાં થોડી વાર આરામ કરવા એઠા; પરંતુ અમે વાતચીત નહોતા કરી શકતા. આસપાસનું હસ્ય ડેવું મનોહર હતું। મને ભૂખ જરાયે નહોતી લાગી. ચાર કલાક સતત ચાલ્યા છતાં ભૂખ ન લાગે એ પણ એક નવાઈ ને? પણ ડોણ જાણે ડેમ, મારી આંખે ઘેરાવા માંડી; હું બીજી ગયો.

હું કેટલું બંધ્યો તે ખાખર ન પડી. પણ હું જાણ્યો ત્યારે સ્વર્ણનાં કિરણો ત્રાંસાં અને સાવ જાંખાં પડતાં હતાં. કોટન નેમો અને તેના માણુસો જિપડવાની તૈયારીમાં જ હતા. હું આગસ મરડતો હતો અને ધીમે ધીમે જિવવાની તૈયારી કરતો હતો, ત્યાં આચિંતા હું ઝૂદ્દો મારીને જિલો થઈ ગયો. મારાથી થોડું જ દૂર એક મોટો દરિયાઈ કરેાળિયો લગભગ ત્રણું ફૂટ લાંખો. મારી સામે આંખે કાઢીને આવતો મેં જેયો. જેકે મારે પોશાક એઠદેંબો મજબૂત હતો કે તે મને કંઈ કરી શકે તેમ નહોતું; તોયે ઘડીક તો મને ખીક લાગી જ ગઈ, હું જિલો થઈ ગયો.

પાણ અમે આગળ વધવા લાગ્યા. અમે દરિયાની સપાઈથી લગભગ ૪૫ વામ નીચે હતા. અંધારું વધતું જતું હતું, એટલે કેપ્ટન પોતાની વીજળાની અતો સંગ્રહાની. અમે ચાલતા હતા ત્યારે વચ્ચે વચ્ચે કેપ્ટન નેમો અટકીને બંધુક તાકતો હતો. બંધુકનો અવાજ તો સંભળતો નહોતો, પણ ચિકાર થતો હતો. અમ કેપ્ટન નેમોની હિલયાલ ઉપરથી જણ્યાઈ આવતું હતું. અનેક નાનાં મોટાં દરિયાઈ પ્રાણીઓ પણ આમથી તેમ નાસી જતાં હતાં.

આખરે ચાર વાગ્યે અમારી સુસાઇરી પૂરી થઈ. સામે એક મોટી ખડકની દીવાલ આડી આવી. અહીંથી અમે પાણ ઝર્યા. કેપ્ટન નેમો અહીં પણ અમારી સૌની મોખરે ચાલતો હતો. અમે જ રસ્તે જતા હતા તે જ રસ્તે પાણ નહોતા ફરતા; નવો રસ્તો તો ખૂબ ઢાળવાણો હતો અને તેથી ખૂબ અધરો પણ હતો. ઐશક એ રસ્તો દૂંડો તો હતો. જ,

પાણા કરતાં મેં કેપ્ટન નેમોની એ સરસ નિશાનખાજુઓ જોઈ. પહેલી વાર એક મોહું દરિયાનું માછલીમાર પ્રાણી તેના શિકારનો લોગ થઈ પડ્યું. તેના જ્ઞાન રૂપેરી, સુંવાળા પેટવાનું લગભગ એ મણું વજનનું આ પ્રાણી દુનિયાના સસુદમાં હવે લાગ્યે જ નેતા મળે છે. કેપ્ટન નેમોના સાથીઓએ તેનું મર્ફતું ખલે ઉપાડી લીધું અને અમારી ટોળી આગળ ચાલી.

ધીમે ધીમે અમે દરિયાની સપાઠી તરફ આવતા જતા હતા. સપાઠી પરનાં ખળખાટ કરતાં મોનં હવે મને જખ્યાતાં હતાં. મોટાં મોટાં પક્ષીઓના આંખા આળા પણ હું જોઈ શકતો હો. આ પક્ષીનાં જડતાં ટોળાં તરફ તાકીને કેપ્ટન નેમોએ પાણીમાંથા જ બંધુકની ગોળી છોડી અને જોતનેતામાં પક્ષી પાણીમાં પડ્યું. તરત જ એક માણુસે તે પક્ષી લીધું. એ પક્ષીનું નામ આલબ્રોસ.

અમારી દૂર્ય ચાલ્યા જ કરતી હતી. હવે હું થાડ્યો હતો. નોટિલસનું આંખું તેજ હૈખાયું. લગભગ અરધા કલાકનો રસ્તો બાકી હશે. હવાની ડોથળીમાંથા હવા પણ જણે ઓછી થતી હોય એમ લાગ્યું, કારણું કે હવે શાસ લેવામાં નેર પડતું હતું.

હું કેપ્ટન નેમોથી લગભગ વીસેક ડગલાં પાણા હોઈશ. અવામાં એકાએક કેપ્ટન નેમો મારા તરફ ફર્યા અને પોતાના મજબૂત હાથને ધક્કો મારી મને નીચે પાડી દીધ્યો. હું તો આલો બની ગયો! કેપ્ટન મને આમ શા માટે પાડી હેતો હશે તેનો ય હું વિચાર ન કરી શક્યો, કારણું કે હું બીજીથી ગલરાઈ ગયો હતો. પણ જ્યારે કેપ્ટન ચેતે અને તેના સાથીઓ પણ નીચે મારી પડ્યે જ સુર્ખ ગયા. ત્યારે ભય ઓછો થયો. પણ આમ કરવાનું કારણું સમજયું નહિ.

મેં ઉપર જ્ઞાન તો અમારા ઉપરથી નાનાં કાળાં વાદળાંની જેમ એ શાર્ક માછલીઓ ચાલી જતી હતી. જેમના ભયંકર જડ્યામાં માણુસ એક જ ડોળિયો થઈ જય એવી એ માછલીઓ હોય છે.

હું તેમતું ઇપેરી પેટ અને લયંકર દાંતવાળું મોઢું જેઈ શક્યો. અમારી અને તેમની વચ્ચે સહભાગે એક નાનો એવો છોડ આવી ગયો હતો. એ ઉપરાંત એ પ્રાણીએ બહું માડું હેખે છે, એટલે શાર્ક માછલીએ અમારા ઉપરથી જ પસાર થઈ ગઈ; અમે જિભા થઈ ગયા. અરધા કલાક પછી પેલા પ્રકાશને આંનારે આધારે અમે નોટિસ પાસે આવી પહોંચ્યા. બહારનું બારણું ઉધાડવામાં આવ્યું; અમે અંદર ગયા. તરત જ પંપ ચાનું થઈ ગયા અને અમે જે ટાંકામાં જિભા હતા તેનું પાણી ઉલેચાઈ ગયું. પછી તે ટાંકાનું ઉપલું ઢાંકણું ઉધાડ્યું અને અમે વહાણુમાં ચડી ગયા. પોશાક ઉતારીને અમે સીધા ખાણું ઉપર પહોંચ્યી ગયા, અને આખા દિવસના થાકેલા તે ખાઈને ઘસઘસાટ જેંવી ગયા.

૧૧

ભેખઠે ભરાયા

ખીને દ્વિસે હું જાગ્યો ત્યારે મારો બધો થાક જિતરી ગયો હતો. હું જિડીને તરત જ તહાણુંના તૂટક ઉપર ગયો. વિશાળ સમુદ્ર ચારે તરફ વીંટણાઈને પડચો હતો. કચાંયે જમીન કે વહાણું હૈખાતું નહેતું. કેસ્પે બેટ પણ હૈખાતો બંધ થઈ ગયો હતો. હું કચાંય સુધી સમુદ્રના તરંગોની પરંપરા જેતો જિભો રહ્યો. કેપ્ટન નેમો થાડી વારે ઉપર આવ્યો; તેની સાથે થોડાએક માણુસો પણ હતા. માણુસો તેમના ચહેરા ઉપરથી બરાબર ઓળખી શકાયા નહિ, પણ બધા યુરોપિયન હતા એમ તો લાગતું જ હતું. આ લોકો આવ્યો જ બોલતા; અને બોલતા તે પણ બહુ જ વિચિત્ર ભાષામાં.

માણુસોએ પાણીમાં જણો નાખી અને જેતજેતામાં ચિત્ર-વિચિત્ર માછલીએ એ જાળમાં બેંચાઈ આવી.

બધા માણુસો ધીમે ધીમે નીચે ચાલ્યા ગયા. કેપ્ટન નેમો હવે મારા તરફ ઝીરીને બોલ્યો : ‘પ્રેઇસર! સમુદ્ર એ ડેવી અદ્ભુત ચીજ છે! ખરું જવન જ અહીં છે, એમ તમને નથી લાગતું? આખી રાત આપણી જેમ નિશ્ચિક લઈને જણો અત્યારે તે જાગ્યો હોય એમ લાગે છે! ’

આ માણુસની રીતભાત ડેવી વિચિત્ર કહેવાય ! વિવેકના બેચાર શહેરો બોલ્યા સિવાય સીધી વાત જ કરવા લાગે છે !

‘જુએા ! સ્વર્ણનાં કિરણો ધીમે ધીમે તેને પંપાળાને જગાડે છે ! ’ એટલું બોલીને તે એકાટસે ફેટલીય વાર સુધી સમુદ્ર તરફ જોઈ રહ્યો.

નીચે જિતરી કેપ્ટન નેમો પોતાના ઓરડામાં ગયો. હું પણ મારા ઓરડામાં ગયો. અમારું વહાણું ૨૦ માઈલની ગતિએ આગળ ચાલવા માંડયું. બેન્ટણ અઠવાડિયાં સુધી સતત મુસાફરી ચાલુ રહી.

વચ્ચે ખાસ ડોઈ બનાવ ન બન્યો. ઇકત ચિત્રવિચિત્ર માછલાંઓ અને બીજાં પ્રાણીઓ દીવાનખાનાના એરડાની બારીમાં બેડો બેડો હું જેણા કરતો હતો.

* * *

૧૮૬૮ની સાલનું પ્રભાત થયું. સવારમાં વહેલો બણીને હું વહાણુના તૂતક ઉપર દરિયાની ઝુશનુમા હવા લેતો બિલો હતો. પાછળથી ડાન્સિલે આવીને મને કહ્યું : ‘નૂતન વર્ષનાં આપને અભિનંદન આપું છું !’

‘હું પણ તને અભિનંદન આપું છું. પણ આપણું આ નવું વરસ કેવું નીકળશે તે કહી શકાય તેવું નથી. પણ તે સુખી જ નીવડે એવી આશા રાખીએ.’

‘હા જ. વહાણુમાં આપણે ડેઢી થયા, ત્યાર પહેલાં મને કેપ્ટન નમો જરા ભથ્યકર માણુસ લાગતો હતો. હવે તો આપણે જણે વહાણુના ઉત્તાપુણો હોઈએ એમ ઇરી શકીએ છીએ.’

‘નેડ શું માને છે ?’

‘નેડ મારાથી તદ્દન વિરુદ્ધ મત ધરાવે છે. તને પહેલાં તો અહીંનું ખાવું જ ભાવતું નથી. વળી આમ રાતદિવસ પુરાઈ રહેવું એ તને કેમ ગમે ? તને માછલીએ વિષે રસ છે, પણ તે ખાવા પૂરતો જ. મારો વખત તો આપની સાથે માછલીએના જુદા જુદા પ્રકારો જોવામાં અને અવદેહાકનમાં આનંદ્યી ચાલ્યો જય છે.’

‘મને પણ અહીં હીક ક્ષાણી ગયું છે.’ મેં કહ્યું. ‘હું તો જણે ડોઈ મહાન સંગ્રહસ્થાનમાં બેડો બેડો અભ્યાસ કરતો હોઉં એવું લાગે છે. ઇકત એક જ વસ્તુ મને સાલે છે કે આ નવા વર્ષના અભિનંદન વખતે હું તને ડોઈ લેટ આપી શકતો નથી.’

‘પણ હું ડોઈ લેટની આશાએ આપની સાથે અત્યાર સુધી રહ્યો જ નથી.’

‘ધ્યી જાન્યુઆરીએ અમારી નજરે પાંચુંા બેટનો કિનારો

હેખાયો. કોપ્ટન નેમોએ મને કણું હતું કે તેનો વિચાર ટોરસની સામુદ્રધુનીમાં થઈને હિંદી મહાસાગરમાં પ્રવેશ કરવાનો હતો.

ટોરસની સામુદ્રધુની પસાર કરવી એ દુનિયામાં ડાઈ પણ સાહસિકમાં સાહસિક વહાણવટી માટે અસંભવિત જેવું હતું. તેની અંદર એવી તો આણીદાર ખડકની દાંતી આવેલી છે કે મજબૂતમાં મજબૂત વહાણુને પણ તે ચીરી નાખે. કેટલાંય વહાણો આ સામુદ્રધુનીના ગર્ભમાં સમાઈ ગયાં છે. આ ઉપરાંત પણ એ જગ્યા એક બીજી રીતે ભયંકર છે; ત્યાંના જંગલી લેડાની વસ્તી કાંઈ ઓછી લયંકર નથી. પાપુઅન લેડા મનુષ્યબક્ષી તરીકે દુનિયામાં પ્રખ્યાત ગણ્યાય છે.

નોટિલસ આ બધાં જેખમને પણ અવગણીને ટોરસની સામુદ્રધુની તરફ ધસ્યે જતું હતું. આમ તો તે સામુદ્રધુની લગભગ ૧૦૮ માઈલ પહોળો છે, પણ વચ્ચે નાના નાના કેટલાયે બેટા તમાં આવે છે. કોપ્ટન નેમો ખૂબ સાવચેતીથી એમાંથી પોતાનું વહાણ લઈ જતો હતો. એને વહાણુની ગતિ પણ સાત ધીમી રાખવી પડી હતી.

આસપાસનો દરિયો ખૂબ તોઝાની હતો. સાંકડી જગ્યામાં આવીને પાણી જણે મૂંઝાતું હોય તેમ ઉછળા ભારતું હતું અને એને લીધે આખું વહાણ ડેલતું હતું. એકએક આંચેકો લાગ્યો અને હું પડી ગયો. નોટિલસ અટકી ગયું. તે એક ખડકની દાંતીમાં ભરાઈ ગયું હતું. એટ થતો જતો હોવાથી દાંતી હવે ચોખ્યી અહાર હેખાતી હતી.

હું વહાણના તૂતક ઉપર પહોંચ્યો ગયો. કોપ્ટન નેમો પણ મારી પહેલાં જ ત્યાં પહોંચ્યો જઈ અદાન વાળીને જેમો હતો.

‘કેમ કોપ્ટન સાહેબ! કંઈ અકસ્માત થયો?’

‘ના રેના, અકસ્માત જેવું તો આમાં કથું જ નથી. એક બડું સાધારણ બનાવ બન્યો છે.’

‘વારુ, પણ આ બનાવ મને તો ઓવે લાગે છે કે હવે દરિયામાં

આ વહાણુથી તમે મુસાફરી કરી શકો એમ મને લાગતું નથી. વહાણું
બરાબર ભરાઈ ગયું છે।'

'એમ નથી, પ્રેફેસર! હજુ તો આ વહાણુમાં તમારે મારી
સાથે રહીને ધારી લાંખી મુસાફરી કરવાની છે. મુસાફરીની તો હજુ
શરૂઆત થાય છે.'

'હા; પણ તમે જણો છો કે પાસિસ્ટિક મહાસાગરમાં ભરતી
અઙ્ગ જેરમાં નથી આવતી, એટલે હવે આ વહાણનું વજન સાવ
હલડું ન થાય ત્યાં સુધી તે ફરી વાર તરતું થાય એમ મને નથી લાગતું.'

'તમારી વાત યોગીએક સાચી છે. પણ આ ટોરસની સમુદ્ર
ઝુનીમાં ભરતી અને એટ વચ્ચે પાંચ દિવસનો તફાવત પડે છે. આજે
ચોથી જન્યુઆરી થઈ. પાંચ દિવસ પછી પૂનમનો ચંક્રમા જિગશે
ત્યારે એવી ભરતી ચડશે કે મારું વહાણ આપોઆપ બહાર નીકળી
આવશે. ફક્ત પાંચ દિવસ આપણે રાહ જેવી પડશે એટલું જ.'

કેપ્ટન નેમો નાચે ગયો. નેડ મારી પડ્યે જ જિલો હતો. કેપ્ટનનાં
ગયા પછી તે બોલ્યો : 'કેમ પ્રેફેસર સાહેબ ! આ કંઈ ઠીકનથયું ?'

'હા. હમણું તો પાંચ દિવસ આપણે અહીં આરામ કરવાનું
મેં કર્યું.'

'મને તો લાગે છે કે કાયમને માટે અહીં જ આરામ કરવાનું
રહેશે.'

'ના, ના. એમ તે હોય ? કેપ્ટનની ગણુતરી જોગી હોય નહિં.'

'અરે, કેપ્ટનની શું, ભલભલાની ગણુતરી અહીં જોગી પડી
જય એવું છે. પણ આ આપણા કાલની વાત છે એમ મને લાગે છે.'

'કેમ ?'

'વહાણુમાંથી નાસી છૂટવાનો આ સરસ લાગ છે.'

'નેડ ! તને ખખર નથી, કદાચ ધારો કે આ જગ્યાએથી નાસી
છીને આપણે ભાગ્યા; પણ ભાગીનેય કચાં જવાના છીએ ? જિલ્યા
અહીંથી નાસીને જો પાપુઆ બેટમાં ભરાયા તો આપણા નાસ્તો

કરવા માટે જગતીએ તૈથાર બેઠા છે । એના કરતાં તો અહીં ઢીક છે. આ કંઈ દુઃખાંડનો કે ઝાનસને કિનારો નથી; અહીંથી નાસવું એ તો ચૂલમાં જવા જેવું છે.'

'તો કંઈ નહિ. પણ આ પાંચ દિવસ આપણે આ બેટ ઉપર ફરી શકીએ એવું થાય તાયે ઢીક છે.'

'હા, એ ઢીક છે. ધણ્યા વખતથી જમીન ઉપર પગ નથી મૂક્યો. જરાક પગ છૂટો થાય તો સારું.' ડાન્સીલે નેડને ટેકા આપ્યો.

'ભલે, હું કેપ્ટનની રજ મારી જોઉં.' મેં કહ્યું.

'એમાંથી રજ ?'

'હાસ્તો.'

હું રજ લેવા માટે કેપ્ટન નેમો પાસે ગયો. મને તો ખૂબ બીક હતી કે રજ નહિ મળે; એટલું જ નહિ પણ વધારામાં કચાંઈક આરીમાં પુરાઈ રહેવું પડશે. પણ મેં રજ મારી કે તરત જ કેપ્ટને રાજ્યભૂષણથી હા પાડી. મારી પાસેથી વખતસર પાછા ફરવાનું વચ્ચે તણે આગયું.

અમને એક નાની હોડી આપવામાં આવી. નેડ આનંદ્યેલો થઈ ગયો હતો. બીજે દિવસે સવારે બધી તૈથારી કરીને અમે ત્રણે જણ્યા હોડીમાં ચડી બેઠા. નેડ અમારો અલાસી હતો. મોટાં મોટાં વહાણો જેમાં ચિરાઈ જય એવી ધારમાં થઈને અમારી નાની હોડી રમતી રમતી ચાલી જતી હતી. નેડના થાંબલા જેવા હાથમાંનાં હુલેસાં પાણીને કાપતાં કાપતાં થોડી જ વારમાં અમારી હોડીને કિનારે લઈ ગયાં.

લગભગ સાડા આડ વાગે અમે જમીન ઉપર પગ દીધ્યા.

૧૨

નેમાનું નવું વજા

ને સૌથી પહેલો જમીન ઉપર કૂદી પડ્યો. અમે શિક્ષાર આટે સાથે બંદ્વોએ તો લિધેલી જ હતી. નેડને આ બેટમાં શિક્ષાર પૂરતો જ રસ હતો. મને અને ડેન્સીલને તેની જમીન, વનસ્પતિ અને પક્ષીઓમાં પણ ખૂબ રસ પડ્યો. ડેન્સીલ મોટી નાળિયેરાએ ઉપર વાંદરાની જેમ ચઢી જતો અને નાળિયેરા નીચે પાડતો. તેતું મીઠું પાણી તથા ટોપરું ખાવાની મંજ ઓર આવતી. નાળિયેરનો સ્વાદ તો નેડને માંસાહાર ભુલાવી હે તેવો હતો. આવાં થોડાંઓક નાળિયેર વહાણુમાં લરી લેવાં એમ પણ અમે નક્કી કર્યું. ચારે તરફ નજર નાખતા નાખતા અમે બેટના જંગલમાં અંદર ને અંદર જવા લાગ્યા. કઈ ઘડીએ અને કચાંથી જંગલી માણુસ કે પણ આવી પડ્યો તેની શી ખખર! રસ્તામાં જતજતનાં સુંદર પક્ષીઓ જેવાની ખૂબ મંજ પડી. ડેન્સીલ એક સુંદર પક્ષી પક્કાને મારી પાસે લાવ્યો. પક્ષી જીવતું હતું; લગભગ ૬ ઈચ્છ લાંબું હતું, રંગની સુંદર મેળવણી તેના આખા શરીર ઉપર હતી. આ પક્ષી ડેન્સીલે જીવતું કઈ રીતે પક્કયું તેની મને નવાઈ લાગી. પણ પાછળથી મને ખખર પડી કે આ પક્ષી અસુક પ્રકારનું ઇણ ખાઈને મદમાં ચેડે છે; એ ને વખતે મદમાં હોય છે ત્યારે એ પોતાનું ભાન ભૂલી જય છે; તે વખતે એધારે તાથ જડી શકતું નથી. ડેન્સીલે લાગ જોઈને આ પક્ષીને પક્કયું હતું.

ને પણ બેન્ચાર પક્ષીઓનો શિક્ષાર કરીને લઈ આવ્યો હતો. સાંજ પડવા આવી હતી. આથમતી સાંજના અમે એક મોટા ઝાડ નીચે ઘડીક વિસામે લેવા બેઠા. રાતે તો અમારે વહાણુમાં પહેંચ્યો જ જવાનું હતું; કારણ કે રાત અહીં કાઢવી એ જોખમ હતું. પણ

જેટલો વખત વધારે જમીન પર રહી શકાય તેટલું રહેણું, પછી વહાણુંની એારડીએ તો છે જ ને ? એમ વિચારી અમે ત્યાં એડા. જગંગલનાં વૃક્ષોની અંદર સમુક પરથી આવતો ઠાડો પવન મહુર શુંજન કરતો હતો. આસપાસ બધે શાંતિ હતી. કિનારાથી દૂર પૈલું નોટિલસ ડોઈ આરામ લેતા જળયર પ્રાણીની જેમ પડણું હતું. સૂર્ય ધીમે ધીમે આથમવાની તૈયારીમાં હતો. આ દસ્ય છાડીને નોટિલસના ડેફ્યાનામાં જવાનું ગમે તેમ નહોનું.

‘ધારો કે આપણે આજની રાત અહીં જ રહીએ અને વહાણ ઉપર ન જઈએ તો ?’ ડોન્સીલે કહ્યું.

‘ધારો કે આપણે કાયમને માટે અહીં રહીએ તો ?’ નેડ ઉમેર્યું. બરાબર એ જ વખતે એક પથ્થર અમારી પડ્યે આવીને પડ્યો. વાત તરફ અટકી ગઈ; અમે નાસ્તો કરતા હતા તે પણ અટકી પડ્યો અને આશ્ર્યથી આસપાસ જેવા લાગ્યા.

‘આ પથરો કાંઈ આકાશમાંથી તો નથી પડ્યો !’ ડોન્સીલે કહ્યું.

ખીને પથ્થર બરાબર ડોન્સીલના હાથ ઉપર આવ્યો. હાથ-માંથી નાળિયેરની કાચલી પડી ગઈ.

અમે ત્રણે બ્લબા થઈ ગયા; બંદુકો ખલા ઉપર ચડાવી.

‘વાંદરા તો નહિ હોય ?’ નેડ કહ્યું.

‘વાંદરા ન હોય તો પણ તેમના ભાઈઓ તો ખરા જ ! અહીંના જગલી માણુસો જ હશે.’ ડોન્સીલે કહ્યું.

‘ચાલો, હોડીમાં ચડી જઈએ. અત્યારે ખીને ઉપાય જ નથી.’ મેં કહ્યું.

અમે પાછળ મોં દેરવી જેયું તો લગભગ વીસેક જેટલા જગલી માણુસો જાડી આગળ દેખાયા. તેઓ તીરકામઠાં લઈને જીમા હતા. પથરોનો વરસાદ ત્યાંથી જ વરસ્તો હતો.

અમે અમારું ખાવાનું જેમતેમ એકું કરીને કિનારા પર હોડી

બાંધી હતી ત્યાં આવી પહોંચ્યા, અને હોડી મારી મૂકી. હોડી થાંકે દુર્ઘાટી ત્યાં કિનારા ઉપર લગભગ સોએક જંગલીઓનું રોળું હોકારા ને દેકારા કરતું આવી પહોંચ્યું; ડેટલાક તો કેડ કેડ સુધી પાણીમાં જિતરી પડ્યા હતો! મને એમ હતું કે એ બધી ગડખડ જોઈને નોટિલસ ઉપર પણ થોડીએક ધમાક થશે, પણ ત્યાં તો કોઈ માણુસ તૂતક ઉપર હેખાયું નહિ. વીસ મિનિટમાં અમે વહાણું ઉપર આવી પહોંચ્યા. તૂતક ઉપર ચડાને બારણું ઉધાડી અમે અંદર ગયા. હું સીધે દીવાનખાનામાં પહોંચ્યો. કેપ્ટન નેમો ત્યાં બેઠો બેઠો એગન વાજું વગાડી રહ્યો હતો. વગાડવામાં તે એટલો તલ્લીન થઈ ગયો હતો કે મેં તેને એક વાર બોલાવ્યો તો પણ તેણે સાંભાયું નહિ. બીજી વાર મેં જરા જેરથી બોલાવ્યો એટલે તેણે મારી સામે જેણું. ‘કેમ પ્રાઇસર સાહેય! કાંઈ નવી શાધ કરી લાવ્યા કે શું?’

‘હા જી, શાધ તો ધણી કરી. સાથે સાથે એક વિચિત્ર શાધ પણ કરી છે; માત્ર એ શાધ આપણું ને જરા મેંવી પડે તેવી છે.’

‘શાની શાધ છે?’

‘અહીંના જંગલી લોકાની.’

‘આહો! જલદું એમ કહો કે અહીંના લોકોએ આપણી શાધ કરી છે।’

‘હા; એટલું જ નહિ પણ આપણા ઉપર તેઓ હુમલો કરવાની તૈયારી કરે છે. અમે તો તેમના હુાથનો થોડોએક સ્વાદ પણ ચાખી લીધો.’ મેં કહ્યું:

‘કાંઈ વાંદો નહિ; પણ આપણે એમની રજ સિવાય અહીં આવ્યા ત્યારે આપણા ઉપર હુમલો કરવાનો તેમનો અધિકાર તો ખરો જ ને? આપણા દેશમાં એ લોકો આવ્યા હોત તો આપણે તેમને કિનારે જિતરવા હેત ખરા?’

‘એ ખરું; પણ આ તો જંગલી લોકો છે?’

‘કુનિયા પર ડોણુ જંગળી નથી?’ એમ કહી કોઈન નેમો તિરસ્કારથી હસ્યો. તેનું કહેવું હું બરાબર સમજ્યો નહિં.

‘પણ આપણે તેમનાથી ચેતતા તો રહેવું જોઈએ જ ને?’
મેં સવાલ કર્યો.

‘કાંઈ હરકત નહિં; મારા વહાણુને કોઈ આંગળી અડાડી શકે તેમ નથી.’

‘પણ તેમની સંખ્યા મોટી છે.’

‘કેટલાક છે?’

‘લગભગ સૌ જણું.’

‘ગ્રાફેસર! આપા પાપુઆ બેટની સધળી વસ્તી એકદી થઈને આ વહાણુ ઉપર હુમલો કરે તો પણ આપણુને જની આંય નહિં આવે! તમે નિરાંતે આરામ કરો. થાકી ગયા હશો.’ આઠથું બોલીને કેપ્ટને પોતાનું ઓર્ગન પાછું શરૂ કરી હીથું. મારે તેને શું કહેવું? મને થયું: આ માણુસ પોતાના વહાણના અલિમાનમાં પોતાના તો ડીક, પણ અમારા જન પણ બોશે!

રાત પરી ગઈ હતી. મને આજે બાંધ આવે તેમ નહોણું. ઘડીક: વહાણુને મથાળે ગયો. આકાશમાંથી તારાઓનું તેજ નીતરી રહ્યું હતું.

હું લગભગ બારેક વાગે સ્વોતો. રાતમાં કંઈ જણુવા જેવો બનાવ ન બન્યો. સવારે જિનીને મેં તૂતક ઉપરથી જેયું તો કિનારા ઉપર લગભગ પાંચસેથી છસો માણુસો હાથમાં તીરકામઠાં લઈને પડકારા કરતા જિભા હતા. તે ખરા પાપુઅન હતા. તેમનાં પડછંદ શરીર, વિશાળ પહોળાં કપાળ, માંસક અવયવો, ચ્યપટાં નાક, ધોળા દાંત, ગુંઘાંવાળા વાળ, બધું બરાબર શોભતું હતું. પુરુષોની સાથે છીએ પણ હતી. તેમનામાંનો એક સરદાર જેવો લાગતો માણુસ જરા વધારે આગામ આવીને નોટિલ્સને ધ્યાનથી તપાસતો હતો. તેના શરીર ઉપરનાં પાંદાંનાં તથા લોઢાનાં આભૂષણો શોભતાં હતાં. હું તેને સહેલાઈથી બંદુક વડે મારી શકત, પણ તેમ કરવામાં હમણું ઉહાપણ નહોણું.

ધણા વખત સુધી તે લોડા વહાણથી થોડેક દૂર રહ્યા રહ્યા
પાણીમાં ક્ષર્યા કર્યા. હાથના ચાળા ફરીને અમને પોતાની પાસે
આવવા તેઓ આમંત્રણ આપતા હોય એમ મને લાગ્યું. મેં તેમનું
આમંત્રણ સ્વીકાર્યું નહિ એ તો સ્પષ્ટ જ છે.

આને હોડીમાં એસીને કિનારે જિતરાશે નહિ એ જાણીને નહને
બહુ દુઃખ થયું.

લગભગ અગિયાર વાગે પેલા જગંગલીઓ પાછા ગયા. અમે
એટલે હું અને ડ્રોન્સીલ થોડા વખતે તે બડકો ઉપરનાં શંખલાંઓ
વીણુવા જિતરી પડ્યા. હું એક બાજુ શંખલાંઓ વીણુતો હતો ત્યાં
ડ્રોન્સીલ હરખાતો હરખાતો મારી પાસે આવ્યો. અને કહેવા લાગ્યો :
‘જુઓ; આ જુઓ.’

તેના હાથમાં એક શંખ હતો. શંખમાં તે એવું શું બતાવવા
જેવું હશે એમ મને થતું. મને ધરીક તો તેતું કારણું સમજયું નહિ; પણ
જ્યારે મેં તેને કાળજીથી જોયો ત્યારે જળાયું કે દુનિયામાં જે જિતના
શંખને માટે શોખીન માણુસ હબરો રિપિયા ખરથી નાખે છે, તેવો
તે શંખ હતો. સાધારણ રીતે કુદરતના દૈકેદૈક બ્લગની ગતિ જમણી
તરફથી ડાખી તરફ હોય છે; પૃથ્વી, તારાઓ, અહે વગેરે સૌ પોતાની
જમણી બાજુથી ડાખી બાજુ તરફ જ ફરતા હોય છે; માણુસ પણ
પોતાના ડાખા હાથ કરતાં જમણો હાથ વાપરતો હોય છે. શંખલાંઓ
ખનાવવામાં પણ કુદરત સાધારણ રીતે આ જ નિયમને અનુસરતી હોય
છે. શંખ ઉપરના આંકાઓ પણ જમણી તરફથી ડાખી બાજુ આવતા
હોય એમ દેખાય છે. પણ આ ડ્રોન્સીલના હાથમાંનો શંખ તેથી તદ્દન
જિલ્લી રચનાવાળા હતો. મારા સંગ્રહસ્થાનમાં આ શંખથી કિંમતી
ઉમરો થશે એ વિયારે હું હર્ષમાં આવી ગયો, ત્યાં તો એક પથર
ગાજતો ગાજતો આવ્યો અને ડ્રોન્સીલના હાથમાંના કિંમતી શંખ
ઉપર જ અફૂળાયો. શંખ કૂટી ગયો.

મારા દિલમાં જ જણે આ પથરનો ધા લાગ્યો હોય જેવો

મને આધાત થયો. ડેન્સીલે મારા હાથમાંથી બંદુક આંચશી, ને હું તને અટકાવું તે પહેલાં તો તેણે ગોળા છોડી. એક ખૂમ પડી ને પથર ફેંકનાર જગલી જમીન ઉપર ઢળી પડ્યો.

‘અરે, અરે! આ તે શું કરી નાખ્યું? એક શંખને માટે કાંઈ માણુસનો જન લેવાય?

‘હરામજોરે આના કરતાં તો મારો હાથ લાંઠી નાખ્યો હોતા તો કાંઈ નહોતું! ’ ડેન્સીલના કોધનો પાર નહોતા.

પેલા માણુસના ભરવા સાથે જ પરિસ્થિતિ બદ્લાઈ ગઈ. લગભગ વીસ નાની નાની હોડીઓ કિનારા ઉપરથી છૂટી. આ હોડીઓ આડના મોટા થડમાંથી ડોતરી કાઢેલી હતી. હોડીઓ હથિયારખંધ માણુસોથી ભરેલી હતી. હજુ તે લોકો આ વહાણુ એ શી ચીજ છે તે ઓળખી શક્યા નહોતા, એટલે મુંગા મુંગા તેનાથી થોડેક દૂર રહીને ફર્યા કરતા હતા.

મેં આકૃતનાં વાંદળાં વેરાતાં જેયાં શું કરવું તેનો વિચાર કરતો હતો ત્યાં તો પેલી હોડીઓ વહાણુની સાવ નજીક આવી ગઈ અને નોટિલસના લોખંડના હેડ ઉપર બાંધોનો વરસાદ વરસવા માંડ્યો.

હું તરત જ દીવાનખાનામાં ગયો પણ કેપ્ટન નેમો ત્યાં નહોતા એટલે હું તેના પોતાના એરડામાં પહોંચ્યો. કેપ્ટન પોતાના સાદા ટેબલ ઉપર બેઠો બેઠો કંઈક ગળિયતના દ્વારખા ગણુતો હતો.

‘આપને મેં જરા અડયણુ કરી; ખરું? ’ મેં કહ્યું.

‘હા; પણ તમારે અગત્યનું કામ હોવું જોઈએ.’ કેપ્ટન કહ્યું.

‘ઘણું જ અગત્યનું અને ગંભીર. લગભગ છસો માણુસો થોડું જ વખતમાં આપણા વહાણુની અંદર ધૂસી જશે.’

‘તે લોકો નજીક આવી ગયા, એમ?’

‘હા.’

‘તો આપણે ઉપરનાં બારણું બંધ કરી દઈએ.’

‘હા. એ જ કહેવા હું આવ્યો છું?’

‘અમાં કાંઈ સુશકેલી નથી.’ કેપ્ટને હણું તરત તેણે પોતાના ટેચ્ક પાસેની વીજળાની ધંટડી દાખી અને મને જણુંયું : ‘ખસ, હવે પતી ગયું.’

‘ના, હજુ સુશકેલીનો અંત નથી આવ્યો. આવતી કાલે સવારે તાજી હવા લેવા માટે વહાણું ઉપરનાં આરણું તો જોખવાં જ પડશે અને તે વખતે હવાની સાથે જ પેલાઓ અંદર ધૂસી જશે; તો ?’

‘તો પછી તેમને કાંઈ ના પડાશે ? મારે એક પણ માણુસનો જન નથી લેવા.’

મારી પાસે કાંઈ જવાબ નહોતો. હું ત્યાંથી મારા ઓરડામાં ગયો. ‘ક્રાન્સીલ ! આમાં આપણું કાંઈ ચાલે એમ નથી. કેપ્ટન નેમો જેમ કરે તેમ કરવા દીધા સિવાય બીજે કોઈ ઉપાય જ નથી. આપણે તો સુઈ જવું એ જ ઢિક છે.’

‘મારી આપને જરૂર પડશે ?’

‘ના ના.’

ક્રાન્સીલ પોતાની ઓરડામાં ચાલ્યો ગયો.

હું સુતો; પણ જરાય જિંધ ન આવી. બહાર જંગલી લોકોના અવાજે આવ્યા જ કરતા હતા. નોટિલસનો લાગાનો કિલ્લો તે બિચારાઓથી તૂટે તેમ નહોતો, તોયે મને થતું હતું કે હમણું જ આરણું ઉધાડીને બુધા અંદર આવશે.

છ વાગે હું જિઠચો. હજુ બારણું જિધડચાંન હતાં; પણ હવાનાં ટાંકાંએ ભરેલાં હતાં એટલે તાજી હવાની જોટ જણુટી ન હતી. આજે દરિયામાં પૂરી ભરતી ચડવાની હતી. બ્રેપેરના અઠી વાગે અમારું વહાણું જિપડવાનું હતું, પણ હજુ કશી તૈયારી દેખાતી નહોતી. હું દીવાનખાનામાં ગયો.

અઠી વાગ્યા; દસ મિનિટ પછી વહાણું જિપડવું જ જોઈએ, ખીજુ જ ક્ષણે વહાણમાં જેમ જીવ આવ્યો હોય એમ અવાજે થવા લાગ્યા. આસપાસના પરવાળાંના ખડકો સાથે વહાણ ધસાતું હોય

એમ લાગવા માંડયું.

થાડી વારે કોઈન નેમો હીવાનખાનામાં આવ્યો.

‘આપણે હવે જિપડાએ છીએ,’ તેણે કહ્યું.

‘એમ ?’

‘હા. અને વહાણુનાં બારણાં પણ ઘોલી નાખવાનો મેં હુકમ આપી દીધો છે.’

‘પેલા જંગલીન્નું શું થયું ? તે લેઝો અંદર નહિ ધૂસી જય ?’

‘તમને ખખર નથી લાગતી. આ વહાણુનાં બારણાં ઉધાડાં હોવા છતાં તેની અંદર મારી રજ સિવાય કોઈ ન આવી શકે, એવી આ વહાણુમાં શક્તિ છે !’

‘હું સમજ્યો નહિ.’

‘ચાલો ઉપર; તમને સમજલવું.’

અમે ઉપર જવા નીકળ્યા. ડોન્સીલ અને નેડ બંને તેમની આરડી આગળ જિલ્લા હતા, તેમનેથ અમે સાથે ઉપાડયા. અમે ઉપર પહોંચ્યા. જતાંવેંત લગભગ ૫૦ થી ૬૦ બયંકર ચહેરાએ મારી નજરે પડ્યા. પણ તેમનામાંથી પહેલાએ વહાણુના તૂતકના કઠેડા પર જેવો હાથ મૂક્યો કે તેના આખા શરીરને જોસખંધ એક આંચેડા લાગ્યો. અને તે પાણીમાં દૂર જઈને પછડાયો. તેની પાછળ તેના થોડાએક સાથીએ પણ ચહેરા લાગ્યા; તેમની એ જ વદે થઈ. અમારા આશ્ર્યનો પાર ન રહ્યો. નેડ અખતરો કરવા માટે પોતાનો હાથ તે કઠેડા પર મૂક્યો; તેને પણ એવો સખત આંચેડા લાગ્યો કે ધડધડ કરતો તે દાદરા પરથી નીચે ગણ્ણી પડ્યો. ‘આમાર્યા, માર્યા !’ તે ભૂમ પાડી જડ્યો. ‘આ તો વીજળાનો આંચેડા લાગે છે !’

હું સમજુ ગયો. એ કઠેડા નહોતો પણ વીજળાના તારવાળું એક હથિયાર જ હતું ! કોઈન નેમોએ અત્યારે તેમાં વીજળા ચાલુ કરી દીધી હતી. આ વીજળાનો કઠેડા એળંગીને અંદર કોણું

આવી શકે ?

દરમિયાન આ ચમતકારથી પાપુઅન લોડો ખૂબ ગભરાયા અને ડરી ગયા. ખૂબો પાડતા પાડતા તેઓ છિનારા તરફ નાસવા લાગ્યા. અમારું હસવું સમાતું નહોતું.

એ જ ધડીએ અમારું વહાણું પૂરી ચટેલી ભરતીને લીધે ખડકમાંથી ઉપર જિંયકાઈ આવ્યું; વહાણુનો પંખો ચાલુ થઈ ગયો. થાડી વારમાં તો નોટિલસ ટોરસની સામુદ્રધુનીનો લેખમી રસ્તો પસાર કરી ખુલ્લા સમુદ્રમાં ડીંચોળા લેવા લાગ્યું.

એ જ ધડીએ અમારું વહાણું પૂરી ચટેલી ભરતીને લીધે ખડકમાંથી ઉપર જિંયકાઈ આવ્યું; વહાણુનો પંખો ચાલુ થઈ ગયો. થાડી વારમાં તો નોટિલસ ટોરસની સામુદ્રધુનીનો લેખમી રસ્તો પસાર કરી ખુલ્લા સમુદ્રમાં ડીંચોળા લેવા લાગ્યું.

એ જ ધડીએ અમારું વહાણું પૂરી ચટેલી ભરતીને લીધે ખડકમાંથી ઉપર જિંયકાઈ આવ્યું; વહાણુનો પંખો ચાલુ થઈ ગયો. થાડી વારમાં તો નોટિલસ ટોરસની સામુદ્રધુનીનો લેખમી રસ્તો પસાર કરી ખુલ્લા સમુદ્રમાં ડીંચોળા લેવા લાગ્યું.

એ જ ધડીએ અમારું વહાણું પૂરી ચટેલી ભરતીને લીધે ખડકમાંથી ઉપર જિંયકાઈ આવ્યું; વહાણુનો પંખો ચાલુ થઈ ગયો. થાડી વારમાં તો નોટિલસ ટોરસની સામુદ્રધુનીનો લેખમી રસ્તો પસાર કરી ખુલ્લા સમુદ્રમાં ડીંચોળા લેવા લાગ્યું.

૧૩

કાયરસ્તાનમાં

બીજે દિવસે નોટિવસે પાછી પોતાની સફર શરૂ કરી. પણ આ વખતે તેણે પોતાની ગતિ ખૂબ વધારી દીધી હતી. મને લાગે છે કે કલાકના ઉપ માઈલની ઝડપે તે જહું હશે. ગઈ કાલના અનાવથી હું ચકિત થઈ ગયો. આ માણુસે વીજળાનો ડેવો ઉપયોગ કર્યો છે! પોતાનું વહાણું ચલાવવા પૂરતો જ તેનો ઉપયોગ નહોંતો; આ તો દુઃખમનોને માત કરવાનું પણ અહલુત સાધન હતું! પોતાના વહાણનો સ્પર્શ પણ બીજે ડાઈ તેની છઢા વિરુદ્ધ કરી ન શકે એટાં શક્તિ તે વહાણુમાં તેણે મુક્કી હતી.

૧૩મી જન્યુઆરીએ નમો રીમેરના સમુક્રમાં આવી પહોંચ્યો. અમે રીમેર બેટને દૂરથી જોઈ શકતા હતા; ત્યાંના વિચિત્ર રાન્ધો, લેંડા અને તેમના રીતરિવાને જોવાનું મન ધણુંચે હતું; પણ તે શા કામનું? વહાણું તા તેની પડપે થઈને પસાર થઈ ગયું. ક્રારીનો નાનો બેટ અમે થાડેક દૂરથી જ જોઈ શક્યા.

અહીંથી વહાણે પોતાનું સુકાન નૈર્કર્ત્ય દિશામાં ફેરબ્યું. તેને ધરાદ્દો હિંદી મહાસાગરમાં પ્રવેશ કરવાનો હતો. કેપ્ટન વહાણું કંચાં લઈ જવા માગતો હશે? શું હિંદી મહાસાગરમાં થઈને તે ભૂમધ્ય સમુક્રમાં જશે અને યુરેપને કિનારે ફરશે? ના ના; માણુસની વસ્તીથાતો તા તે દૂર ને દૂર રહે છે. ત્યારે શું અહીંથી તે દક્ષિણ ધ્રુવ બાજુ જશે, અને ત્યાંથી વિશાળ પાસિસ્કિક મહાસાગરમાં ફરશે? કાંઈ નક્કી કહી શકાય તેમ નહોંતું. કાર્ટિયર, હિનેર્નિયા વગેરે બેટાની લાંબો દરિયામાં ઘૂસી જતી ધારોને દૂર ને દૂર કરતી જતી અમારી નૌકા આ મહાસાગરમાં આગળ ધર્યે જતી હતી.

કેપ્ટન નેમો તો જતજતના પ્રયોગો કરી રહ્યો હતો. પાણીની જુદી જુદી બંડાઈએ દરિયાની ગરમીનું કેટલું પ્રમાણ હોય છે તેના આંકડાઓ તે થમોભિટરથી કાઢતો હતો. વહાણુમાં રાખેલી ટાંકીઓ પાણીથી ભરીને ૩૫,૦૦૦ ફૂટ સુધીની બંડાઈએ વહાણુને લઈ જતો હતો, મને પણ તેના આ પ્રયોગમાં એટલો રસ પડતો કે વહાણ કઈ દિશામાં જય છે તે જાળવાની પરવા એછી રહેતી. મને મનમાં થતું કે કેપ્ટન નેમોના આ પ્રયોગનો દુનિયાને શા ઉપયોગ છે ? આવા માણુસો દુનિયાના શત્રુ થઈને બેસે એ પણ એક દુઃખદ સ્થિતિ જ નહિ ? મારું પોતાનું ભવિષ્ય પણ કેપ્ટન નેમોની સાથે જ જોડાયેલું છે, એ વિચાર આવતો ત્યારે તો હું પણ ઘડીભર કંપી જાઠતો.

૧૬મી જન્યુઆરીએ નોટિલસ સ્થિર થઈ ગયું. મને લાગ્યું કે વહાણુમાં કંઈક સમારકામ કરવાના જરૂર પડી હશે. થોડી વારે એક અદ્ભુત દસ્ય અમને જોવા મળ્યું. અમારા એરડાની ખારીઓ ઝુલ્લી હતી. એરડામાં બતી નહોતી સળગતી; છતાં અંદર અંખો એવો પ્રકાશ આવતો હતો. મેં ખારીમાંથી નજર કરી તો દરિયાના પાણીમાં ધણ્ણો પ્રકાશ ફેલાયેલો હતો. ‘આ શાને પ્રકાશ હશે ?’ જરા ખારીકાઈથી જોતાં માલૂમ પડ્યું કે એ સ્થળે દરિયાની અંદર પ્રકાશિત માછલીઓના મોટાં ટોળાં ને ટોળાં રમતાં હતાં. તે માછલી ઓના પ્રકાશને લીધે અમારા વડાણું બહારનું પતરું પણ ચળ-કાટ ભારતું હતું. હું અને ડાનિસલ તો તે માછલીઓને જોવામાં તહીન થઈ ગયા.

આ અદ્ભુત દસ્ય વટાવીને અમે ચાગળ ચાલ્યા.

એક દિવસ સવારમાં મારા નિયમ પ્રમાણે હું તૂતક ઉપર જિમો હતો. પણ આજે તૂતક ઉપર કંઈક ધમાલ હોય એમ લાગતું હતું. કેપ્ટન નેમો મારી પહેલાં ત્યાં આવીને જિમો હતો, અને વહાણુના ઐન્ત્રણ માણુસો સાથે વિચિત્ર ભાષામાં થોડી થોડી વારે કંઈક ખોલતો હતો. તેના હાથમાં મોટું દૂરખીન હતું. વારે વારે તે દૂરખીનથી દૂર

કિલિજમાં નજર નાખતો હતો. મને કુરૂહલ થયું. હું પણ મારા આરડામાં જઈને એક દૂરભીન લઈ ઉપર આવ્યો. પણ જ્યાં આંખ માંડી જોઉં હું ત્યાં મારું દૂરભીન ડોઈકે પાછળથી આંચદી લીધું। પાછળ ફરી જોઉં તો કેપ્ટન નેમો જિલ્લો હતો. પણ અત્યારે તે ન આણખાય તેવો હતો. તેની આંખમાંથી જણે આગ વરસી રહી હતી. તે સ્થિર અવાજે મારા સામું જોઈને બોલ્યો : ‘આપણા વચ્ચન પ્રમાણે અત્યારે તમારે આરડામાં બેસી રહેવાનું છે !’

હું સ્તરબંધ અની ગયો। એવું તે શું હશે ? મેં પૂછ્યું : ‘મારે જવામાં વાધો નથી. ફક્ત એક જ પ્રક્રિયા તમને—’

‘નહિ; અત્યારે એક પણ પ્રક્રિયા શકાશે નહિ.’

મને એક માણુસ મારા આરડામાં મૂકી ગયો. મારા બંને સાથીઓ પણ તેમાં જ હતા. મેં તેમને બંધી વાત કરી. તેઓ પણ કાંઈ સમજી શક્યા નહિ. થોડી વારે ખાવાનું આવ્યું; અમે ત્રણે જણ્ણા નિરાતે જમ્યા. પણ જમ્યા પણી ત્રણે જણ્ણને તરત જિંધ આવવા માંડી. અમે આંખો ફાડી ફાડીને જગવાનો પ્રયત્ન કરતા હતા, પણ તે નિષ્ઠળ ગયો. અમને કશાક ઘેનતી અસર થતી હોય તેમ લાગ્યું. થોડી વારે જ અમે જિંધી ગયા.

સવારે જગીને જોખું તો મારા બંને સાથીઓ મારા આરડામાં નહોતા. મારા શરીરમાંથી ઘેનતી અસર ચાલી ગઈ હતી. વહાણું પોતાની નિયમિત ગતિઓ દરિયાની સપાઈથી લગભગ ૪૫ કૂટની ઊંડાઈએ ચાલતું હતું.

લગભગ અપેરના બે વાગે મારા આરડામાં કેપ્ટન નેમો આવ્યો. મેં તેને નમન કર્યું; તેણે સામું નમન કર્યું. પણ તેના મોં પર જુહો લાલ દેખાતો હતો. શોકની ને દુઃખની ઘેરી છાયા તે પર પથરાઈ હતી. ઉન્જગરાથી તેની આંખો લાલ હતી. થોડી વાર અમે બંને કાંઈ પણ બોલ્યા વગર જિલ્લા રહ્યા.

પછી કેપ્ટન બોલ્યા : ‘તમે ડોક્ટરનું કામ પણ જણો છો,

નહિ ?

‘ હા જી. થાડો વખત મેં તે કામ પણ કરેલું છે. ’

‘ એક દરદીને તપાસીને તેને માટે કંઈક દવા અનાની શક્રો ?

‘ કચાં ? વહાણું ઉપર કોઈ દરદી છે ? ’

‘ હા. ’

અમે બને યાત્યા. હું વિચાર કરવા લાગ્યો કે ગઈ કાલ સંજના બનાવને અને આ માંદા માણુસને કંઈક સંઘંધ તો નહિ હોય ? કેપ્ટન નમેં મને વહાણુને છેડે ને ઓરડામાં ખલાસીએ રહેતા હોવા જોઈએ તેવા એક ઓરડામાં લઈ ગયો. ખાટવામાં એક પડ્છંદ કાયા પડેલી હતી. તેને માથે પાઠા બાંધેલા હતા; માણુસ વાયલ થયેલો હતો.

મેં તેના પાઠા છોડવા માંડ્યા. તે માણુસ તેની મોરી સ્થિર અંઝાએ મારી સામે જોઈ રહ્યો. પીડાની આહ સરખી પણ તેના માંમાંથી ન નીકળી. ધા લયંકર હતો. ખાપરીનો એક ભાગ કયરાઈ ગયો. હતો અને તેમાંથી ભગજતું માંસ દેખાતું હતું. તેના શાસો-ચૃષ્ણવાસ ધીમો પડતો; જતો હતો; તેના ચહેરો હિંકો પડતો જતો હતો, તેની નાડી તૂટેલી હતી; મૃત્યુ તેની સામે આવીને જિભેલું હું જોઈ શકતો હતો. મેં ધા ધોઈને ફરીથી પાઠો બાંધ્યો. કેપ્ટન તરફ ફરીને મેં પૂછ્યું : ‘ કેપ્ટન ! આવો જમાર જખમ કેમ કરીને થયો ? ’

‘ એ તો સહેજ નોટિબસના એક મશીનના લીવર સાથે આ માણુસનું માથું અથડાયું હતું. તમને કેમ લાગે છે ? તેની હાલત કેવી છે ? ’

હું જવાબ આપતાં અચકાયો.

‘ તમે ખુશીથી બોલો. એ માણુસ ફેન્ચ ભાષા સમજતો નથી. ’

‘ એ કલાકમાં આ માણુસનો જીવ જીડી જશો. ’

‘ કોઈ પણ રીતે બચી શકે તેમ નથી ? ’

‘ ના જી. ’

કુપ્ટન નેમાણે પોતાના બંને હાથને એકખીજમાં જોરથી દૂધયા; અને થોડી વારે પોતાની આંખો લુંઝી. મેં પેલા માણુસની સામે જેયું. મૃત્યુની ભાયા ધીમે ધીમે તેના મુખ પર પથરાતી જતી હતી. વીજળાના દીવાના પ્રકાશમાં તેનું મોદું વધારે દ્રિકું લાગતું હતું.

‘હવે તમે જઈ શકો છો. ’

હું મારા ઓરડામાં ચાલ્યો ગયો. મારા દિવસમાં આજે ખૂબ ભાર લાગતો હતો. તે આખો દિવસ અને આખી રાત વિચારો ને વિચારોમાં જ પસાર થઈ. રાતના દૂર દૂરથી જણે ક્રીણું કરુણું સંગીત મારા કાન પર અથડાવા લાગ્યું. મેં ધારું: ‘પેલા માણુસ જરૂર મરી ગયો હતો. અત્યારે તેની મરણપથારી પાસે પ્રાર્થના થતી હોવી નેઈએ.’

‘કેમ આજે ફરવા જઈશું?’ કુપ્ટને પૂછ્યું.

‘ખુશીથી, જેવી આપની છચ્છા.’

‘તો પણ તમારો પોશાક પહેરી લો. તમારા સાથીએ પણ ભલે આવે.’

મેં મારા બંને સાથીએને તૈયાર કર્યો. હું પણ પોશાક પહેરીને તૈયાર થઈ ગયો. દરિયામાં જીતરવાના બારણા પાસે ખીજ માણુસો પણ તૈયાર હતા. અમે બધા જીતર્યા. અહીં સમુદ્રનું તળિયું જુદી જ જાતતું હતું. પરવાળાંની મોટી સુષ્ઠિ અહીં પથરાઈને પડી હતી. પરવાળાંનાં જ કંઠાંએ એ પણ કુદરતનો એક મહાન ચમત્કાર છે. અસંખ્ય જીવડાંએ એકખીજ સાથે મળાને એક મહાન દુનિયા બનાવવા માટે રાતદિવસ અખંડ પરિશ્રમ કર્યા જ કરે છે! અમે તેની વચ્ચે થઈને આગળ વધવા લાગ્યા. વચ્ચે વચ્ચે મોટા છોડો, લાંબાં લાંબાં ધાસો, કચાંક સુંવાળા ધાસની ગંજાએ. વગેરે આનંદ આપતી હતાં; કચાંક કચાંક છોડ ઉપર નાની માછકીએ પક્ષીની જેમ આમથી તેમ ઝૂદકા મારતી હતી. ધીમે ધીમે બંને બાળુ ખડકોની હાર આવવા માંડી. તેની વચ્ચે થઈને કુપ્ટન નેમો અમને લઈ જતો હતો. ખડકોની

હાર પૂરી થઈ અને અમે મોટા જંગલમાં પેડા. ચારે બાજુ ઝાડોની કટારો આવવા લાગી ગઈ હતી. વચ્ચે એક નાના એવા ખુલ્લાં મેદાનમાં અમે આવ્યા. કેપ્ટન નેમો અહીં અટક્યો; અમે જેણું તા અમારી પાછળ ને માણુસો આવતા હતા તેમાંથી ચાર જણ્ણાએ ઢાઈક લાંબી વસ્તુ ઉપાડી હતી. અહીં આવીને તેમણે તે નીચે મૂકી. અમે નવાઈ પાખ્યા. એ મેદાનની વચ્ચે પરવાળાનો જ બનાવેલો એક મોટા કોસ હેખાતો હતો.

કેપ્ટન નેમો તરફથી નિશાની થતાં જ થોડાક માણુસો ત્યાં આગળ ઘાંધવા લાગી ગયા. હવે મને સમજયું. ગઈ કાલે મૃત્યુ પામેલા માણુસની કબર અહીં થવાની હતી. કેવો અજ્ઞાત માણુસ! પોતાના માણુસોને માણેનું કબરસ્તાન પણ તેણે નકી કરેલું છે। ખાડો ઘાંધાઈ ગયા પછી વિધિપુરઃસર શરૂને અંદર મૂકવામાં આવ્યું. બધાએ ઘૂંટિયે પડીને નમન કર્યું. અમે પણ સ્વાભાવિક રીતે જ તેમાં લગ્ન ગયા.

બધા પાછા વહાણું તરફ વલ્યા. ગયા હતા એ જ રસ્તે થઈને અમે વહાણું પર પહોંચ્યી ગયા.

હું કપડાં બદ્દલાવીને તૈયાર થયો ત્યાં કેપ્ટન નેમો મારી પાસે આવ્યો.

‘મેં કહ્યું હતું તે પ્રમાણે પેદો માણુસ રાતના જ ગુજરી ગયો હતો કે?’ મેં પૂછ્યું.

‘હા. તેમ જ થયું, અને અત્યારે તે તેના સાથીઓની સાથે જ સમુદ્રને તળિયે આરામ કરે છે.’ આઠલું બોલતાં જ તેણે પોતાના હાથથી પોતાનું મોટું ઢાંકી દીધું. એક દૂસરું તેના મોટામાંથી નીકળી પડ્યું. ‘તે અમારું શાંતિમય કબરસ્તાન છે. અમે બધા જીવતા સાથે રહેશું અને મૃત્યુ પછી પણ એ જ કબરસ્તાનમાં સાથે રહેશું. દરિયાનું પાણી કે દુનિયા ઉપરનો ડાઈ પણ માણુસ અમને અમારા એ સ્થળોથી છુટા પાડી શકે તેમ નથી.’

૧૪

સાચાં મોતી

આ રીતે સમુદ્રના ગર્ભમાં અમારું તથા કેપ્ટન નેમેતું જીવન વ્યતીત થતું હતું. કેપ્ટન નેમેને હજુ અમે બરાબર ઓળખી શકાય છીએ એમ કઢી શકાય તેમ નહોતું. ડ્રાન્સલ્બ માનતો હતો કે દુનિયામાં આ માણુસને ખૂબ સહન કરવું પડ્યું હશે અને તેથી અત્યારે તે મનુષ્યજ્ઞતિથી દૂર ને દૂર જ રહે છે. મારી માન્યતા પ્રમાણે તે મનુષ્યથી ભાગતો ફરતો માણુસ નહોતો, પણ પોતાને થયેલા અન્યાયનો બદલો મનુષ્યજ્ઞતિ ઉપર લેવા માટે તે તલસતો હતો. પણ તોયે આ માણુસને વખાલું કે નિંદા કરવી એ હું નક્કી કરી શકતો નહોતો. મને તો સમુદ્રની અંદર રહેલી આ અગાધ સમૃદ્ધ જોઈ વળવાની ધ્રચા હતી. હજુ તો અમે માત્ર ૧૮૦૦ માઈલ જ ફર્યા હતા; હજુ કોણ જણે કેટલું જોવાતું બાકી હતું।

પણ બીજુ બાળુ મારા સાથીએની અહીંથી ગમે તે ઉપાયે નાસી છૂટવાની ધ્રચામાં પણ મારે મારો ભાગ રાખવાનો જ હતો. મારી પોતાની મહુત્વાકાંક્ષાએની ખાતર મારા મિત્રોને પણ મારી સાથે રોકી રાખવા એ બરાબર નહોતું. મારે તેઓની પાછળ પાછળ જવું જ જોઈએ. જેલડું મારે તો તેમના આગેવાન તરીકે કામ કરવું જોઈએ. પણ અહીંથી નાસી છૂટાય એવી તક આવશે ખરી?

અમારું વહાણું ડિંદી મહાસાગરનાં નિર્મણાં પાણીની અંદર અપાટાંધ પદ્ધિમ દિશામાં જતું હતું. હું મારા ઓરડાની કાચની બારીમાંથી આખે દિવસ આસપાસ નાચતી-કૂદતી માછલીએ જોવામાં જ કાઢતો હતો. કેટલાયે દિવસો સુધી આમ ને આમ ચાલ્યું. હું સમુદ્રનાં પાણી જોતાં થાકતો ત્યારે વાંચતો; વાંચતાં થાકતો ત્યારે

જાંધી જતો. ડોઈ ડોઈ વાર તો જળ નાખીને જતજતની માછકીએ બેળી કરવાનું કામ પણ હું કરતો. ડોઈ ડોઈ માછકીએ તો કેપ્ટન નેમાંથે પોતાના નાનકડા પણ ખૂબ સમૃદ્ધ એવા સંબુદ્ધસ્થાનમાં રાખી લાધી હતી. ૨૧મીથી ૨૩મી જન્યુઆરી સુધી અમારા વહાણે ૨૪ કલાકના ૭૫૦ માઈલની ઝડપથી આગળ વધવા માંડ્યું. જતજતની માછકીએ આ વહાણના વીજળીના પ્રકાશથી આકર્ષાઈને વહાણુંની સાથે શરતમાં જિતરી હોય એમ તરવાને પ્રયત્ન કરતી, પણ તે પાછળ જ પડી જતી.

‘ધીમે ધીમે કિલિંગના બેટો નજીક આવવા લાગ્યા. નેડ મને પૂછ્યું : ‘હવે હિંદુસ્તાનનો કિનારો નજીક આવતો જય છે. શો બિચાર છે ? મને લાગે છે કે આપણે રીતસર કેપ્ટનની રણ મારીને આ કિનારે જિતરી જઈએ. હિંદુસ્તાનમાંથી આપણે આપણા વતનમાં જઈ શકશું ?’

‘નેડ ! હજુ શું થાય છે તે આપણે નેઈએ. કદાચ અહીંથી આ વહાણું યુરોપ તરફ જ વળશે. તે તરફ વહાણું જય ત્યારે શું કરવું તે આપણે તે વખતે નક્કી કરશું. એ વખતે જેવી તક હશે તે પ્રમાણે કરશું. વળી મને તો ખાતરી છે કે કેપ્ટન નેમો પાસે રણ માગવી એ ખાલી ફંકાં છે ! આ વખતે તો તે આપણુંને પાપુઅન બેટની જેમ અહીંના ડોઈ બેટ ઉપર શિકાર કરવા પણ જિતરવા હે એવા સંસ્કર નથી.’

‘તો પછી આપણે તેની રણ ન મારીએ તો ?’

એનો ઉત્તર મારી પાસે નહોતો. હું પણ અંતરના જિંડાળુમાંથી નેડની જેમ જ ધર્યાનો હતો. કિલિંગ બેટ પસાર થઈ ગયા પછી અમારી ગતિ જરા ધીમી પડી; અહીં અમે વારંવાર દરિયાને તળિયે વહાણુંને ઉત્તારના અને ડોઈ ડોઈ વાર ફરવા નીકળતા. દરિયાને સાવ તળિયે ગરમી શરૂ ઉપર ૪ ડિગ્રી રહેતી. સમુક્ષના સાવ તળિયે તેનાથી ઉપરના લાગ કરતાં થોડી વધારે ગરમી રહે છે.

૨૬મિનો આજો દિવસ સમુક્તની સપાઈ ઉપર કાઢ્યો. ચારેય વાળું પાણી, પાણી ને પાણી જ હતું। દૂર દૂર એક સીમર વુંમાડી કાઢ્યી ચાલી જતી હતી; પણ તે અમને જોઈ શકે તેમ નહોતું.

ખીને દિવસે અમે વિષુવવૃત્તની રેખાને ઓળંગી ઉત્તર ગોળાર્ધમાં ચેઠા. આજે અમારા વહાણુંની પડ્યે ભયંકર શાર્ક માછલીઓનું ટોળું દેખાયું. ડોઈ ડોઈ માછલીઓ લેર જેરથી વહાણુંની બારીઓને બટકાં ભરતી હતી. તેમના ભયંકર દાંત અંદર બેઠાંબેઠાં પણ અમારામાં ભય પેઢા કરતા હતા. નેડના હાથમાં ચળ આવવા લાગી. તૂતક ઉપર જઈને હારપૂનથી એકાદ બેને વાંધી નાણું એમ તેને થઈ ગયું, પણ ત્યાં તો નોટિક્સની ઝડપ વાંધી અને શાર્ક માછલીઓ પાણી રહી ગઈ.

વહાણ બંગાળાના ઉપસાગરમાં પેડું. અહીં આગળ અમને એક કરુણ દેખાવ નજરે પડ્યો. માણુસોનાં તથા ઢારેનાં ડેટલાંથ મડાં પાણી પર તરતાં દેખાયાં; કદાચ ગંગાના મહાન પૂરમાં એ તથ્યાર્થ આવેલાં હશે. શાર્ક માછલીઓ તેમને ડોલી રહી હતી.

અહીં એક ખીને ચ્યાતકાર પણ જેવા મજયો; વચ્ચે એક જગ્યાએ સમુક્તનું પાણી દુધ જેવું સફેદ દેખાવા લાગ્યું. જણે અમે દુધના સમુક્તમાં આવી પડ્યા! ડાનિસલના આશ્ર્યને પાર ન રહ્યો. તેણે પૂછ્યું : ‘આ શું?’

મેં કહ્યું : ‘એમાં આશ્ર્ય પામવા જેવું કાંઈ નથી; ધન્યાસોરિયા નામનાં એક પ્રકારનાં જવડાંઓમાંથી નીકળતો આ પ્રકાશ છે; આવાં અસંખ્ય જવડાંઓ માઈલેના માઈલેસ સુધી પથરાઈને ડોઈ વાર પડ્યાં હોય છે. અને મેં વાંચ્યું છે તે પ્રમાણે એક વખત એક વહાણ ચાળાશ માઈલ સુધી આવા દુધિયા પાણીમાંથી પસાર થયું હતું.’

૨૮મી ઇથ્યારીએ જ્યારે વહાણ સમુક્તની સપાઈ ઉપર આવ્યું ત્યારે તે ઉત્તર ગોળાર્ધના ૮° ૪' અક્ષાંશ ઉપર હતું. પૂર્વ દિશામાં એ માઈલને અંતરે જ જમીન હતી. તે જમીન ખીજુ ડોઈ નહિ પણ હિંદુસ્તાનનાં ચરણોમાં બિડાયેલા કમળની જેવું શોકતું સિલોન હતું.

હું પુસ્તકાલયમાં બેડો બેડો સિલોન વિષે વાંચ્યો હતો, ત્યાં કેપ્ટન નેમો અંદર દાખલ થયો. તેણે કહ્યું : ‘ સિલોનનો દરિયો તો મોતીઓ માટે પ્રસિદ્ધ છે. અહીં મોતી કાઢવાની જગ્યા આપણે જેવી હોય તો જઈએ. ’

‘ મારે જરાય વાંધો નથી. હું તો તૈયાર જ હું. ’ મેં કહ્યું. નેડને તથા કોન્સલને જ્યારે મેં આ વાત કરી ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. તેમણે મોતી કાઢવાની રીત વિષે ધણું સાંભળ્યું હતું; પણ દરિયામાં મોતી કંચાં રહેતાં હશે, તેને કઈ રીતે ભેગાં કરાતાં હશે, તે વિશે તેઓ કાંઈ જાણતા નહોતા. મેં પહેલાં તો તેમને મોતીની ધીપો કઈ રીતે ભેગી થાય, દરિયામાં કઈ રીતે માણુસ દૂબકી મારીને તે એકકી કરે, વગેરે વિષે અધી માહિતી આપી. મોતી કેટલી જલતાં અને કેવડાં કેવડાં થાય છે, કેટલી કેટલી કિંમતનાં હોય છે, તે સાચું છેકે બોધું તેની પરીક્ષા શી. વગેરે વિષે પુસ્તકોમાં મેં જેટલું જેટલું વાંચ્યું હતું તે સધળું તેમને કહી સંભગાવ્યું.

ખીજે દિવસે અધી તૈયારી થઈ ગઈ. મને મનમાં એક જ ખીજી હતી. ગઈ કાલે વાતચીતમાં કેપ્ટન નેમોએ મને કહ્યું હતું : ‘ અહીંના દરિયામાં શાર્ક માછલીઓ ખૂબ જેવાની ભગશે. ’ શાર્ક માછલીના નામથી જ એક તો મારા મનમાં લય જીબો થયો હતો; તેમાં આજ તો તેમનાં હાજરાહજૂર દર્શન થવાનો સંભવ હતો. મેં નેડને શાર્કની વાત કરી એટલે તે તો તેના શિકારનાં સ્વપ્નાં ઘડવા મંડી પડ્યો. મારી આગલી આખી રાત શાર્ક માછલીના લયંકર સ્વપ્નામાં પસાર થઈ. હું ડોઈની સાથે વાત કરતો તો તે ચોજને બદલે શાર્કનું નામ મારા મોઢામાંથી નીકળો પડતું. ડોઈ પણ રીતે મોતી પાકવાની જગ્યા જેવાનો કાર્બિકમ અંધ રહે એમ હું અંદરખાનેથી ધર્યતો હતો. પણ એ બહાર કેમ બોલાય? આખરે વખત આવી પહોંચ્યો. અમે વહાણુંના ગુતક ઉપર આવ્યા. પડ્યે જ હોડી તૈયાર હતી. અમે ત્રણેય જણ્ણા, કેપ્ટન નેમો અને ખીજે એ માણુસો એટલા

હેડીમાં ચડી બેઠા અને હલેસાં ચલાવા લાગ્યા. અમે દક્ષિણ દિશા તરફ હેડી હુંકારી. કિનારથી થોડે દૂર એક નાના એવા અભાતમાં અમે આવી પહોંચ્યા. મોતી કાઢવાની ઝડપને હજુ એક મહિનાની વાર હતી, એટલે ત્યાં ડોઈ માણુસની વસ્તી નહોતી; ડોઈ હેડી પણ તરતી હેખાતી નહોતી. અમારી હેડીએ લંગર નાખ્યું અને અમે પાણીમાં પહેરવાનો પોશાક ચડાવી અંદર જિતર્યા. નેમોએ અમને અમારી સાથે વીજળીની બતી લેવાની ના પાડી હતી; કારણ કે એક તો સૂર્યના કિરણો ડેઢ તળિયા સુધી પ્રકાશ નામી શકતાં હતાં, અને બીજું બતીને લીધે કદાચ બ્યાંકર દરિયાઈ પ્રાળીએ અમારા તરફ આકર્ષય એવો સંભવ હતો. હથિયારમાં બધાએ પોતાની સાથે માત્ર એક એક ખંજર અક્સમાત માટે રાખ્યું હતું. અમે માંડ ૧૦ ફૂટ સપાઠીથી નીચે હોઈશું. થોડી વારે અમે મોતીના એતરમાં આની પહોંચા. ખડકો ઉપર હંજરો - બલકે લાખો કાળું માછલીએની છીપલીએ જાણું લટકતી હતી. અમે જેવા જભા રહેવાનો વિચાર કરતા હતા, પણ કેટન નેમો તો ચાલ્યે જ જતો હતો. અમારે તેની પાછળ જ જવાનું હતું: આ રસ્તાનો જાણું તે પૂરેપૂરો ભોમિયો હોય એમ લાગતું હતું.

રસ્તામાં વચ્ચે વચ્ચે જાંચી જમીન આવતી હતી. ડોઈ ડોઈ જગ્યાએ તો અમે લગભગ પાણીની સપાઠી સુધી આવી જતા હતા. પાછો ધીમે ધીમે ઢાળ આવતો ગયો અને અમે એક નાની એવી ગુંજા જેવા રસ્તા ઉપર આવી પહોંચ્યા. અહીં અંધારું લાગવા માંડયું. પહેલાં તો કાંઈ ન હેખાયું, પણ ધીમે ધીમે આંખ ટેવાઈ ગઈ અને અંદર હેખાવા માંહયું; પણ પ્રકાશ ખૂબ જાંખો હતો.

જરાક આગળ વધ્યા એટલે કેપ્ટને મને આંગળી ચાંધીને કંઈક બતાવ્યું મે જેયું તો તે એક છીપના આકારની 'ઓઈસ્ટર' માછલી હતી. આવી મોટી ઓઈસ્ટર માછલી મેં પહેલવહેલી

નેઈં. તેનું વજન ૧૫ મણુ જેટલું હશે એમ મને લાગે છે. કેપ્ટન નેમોની આંખો આ નેઈને હર્ષથી ચમકતી હું નેઈ શકતો હતો. આ જ્યાં અને આ માછલી તેણે ઘણી વખત નેઈ હશે એમ મને લાગ્યું. એ માછલી-ધીપ અરધી ઉવાડી હતી. કેપ્ટને પોતાનું ખંજર તેની વચ્ચે ભરાવ્યું નેથી તે બિડાઈ ન જય; પછી તેણે હાથ નાખીને ધીપને વધારે પહોળા કરી.

મેં અંદર નેયું તો લગભગ નાળિયેરીના ગોઠા જેવડું એક મોટું મોતી ચમકતું હતું! આવડું મોટું મોતી મેં પહેલી વાર જ નેયું. દુનિયા પર આવડું મોતી હોઈ શકે તેની જ મને કલ્પના નહોતી. મેં અનુમાન બાંધ્યું કે કેપ્ટન નેમાંચે ખાસ કાળજીથી આ મોતી ઉછેયું હોયું નેઈએ. દર વરસે મોતી ઉપર નવા ને નવા રસના થરો જમતાં જમતાં આવડું મોતી થયું હશે; અથવા તો કોઈ કોઈ જ્યાંથી - ખાસ કરીને હિંસુંતાનમાં અને ચીનમાં કરે છે તે પ્રમાણે - ધીપમાં કાચ કે બીજી ધાતુ મૂકી રાખીને ધીપલીઓના રસ માથે ભણાને તે એક થઈ જય અને એ રિતે મોતી મોટું થાય. એમ પણ કર્યું હશે. ગમે તે હોય. પણ દુનિયાની એક મહાન અનુયાયી ગાણી શકાય એવું એ મોતી હતું.

અમે તે નેઈને પાણ ફરવા લાગ્યા. આ મોતીના વિચારમાં ને વિચારમાં હું શાર્ક માછલીની વાત ભૂલી જ ગયો. અમે ચાહ્યા જતા હતા, તેવામાં કેપ્ટને અમને એકદમ અટકાવ્યા. મેં સામેનજર કરી તો પાણીમાં કાંઈક આકૃતિ તરતી દેખાઈ. તરત મારા મગજમાં શાર્ક માછલી આવીને જોલી! પણ મેં નેયું તો તે આકાર માણુસનો હતો. મોતી કાઢવા તે પડેલો હોય એમ લાગ્યું. એક મોટા પથર અને એક ટોપલી દોરડા સાથે બાંધેલી તેની પાસે હતી. તળિયે જઈને ટોપલીમાં તે ધીપલીઓ ભરવા લાગી જતો; ચોડી વારમાં પાણો ઉપર જતો ને પાણો નીચે આવતો. આ પ્રમાણે તેણે કેટલીય દૂખકાઓ. ખાધી. અમે ખૂબ ધ્યાનથી આ બધું

નોઈ રહ્યા હતો.

તે માણુસ જ્યાં ગોડળુભેર થઈને છીપકીએ વીણું હતો ત્યાંથી એકાએક લયનો માર્યો કૂદ્યો, અને ઉપર પહેંચવા માટે તરવા લાગ્યો. પણ ત્યાં તો દૂરથી શાર્ક માછલી પાસે જ આવી પહેંચ્યો. પેલો માણુસ તેના હુમલાથી બચવા માટે નીચે દૂષકી મારી ગયો. આ બધું થાડી જ સેકંડમાં બન્યું; શાર્ક તે માણુસની પાછળ પાછી તળિયે આવી; પોતાની કરવત જેવી સ્કુંદથી તે પેલા માણુસને વહેરી નાખવાની તૈયારીમાં હતી. હું લયથી સ્તલઘ બની ગયો હતો, પણ કેપ્ટન નેમો વીજળાની જેમ કૂદ્યો; તેના હાથમાં ખંજર હતું. રાક્ષસી માછલી પાસે તે જઈ પહેંચ્યો; માછલી પણ કેપ્ટનને સામે જિમેદા નોઈને પેલા માણુસને પડતો મૂર્હી તેના તરફ જ ધસી. કેપ્ટનની તે વખતની જીલા રહેવાની રીત તો હું કઢી નહિ ભૂલું. એક પગ આગળ રાખીને તે અડગ જિલો. શાર્ક તેના પર હુમલો કર્યો. વાંકા વળાને તથું તે તરાપ ચુકવી દીવી, અને નીચા વળાને પોતાનું ખજર શાર્કના પેટમાં ભોંકી દીધું. શાર્કના પેટમાંથા લોહિનો ધોધ છૂટચો ! પેલું પ્રાણી હવે વધારે લયંકર બન્યું. એટલા ભાગમાં દરિયાનું પાણી પણ લાલધૂમ અની ગયું. હું કેપ્ટનની મદદે જવાને વિચાર કરતો હતો પણ મારા પગ જ જિપડતા નહોતા. લડાઈ લયંકર બનતી ગઈ. શાર્ક માછલીના રાક્ષસી જેર પાસે કેપ્ટન થાક્યો; તે નીચે પડી ગયો. શાર્ક તેને હમણું જ વીંધી નાખશે એમ લાગ્યું. લયથી મારી અંખો ઝાટી ગઈ : અંખે અંધારાં આવી ગયાં ! પણ ત્યાં તો મારી પડ્યે જિલેદો નેડ જેરથી ધસ્યો અને કેપ્ટનના શરીર ઉપર શાર્ક પોતાની સુંદ ભાંડે તે પહેલાં તો તેનું ખંજર શાર્કના પેટમાં ધૂસી ગયું. આ ધા તેને જીવલેણ ધા થઈ પડ્યો. તેના મરણ વખતનાં તરફ-હિયાં પણ લયંકર હતાં. નેડે હાથ જાલીને કેપ્ટનને બેઠો કર્યો. કેપ્ટન જિલો થયો કે તરત જ પેલા મેતાિ કાઢનાર માણુસ પાસે તે પહેંચ્યો. માણુસ જેલાન હતો; તેને જાંચકીને એક જ ફ્લાંગે તે પાણી ઉપર

આવી પહોંચ્યો અને તેની હોડીમાં નાખીને તેને ભાનમાં આપ્યો. કેપ્ટને પછી પોતાના બિસ્સામાંથી મેતીથી ભરેલી એક નાની ડ્રાથળી કાઢીને તેના હાથમાં મુકી. પેદો માણુસ તો આબો જ બની ગયો હતો! અમે બધા પાછા તળિયે જતરી ગયા, અને ત્યાંથી ચાલતા ચાલતા અમારી હોડી પાસે પહોંચ્યા અને સીધા નોટિલસ ઉપર પહોંચ્યી ગયા.

પોષાક ઉતારીને અમે ઓરડામાં ગયા. તરત જ કેપ્ટને આવીને નેડનો હાથ હલાવીને કહ્યું : 'મિસ્ટર નેડ! તમારો ધર્ણા ઉપકાર થયો.'
'ના. મેં તો માત્ર મારી ફરજ જ બળવી છે.' નેડ કહ્યું.

'કેપ્ટન શિક્ષણ હસ્યો. પછી તે મારા તરફ ક્રીને બોલ્યો : પ્રોફેસર સાહેબ! તમે પેલો માણુસ જેયો? દુનિયાની કચડાયેલી દાયારેલી પ્રજનો તે પ્રતિનિધિ હતો; અને હું પણ મારી મરણું અર્થાત તનો જ સાથી રહેવાનો છું.' કેપ્ટન કર્યા હતી નિયમ વિના

૧૫

સુઅેઝની ધૂપી નહેર

ધીમે ધીમે સિલોનનો બેટ હેખાતો બંધ થઈ ગયો. લક્ષીવ અને ભાલીવના બેટા પણ પાછળ રહી ગયા. અમારું વહાણુ કલાકના ૨૦ માર્ચલની જડે વાયવ્ય દિશામાં જતું હતું. અમે કઈ બાજુએ જઈએ છીએ તેની કાંઈ ખઅર પડતી નહેતી. અમે જે તરફ જતા હતા તે દિશામાં એક બાજુ ઈરાનનો અખાત અને બીજું બાજુ રાતો સમુદ્ર હતો. બંનેનો આગળ જતાં રસ્તો બંધ થઈ જતો હતો, એટે વહાણુને ત્યાં જવાનું કઈ પ્રેરોજન ન હતું; તે પણ વહાણુ તે દિશામાં ધસ્યે જતું હતું. મને થયું કે કંદાય ઈરાનનો અખાત અને રાતો સમુદ્ર જેઠને પાછા ફરવાનું હશે, અને આદ્ધિકાની પ્રદક્ષિણા કરીને આટલાંટિક મહાસાગરમાં પહોંચાડે. નેડ ભારે ધૂંધવાતો હતો; ત્રણ ત્રણ મહિનાથી કેઢીની જેમ અહીં પુરાઈ રહેવું એ ભારે જુલમ હતો. મને તો અવલોકનના શોખને લીધે આ રસ્તું નહેતી સાલતી, પણ હું નેડની સ્થિતિ સમજી શકતો હતો.

અમારું વહાણુ આમનના અખાતમાં આવી પહોંચ્યું. દૂરથી મસ્કત શહેરની મસ્નાદોના ધુમમણો નજરે પડતા હતા. હેડામાઉંટ અને મહરાહના કિનારાઓની પડે થઈને અમારું વહાણુ એડન પાસેના બાખ્લમાંડપના અખાતમાં ધૂસતું હતું. બંને બાજુ કાળા પહાડોની મોટી હારો નજરે પડતી હતી. દરિયાની અદ્ભુતતામાં ખૂબ રસ પડે છતાં જમીન પરની સમૃદ્ધિ કેવી મધુર લાગે છે?

છુટી ફેલુંઆરીએ એડનના બંદર પાસેથી દૂયકી મારીને અમારું વહાણુ રાતા સમુદ્રમાં પેડું. એડનને અમે બરાબર જોઈ ન શક્યા; તો પણ દૂર પડેલી નાની મોટી કલકતા, સુંબરી, સુઅેઝ, બુઝેન,

મોરેશિયસ વગેરે સ્થળે જવા માટેની સ્ટીમરો બુમાડા કાઢતી પડેલી હેખાતી હતી, બંદર ઉપર ખિટિશ સરકારનો વાવટો ફરકતો હતો.

અમારી સ્ટીમર રાતા સમુદ્રમાં તરતી હતી. આ જ રાતો સમુદ્ર જૂના ધર્તિહાસમાં મહા લયંડર સમુદ્ર તરીકે ગણ્યાઈ ગયે છે. અનેક નાનાં મોટાં વહાણોને તેણે પોતાના ઉદ્દરમાં સમાવી દીધાં છે. પણ અત્યારે સ્ટીમરો આગળ તેનું તોઝાન ચાલી શકતું નથી. અમારું વહાણું રૂષકીદાવ રમતું હોય તેમ ઘડીક ઉપર ને ઘડીક નીચેતરતુંતરતું આગળ ને આગળ ધર્યે જતું હતું. નોટિલસ આફ્ઝિકાના કિનારાની ખાજુએ વધારે ચાલતું હતું. કારણ કે ત્યાં પાણી બંડાં હતાં. આ સમુદ્રનાં પાણી સ્વચ્છ ભૂરાં હોવા છતાં તેનું નામ રાતો સમુદ્ર દેમ પડ્યું હશે તેની મને નવાઈ લાગતી હતી; પણ નેમો તરફથી મને તેનો થાડાએક ખુલાસો મળ્યો. તેણે કહ્યું : ‘આ સમુદ્રમાં – ખાસ કરીને ટોર નામના અખાતમાં તળિયે પાણી વધુ લાલ હેખાય છે તેનું કારણ ત્યાં ઉત્પન્ન થતી એક પ્રકારની વનસ્પતિમાંથી જરતો રસ છે.’

અહીં અગાઉ કચાંયે નહિ જોયેલી એવી ચોને અમને ખૂબ જેવા ભળી. આ ચીજ તે વાદળા. જતની આકારની આ વાદળાએ આંખને ખૂબ આનંદ આપતી હતી. આ વાદળા સખ્યે મેં જે થોડું ધણું વાંચ્યું હતું, તે મને ઢીક ઉપયોગી થઈ પડ્યું. વાદળા એ વનસ્પતિ છે કે જીવાં છે એ વિષે હજુ પૂરો નિર્ણય થયો નહોતો; પણ વાદળા એ જીવાં છે અથવા તો એ જીવાંએ ઉત્પન્ન કરેલો પદાર્થ છે એમ મોટા પક્ષ માનતો હોય. કેનિસલન મેં આનો પદાર્થ પાક મારી ડેઝિનની ખારી પાસે બેડાં બેડાં આપ્યો,

ધીમે ધીમે સુઅેજની ખાદી નહેર નશ્ચક આવતા જતા. હતા. કેપ્ટન નેમો હવે કચાંથી પોતાનું વહાણું પાછું ફેરવવા માગે છે તે મને કાંઈ સમજતું નહોતું. એક દિવિસ વહાણુના તૂતક ઉપર અમે લેગા થઈ ગયા. હું તેને પૂછું તે પડેલાં તો તે બોલવા લાગ્યો : ‘પ્રોઇસર સાહેબ! જે કામ ફુનિયાના ડેઈ છજનેરે માણે ન લીધું’

તે તમારા ફ્રાન્સના વતની લેસેપે હાથ ધર્યું ! જેતનેતામાં દુનિંધાનો વેપાર બધાઈજશે, પહેલાંના કાળમાં લોકો અડીંથી આફિકાને કિનારે નાઈલ નદીની નહેર વાટે ભૂમધ્ય સમુદ્રમાં પહેંચતા; પણ ડાઈને આ નહેરાતું સ્ફુરતું; અને સૂર્યે તાથ માથે ડ્રાણુ લે ? આખરે તમારા દેશમાંથી હિંમતવાળો આદમી નીકળ્યો ! આ ખાડીનો આપણે જેકે લાલ લઈ શકીએ એમ નથી. પણ જ્યારે આપણે પરમ દિવસે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ કરશું ત્યારે પોટ સૈયદનું બંદર તે જેઈ જ શકીશું. '

‘ ભૂમધ્ય સમુદ્રમાં ? ’ મેં આથર્ય પામીને પૂછ્યું.

‘ ડેમ, એમાં નવાઈ ડેમ પામો છો ? ’

‘ પરમ દિવસે આપણે ભૂમધ્ય સમુદ્રમાં તે ડેમ પહેંચી શકીએ ? વહાણુને ગમે તેટલી ઝડપ હોય તોયે પાછો આપો રાતો સમુદ્ર વટાવી આફિકાની પ્રદક્ષિણા કરીને ડેઢ ભૂમધ્ય સમુદ્રમાં આવવું એ કાંઈ એકણે દિવસમાં બને ? એ તો મહિનાઓ લાગે. હા, એમ બને ડે તમારું નોટિલસ વહાણ જેમ દરિયાની સપાઈની નીચે તરે છે તેમ જમીનની ઉપર પણ તરવા એટલે ડે જિડવા માંડે ! ’

‘ પ્રેફેસર ! ત્યારે તમને ખખર નથી. સુઅેજની સંયોગીભૂમિ ઉપર ચાલવાની જરૂર નથી. તેની નીચે થઈને મારું વહાણ ખુશીથી ભૂમધ્ય સમુદ્રમાં પહેંચી શક્શે. ’

‘ નીચે થઈને ? ’

‘ હા હા, નીચે થઈને. નીચે થઈને મારા વહાણુને જવા માટેનો રસ્તો તૈયાર છે. ’

‘ પણ સુઅેજની સંયોગીભૂમિ ઉપર તે રેતી જ છે ! ’

‘ હા. પણ તે ૫૦ કૂટ સુધી જ છે. તે પછી તો કઠણું ખડકો આવે છે. અને એ ખડકોની નીચે એક મોટી કુદરતી નહેર છે. મેં આનું નામ અખાડમ નહેર રાખ્યું છે. ’

‘તમને તો આ રસ્તો અકસ્માત જ મળી ગયો કે?’ મેં પૂછ્યું.

‘એમાં અરધી અકસ્માત અને અરધી અટકા. હું કેટલીયે વાર એ રસ્તેથી ભૂમધ્ય સમુદ્રમાં ગયો છું; આ પહેલી જ વાર નથી.’

‘આ માર્ગ તમે કઈ રીત શોધી કાઢ્યો?’

‘જુઓ, તમને એ કહેવામાં વાંદ્યો નથી, કારણ કે આપણે બંને કેઠ સુધી સાથે જ રહેવાના છીએ. મેં જેયું કે ભૂમધ્ય સમુદ્રની અંદરની માછલીઓ અને રાતા સમુદ્રની અંદરની માછલીઓ ધણીખરી એક જ જતની છે. મેં એક વાર બેન્ચણું માછલીઓને પકડીને તેમને વાંટીઓ પહેરાવી હતી; જે માછલીઓને મેં વાંટીઓ પહેરાવી હતી તેમને જ મેં પાછી રાતા સમુદ્રમાં પણ જેઠી! આથી મને દરિયામાં નીચે ડોઈ માર્ગ હોવાની ખાતરી થઈ.’

મેં ભારા સાથીઓને આ વાત કરી ત્યારે તેઓ કેપ્ટન નેમેની ઝુદ્ધ ઉપર તાજુખ થઈ ગયા. ‘દરિયાની અંદર થઈને એક દેશમાંથી ખીંચ દેશમાં જવાનો માર્ગ શોધનાર આ માણુસનું જેજું હેવું હોશે?’

ત દિવસે સાંજે અમે અરથસ્તાનના કિનારા બાજુ આવ્યા. ત્યાંથી જેડાહ બંદર સ્પષ્ટ હેખાતું હતું. આ બંદર મોટું વેપારનું સ્થળ હતું. તેનાં મકાનો તેમ જ બંદર ઉપર લંગર નાખીને પડેલાં નાનામોટાં વહાણો અમે જોયાં. સર્દી આથર્યો ને દરિયાનાં કાળાં પાણી વધારે કાળાં થયાં. અમારું વહાણ અંધારાનો લાલ લઈને સપાઈ ઉપર જ તરતું હતું.

ખીંચ દિવસે સવારે વળી નેડને મજન આવે એવો એક બનાવ અન્યો. અમે બધા તૂતક ઉપર જિભા હતા, ત્યાં દૂર મોટા તરતા અડક જેવું હેખાયું. અમે તેને દૂરથી આળખી ન શક્યા, પણ પાસે આવતાં જેયું તા તે ડ્યુગોંગ નામનું દરિયાઈ પ્રાણી હતું. નેડ તો હારપૂન લઈ તૈયાર જ હતો. તેણે કહ્યું: ‘હજુ આવા ડોઈ પ્રાણીના પેટમાં મારું હારપૂન નથી ગયું.’

કેપટન નેમો પણ ઉપર આવી પહોંચ્યો હતો. તેને પણ નેડના શિકારમાં ખૂબ રસ હતો. તેના બળ ઉપરની અદ્ધા પેલી શાર્ફ માછલી સાથેના ચુંબક પઢી ખૂબ વધી ગઈ હતી. ડચુગોંગ જે છંછેડાય તો ભયંકર હોય છે, પણ નેડના હારપૂનનો એક જ ધા તેનો જીવદેણું ધા થઈ પડ્યો. થોડા જ વખતમાં નોટિલસના રસોડામાં તે પ્રાણી પહોંચ્યી ગયું. નેડને આજે ખૂબ ખૂબ લાગી ગઈ - ધંધે વખતે આવું ખાણું તેને મળ્યું હતું !

રાતના વખતે અમારું વહાણું સુઅઝની ઘોદાતી નહેર પાસે
આવી પહોંચ્યું. દૂરથી જાંખી હેખાતી દીવાદાંડી તારાની જેમ ચમકઠી
હતી. અમને બધાને તૂટક ઉપરથી અંદર જવાનું કહેવામાં આવ્યું
કારણું કે અડીથી અમારી પાણીની અંદરની સુસાક્ષરી શરૂ થવાની
હતી. નેમાંચ શાધી કાઢેલી નહેરમાંથી અમારે પસાર થવાનું હતું.
નોટિલસની પાણીની ટાંકીઓ ભરાઈ અને અમારું વહાણું દરિયામાં
જિંડે જીતરવા લાગ્યું.

કેપ્ટન નેમો મને સુકાનની કેળિનમાં લઈ ગયો; સુકાન ઉપર કેપ્ટન પોતે ધ્યાન રાખતો હતો. એક પડ્છંદ માણુસ ત્યાં બેઠો એઠો મેનોમિટર તપાસી રહ્યો હતો. વહાણું નીચે ને નીચે જિતરતું ગયું. અહીંથી કેપ્ટનની સ્ફુર્યના પ્રમાણે વહાણ પોતાની દિશા ફેરબ્યા કરતું હતું. આખરે લગભગ ૧૦ વાગે અમારી સામે મોટો ગુફા જેવું દેખાયું. અહીં સુકાન કેપ્ટને પોતે હાથમાં લીધું. અમારું વહાણું અથાડમ નહેરમાં પેટું. આ નહેર આખી ઢોળાવવાળી હોવાથી રાતા સમુદ્રનાં પાણી ખૂબ જોરથી વહેતાં હતાં. અમારું વહાણું અથડાઈ પડે એવો તે સાંકડો માર્ગ હતો. મારું હદ્દય આ દેખાવ જેઈને જોરથી ધડકી રહ્યું હતું. ૨૦ મિનિટ પછી કેપ્ટને સુકાન છોડી દીનું અને મારા તરફ ક્રીને બોલ્યો: ‘ભૂમધ્ય સમુદ્ર !’

૧૬

ભૂમદ્ય સમુદ્રમાં

‘ભૂમદ્ય સમુદ્ર ?’

મારા સાથીએ સવારે જઠચા અને જ્યારે મેં કહ્યું કે આપણે ભૂમદ્ય સમુદ્રમાં સફર કરી રહ્યા છીએ, ત્યારે તેમને ઘડીભર તો સ્વચ્છ લાગ્યું.

પણ બહાર આવીને તેમણે દરિયાની સપાટી ઉપર નજ્ર નાખી તો ચાર્ટ સૈયદનો કિનારા ધોમે ધોમે અદ્યથ થતો જતો હતે.

થાડી વારમાં અમે ચારે તરફ યુરોપનાં જુદાં જુદાં રાજ્યોના કિનારા જેવા પામશું, એ વિચારે અમને હલાવી મુક્કા. નેડલેન્ડના મનમાં નાસી છૂટવાનો વિચાર ઝરી બમણું જોરથી જથ્રત થયો. અમે બધા બંધારણે મારા ઓરડામાં બેઠા હતા, ત્યાં નેરે વાત ઉપાડો : ‘કેમ ગ્રેફેસર એરોનાના! હવે શો વિચાર છે? યુરોપના કિનારા પાસે તો આવી પહોંચ્યા છીએ.’

‘કેમ? આ મુસાફરીથી કંટાળો આવી ગયો?’ મેં પૂછ્યું.

‘સાચી વાત કહું તો મને બહુ કંટાળો નથી આવ્યો; પણ ગણે તેવી સારી મુસાફરી હોય છતાં તેનેથે કાંઈ અંત હોય ને? આ તો મને પૃથ્વીના ગોળાની જેવી અનંત મુસાફરી લાગે છે.’

‘તેનો ય અંત આવશે; ધીરજ રાયો.’ મેં કહ્યું:

‘કેમ? આએ દરિયો ઝરી વળશું એટલે મુસાફરી પૂરી થશે।’

‘બરાબર છે.’ ડાન્સીલે કહ્યું. ‘મને તો લાગે છે કેપ્ટન નેમો આપણુંને આખી દુનિયા પરના સમુદ્રની અંદર ફેરફાને પછી છૂટા કર્યો.’

‘મને તો લાગે છે કે આ દેહથી આપણુંને છૂટા કરશો,

વહાણુમાંથી તો નહિ કરે।' નેડે કહ્યું:

'ના ના, એમ તો શું બને? પણ મને એક વાત સાચી લાગે છે કે કેટન નેમો પોતાની મરજીથી આપણને શુદ્ધ નહિ કરે. એ તો આપણે જ નાસી શુદ્ધવાતું રહેશે, જે નાસી શુદ્ધવું હોય તો.' મેં કહ્યું:

'ત્યારે કેમ કરશું?' નેડ મુંઝાયો.

'રાહ જેવી, ને લાગ આવે ત્યારે નાસી શુદ્ધવું.'

'તમે તો ભવિષ્યકાળની જ બધી વાતો કરો છો।' નેડ જરા ચિડાયો. 'રાહ જુઓ, રાહ જુઓ, તે કચાં સુવો? આ ભૂમધ્ય સમુદ્ર જેવા લાગ કચારે મળવાનો છે? મને તો લાગે છે કે તમારી પોતાની જ ધ્રયણ નથી. ધારો કે અત્યારે જ કેટન આવીને તમને કહે કે "તમે શુદ્ધ છો," તો તમે અહીંથી જાઓ ખરા?'

હું કાંઈ ન બોલ્યો.

'અને ધારો કે એમ કહે કે "આ એક વાર તમને અહીંથી જવાની જુદી છે, પછી ફરી વાર અહીંથી જવાની વાત નહિ કરતા!"' તો અહીંથી તમે ખ્સો ખરા? નેડ મને વડીલની જેમ પૂછવા માંડયું.

હું કાંઈ ન બોલ્યો.

'કેમ ડ્રાન્સીલ! તને શું લાગે છે?'

'હું ના શું કહું?' કોનિસલે તત્ત્વજ્ઞાનીની જેવી વૃત્તિથી જવાબ આપ્યો. 'આપણે તો જવાની કશી ઉતાવળ નથી. ધરે આપણા ત્રણુમાંથી ડાઈની વાટ જુઓ એવું કોઈ નથો. જીવ્યા કરતાં જેથું ભલ્યું! અને તેમ છતાં મારા શેઠ તૈયાર થાય તો આપણું પોટલું પહેલું તૈયાર સમજવું.'

'દ્યો ગ્રાઇસર! ડ્રાન્સીલ તો પોતાની જતને શરૂં જ માને છે। સવાલ આપણા બે વચ્ચે જ છે. તમને જે લાગતું હોય તે કરો.'

મારે હવે બોલ્યા સિવાય છુટકો જ ન હતો. નેડ મારા મેંમાં આંગળાં નાખીને ભને બેલાવતો હતો. મેં કહું : ‘નેડ! તું જીત્યો ને હું હાર્યો! નાસી છુટવા માટે તક મળે ત્યારે તે ચૂકવી નહિં. હું તે માટે તારી સાથે તૈયાર છું એમ સમજને. આપણે મરી ગયા પણ પણ ડેપ્ટન નેમા આપણુંને છુટા કરે એમ નથી. આપણું કણ્ણર પણ તેના જ કાયરસ્તાનમાં થાય એવો સંભવ વધારે છે! માટે હું કહે ત્યારે હું તૈયાર જ છું?’

‘શાબાશા! હવે તમે સમજ્યા! ’ નેડ મારો ખબો ટોક્યો.

‘પણ એની તૈયારી બધી તારે કરવાની! ’ મેં કહું.

‘તેના વાંધી નહિં; મેં ભનમાં બધી યોજના ઘડી રાખી છે. જે હિનારે પાસે હોય તો અનામાના તરીને ભાગી જવું; કદાચને વહાણું સપાઠી પર ન આવે તોપણ તેના ઉપાય મારી પાસે છે. વહાણની સાથે ને હોડી બાંધેલી છે, તેને ડેમ વાળવી, તેને કદ રીતે છોડવી, એ બધું મેં વિચારી રાખ્યું છે.’

‘હા, એ બધું હીક, પણ જે જરાક ભૂત થઈ અને પકડાવા તો શું થશે તેના પણ વિચાર કરી રાખને! ’ મેં કહું.

‘અરે, એમાં વાંધી ન આવે! ’

‘નેડ હું! ગમે તે કર પણ ડેપ્ટન નેમોને ચાર આંખો છે. તે ભૂમધ્ય સમુદ્ર કે જ્યાં ચારે તરફ યુરોપનાં રાજ્યોનાં બંદરો હોય ત્યાં નોટિલસ જિલ્લાં રાખે અને સમુદ્રની સપાઠી પર આવે એમ માને છે? અતાં હું જે બધી તૈયારી કરી શકતો હોય તો અમે તારી સાથે તૈયાર જ છીએ. અમને આગળથી, ખખર આપને?’

નેડને આ બધું માન્ય હતું.

અમારું વહાણું અપાટાબંધ આગળ વધ્યે જતું હતું. ભૂમધ્ય સમુદ્રનાં ભૂરાં પાણીની આંદર તરતી માછકીઓની ગમ્મત જેવાની પણ અમને પૂરી તક નહોંતી ભળતી.

એક દિવસ એક વિચિત્ર ખનાવ ખન્યો. અમારું વહાણું

દરિયાની સપાઈથી થાએક જ નીચે તરતું હતું. મારા ઓરડાની બારી ઉધાડી હતી. હું એક્ષિટશે દરિયાની માછલીઓ જોઈ રહ્યો હતો. તેવામાં પાણીમાં માણુસની આકૃતિ નજરે પડી. આકૃતિ ઘડીક ઉપર ને ઘડીક નીચે આવતી હતી. મને થયું કે આ માણુસ રૂપે છે। હું એકદમ કોટન નેમેના ઓરડામાં ગયો; તને એક માણુસ રૂપે છે એવા ખરર આપ્યા ને કહ્યું: ‘આપણે તને ડાઈ રીતે બચાવવો જ જોઈએ.’

કોટન નેમે જરાક હસ્યો. તે જિન્મો થયો અને એક લોઢાની માટી પેટીમાંથા તિનેરી જ્વા એક પેટી કાઢી. પેટી ઉધાડીને તણું અંદર જેયું; અંદર સોનાની લગડીઓ હતી. કોટને તે બરાબર ગોડીની મૂકી. ઘંટડી વગાડતાંતી સાથે જ ચાર માણુસો અંદર આવ્યા. ચારે જણાએ મહામુશકેલીએ એ પેટી ઓરડાની બડાર ધેક્લી. તેનું વજન આશરે ૨૫ મળું હશે. એક લાખ પૌંડની કિંમતનું આ સેનું જોઈને મારી આંખો તો ઠરી જ ગઈ! આઠથું સેનું કચાંથી આવ્યું હશે? કચાં જતું હશે? માણુસોએ પેલી તિનેરી જ્વા પેટીને વહાણુના તૂતક ઉપર ચડાવી. વહાણું હવે દરિયાની સપાઈ ઉપર આવી ગમું હતું. ઉપર શું થયું તે કાંઈ હું જણી ન શક્યો, પણ મને લાગ્યું કે પેલા ઇબકી ખાતા માણુસને અને આ સોનાની તિનેરીને કાંઈક સંબંધ હોવો જોઈએ.

મારા સાથીએને પણ આ વાત સંભળીને અજાય આથર્થ થયું. આવી સમૃદ્ધિ આ વહાણુમાં ભરી હશે, તેની શી ખરર? વહાણું પાછું આગળ ચાલ્યું. હું મારા ઓરડામાં બેડા બેડા નોંધ લાખતો હતો. સંજના પાંચનો સમય હતો. એકાએક મને સખત ગરમી લાગવા માંડી. મેનો મિટર જેયું તો વહાણું દરિયાની સપાઈથી ૧૦ ફૂટ નીચે હતું. અહીં સુધી સુર્યની ગરમી આવે એ બને તેમ નહોતું. ત્યારે આ ગરમી શી? કદાચ વહાણુમાં આગ તો

નહિ લાગી હોય? હું તપાસ કરવા જિબો થતો હતો ત્યાં કેપ્ટન જ મારી ઓરડીમાં આવ્યો.

‘આ શું? આટલી બધી ગરમી શી? ’ મેં પૂછ્યું.

‘થાડા વખત માટે આ ગરમી રહેશે. આપણે અત્યારે જિકળતા પાણીમાંથી પસાર થઈ રહ્યા છીએ.’ એમ કહીને તેણે બારી ઉઘાડી. મેં બહાર નજર કરી તો પાણી સેફેદ થઈ ગયું હતું. પેક આરથું છતાં એમાંથી નીકળતો ગંધકનો ધુમાડો સ્ક્રમ વાસ ફેલાવી રહ્યો હતો.

‘આપણે અત્યારે સેન્ટેરીનના બેટની નજીક છીએ.’ કેપ્ટન નેમાંચ કહ્યું.

આ બનાવ પછી કોઈ ખાસ બનાવ ન બન્યો. વહાણુની ઝડપ ખણું ધામે ધામે વધવા માંડી. જેમ જેમ ઓસ અને કીટનો કિનારા નજીક આવતો ગયો તેમ તેમ વહાણું આયો દ્વિસ સતત ગતિમાં જ રહેતું; રત્ન થાડો જ વખત હવા લેવા માટે તે ઉપર આવતું. આવી ઝડપથી જતી ‘સખમરીન’ માંથી નાસી ધૂટયું એટલે ઝડપથી ચાલતી ગાડીએ ભૂસડો મારવા જવું હતું. કેપ્ટન નેમો પણ હમણું અને મળવા નહોતો આવતો. માછલીઓ સિવાય નવું જેવાનો અવકાશ નહોતો. ઈટાલીના રળિયામણું કિનારા જેવાની આશા પણ નકારી ગઈ. અમે પુરાઈ રહ્યા. નેઈ પણ આશા છોડી. કેપ્ટન નેમાંચ મારા ધાર્યા પ્રમાણે જ કર્યું. કચાંયે વહાણુને અટકાવે તો નાસી ધૂટવાનું બને ને? અમારે તો ઓરડીમાં પડચા પડચા બારી-માંથી જેવાય તેટલું જેઈને સંતોષ માનવાનો હતો. અંદરના નકશા ઉપરથી અમે જેઈ શકતા કે ઓસનો પડખે થઈને પસાર થઈ ગયો. પણ તેથી તો મનમાં વધારે બળતરા થતી. કોઈ જગ્યાએ તૂટી ગયેલી જબરી સ્ટોમરોનાં હાડપિંજર હેખાતાં, ને અંદર લેઠાનાં મોટાં થત્રો તથા એંજિનો પટેલાં નજરે પડતાં. મોટાં મોટાં માછલાંઓ સેમી સાથે પોતાની પૂંછડીઓ અફ્લગાવતાં હતાં.

ધૂપી નહેર છોડચાને હળુ ૪ કલાક જ થયા હતા. ૧૮મીએ
સવારે તૃણ વાગે અમે જિખાદટરની સામુદ્રધુનીમાં પેઢા. હરકયુલિસનાં
ખંડેરા નજરે પડે ન પડે તે પહેલાં તો ભૂમધ્યને તળિયે વહેતા
આંદરના સામા પ્રવાહે અમારા વહાણુને વિશાળ આટલાંટિક મહા-
સાગરમાં ધકેલી દીધું ।

૧૭

દુખી ગયેલા હેશની શોધ

આટલાંટિક ! દુનિયા પરનો મોટા ભાગ રોકીને પડેલો આ આઇટ વિશાળ સાગર ! દુનિયાની મહાનમાં મહાન નદીઓને પોતાના પેટમાં સમાવી હેતો આ આટલાંટિક અમારી નજરે પડ્યો. દુનિયાના મોટાં મોટાં રાજ્યોનાં અને વેપારીઓનાં હજરો જહાને આતી છાતી ઉપર રાતદિવસ તર્ફાં કરે છે.

જિયાલ્ટરની સામુદ્રધૂની વટાવીને અમારું જહાજ આટલાંટિકનાં તોક્ષાની પાણી સાથે લડતું લડતું આગળ ચાલ્યું જતું હતું. પવન પણ જોરનોરથી કુંકાતો હતો. વહાણુના તૂતક ઉપર જીબા રહેવું સુશ્કેલ હતું. હું મારી ઓરડીમાં ગયો. મારી પાછળ જ નેડ અને ડેન્સીલ પણ આવ્યા. નેડ બારણું અંદરથી બંધ કર્યું; હું કારણું સમજ ગયો.

‘નેડ ! બ્લૂમધ્ય સસુદ્ધમાં તો આપણી યોજના પાર ન પડી શકી. વહાણુ ડેટલી જડપથી જતું હતું। તેમાંથી છટકવું એટલે મેતને જ નોતરવાનું હતું.’

નેડ કાંઈ ન બોલ્યો. તેણે પોતાના હોઠ ભીડચા.

‘પણ હજુયે નિરાશ થવાનું કારણ નથી; આપણે પોર્ટગલના કિનારાની નજીક આવતા જઈએ છીએ. ઇન્સ ને ઈંગ્લાંડ બહુ દૂર નથી; માત્ર જો વહાણુ ઉત્તર તરફ જવાને બદલે દક્ષિણ તરફ જય તો મુંઝવણુ ઊભી થશે. પણ મને લાગે છે કે કેપ્ટન નેમો વહાણુને ઉત્તર બાજુ જ હાંકશે. આ બાજુના સુધરેલા હેશાથી તે ભાગતો ફરતો હોય તેમ લાગતું નથી. આપણે વળી બીજે લાગ શોધશ્યું.’

નેડ મારા સામું તાકીને જોઈ રહ્યો; આખરે બોલ્યો : ‘તો

પછી આજે જ રહે !'

હું ચમક્યો. નેડના આ વાક્ય માટે હું તૈયાર જ નહોતો. નેડને શો જવાય આપવો તે મને સૂજયું નહિ.

'કેમ ? આપણે નક્કી નહોતું કર્યું કે લાગ આવે ત્યારે નાસી છૂટવું ? આજે રહે આપણે લગભગ સ્પેનના કિનારા પાસે આવી પહોંચયશું. આજે રાત અંધારી છે, તમારે તૈયાર રહેવાનું છે.'

હું હજુ મૂંગો જ રહ્યો હતો. નેડલેન્ડ મારી વધારે નળુક આદ્યો અને ધીમેથી બોલ્યો : આજે રહે નવ વાગે; ડ્રાન્સિલ પણ તૈયાર છે. કોઈન નેમો એ વખતે પોતાની ઓરડીમાં હશે. મેં હોડી પણ તૈયાર જ રાખ્યો છે. અંદર થોડોએક ખાવાપીવાનો સામાન પહોંચાડી આવ્યો છું. બધું તૈયાર છે. નવ વાગે તૈયાર રહેને; હું નિશાની કરીશ.'

'પણ દરિયો આજે જરા તોકાની છે.' મેં કહ્યું.

'હા, એ તો હું બાળું છું. પણ એટલું તો નેખમ ખેડલું જ જોઈએ ને ? સ્વાતંત્ર્ય કાંઈ મહત નથી મળતું; વળી હોડી ખૂબ મજબૂત છે. એકદમ ઝૂભે તેવી ચે નથી. મને તો લાગે છે કે સાન્માંડા પણ દરિયાને કાઈ કંડે તો પહોંચી જ જર્દશું. પછી તો ઈશ્વરની ભરજી !'

નેડલેન્ડ ચાલ્યો ગયો. મારા મગજમાં અનેક વિચારોની પરંપરા ચાલી. મારા અંતરમાં તો અહીંથી છૂટવાની ઈચ્છા હતી, પણ આજે જ અહીંથી આ વહાણ છોડીને જવાનું છે એ વિચારે મારા હૃદયમાં ભારે તોકાન મચાવ્યું : 'આ મહાસાગર છોડીને જવું ? હજુ તો સાગરનો કેટલોયે ભાગ નિહાળવાનો બાકી છે. હજુ તો આ મહાન પુસ્તકનું પહેલું પાતું વાંચું ન વાંચ્યું ત્યાં તો મારા હાથમાંથી આ પુસ્તક પડી જશે ? હજુ તો મધુર નિદ્રામાં આ મહાન સ્વપ્ન શરૂ થાય ન થાયત્યાં તો મારી બંધ જડી જશે ? પણ નેડને કેમ સમજવાય ? અને આ તક ગઈ તો ફરી આવશે જ નહિ, એ

વાત પણ એટલી જ સાચી છે.' ઘડીભર એમ પણ થયું કે 'વહાણુ પેતાની ઉત્તર દિશા બદલીને જે દક્ષિણ દિશા તરફ મોઢું ફેરવે તો ડેવું સારું !' પણ વહાણુ તો ઉત્તર તરફ જ ચાલ્યું જતું હતું. પોર્ટાઈંગલનો કિનારો નજીક ને નજીક આવતો જતો હતો. મારે તૈયાર જ થવું જેઈએ ! મારી પાસે સામાનમાં મારી નોંધપોથી સિવાય ખીજું કાંઈ ન હતું. મને વિચાર આવ્યો કે 'અમારા નાસી જવાધી કેપ્ટન નેમોની શી સ્થિતિ થશે ?' જે વાત તેને જગતમાં કાઈને જણાવવી નથી તે વાત અમે તેનો વિશ્વાસધાત કરીને જગતને જણાવી હેશું ! કેપ્ટન ગમે તેવો હોય તાં હજુ સુધી તેનો દ્વાષ કાઢવા જેવું એક પણ કાર્ય અમે જેવું નથી. વહાણુમાં મને તે જે રીતે રાખે છે એથા વધારે સારી રીત ખીને કોણું રાખી શકે ? જે તે આ વહાણુમાંથી ગમે ત્યારે પણ છુટા થઈને ફરવાનું વચ્ચે આપે તો અમે નાસવાનો કદી વિચાર જ ન કરીએ ! સેનાની બેડી હોય તોપણું આખરે તે બેડી તો ખરી જ ને ?

આવા આવા વિચારોમાં મને આવાનું પણ ન ભાવ્યું. સાંજના સાત વાગ્યા. એ જ કલાક ખાડી હતા. મારું હૃદય જેરથી ધખકવા સાગ્યું; મારી નાડી પણ જેરથી ચાલવા લાગી. અત્યારે કેપ્ટન નેમો આવે ને મને જુઓ તો તે શું ધારે ? હું મારો આવેગ સમાવવા ધારો. પ્રયત્ન કરતો હતો, એક પણી એક પુસ્તક કાઢીને વાંચવાની મહેનત કરતો હતો, પણ એક પણ અક્ષર મને જાકલતો નહોતો. નાસી છુટ્યા પણી અમારું શું થશે તેની મને બહુ ખીક નહોતી; પણ નાસતાં પહેલાં અમારું કાવતરું પકડાઈ જય તેનો ડર ખૂબ હતો. અને પકડાઈ ગયા પણી અમારી શી હાલત થાય એની તો કદ્દપના જ લયંકર હતી !

હું કેપ્ટન નેમોની ઓરડીનાં છેલ્ખાં દર્શિન કરવા નીકળ્યો. તેની ઓરડી ખાલી હતી. આ વખતે તેની ઓરડીમાં અગાઉ નજરે નહિ પડેલાં ચિત્રો મેં જોયાં. દુનિયાના જુદા જુદા હેઠાના

સ્વાતંખ માટે ખુલાર થઈ ગયેલા મહાપુરુષોનાં તે ચિત્રો હતાં. ગુલા-
મેને કારણે જન ગુમાવનાર અખાડમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન,
આયર્લાંડ માટે લડનાર ઓડેનેલ, ઈટલીનો વીર મેર્ઝિની, અને એવા
ઘણ્યાનાં ચિત્રો ત્યાં ટાંગેલાં હતાં. કેપ્ટન નેમો આવાં ચિત્રો પણ
શા માટે રાખતો હશે? ડેંડ ગુલામ પ્રજને માટે બડારવટે ચેલેલા
ડેંડ ગુપ્ત વીરપુરુષ તો તે નહિ હોય?

આઈ થયા; હું પ્રૂજ જિઠચો! વહાણ હજુ ઉત્તર બાળુ જ
ધસતું હતું. હું મારા ઓરડામાં પાછો ગયો; કપડાં પહેરી લીધાં.
હું તૈયાર હતો; રાહ જેતો હતો. વહાણનાં યંત્રોનો જ ધીમે
અવાજ આવતો હતો. મારા કાન વારે વારે ચ્યમકતા હતાઃ ‘નેડને
હમણું ડેંડ પકડીને કેપ્ટન પાસે તો નહિ લાવે?’

એકાએક વહાણનું યંત્ર બંધ પડી ગયું. ચોમેર શાંતિ છવાઈ
ગઈ. થોડી વારે એક આંચેક લાગ્યો. મને ખખર પડી કે વહાણ
સમુદ્રને તળિયે બેદું.

એ જ ધરીએ મારા ઓરડાનું આરણું જિધકચું અને કેપ્ટન
નેમો અંદર આવ્યો! હું ચ્યમકચો. મને થયું કે હું પકડાઈ ગયો
છું. પણ કેપ્ટન નેમા તો આવતાંવેંત જોલ્યો: ‘પ્રોફેસર સાહેબ! તમે
સ્પેઇનનો ધતિહાસ જાણો છો?’

આ પ્રશ્નથી મને આશ્ર્ય થયું; પણ મારી બીડ ઓછી થઈ.
તોય હું જવાબ તો ન આપી શક્યો.

‘કુમ, મેં પૂછ્યું તે તમે સાંભળ્યું?’ તેણે કરી પૂછ્યું.

‘હા જ; જણું છું પણ બહુ જ થાડો.’

‘ત્યારે બેસો; હું તમને તેના ધતિહાસનું એક પાનું બતાવું.
આપણે અત્યારે વીગાના અખાતમાં છીએ. તમને યાદ હશે કે આ
અખાતમાં વીગાના બંદર પાસે જ ૧૭૦૨ના ઓક્ટોબરની બીજ
તારિયે સ્પેનિશ અને ઇંગ્લિશ લશકરને લડાઈ જમેદી. સ્પેઇનના
લશકરના કેપ્ટને પોતાના થોડા લશકરથી પણ દુસ્મન સામે ટક્કર

ઝીલેકી અને આખરે પોતે હારવાની અણી ઉપર હતો ત્યારે પોતાના દેશના વેપારીઓનાં કિંમતી માલથી ભરેલાં વહાણ્ણા દુર્મનના હાથમાં ન જય તે ખાતર સળગાવીને કુબાડી દીવાં હતાં : એ આ જ સ્થળ, હવે તે બધું નજરે જુણો !'

એમ હળિને તે મને પોતાના સલૂનમાં લઈ ગયો. તેણે સલૂનની બારી ઉધાડી નાખી. રાત હતી, પણ વીજળીના પ્રકાશથી આસ-પાસ ઘણ્ણા ભાગમાં અજવાળું પડતું હતું. મેં જેયું તો અમારા વહાણુના માણુસો સમુદ્રમાં જ્યાં ધૂમતા હતા ત્યાં તૂટી ગયેલાં વહાણ્ણાના અવશેષો પડ્યા હતા. પેલા માણુસો અંદર ક્રીને કાંઈક એકહું કરતા હતા. મેં બારીકાઈથી જેયું તો સોનાઇપાની લગડીઓ, જવેરાત વગેરે ઘણું તેમાંથી નીકળતું હતું.

'પ્રોફેસર સાહેબ ! દર્શિયામાંથી આ બધી ધાતુ નીકળા શકે છે; પણ તે કાઢવાનો ખરચ જ ધાતુની કિંમત કરતાં વધારે થઈ પડે છે. આ તો દુનિયાના પૈસાદારોએ ખાયેલો માલ મને તૈયાર મળે છે ! અને હવે તમે સમજ શકશો કે હું આટલો બધો પૈસાદાર શાથી છું ?'

થોડી વાર શાંત રહ્યા પછી પાછો તે ખાયેલો : 'પ્રોફેસર, તમને એમ લાગશે કે આ માણુસ બીજની મહેનતનો લાલ ઉડાવીને પૈસાદાર થાય છે ! પણ હું આ પૈસા મારા માટે એકઠા કરું છું એમ તમે રખે માનતા. શું મારામાં એટલી પણ લાગણી નહિ હોય કે દુનિયાના ભારથી દબાયેલી-કયડાયેલી પ્રજનો હું વિચાર ન કરું ?'

મારા હૃદયમાં કેપ્ટન નેમો વિષે નવો જ પ્રકાશ પડ્યો. તે દિવસે સેનાની લગડીઓવાળી તિનેરી કચાં ગઈ તે મને હવે કાંઈક સમજયું. 'આ લયંકર લાગતો પુરુષ ડેવા કોમળ હૃદયનો છે !'

આ વિચારમાં ને વિચારમાં હું અમારી યોજના ભૂલી જ ગયો. વહાણું તો આગળ ચાલવા માંડયું હતું.

ભીજે દિવસે સવારે નેડ મારી પાસે મારી આરડીમાં આવ્યો. તે નિરાશ થઈ ગયો હતો.

‘આપણું નસીબ જ આપણી સામે હતું.’ મેં કહ્યું.

‘મેં બધી તૈયારી કરી તે જ ઘણીએ કુપ્પને વહાણુને તળિયે ઉતારું.’ નેડે કહ્યું.

‘ને તળિયે જઈ તણે મને વાતાએ ચડાવ્યો, ને મોટા ખજનો અતાવ્યો।’ એમ કહી નેડને મેં ગઈ કાલ રાતની બધી વાત કરી.

નેડને આ વાતમાં બહુ રસ પડ્યો. તણે કહ્યું: ‘દીક, હજ વખત નથી વીતી ગયો. એક ખીલો પ્રયત્ન, અને તે પણ આજે સાંજે જ.’

નેડ ગયો. મેં નેમોના ઓરડામાં જઈને તપાસ કરી તો કંપાસમાં વહાણુની દિશા નેત્રક્રિય હતી. વહાણ ઉત્તર દિશા તરફ એટલે યુરોપના કિનારા તરફ પોતાની પીઠ ફેરવીને દક્ષિણ બાજુ હોડતું હતું! અગિયાર વાગે અમારું વહાણ સપાઠી ઉપર આવ્યું. અમે તરત જ રૂતક ઉપર પહોંચ્યી ગયા. આસપાસ નજર નાખી તો ચારે તરફ પાણી, પાણી ને પાણી। અમે યુરોપના કિનારાથી ખૂબ દૂર નીકળી ગયા હતા. નેડના કોણનો પાર ન હતો.

દરિયો તોઝાની હોવાથી અમારે અંદર જવું પડ્યું.

નેડની યોજના પડી ભાંગી; મને પણ તેનું દુઃખ થયું. રાતના હું મારા ઓરડામાં એડો હતો ત્યાં અણુવાર્યો જ કોટન નેમો અંદર આવ્યો ને બોલ્યો: ‘કાલે રાત્રે મેં તમને જગાડીને દીક હેરાન કર્યાં, કેમ?’

‘ના ના, એવું કશું નથી, કુપ્પન સાહેબ !’ મેં કહ્યું.

‘તો પછી આજે એક બીજી નાની એવી સફર માટે તમને ઓલાવવા આવ્યો છું; અને તે પણ અત્યારે જ.’

‘અત્યારે ? રાતે ?’

‘હા, અત્યારે જ. એક વખત રાતની મુસાફરી પણ માણુની જોઈએ ના ?’

‘હું તો તૈયાર જ છું.’

‘તો ચાલો.’

અમે જિંદચા, વહાણ તળિયે બેદૂં: અમે પોશાક ચડાવીને

સમુદ્રને તળિયે ઝૂઢી પડયા.

હું અને કેપ્ટન નેમો સાથે જ ચાલતા હતા. થોડેક સુધી તો રસ્તા સીધો આવ્યો, પણ પછી પથથરવાળી જમીન અને ચઠાવ શર થયો. લાવારસના જમીન ગયેલા આણીદાર પથરો ઉપર થઈને અમારો રસ્તો જતો હતો. અમે જીંચે ને જીંચે ચાલતા ગયા, અમે ક્યાં જઈએ છીએ તેની મને ખખર નહોટી. ઘણે સુધી ચાલ્યા; મને હવે થાક પણ લાગવા માંડચો હતો. પણ સાથે લીધેલી લાકડીએ ઢીક મદદ કરી. ડોઈ ડોઈ જગ્યાએ પડ્યે થઈને ડોઈ ભયંકર દરિયાઈ પ્રાણી પસાર થતું જોઈને હુદયના થડકારા વધી જતા.

કેપ્ટન નેમો હજુ મને જીંચે ને જીંચે લઈ જતો હતો. મારામાં નેટલી શક્તિ હતી તે શક્તિથી હું કેપ્ટન નેમોની સાથે ચાલતો હતો. આખરે કેપ્ટન નેમો જોનો રહ્યો. એક ટેકરીની ટોચ આવી. ત્યાંથી મેં આગળ નજર કરી તો તે પછી એટલો જ જીંચો બીજો ટેકરો દેખતો હતો. મેં જેયું તો તે પર્વત જવાળામુખી હતો. તેમાંથી જ્યારે મેં ધોધમાર લાવા બહાર પડતો જોયો. ત્યારે હું સ્તરખ થઈ ગયો! પાણીને લઈને જવાળામુખીમાંથી અગિન તો કઈ રીતે નીકળી શકે? પણ લાવારસ પાણી સાથે લારે યુદ્ધ કરી રહ્યો હતો, અને પાણીને પોતાના અગિનથી વરાળ બનાવી દેતો હતો. અહીંથી લાવા પર્વતની ખીણોમાં બે-ત્રણ મોટા પ્રગાહમાં વહેતો હતો. મેં વીજળી બતીના પ્રકાશમાં નજર કરી તો તે પર્વતની પાસે એક મોટા નગરનું હાડપિંજર સાવ જીર્ણ અવસ્થામાં પડેલું જેયું. તેનું ટસ્કન સ્થાપત્ય હજુ પણ તેની જૂની અવ્યતાળો કંઈક જ્યાલ આપતું હતું. ક્યાંક મોટા દેવળોના તૂટી પડેલા ધુમમટો તો ક્યાંઈક ફ્લાઇ પડેલા મોટી મોટી અગાશીઓ, આ નગરની જહોજલાલી બતાવતાં હતાં. હજુ પણ નગરની શેરીઓ અને રસ્તાઓ સાક્ષ જોઈ શકતાં હાં. જણે પડદા પર ચીતરેલું ડોઈ મહાન ચિત્ર હોય તેવું એ બધું લાગતું હતું.

‘આ શું? આ તે સ્વપ્ન કે સાચું? કેપ્ટન નેમો મને ક્યાં લઈ

આવ્યો? આમ હું વિચારમાં પડ્યો હતો ત્યાં કેપ્ટન મારી પાસે આવ્યો અને નીચે પડેલો એક ભૂખરો પથ્થર હાથમાં લઈને તેણું પાસેના એક સપાટ ખડક ઉપર લખ્યું : ‘આટલાંટિસ.’

આ શહેરે મારા ભગવતમાં પ્રકાશ પાડું હો. મહાન બીજી કિલ્લસુદુ
પ્રેરણનું આટલાંટિસ તે આ ? ડેટલાક ધતિહાસકારો આટલાંટિસ
નગરને કલ્પનાનું જ શહેર માને છે; ડેટલાક ખરૈખર હતું તેમ પણ માને
છે. મારી તો દશ્ચિ સન્મુખ તે ખડું થયું ! અમે પાછા ઝર્યા પણ
મારું મન ત્યાં જ હતું. હું એટલો બંધો વિચારમાં પડી ગયો હતો
કે અમે વહાણ ઉપર કચારે આવ્યા તેની મને ખખર ન રહી ।

૧૮

જવાણમુખીના ગર્ભમાં

લગભગ સવાર પડવા આવી ત્યારે અમે વહાણમાં પહેંચ્યા. પથારીમાં પડતાં વેંત જ હું ઘસઘસાટ જિંદી ગયો. હું જમવા વખતે જાયો. જગીને કંપાસમાં જેયું તો અમારું વહાણ ઝપાટાયંધ દક્ષિણ દિશામાં હંડારાતું હતું. હું જમી રહ્યો અને મારા સાથીએના આરડામાં ગયો. ગઈ કાલ રાતની વાત મેં તેમને કરી. તેમને કંઈ તેમાં બહુ રસ ન પડ્યો હોય એમ કાગળું. નેડને તો કથામાં રસ ન હતો. ડેન્સીલને આટાંટિક મહાસાગરની માછલીએ જેવામાં વધારે રસ હતો. અમે બંને આ માછલીએ જેવામાં અને તેના જુદા જુદા વિલાગ પાડવામાં રોકાયા. વહાણ ખૂબ ઝડપથી એટલે કે કલાકના વીશ માઈલની ઝડપથી ચાલતું હતું. ઝપાટાયંધ દરિયાના માછલાંએ અમારી પાસેથી પસાર થઈ જતાં હતાં. આમ આપો દિવસ સતત વહાણ ચાલ્યા કર્યું. રાતના થેડેક વખત વહાણ દરિયાની સપાઈ ઉપર આવ્યું. સ્વચ્છ આકાશમાં મૃગશીર્ષના તારાએને હું મધ્યાકાશે જોઈ શકતો હતો.

બીજે દિવસે હું આઈ વાગે પથારીમાંથી બિઠ્યો. મેં મેનોમિટરમાં જેયું તો વહાણ દરિયાની સપાઈ ઉપર હતું અને તૂતક ઉપર કંઈક બેંધાટ થતો હતો. હું તરત જ ઉપર ગયો; પણ ઉપર દિવસનું અભવાળું હોવાને બદલે ગાઢ અંધારું હતું! ત્યારે મેં રાતને દિવસ ધારી લેવાની ભૂલ કરી? ના, પણ ઉપર તો તારા પણ હેખાતા નથી. ડેઈ પણ રાત આવી અંધારી મેં હીઠી નથી. આ તે શો ગોટાયો?

મારે શું ધારવું તની મને ખબર નહોંતી પડતી. થાં તો પાછળથી અવાજ આવ્યો : ‘કોણ, પ્રોફેસર ઓરોના?’

‘આહો કોપ્ટન સાહેબ! આપણે કચાં છીએ?’

‘જમીનની નીચે.’

‘જમીનની નીચે! અને પાછું વહાણું દરિયા ઉપર? આ તમે શું બોલો છો? આપણે જમીનની નીચેના દરિયાની ઉપર? અત્યાર સુધી આપણે જમીન ઉપર ને દરિયાની નીચે જતા; આવું તો આજ જ જેયું! તમે મસ્કરી તો નથી કરતા?’ મેં પ્રશ્ન ઉપર પ્રશ્ન મૂક્યા.

‘તમને બધું સમજશે. હમણાં બતી સળગશે, એટલે બધું સમજશે.’ હું બતીની રાહ જેતો રહ્યો. ચારેથ બાજુ અંધારું હતું, ફક્ત ઉપર નજર કરતાં દૂર દૂર જાંચે થાડોએક પ્રકાશ હેખાતો હતો; તે એક મોઢું કાણું હોય અને તેમાંથી હેખાતો પ્રકાશ દિવસના પ્રકાશ જેવો હોય એમ લાગતું હતું.

થાડી વારે બતી સળગી. નોટિવિસ ખડકવાળા કિનારા પાસે જિસું હતું. દરિયો સાવ સરોવર જેવો શાંત હતો; એટલું જ નહિ પણ સરોવરની પેઠે જ તે ખડકથી ચારે બાજુથી ઘેરાયેલો હેખાતો હતો. ઘેરાવો લગભગ છ માઈલનો હશે. તેની સપાઈ દરિયાની જેટલી જ હતી, એમ મેનો મિટર પરથી જેઈ શકતું હતું. અને અર્થે એ થયો કે દરિયાના પાણોને નીચેથી આ સરોવરના પાણીઓથે કંઈક સંખ્યાંધ છે. ઉપર જે પ્રકાશવાળું કાણું હેખાતું હતું, તેમાંથી દિવસનો જ પ્રકાશ આવતો હતો. આ બધું કંઈ રીતે બનેલું હશે એ કંઈ મને સમજતું નહોતું. મેં કોપ્ટન નેમાને ફરી વાર પૂછ્યું: ‘આપણે કચાં છીએ?’

‘હણુ કાંઈ ખબર ન પડી? આપણે એક જ્વાળામુખી પર્વતના ગર્ભમાં છીએ. આ પર્વત હવે જ્વાળામુખી રહ્યો નથી, અને તેના ગર્ભભાગમાં દરિયાએ તળિયેથી પોતાનાં મોનાં વડે બહારનો ભાગ ફેડીને મોઢું સરોવર બનાવી દીણું છે! કલ્પના કરો કે જ્યારે આ જ ગર્ભમાં ઉકળાટસર્યો લાવારસ પેલા જાંચે હેખાતો કાણુામાં થઈને બહાર પડતો હશે ત્યારે દર્શય કેવું લયંકર હશે? અત્યારે એ

લાવારસને નીકળવાના માર્ગમાં જ આપણે બેભા છીએ, ને એ જ જગ્યાએ અત્યારે શાંત સરોવર સ્વરૂપ છે. આ અદ્ભુત જગ્યા મને બહુ જ અક્ષરમાત્રથી હાથ લાગી. દુનિયામાં આથી વધારે કઈ સહીસલામત જગ્યાએ મારું વહાણું કે દુનિયાનું કોઈ પણ વહાણું આરામ કરી શકે ?'

'પણ અહીં કયું વહાણું આરામ લેવા માટે આવે ? અને તમારા વહાણુને તો આવા બંદરની જરૂર પણ શી છે ?' મેં પૂછ્યું.

'હા, એ વાત સાચી કે મારા વહાણુને આશ્રયની જરૂર નથી. પણ તેને વીજળાની જરૂર છે, અને વીજળાને માટે ડાલસા અને સેડિયમની જરૂર છે. એ બધું મને આ જગ્યાએથી ઠગલાયંધ મળે છે !'

'ત્યારે અહીં તમારા માણસો ડાલસા લેવા માટે રોકાશો, કેમ ?'

'હા, જુઓ. માણસો દરિયામાં ચાલવાનો પોથાક પહેરીને અને ડાદા-ળાપાવડા લઈને આ નીકળી પડચા.'

'તો આપણે પણ તે જોવા જરૂરશું ?' મેં પૂછ્યું.

'ના; અત્યારે ત્યાં બહુ બોદ્ધામ નહિ ચાલે, કારણું કે થોડું ક સેડિયમ તો ત્યાં સિલિકમાં પડ્યું છે. વળા કોઈ [બીજી] વાર વાત. પણ અત્યારે થોડો વખત આ સરોવરના કિનારા ઉપર ફરવું હોય તો તમને છૂટ છે.'

હું આનંદમાં આવી ગયો. મારા સાથીઓને હું બોલાવી લાવ્યો. અને તેમની સાથે કિનારા ઉપર ફરવા નીકળી પડચો. ખડક સાથેના પાણીના નિરંતર ઘસારાથી થોડાએક લાગમાં રેતી થઈ ગઈ હતી; બાકીનો કિનારો આણીદાર દાંતીનો જ બનેલો હતો. નેડની ચેકોર નજર ચારે પાસ ફરતી હતી.

'આખરે પાછા આપણે જમીન ઉપર ધર્યે વખતે પગ મૂકી શકચા.' કોન્સીલે કહ્યું:

'હું આને જમીન ઉપર પગ મૂક્યો કઈ રીતે ગણું ? આ તો

જમીનની નીચે છે. જમીન ઉપર કાણું હેખાય છે, ત્યાં ચડી જવું જોઈએ।' નેડે કહ્યું.

'એ વાતો છે. આટલે જાંચે પર્વતના અંધારા પેટાળમાં થઈને ચડવું, એ કાંઈ વહેલ માછલી મારવાની વાત નથી.' ડોન્સીલે કહ્યું.

નેડને આથા ઐંડું લાગેશે એમ માનીને મેં તરત જ ડોન્સીલનું કહેવું વાળો લીધું : 'આ ચઢાવ એટલો બધો સીધો છે કે એ છોઈનાથી બને જ નહિ. તો પણ ચાલો આપણે જોઈએ તો ખરા કે ક્યાં સુધી ઉપર જઈ શકાય છે ?'

અમે કિનારા ઉપર ચડવા લાગ્યા. જવાળામુખી ધણું વખતથી શાંત થઈ ગયેદો. હોવો જોઈએ, કારણું કે તેમાં કચાંઈક કચાંઈક વનસ્પતિ પણ જણી હતી. નવાઈની એક વાત એ જેવા મળી કે એક જગ્યાએ એક મોટો મધ્યપૂડો જમેલો હતો. એક ઝડાની બખોલમાં આ મધ્યપૂડો માખીએથી બણુંથણુંતો હતો. નેડની છંચા આ મધ્યપૂડો પાડીને મધ એકદું કરવાની થઈ. મારથી તેને ના કેમ પડાય ? થાડાંક સ્ક્રાં લાકડાં ને ડાળાઓ સણગાવિને સાચેસાચ તેણું તેમાંથી મધ પાડવું, અને પોતાની શણુંની એક મજબૂત કોથળામાં તે ભરી લીધું. અમે સરોવર ફૂરતા પ્રદક્ષિણા ફૂરતા હતા, અને સાથે ઉપર જેટલું ચડાય તેટલું ચડતા પણ જતા હતા. રસોએ ખૂબ મુશ્કેલ હતો; પણ નેડ અને ડોન્સીલ સાથે હોવાથી મને બહુ અડચણું ન પડી. અમે ફૂરીને આખરે પાણી એ કિનારા પાસે આવ્યા. ઉપર જવાળામુખીના મોઢાના કાળુંમાંથી ઝડપથી પસાર થઈ જતાં વાંદળાં જોઈ શકતાં હતાં. કિનારા પરની સુંવાળા રેતી ઉપર અમે ઘડીક આરામથી પડયા, અને વાતોના ગપાટા મારવા લાગ્યા. વાતોમાંથી વાતો નીકળતાં પછી આ વહાણુંમાંથી નાસી શટવાની વાત નીકળી. મેં નેડને એક આશ્વાસન આપ્યું : 'કદાચ કોઈન નેમા આ દક્ષિણ બાળુ તો ફૂરત અહીંથી સેડિયમ લેવા જ આવ્યો હશે, એટલે હજુ નિરાશ થવાનું કાંઈ કારણ નથી.'

અમે લગભગ કલાકેક સુધી આમ પડયા હથું. ધીમે ધીમે અમારી આંખો બેરાવા માંડી. હું તો જાંબી જ ગયો. સ્વપ્નામાં હું જાળી ગયો; મારાં કપડાં બધાંથી પલળી ગયાં હતાં.

‘આ શું?’ એમ વિચાર કરું છુંત્યાં તો સરોવરના પાણીની ખીજ છાલકે આવીને મને બધારે લીંજબી નાખ્યો. અમે ત્રણેથી જણ્ણા પલળી ગયા હતા. હું કારણું સમજ્યો; દરિયાની અંદર ચડતી ભરતીની અસર આ સરોવરના પાણી ઉપર પણ થઈ હતી. અમે વહાણુમાં ચડી ગયા ને આરડામાં જઈને કપડાં બદલી નાખ્યાં.

મારી ઠચણ આ વહાણ પાણું કથે રસ્તેથી કદ્દ રીતે દરિયામાં પ્રવેશ કરે છે તે જેવાની હતી; પણ કેપ્ટને વહાણ જિપડવાનો ફુકમ ટેક રાત પડતાં સુધી પણ આપ્યો નહિં. કદાચ તેનો વિચાર અમે જાણી ન જઈએ તેવી રીતે આ છૂપા માગમાંથી નીકળા જવાનો હશે.

ગમે તેમ હોય, બીજે દિવસે સવારે મેં જેયું તો વહાણ આટલાંટિક મહાસાગરમાં તરતું હતું.

નેડની અકળામણુ

વહાણે હજુ પોતાની દિશા બદલી નડોતી. યુરોપનો કિનારો જેવાની અમારી આશા ધીમે ધીમે નષ્ટ થતી ગઈ. અમે દક્ષિણમાં જતા હતા.

તે દિવસે નોટિલસ આટલાંટિકના એક વિચિત્ર લાગમાં આવે પહોંચ્યું. દરિયાની અંદર જુદે જુદે સ્થળે ગરમ પ્રવાહો વહેતા હોય છે એ આપણે જાણીએ છીએ. એ ગરમ પ્રવાહને 'ગલ્ફ સ્ટ્રીમ' ને નામે આપ્યાં આવે છે. એક ગલ્ફ સ્ટ્રીમ ફ્લેઓરિડાના અભાતમાંથી નીકળાને ટેક રશિયાની ઉત્તરે સિયાજઅર્ગન તરફ જય છે. ૨૪૮૮ મેદિસિકાને અખાત છોડ્યા પછી તે પ્રવાહ એ મુખ્ય લાગમાં વહોંચાઈ જય છે; એક પ્રવાહ આયર્લાંડ અને નોર્વે બાજુ જય છે; જ્યારે ખીને જરા દક્ષિણમાં મરડાઈ એઝેરસના બેટા તરફ જઈને આફ્રિકાના કિનારા સાથે અથડાઈ આંગીલતી ઉત્તરે એટાલસના દ્યાપુએ તરફ પાણે ફરે છે.

આ ખીને પ્રવાહ એક લંબગોળના આકારમાં એટલે કે ગગાના કાંડલાના આકારમાં ચક્કર ચક્કર ફરે છે, અને આટલાંટિક મણસાગરના તેટલા લાગને પોતાના ગરમ પાણીના પ્રવાહથી ઘેરી લે છે. ચક્કરમાં આટલાંટિકનું તાદ્દાની પાણી એક સરોવર જેવું બની જય છે. આ સરોવર એવડું મોઢું છે કે તેની આસપાસ એ ગરમ પ્રવાહને ફરી રહેતાં જ ત્રણ વરસ લાગી જય! આ જગ્યાને સારગેસ્સેનો સમુદ્ર ઠહેવામાં આવે છે. આ ગરમ પ્રવાહમાં એક વિચિત્ર પ્રકારનું જગેદું ધાસ હોય છે, તને સ્પેનિશ ભાષામાં 'સારગેડો' ઠહેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આ ધાસ અમેરિકા બાજુના

કિનારાથી એ ગરમ પ્રવાહની સાથે ઘસડાઈ આવ્યું હશે. એમ પણ કહેવાચ છે કે ડેલાંબસે આ ઘાસ ઉપરથી જ આગળ ઉપર જીને દેશ હોવો જોઈએ એમ અટકળ બાંધી હતી. આ ઘાસની આંટીઘૂંઠી અતિ મજબૂત હોય છે. તેમાંથી નીકળતાં ડેલાંબસનાં વહાણુને બહુ ભારે થઈ પડી હતી।

નોટિલસ તો દરિયાની સપાઠીથી નીચે જઈને આ ગલ્ફ સ્ટ્રીમ પસાર કરી ગયું. આખે દિવસ અમે સારગેરસો સમુદ્રમાં પસાર કર્યો. તેની વિચિત્ર પ્રકારની વનસપતિ તથા પ્રાણીઓ જોઈને છેવટે અમે આટલાંટિકના તોઢાની જળમાં પ્રવેશ કર્યો.

૨૪ કલાકમાં ૬૦૦ માઈલ કાપી નાખે એટલી ઝડપથી નોટિલસ આગળ ને આગળ વધે જતું હતું. નેડલેન્ડ નિરાશ થઈ ગયે. મનમાં હવે એક જ આશા હતી કે કેપ્ટન બધા સમુદ્રોની સુસાફરી કર્યા પછી આપણુને કદાચ સુકંત કરે ખરો ! પણ એ વાત કાઢની કરી રહેતે ? તે વિષયની વાત કાઢવાથી કેપ્ટનને અમારા ઉપર શંકા આવે અને અમારી હિલયાલ ઉપર વધારે અંકુશ મૂકે એવો સંભર હતો.

આ પ્રમાણે ૧૬ દિવસ સતત કર્યા પણ બનાવ બનાવ વગર પસાર થઈ ગયા. કેપ્ટન નેમાં પણ આ દિવસો દરમિયાન લાગ્યે હેખાતો. તે ખૂબ જ વાંચ્યો. તે ખૂબ જ વાંચ્યો હશે એમ લાગ્યું, કારણું કે પુસ્તકાલયમાં કેટલાંથે પુસ્તકો અરધાં ખુલ્લાં પડેલાં અને કચાંદીક કોઈ નિશાની કરેલાં પડ્યાં રહેલાં, તે હું રોજ જોતો. કોઈ કોઈ દિવસ રાત્રે તેના આરડામાંથી એર્ગનનો ધીમો ધીમો અવાજ સંભળાતો.

ઘણી વાર તો દિવસોના દિવસો અમારું વહાણું દરિયાની સપાઠી ઉપર તરતું. દરિયો ઉજાજ હતો. કોઈ કોઈ જગ્યાએ એકાદ બે વહાણું નજરે પડતાં. એક દિવસ એક વહેલના શિકારીઓનું વહાણ અમારી નજીક આવતું અમે જોયું. કેપ્ટન નેમાંથી લોકાને નકામાં હેરાન ન કરવા એ ધરાદાથી પોતાના વહાણુને દૂઃખી ખવરાવી હીથી. લયંકર માણદીઓ જોવાનો પ્રસંગ અહીં સૌથી વધારે સારો મળ્યો.

ડેગફિશ અને ડોલ્ફિન નામની માછવીઓ ટોગાબ્ધ અમારા વહાણુંની સાથે ભૂખ્યા વરુની માફિક દોડતી ને બટકાં ભરતી.

૧૨મી માર્ચ સુધી આ રીતે અમારી મુસાફરી ચાલી. અમે ખાંધાએ કુલ ૩૬,૦૦૦ માઈલની મુસાફરી કરી હતી. અમારું વહાણું અત્યારે પૃથ્વીના ૪૫° ૩૭' દક્ષિણ અક્ષાંશ અને ૩૭° ૫૩' પશ્ચિમ રેખાંશ પર હતું. આ જગ્યાએ દરિયો લગભગ ૭૦૦૦ થી ૮૦૦૦ વામ ડાંડા હતો. કેપ્ટન નેમોએ આ જગ્યાએ વહાણુને થોભાવીને એટલે જાંડ દરિયાને તળિયે વહાણુને લઈ જવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય જ્યારે મારા જ્ઞાનવામાં આવ્યો, ત્યારે મને બહુ આશર્ય થયું. મેં કેપ્ટનને પૂછ્યું : ‘એટલે બધે જાંડ સુધી તમારું વહાણું જઈ શકે અને પાણીનું આઠલું દાયાણું સહન કરી શકે એમ તમને લાગે છે ?’

કેપ્ટન કહ્યું : ‘તમારી ખીક થાડીએક સાચી છે. એ બહુ મુશ્કેલ તા છે જ, કારણ કે મારી પાસે પાણીનાં જેટલાં ટાંકાં છે એ બધાંય ભરું તો પણ તેના જેરે વહાણું એટલે જાંડ ન જ જિતરી શકે. પણ હું પાણીનાં ટાંકાંને જેરે નાચે નહિ જિતરું. મારો વિચાર વહાણુના મશીનને ચાલુ રાખીને જેમ હું દરિયામાં આગળ વધી શકું છું તેમ જ તળિયે પહેંચવાનો છે. વહાણુના પંખાને કલાકના ૫૦ માઈલની ઝડપે હું ચલાવીશ ત્યારે જ નાચે જિતરી શકીશ, એ વાત સાચી; અને ત્યાં આગળ સિથર રહેવા માટે પણ મારે મશીન તો ચાલું જ રાખવું પડશે। અમારા વહાણું પતરું એટલું મજબૂત છે કે થોડા વખત સુધી તો વહાણું ખુશીથી પાણીનું ગમે તેટલું દાયાણું સહન કરી શકશે.’

કેપ્ટનની ખુલ્લિને પહેંચાય એમ ન હતું. મશીન કેપ્ટનના હુકમથી ચાલુ થઈ ગયું. પંખા જોરથી ફરવા માંડયો. વહાણ ત્રાંસું થઈને સમણાની પેઢી નાચે જિતરવા માંડયું. એક હજર, બે હજર, ત્રણ હજર, એમ થતાં થતાં ૬,૦૦૦ વામ સુધી વહાણ આવી પહેંચ્યું. દરિયામાં આટલે જાંડ પણ કોઈ કોઈ જગ્યાએ હું પ્રાણીએ જોઈ

શકતો હતો; તેનાથી મને ખૂબ નવાઈ લાગી. વહાણું હજુ નીચે ને નીચે જિતરતું હતું. વહાણુની બારીમાંથી દૂર દૂર હું કાળા આકારા જોતો હતો. આ આકારા દરિયાની અંદરના પર્વતોના હતા. આ પર્વતો નિરંતર પાણીની અંદર જ રહેવાથી ખૂબ લીસા થઈ ગયેલા દેખાતા હતા. હું મેનોમિટર પર વારંવાર નજર નાખ્યા કરતો હતો. વહાણું ૮,૦૦૦ વામ જેટલી જિંડાઈએ ગયા પછી જ અટકયું. ત્યાં જભીન આવી. દરિયાની આટકી જિંડાઈએ જે શાંતિમય, અંધકારમય અને દૈવી વાતાવરણું મેં ઘડીક અનુભવ્યું, તે મારા જીવનની ધન્ય ક્ષણ હતી! કેપ્ટન પણ મારી સાથે આ દશ્ય જેવામાં તદ્વારાની થઈ ગયો હતો. આ સ્થળ નિર્જીવ હતું, જ્તાં ચેતનમય દેખાતું હતું! કેપ્ટને મને આ જગ્યાનો હૈટો લેવાની સ્ફુર્યના કરી. વીજળાનો પ્રકાશ દરિયાના પાણીમાં ઝેંકવામાં આવ્યો, અને તે પ્રકાશને જેરે દરિયામાં દેખાતા દશ્યનો એક હૈટો લીધો પણ અરો! દરમિયાન વહાણુનો પંચ્ચો ખૂબ જોરથી ધૂમ્યા જ કરતો હતો.

કેપ્ટને કહ્યું: ‘બસ! હવે આપણે ઉપર જઈએ છીએ, તમે બરાબર સ્થિર બેસનો.’

સ્થિર બેસવાની સ્ફુર્યનાની જરિયાતનો હું વિચાર કરું તે પહેલાં જ હું ધક્કાથી પાથરણું પર પછાઈ પડ્યો! એકએક એંજિન બંધ થઈ ગયું હતું, અને તોપમાંથી છુટેલા ગોળાની માઝીક અમારું વહાણું એ ૮,૦૦૦ વામ પાણી વીધીને સસુદ્ધની બહાર જડી આવ્યું અને હવામાં જાંચે જઠળા પાછું સપાઈ પર પછાયું! મેં વહાણુના તૂંક ઉપર ચડીને નજર કરી તો વિશાળ આટલાંટિક મહાસાગર મોંન ઉભાળતો મારી સામે પડ્યો હતો.

વહાણું હજુ પણ દક્ષિણ દિશામાં જ ચાલતું હતું; મને હતું કે વહાણું હવે હોર્નની ભૂશિર સુવી જઈને પછી પચ્ચિમ બાજુ વળાને પાસિસ્કિક મહાસાગરમાં પ્રવેશ કરશે; પણ એમ ન બન્યું. વહાણું હોર્નની ભૂશિરને બાજુએ રાખીને આગળ ન આગળ વધ્યે

જ જતું હતું. 'આ તે હવે કચાં જશે? દક્ષિણ પ્રિય સુધી તો નહિ પહેંચી જાય ને?' મને શાંકા આવી.

થોડા વખતથી નેડોનેડ વહાણુમાંથી નાસી શુટવા સંબંધે ડોઈ વાત મારી સાથે કરતો નહાતો. તે અમસ્તો પણ હવે એણું બોલતો હતો. તેના ચહેરા પરથી હું જોઈ શકતો હતો કે આ ડેફાન્ટ તેને કેવું અકારું થઈ પડ્યું છે. તેની આંખો ડોઈ ડોઈ વાર કોધમાં ચમકારા મારતી હતી.

'૧૪મી માચે' તે અને ડેન્સીલ મારી ઓરડીમાં આવ્યા.

'કેમ, શા નવીન છે?' મેં પૂછ્યું.

'મારે એક જ પ્રશ્ન પૂછવો છે.' નેડ કહ્યું.

'શો?' ૧૫

'આ વહાણુ ઉપર કેટલા માણુસો હશે?' ૧૬

'મને કેમ ખખર પડે?' ૧૭

'મને લાગે છે કે બહુ માણુસો નહિ હોય. આ વહાણુમાં રહેનારાએ પણ કેટનની જેમ જીવનપર્યાત આ વહાણુમાં જ રહેવાનો નિશ્ચય કરીને આવ્યા હશે. અને એવા કેટનના જેવા મૂરખાઓની સંખ્યા કેટલી હોય?' નેડ કહ્યું.

'પણ આપણે ભીજુ રીતે ગણુતરી કરીએ. આ વહાણુમાં જેટલી હવા સમાઈ શકે તેના પ્રમાણુમાં કેટલા માણુસો માટે એ હવા પૂરતી છે, એનો હિસાબ કાઢીએ તો સાચી સંખ્યા મળે.' ડેન્સીલે યુક્તિ બતાવી.

'પણ એના ઉપરથી જે સંખ્યા આવે તેટલાં જ માણુસો હોય એવું ન બને. તોયે હું તમને તેનો હિસાબ કરી આપું. એક કલાકમાં એક માણુસ * ૧૦૦ લિટર હવામાં રહેલો ઓફિસરન વાપરે છે; એટલે કે ૨૪ કલાકમાં ૨૪૦૦ લિટર હવામાં રહેલો ઓફિસરન

* લિટર એ ઘનદળ માપવાનું ફેન્ચ મેટ્રિક સિસ્ટમનું માપ છે, ૨૭ લિટર એટલે લગભગ એક ઘનફૂટ જગ્યા થાય છે,

એક માણુસને જોઈએ. હવે આ વહાણુની સમાસશક્તિ ૧૫૦૦ ટન છે; એક ટનમાં ૧૦૦૦ લિટર હવા સમાય છે, એટલે કે નોટિલસમાં ૧૫,૦૦,૦૦૦ લિટર હવા રહી શકે. હવે ૧૫,૦૦,૦૦૦ને ૨૪૦૦ વડે લાગીએ તો કેટલા આવે ?'

ફાન્સીલે હિસાબ કરીને કહ્યું : ' ૬૨૫ .'

' તો પછી ૬૨૫ માણુસો આ વહાણુમાં સમાઈ શકે.' નેડ કહ્યું :

' અરે ! ' નેડ અને ફાન્સીલ બન્ને આશ્રમ્ય પામ્યા.

હું નેડનો અને ફાન્સીલનો વિચાર સમજી ગયો હતો. મેં કહ્યું : ' એ વિચારો બધા નકામા છે. હુમણું શાંતિ રાખવા સિવાય ભીજે ઉપાય નથી.'

' વળો પાછી "શાંતિ" આવી ? ' એમ કહી પગ પછાડીને નેડ ઓરડામાં ચાલ્યો ગયો !

બરકુની હીવાલ

ખીલ દિવસે અગિયાર વાગે અમારું વહાણ દરિયાની સપાઈ ઉપર તરતું હતું. અમે અવા વહાણના તુતક ઉપર જોલા હતા, ત્યાં નેડે ભૂસ મારી: ‘જુઓ, પણ વહેલ દેખાય.’ મને તેથી આશ્રય ન થયું, કારણુંકે મને ખરર હતી કે વહેલ માછકીઓ શિકારીઓની ખીકને લીધે મોટે ભાગ ઉત્તર ધૂન કે દક્ષિણ ધૂનના ભાગમાં ભરાઈ રહે છે.

‘આહો! ડેવી મોટી છે! અત્યારે એક હોડી હોય તો ડેવી મળ આવે! ડેવી હવા ને વરાળ તેના નાકમાંથી નીકળે છે! ’ માછલી જોતાંની સાથે જ નેડનો પોતાનો અસર શોખ જગત થયો; તેનું દિલ શિકાર માટે જાંચુંનીયું થવા લાગ્યું.

ધીમે ધીમે વહેલ પાસે આવતી જતી હતી. નેડની નજર તેની સામે ને સામે જ ચોટેલી હતી. ‘અરે, અરે! આ તો એક જ વહેલ નથી; દસ, વીસ...અહોહો! આ તો ટોળાખંધ વહેલો છે! અરે, હવે હું શું કરું? મને અહીં લાયાર બનાવી મૂક્યો છે. નહિતર...’ નેડ આવેશમાં આવી પગ પણડયો.

‘પણ તો ડેપ્ટનની રણ માગી કે ને?’ ડેન્સીને કહ્યું:

નેડ તરત જ નીચે જિતરીને ડેપ્ટન પાસે ગયો. થાડી વારમાં તે અને ડેપ્ટન બંને ઉપર આવ્યા.

ડેપ્ટન નેમાણે સસુદ્ધ ઉપર નજર નાખી. ‘આહો! આ તો દક્ષિણની વહેલો છે!

‘કુમ, આના શિકાર માટે કાઈ થઈ શકે કે નહિ? ’ નેડ પૂછ્યું:

‘શા માટે? હમણું આપણે વહાણમાં તેના તેલની કે ખીલ

કોઈ પદાર્થની જરૂર નથી.'

'પણ કંઈ જરૂર હોય તો જ શિકાર થાય?' નેડ પૂછ્યું.

'હા જ તો! જરૂર પડે ત્યારે નશ્વરુંકે શિકાર કરવો પડે. શિકાર તો આપણી લહેર ખાતર તેમને મારવાની વાત છે; એ કેમ ચાલે? તેમને જવાનો અવિકાર છે તેણો જ અવિકાર તેમને પણ છે. તે બિચારીને દરિયામાં પણ કેટલા શત્રુઓ છે? શાર્ક, કેચેલોટ, વગેરે ભયંકર દરિયાઈ માછલીઓ રાતદિવસ તેમને જ પવા નથી હેતી. તેમાં વળા તમે ઉમેરો કરવાનો વિચાર કરો છો?'

આ ધર્મપદેશ નેડ ઉપર ઠથી અસર કરે તેમ ન હતું. નેડ તો એટલું જ સમજ્યો કે પોતાને શિકારની ના પાડી છે.

'જુઓ; દૂર નજર કરો. આડ માઈલને અંતરે પાણીમાં તેમને કંઈ તરતું લાગે છે?' કેપ્ટન મને પૂછ્યું.

'હા.'

'એ જ આ વહેલ માછલીની શત્રુ છે. કેચેલોટ નામની માછલીએ આ વહેલની પાછળ જ પડી હોય એમ લાગે છે. આ માછલીએ ખૂબ કૂર ને ભયંકર હોય છે; તેમને મારવામાં પાપ નથી.'

નેડ તૈયાર થઈ ગયો. 'કેપ્ટન સાહેય! તો પછી હોડી ઓડથું?'

'ના ના, એમ એકલા હોડીમાં નીકળવામાં તો આપણું મોત જ છે. આ કંઈ સામાન્ય માછલીએ નથી. તમે જુઓ, આપણે ઠથી મહેનત કરવી નહિ પડે. મારું વહાણું જ એ માછલીએને પહેંચી વળશે, ને એક નવી જ જાતનો શિકાર જોવાનું પણ તેમને મળશે.'

દરમિયાન વહેલ માછલીએનું ટોળું જપાટાયંધ નજુક આવી પહેંચ્યું. તે ટોળું ગલરાટમાં આમથી તેમ ભાગતું હતું. સમૃદ્ધ પાણી એટલામાં એટલું બધું ખળખળી જઠ્યું કે અમારું વહાણું આપ્યું ડોલી બિઠ્યું. તેમની પાછળ કેચેલોટ માલખીએનું ટોળું પણ એટલી જ ઝડપથી ધર્સને આવતું હતું. કેચેલોટ માછલીની ઝડપ

આગળ વહેલનું ટોળું ન પહોંચી શક્યું. બધાં એક થઈ ગયાં, અને જોતનેતામાં તો યુદ્ધ જમી પડ્યું. કેચેલોટ માછલીઓ મજબૂત હતી; એટલું જ નહિ પણ તેમને એક લાલ એ હતો કે પાણીમાં તેઓ વહેલ માછલી કરતાં વધારે વખત રહી શકતી હતી. એટલે દૂખકી મારીને વહેલ માછલી ઉપર તે આચિંતા હુમલે કરવી અને પોતાના તીક્ષ્ણ દાંતોથા તેને વાંધી નાખતી - ચીરી નાખતી. વહેલ માછલીની ભયંકર ચીસો સંભળાતી હતી.

દસ્ય ક્રમકમાંત્રી ઉપજને તેવું હતું. કેપ્ટન નેમો તરત જ આ કેચેલોટના પંખમાંથી વહેલને બચાવવા તૈયાર થઈ ગયો. તેણે સુકાનનું માદું બદલાવીને વહેલો અને કેચેલોટ માછલીની વચ્ચે પોતાનું વહાણું નાખ્યું; અને વહાણુની આગળ ભયંકર કરવતી જેવો જે પંખો હતો તે મશીનથી ચાલુ કરાવી દીધો. કેચેલોટ આ પંખાની દાંતોમાં જોતનેતામાં કરવત તળે ધમારતી લાકડાં વહેરાય તેમ એ લાગમાં ચિરાઈ જતી હતી. કેચેલોટ દૂખકી મારે ત્યારે આ વહાણું પણ દૂખકી મારીને તેને પછી પાડતું, એક પછી એક કેચેલોટને પછી પછીને કેપ્ટન તેનો સંધાર કરવા લાગ્યો !

સસુદનાં પાણી પણ લાલ લાલ થઈ ગયાં. માછલીઓની મૃત્યુની ચીસો કાન ચીરી નાખતી હતી. વહેલ માછલીઓ તો જુવ લઈને નાસી જ ગઈ હતી; કેચેલોટમાંથી પણ ધાર્યાખરી ભરી ગઈ અને બાકીની નાસી ગઈ.

અમારું વહાણું જણે દોહીના સમુદ્રમાંથી આગળ ચાલ્યું. નેડ કેપ્ટનની આ શક્તિ જોઈને મેંમાં આંગળાં નાખી રહ્યો.

આગળ વધ્યા પછી એકાદ માર્ફલને અંતરે એક વહેલ માછલી અમે તરતી જોઈ. તે અડધી જીંધી થઈ ગઈ હતી; એક નાનું બચ્ચું તેને પેટ વળગેલું હતું. અંતે કેચેલોટની તલવારથી ઘાયલ થઈને ભરી ગયાં હતાં. વહેલ માછલી તાજ જ વાંધાયેલી લાગતી હતી. કેપ્ટને તરત જ પોતાના એક ભાણુસ્કને હોડીમાં બેસાડીને તે વહેલ

માછલી પાસે મોકલ્યો; ઘણી વારે દૂધનાં એ મોટાં વાસળો. ભરીને તે પાછો આવ્યો.

‘જુઓ, પ્રોફેસર સાહેબ ! આ વહેલ માછલીનું દૂધ ! વહેલ હજુ હમણું જ મરી લાગે છે. દૂધ તાજું છે. ગાયના દૂધ કરતાં આ ડોઈ રીતે જિતરતું નથી. પો જુઓ.’ એક પ્યાલામાં લઈને મેં તે દૂધ પીધું; સ્વાદમાં તે ગાયના દૂધ જેવું જ હતું.

વહાણ હજુ, દક્ષિણમાં ને દક્ષિણમાં જ આગળ વધ્યે જતું હતું. ‘આ વહાણ તે આમ ને આમ કંચાં સુધી જશે ? દક્ષિણ દ્વારા સુધી તો નહિ જય ? ના ના, હજુ સુધી ત્યાં ડોઈ જઈ શક્યું જ નથી. અને કદમ્બ કેટન ત્યાં જવાનું સાહસ કરે તો પણ તેને માટે અત્યારે નાદતું અનુકૂળ નથી.’

૧૪મી માર્ચ ૫૫° અક્ષાંશ ઉપર મેં પહેલવહેલો તરતો બરફ નેયો. આ કુકડો માર્ડ ૨૦ થી ૨૫ કુટ જ લાયો હતો. ધીમે ધીમે આવા બરફના તરતા કુકડાઓનું પ્રમાણ વધતું ગયું – સંખ્યામાં અને કદમ્બમાં જેમ જેમ અને આગળ વધતા ગયા તેમ તેમ સર્વેનાં કિરણોમાં ચણકાટ મારતાં બરફનાં પહાડો અને મેદાનો વધતાં ચાલ્યાં. દક્ષિણ દ્વારાવાસી પક્ષીઓ હજારોની સંખ્યામાં આ બરફના બેટા ઉપર બેઠાં બેઠાં તેમના તોણું અવાજથી દિશાઓ ગજવી મુકૃતાં હતાં. ડોઈ ડોઈ તો અમારા વહાણને ડોઈ દરિયાઈ પ્રાણી ધારીને તેના પર હવેલા કરવા માટે વહાણનો ઉપર બેસતાં અને તેને ચાચો મારતાં. અમારું વહાણ સપાટી ઉપર જ ચાલતું, અને એ જ સર્હાસલામત હતું, કારણું કે વહાણનો રસ્તો બરફના કુંગરાઓ તથા બેટાની વરચે થઈને કાઢવાનો હતો. મને જેટલો ભય હતો, તેટલું જ કુરૂહલ હતું. આ પ્રદેશનું સૌંદર્ય તો અવર્ણનીય હતું – બરફના પહાડો ઉપરથી ધસી આવતી બરફની મેટી મેટી બેખડો, તેનો પાણીમાં પડતો વખતનો અવાજ, મદજરતા હાથી જેવા બરફના પર્વતરાને તોલતા તોલતા, સ્વર્ચછં હે આ દક્ષિણ દ્વારાપ્રદેશના પાણીમાં વિહાર કરતા

હતા. આની વચ્ચે થઈને રસ્તો કાઢવાનું કામ બહુ કૃપણું હતું. કેટન ગમે ત્યાંથી તેના વહાણું માટે રસ્તો શોધી કાઢતો હતો. કચાંક કચાંક બરક્ષને તોડી નાખીને પણ વહાણું પોતાને રસ્તો આગળ કરતું; કચાંક કચાંક કુહાડા ને ડોઘળી લઈને બરક્ષને તોડવો પડતો. ઉપરથી પણ બરક્ષ વરસ્યા કરતો હતો. ઉષગુતામાન શન્યતી નીચે ૫૦ સુધી ગયું હતું. વહાણુની દિશા ચોક્કસ કરવી એ પણ મુશ્કેલ હતું, કારણ કે પૃથ્વીના દ્વુત્વ અને લોહચું અકના દ્વુત્વ બંને વચ્ચે અંતર હોઈ એ એ વચ્ચેનું માપ ચોક્કસ કરવાનું કામ મુશ્કેલ હતું.

આખરે ૧૮મી માર્ચે નોટિલસ કુદરતથળ પાસે હાર્યું. નોટિલસનો રસ્તો બંધ થઈ ગયો, આગળ પાછળ તથા આસપાસ ચારે તરફ બરક્ષનો કિલ્લો બંધાઈ ગયો. દક્ષિણા દ્વુત્વરક્ષક ચોક્કિદારો જેવા, ખલેખખા અડાડિને જણે જિલ્લા હોય એમ બરક્ષનાં પહાડો ને મેદાનો નોટિલસને વેરી વજાં. વહાણું અટકી પડ્યું, કચાંય પાણી હેખાતું નહોતું. સધળે બરક્ષ, બરક્ષ ને બરક્ષ છવાઈ રહ્યો હતો !

નેડ આવીને મને કહ્યું : 'કેમ, આખરે તમારો કેટન પણ સપડાયો ને ?'

'હજુ એમ કેમ કહેવાય ?' મેં કહ્યું.

'ત્યારે હજુ તમને આશા છે, એમ ? કેટન બુદ્ધિશળી છે એમાં ના નિષ્ઠા ; પણ કુદરત આગળ કાઈનું ચાલ્યું છે ? હજુ પાણા ઉત્તર બાજુ જવું હોય તો તે બંને એમ છે ; કારણ કે એ રસ્તો ગમે તેમ કરીને કરી શકાય ; પણ આગળ તો હવે ટેઠ સુધી બરક્ષ સિવાય ખીજું કાંઈ નિષ્ઠ ભગવાનું.'

નેડની વાત સાચી હતી. બરક્ષની દીવાદો વીંધીને જવાય કઈ રીત ? સિવાય કે બરક્ષ ઉપર ચાલનારું વહાણું કાઈ શોધી કાઢે !

દરમિયાન બરક્ષને તોડી નાખવા માટે વહાણું અથાગ અમ કરી રહ્યું હતું ; પણ તેમાં સઝણતા મળે તેમ જણાયું નિષ્ઠ.

હું પણ વહાણના તૂતક ઉપર જિલ્લો જિલ્લો આ બધું જેયા સા. ૮

કરનો હતો. ત્યાં પાછળથી અવાજ આવ્યો : ‘કેમ પ્રોફેસર સાહેબ ! હવે શું કરશું ?’ કેટન મારી પાસે આવીને જોખા હતો.

‘મને લાગે છે કે આપણે સપદાઈ ગયા !’ મેં કહ્યું.

‘સપદાઈ ગયા એટલે શું ?’ તેણે પૂછ્યું.

‘એટલે કે આપણે હવે આગળ કે પાછળ કચાયે જઈ શકીએ એમ નથી.’

‘પ્રોફેસર ! તમે સુશ્કેલીએ જ જુઓ છો; આપણે આટલે આવ્યા તે હવે આગળ વધ્યા સિવાય ચાલે ?’

‘હણું આગળ જવું છે ?’

‘હા જ તો. હજુ દક્ષિણ ધ્રુવને છેડે પહોંચવું છે.’

‘દક્ષિણ ધ્રુવ !’ મારા મેંમાંથી ઉદ્ગાર નીકળા ગયો.

‘હા હા. દક્ષિણ ધ્રુવ. હજુ સુધી ત્યાં કાઈ ગયું નથી. હું પણ નથી ગયો. આપણે બંને સાથે એની શોધમાં આજે જઈએ છીએ. આપણે આગળ જવું જ નોઈએ.’ કેટને કહ્યું:

‘હા; પણ તે કઈ રીત ?’

‘કઈ રીત ? આપણે બરફને તોડી નાખશું; અને જે નહિ તૂટે તો તેની ઉપર થઈને ચાલ્યા જઈશું.’

‘ઉપર થઈને ?’

‘ના, ના. ઉપર થઈને નહિ પણ નીચે થઈને; મારી બોલવામાં ભૂલ થઈ.’

મારા મગજમાં નવો જ પ્રકાશ પડ્યો. ધણુા દિવસથી પાણીની ઉપર જ સંકર ચાલતી હતી તેથી આ વડાણું પાણીની નીચે પણ ચાલી શકે છે એ હું ભૂલી જ ગયેલો !

‘કેમ, હવે તમને લાગે છે ને આપણે જઈ શકીશું ? જે દક્ષિણ ધ્રુવ ઉપર જમીન હશે તો આપણે તેને કાંઠે જોતરશું અને જે સમુદ્ર હશે તો વડાણું સીવું દક્ષિણ ધ્રુવના છેડે જ જઈને જીલું રહેશે.’

‘બસ ! હવે બરાબર છે, બરફ એટલો બહાર હેખાય છે તેથી

ત્રણુગણેં અંદર હોય છે. અને સામે દેખાતા બરક્કના કુંગરો વધારેમાં વધારે ૩૦૦ કૂટ જાંચા હેખાય છે; માટે બહુ તો ૬૦૦ કૂટ આપણે જાડે જવું પડશે.’

‘અને ૬૦૦ કૂટ એટલે કાંઈ નહિ. પણ એક સુશેષલી આવશે અને તે એ કે આપણે ઘણું વખત સુધી સમૃદ્ધની નીચે રહેવું પડશે, એટલે તાજુ હવા નહિ મળે.’ કેપ્ટન શાંકા કરવા માંડી.

મને ધીમે ધીમે ઉંસાડ યડતો જતો હતો. મેં કહ્યું : ‘આપણાં હવા ભરવાનાં ટાંકાં પૂરૈપૂરાં ભરી નાખો. ઘણું વખત સુધી આપણુને તેમાંથી હવા મળ્યા કરશે.’

‘બરાબર, બરાબર !’ કેપ્ટન જરાક હસ્યે. ‘પણ હજુ એક બીજુ સુશેષલી છે, દિક્ષિણ ધ્રુવને છેડે ને પાણી કે જમીનને બદલે એકલો બરક્ક જ જલ્મી ગયેદો હશે તો ?’

‘તો શું ? આપણું વહાણું બરક્ક તાડીને ઉપર આવશે. પરંતુ નેમ ઉત્તર ધ્રુવમાં છેડે સમુદ્ર છે તેમ અહીં પણ શા માટે સમુદ્ર નહિ હોય ?’

કેપ્ટન નેમાંચે કહ્યું : ‘પ્રોફેસર સાહેય ! આજે તમે ભારે હિંમત બતાવી. આજે તો ભારા મનમાંય જે થોડીઘણી નિરાશા હતી તે પણ તમે દૂર કરી ! આપણે જર આગળ વધશું :’

તરત જ કેપ્ટન એક માણુસને બોલાવ્યો ને તેને તેની વિચિત્ર ભાષામાં હુકમ આપ્યો. બીજુ જ ક્ષણે વહાણુનાં હવાનાં ટાંકાં ભરાવા માંડયાં; ને પછી પાણીનાં ટાંકાં પણ ભરાવા માંડયાં. હું તથા કેપ્ટન વહાણુની અંદર ચાહ્યા ગયા, બારણું દેવાઈ ગયું, ને વહાણું ધીમે ધામે પાણી ભરાવાથી નીચે ભીતરવા લાગ્યું.

મેં નેડને તથા ડોન્સીલને આ બધી વાત કરી. તેણે કહ્યું : ‘અન્યાર સુધી વહાણુમાં એક જ મૂર્ખ હતો; હવે એ થયા ! તમે દિક્ષિણ ધ્રુવ જશો ખરા, પણ ત્યાંથી પાણ આવશો નહિ !’

‘પણ ત્યાં તો આપણે બધા સાથે જ છીએ ને !’ મેં મસ્કરીમાં

કહ્યું:

‘હા, એ જ તો દુર્ભાગ્ય છે! ’

વહાણુની આસપાસ જામી ગયેલો બરફ કુહાડા લઈને તોડી નાખ્યો. આથી વહાણુને નીચે જિતરવામાં બહુ મુશ્કેલી ન નરી. વહાણ જોતનેતામાં ૬૦૦ કૂટ નીચે ગયું. મેં ધાર્યા પ્રમાણે જ અર્ડીં હવે પાણી આવ્યું, પણ સલામતી ખાતર અમારું વહાણ સહેજ વધારે નીચે જિતર્યું; અને પાણી કાપતું આગળ વધવા લાગ્યું. અર્ડીં પાણીનું ઉણ્ણતામાન પણ ૧૦૦ હતું.

વહાણ સાધારણ ગતિએ આગળ વધ્યે જતું હતું. ડોન્સિલ મારી પડ્યે જ બેડો હતો. તેણે કહ્યું: ‘હવે લાગે છે કે આપણે ધારાલે સ્થળ પહોંચ્યે જશું:’

વહાણ જેમ જેમ આગળ જતું હતું, તેમ તેમ મારા મનની આતુરતા વધતી જતી હતી. હું ભાગ્યે જ જીંઘતો. આજે દિવસ અને રાત મેનોમિટર ઉપર નજર રાખ્યા કરતો. ડોઈ વાર બરફને લીધે વહાણુને ૧૦૦૦થી ૨૦૦૦ કૂટ સુધી નીચે જિતરવું પડતું। કયાંક કયાંક તો ૫૦૦ વામ સુધી નીચે જિતરવું પડતું। વહાણ ને દરિયાની સપાઈને કેટલું બધું અંતર રકેતું હતું। રાતના આડ વાગ્યા, હજુ સુંવી વહાણુમાંનાં હવાનાં ટાંકાંમાંથી હવા કાઢવાની જરૂર નહોતી પડી. સૂવાનો વખત થયો. મારી આંખ ઘેરાતી હતી, પણ આશા અને નિરાશા વચ્ચે મારું મન એટલું બધું જેંચાતું હતું કે હું ધીકમાં જગી જતો હતો. સરારે ત્રણ વાગે બરફનો થર પાતળા થયો હોથ એમ લાગ્યું. મેનોમિટરનો કાંટા દરિયાની સપાઈથી અમારું વહાણ ફક્ત ૨૫ વામ જાંડે છે એમ બતાવતો હતો; અને ધીમે ધીમે તે અંતર પણ ઓછું થતું જતું હતું. વહાણ ઉપર ચડતું જતું હતું.

આખરે ૧૬મી માર્યના સવારના છ વાગે મારા ઓરડાનું બારણું ખૂલ્યું ને કોટન નેમો દેખાયો.

‘દરિયાની સપાઈ આવી ગઈ! ’ તે બોલ્યો.

૨૧

દક્ષિણ ધ્રુવ ઉપર

હું હોડતો હોડતો વહાણુના તૂઠક ઉપર પહેંચ્યો ગયો. પાછા વિશાળ ખુદલો સમુર નજર આગળ પથરાયેલો હેખાયો. કચાંક કચાંક છૂટક છૂટક બરફના ખડકો તરતા હતા; આકાશમાં પક્ષીઓ તરતાં હતાં. થરમોભિટર શુન્ય ઉપર ઉ ડિગ્રી બતાવતું હતું.

લગભગ દસ માઈલને અંતરે એક નાનો એવો ટાપુ હેખાતો હતો. અમે વહાણ તે તરફ હંકારું અને થાડી વારમાં કિનારે આવી પહેંચ્યા. કેટલાય લાંબે વખતે અમે જમીન પર પગ મૂક્યો. ટાપુ લગભગ ૬૦૦ ફૂટ દરિયાની સપાઠીથી જાંચો હતો. બહુ તો ચારથી પાંચ માઈલનો તેનો વિસ્તાર હશે. અમે ડેડ કિનારે વહાણ લઈ ન ગયા, પણ લગભગ અરવે માઈલ દૂર રાખીને હોડીમાં બેસીને ગયા, કારણ કે પાણીમાં જો જમીનની દાંતી છુપાયેલી હોય તો વહાણ નકારું જેખમાય.

અમારી હોડી નેવી કિનારાને અડકી કે તરત જ ડોન્સીલ ઝૂફ્વા જતો હતો, પરંતુ મેં તેને અટકાયો. મેં કહું : ‘ આ જમીન ઉપર પહેલો પગ મૂકવાનો અધિકાર કેપ્ટન નેમોનો છે. દુનિયામાં મનુષ્યનો પહેલવહેલો પગ જો આ જમીન ઉપર ડોઇનો પડતો હોય તો કેપ્ટન નેમોનો જ જરૂર પડે ! ’ બધાએ તે કખુંખ કર્યું. ધારે પગલે કેપ્ટન કિનારે જીતયેં; તેની પાછળ અમે બધા જીતયાં. હું તથા કેપ્ટન બે જ જણ્ણા આ બેટની જાંચી ટેકરી ઉપર ચડા માંડચા. ડોન્સીલ વગેરે તો પાછળ હોડીમાં જ રહ્યા હતા. તેને તથા નેડને માટે શિકારનું કામ તૈયાર હતું.

આ જગ્યાએ વનસ્પતિ બહુ થાડી હતી, અને તે પણ નાના

નાના ધાસ અને છોડવાયોની જ. પણ પક્ષીઓ તો ત્યાં અસંખ્ય હતાં. જમીન ઉપર ચેંગુઈનાં ટોળાં ડોઈ વૃદ્ધોની મહાસભા મળી હોય એમ કાળા ડગલા પહેરીને બેઠાં હતાં.

ઉપર ચડતાં ચડતાં હું તો પક્ષીઓની ઝડકોમાંની મોટી મોટી બઘોલો, તેમનાં દ્યાડાં, નાનાં નાનાં બચ્ચાંઓ વગેરે જેતો જતો હતો. કેપ્ટન નેમો મારાથી આગળ નીકળા ગયેલો. જ્યારે હું તેની નજીક પહોંચ્યો. ત્યારે તે અદિય વાળા સ્થિર નજરે અને શાંત ચહેરે આકાશ સામે જેતો હતો. તે સૂર્યની વાટ જેતો હોય એમ લાગતું હતું; પણ આકાશમાં એટલું ધુમ્મસ હતું કે બપોરના બાર વાગ્યા સુધી અમે રાહ જેતા જીબા હતા છતાં સૂર્ય દેખાયો નહિ. ‘આપણે કાલ સુંદરી સૂર્ય માટે અહીં રોકાવું પડશે. આપણે દક્ષિણ ધૂર ઉપર છીએ કે ખીને, તે સૂર્ય વગર કઈ રીત નક્કી થાય?’ કેપ્ટન નેમો આટલું બેલીને પાછા જીતયો; હું પણ તેની પાછળ પાછળ જીતયો. અમે વહાણુમાં પહોંચ્યા ત્યારે તાજ શિકારતું ખાણું તૈયાર હતું.

ખીને દિવસે એટલે ૨૦મી માર્ચ પાછા અમે એટ ઉપર આવવા નીકળ્યા. આજે ધુમ્મસ અને બરફ બંને એછાં હતાં; લગભગ બંધ થઈ ગયાં હતાં; પણ ઠંડી જરા વધારે હતી. અમે કિનારે જીતય્યા, ત્યારે કિનારા પરની રેતી ઉપર ટોળાંબંધ સીલ પ્રાણીઓ આગોટાં અને ગેલ કરતાં અમે દીઠાં. નાનાં નાનાં બચ્ચાંઓ પણ પોતાની વિચિત્ર પૂંછડી પટપટાવતાં તેમની માની પીઠ ઉપર ચડીને ગેલ કરતાં હતાં. કેટલાં નિર્ભયપણે આ બધાં અહીં પડ્યાં હતાં! અમેરિકા કે દુંગાંડના કિનારા પર આમ હોય તો? અરે પણ હોય જ શાનું? એકાદ સીલ જુઓ તોપણ ડોઈ નિશાનબાળ-ઓનાં ટોળાં તેના પર તૂટી પડે! ખીનાં વોલરસ નામનાં સીલને મળતાં પ્રાણીઓ પણ એક બાજુ બૂમાબૂમ પાડીને રમતાં હતાં. આ બિચારાં આમ તો ખીકણું હોય છે, પણ તેમના પર હુમલો.

કરવામાં આવે, અને ખાસ કરીને તેમનાં બચ્ચાને જે કોઈ પકડવા આવે તો તે જરા આકરાં પડી જય એવાં હોય છે. હું અને ડેન્સીલ છાનામાના લપાતા લપાતા આ બંધું જેવા નીકળ્યા હતા. કરીને અમે પાણી આવ્યા ત્યારે એક નાની ટેકરી ઉપર કેપ્ટન નેમો સર્થની વાટ જેતો જેલો હતો. આજે પણ આકાશ ગઈ કાલના જેલખું નહિ, તો ડીક ડીક વેરાયેલું હતું. ધણી વાર સુધી રાહ જેયા પછી કેપ્ટન મારા સામું જેઈને બોલ્યો : ‘આજે પણ સૂર્ય હેખાય તેવા સંભવ નથી. હજુ આવતી કાલ સુધી આપણે રોકાવું પડશે.’

‘હા; પણ તમને યાદ છે, કે આવતી કાલે માર્યની એકવીશમાં તારીખ છે ? કાલથી સૂર્યનું ઉત્તરાયથું થશે, એટને પછી દક્ષિણ ધ્રુવના પ્રદેશની તો લાંખી રાત થશે. એટથે પછી દક્ષિણ ધ્રુવનું સ્થાન નક્કી કરવું હશે તો તો અહીં છ મહિના સુધી રોકાવું પડશે।’

‘હા, તે મારા ધ્યાનમાં છે. પણ ભલે છ મહિના થાય તો યે જે નક્કી જ કરવું હોય તો તેથાયે વધારે લાંખો વખત રોકાવામાં મને કંઈ વાંદ્યો નથી. આપણે સાથે જ છીજે ને ?’

આવતી કાલે જે સૂર્ય નહિ હેખાય તો કેપ્ટન અહીં રોકાશે, અથવા ફરી પાછો મને લઈને છ મહિનેય અહીં આવશે જ, એ વિચારે મને ભય ઉત્પન્ન થયો. કાલે સૂર્ય જેગે એવી પ્રલુબ પાસે પ્રાર્થના કરતો હું નેમાની સાથે પાછો વહાણમાં ગયો. પાછાં ફરતાં રસ્તામાંથી ચેંગુઈનનું એક સુંદર ધીકું હું નેમાના પ્રદર્શન માટે દેતો આવ્યો.

૨૧મી માર્યની સવાર પડી. સહ્લાંયે આકાશ ચોખ્યું હતું. સૂર્ય હેખાશે એવી આશા મારા મનમાં જલ્દી થઈ. અમે પાણી હોડીમાં બેસીને કાંઠે આવ્યા અને પેલી ટેકરી ઉપર એક અનુકૂળ જગ્યા શાધીને બેઠા. સાથે એક ડેનામિટર (ધડિયાળ), દુરઘીન તથા બેરામિટર હતા.

લગભગ અગિયાર વાગે અમે ટેકરીની ટોચે પહોંચ્યા. બરાબર

બાર વાગે સૂર્ય ઉપરથી અમારી જગ્યાના અક્ષાંશ-રેખાંશ નક્કી થવાના હતા. હું ધડિયાળ લઈને બિલો હતો. એરોમિટરથી ભાંચાઈ તો નક્કી થઈ જ હતી; વાર ફક્ત ૧૨ વાગવાની હતી.

૧૧૩૩ થથા; સૂર્યનું ક્ષિતિજ ઉપર પડતું પ્રતિબિંબ હેખાયું. જણે સોનાની મોટી થાળી! સૂર્ય પોતાનાં છેલ્લાં કિરણો આ નિર્જન સ્થાનમાં હેંકી રહ્યો હતો, અને બરફને સોનાથી મઠી હેતો હતો. હું બરાબર ધડિયાળ લઈને બિલો હતો. સૂર્યનો બરાબર અર્ધો જ ભાગ જે બરાબર બાર વાગે હેખાય તો અમે બિલો હતા તે જગ્યા દક્ષિણ ધ્રુવ છે એમ નક્કી થાય. પરિણામ માટે મારું હૃદય ખૂબ આતુર હતું.

ધડિયાળનો કાંટા બાર ઉપર આવ્યો. હું બોલી બઠક્યો : ‘બાર !’ અને બીજી જ ક્ષણે સામે નેમોના અવાજ મળ્યો : ‘દક્ષિણ ધ્રુવ !’

કેપ્ટન નેમાંએ સૂર્યના પ્રતિબિંબને ઝીલવા માટે રાખેલા કાચની અંદર ધીમે ધીમે આથમી જતા સૂર્યનો અડધો ભાગ ધડીક હેખાયો, ન હેખાયો ત્યાં તો તે અદસ્ય થતો ચાહ્યો; થાડી વારે હેખાતો બંધ થયો.

‘સલામ, ઓ જગતના જીવનદાતા ! આ સમુદ્રમાં આરામ કરો. આ મારા પોતાના પ્રદેશ ઉપર હમણાં છ મહિના સુધી અંધકારનો પછેડા એઢાડી હૈ !’ કેપ્ટન નેમા ગંભીર અવાજે સૂર્ય તરફ જોઈને બોલ્યો.

થાડી ક્ષણું પછી મારા તરફ ફરીને તેણે કહ્યું : ‘પ્રોફેસર ! અત્યાર સુધીમાં ધણુ માણસોએ અહી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે; તમે એ બંધું જણુતા જ હશો. આજે હું આ પ્રદેશ કણજે કરું છું, પણ તે ખીંચ ડાઈના નામે નહિ પણ ખુદ મારા નામે.’

પોતાની પાસેથી એક નાનો કાળો વાવટો તેણે કાઢ્યો અને હવામાં ફરકાયો. વાવટાની વર્ચ્યે સોનેરી અક્ષરે લખેલો ‘N’ ચળકતો હતો.

૨૨

બરક્કમાં પુરાયા

બાળીસમી માર્ચે સવારના છ વાગ્યામાં અમારું વહાણુ જોપડવા
 માટે તૈયાર થઈ ગયું. સંદ્યાનો આછો પ્રકાશ ધીમે ધીમે રાત્રિમાં
 ભળી જતો હતો. ઠંડી ખૂબ હતી. નક્ષત્રમંડળો સ્વર્ચ આકાશમાં
 પ્રકાશી રહ્યાં હતાં. મધ્યાકાશે સ્વસ્તિકનું નક્ષત્રમંડળ વિરાજતું હતું.
 થરમોભિટરમાં પારો શુન્યની નીચે ૧૨ ડિગ્રી જેતરી ગયો હતો, અને
 પવન વાતો ત્યારે ઠંડી શરીરને જાણુ નાંધી નાખતી ! બરક્કનાં
 ચોસલાંએ જમતાં જમતાં મોટા ખડકો! બંધાતા જતા હતા.

વહેલ માછલીએ તો બરક્કની ઝડતુ પહેલાં જ આ ભાગોં
 માંથી આછા ઠંડા ભાગોમાં ચાકી ગઈ હતી. સીક આ જમતા
 જતા બરક્ક ઉપર ઝૂદકા મારતાં હતાં; કોઈક કોઈક પોતાને માટે
 બરક્કમાં બણેલો પણ જોદતાં હતાં.

અમારું વહાણુ આ બરક્કના ખડકોની વર્ચ્યે થઈને દરિયાની
 સપાઈ ઉપર તો ન જ ચાલી શકે. તરત જ પાણીનાં ટાંકાંએ
 લરાયાં અને વહાણુ નીચે ઝૂભવા લાગ્યું. લગભગ ૧૦૦૦ ઝૂટ નીચે
 જેતરીને ઉત્તર તરફ કલાકના પંદર માઈલની ઝડપે આગળ વધવા
 લાગ્યું. સાંજ પડી ત્યાં તો અમારું વહાણુ બરક્કની છત નીચે થઈને
 ગતિ કરી રહ્યું હતું.

સલૂનની બારીએ તો બંધ કરી હતી; કારણ કે કાચ સાથે
 કદાચ કોઈ બરક્કનો રખડતો ઝૂટો પડેલો દુકટો અથડાઈ જથ તો
 વહાણુ જોખમાઈ જથ. આથી હું તો મારા ઓરડામાં બેડો બેડો
 નિરાંતે લખતો-વાંચતો હતો, અને મોટા ભાગ તો અત્યાર સુધીના
 સાડા પાંચ મહિનાના ૪૨,૦૦૦ માઈલના પ્રવાસમાં બનેલા બનાવો

ઉપર નજર ફેલવતો હતો. કેવાં કેવાં વિચિત્ર દક્ષયો! કેવા કેવા વિચિત્ર બનાવો! કેપ્ટન નેમો કેવો ભેગી માણુસ! કેસ્પેના ટાપુ, પાપુઅન લોડા સાથેનું કુદ્દ, સિલેન પાસેનું અદ્ભુત મોતી, વીગેનો અખાત, આટલાંટિક નગર, દક્ષિણ પ્રિંચ : આ બંધાં સ્થળો તથા બનાવો. એક પણી એક મારી નજર આગળ આવીને ચાલ્યા જતાં હતાં. કેપ્ટન નેમેની આંખો તો બધો વખત મારી નજર સમક્ષ જ રહેતી. રાત્રે સુતો તોપણું તે બનાવો અને તેના જ વિચારો. નજર આગળથી ખસતા નહોતા. મને જીંધ તો આવી ગઈ, પણ સ્વપ્નામાં પણ આ જ સમરણો આવતાં હતાં. એકએક લગભગ ત્રણેક વાગે વહાણુંને એક જરૂરો આંયડો લાગ્યો, ને હું જાગી ગયો. જેઉં તો પથારિમાંથા હું કચાઈ દૂર જઈ પડેલો। ત્યાંથા જીણે હું દીવાનખાનામાં (સલૂનમાં) ગયો તો ત્યાં પણ ટેબલ-ખુરશી વગેરે બધુંધ જધુંચતું થઈ ગયું હતું. ઓરડાની બાજુની લીંતો ઉપરનીચે થઈ ગઈ હતી અને તળિયું તથા છત પડ્યાં બની ગયાં હતાં!

હું ગભરાયો. ઘડીભર તો આ બધું મને સ્વપ્ન જેવું લાગ્યું. પણ ત્યાં તો નેડ અને ડાન્સીલ પણ મારી પાસે આવ્યા. ‘કેમ, આ શું થયું?’ મેં પૂછ્યું.

‘અમે પણ એ પૂછવા જ આવ્યા છીએ.’
આવો વિચિત્ર બનાવ આ વહાણુમાં પહેલી જ વાર બન્યો હતો. અમે તરત જ કેપ્ટન નેમેની તપાસમાં નીકળ્યા. કેપ્ટન સુકાનની કેબિનમાં હશે એમ મને લાગ્યું. અમે તેની રાહ જેતા કેબિનમાં ચડવાની સીડી પાસે જિલ્લા. થોડી વારે કેપ્ટન નેમો સીડી પરથા નીચે જિતરીને જણે અમે જિલ્લા જ નથી એમ દીવાનખાનામાં ગયો. અમે પણ તેની પાછળ પાછળ ગયો. ઘડીક મેનોમિટર તરફ, ઘડીક કંપાસ તરફ તો ઘડીક દરિયાના નકશા તરફ તે જેતા હતો. મેં તેને વર્ચે ખોલાવ્યો નહીં. ઘણ્ણી વારે તે મારા તરફ ઝર્યો. તરત જ મેં પાપુઅન બેટોના કિનારા પર જ્યારે વહાણ દાંતીમાં ભરાયું

હતું ત્યારે જે શખદ તેણું વાપર્યો હતો તે જે શખદ વાપરીને પૂછ્યું :
 ‘કેમ કંઈ બનાવ બન્યો ? ’

‘ ના, પ્રોફેસર ! આ વખતે “ બનાવ ” નથી બન્યો, પણ
 “ અક્સમાત ” બન્યો છે ! ’

‘ બહુ ભયંકર છે ? ’

‘ હા, એમ લાગે છે.’

‘ વહાણ કોઈની સાથે અથડાયું છે ? ’

‘ ના, પણ વહાણની સાથે કોઈ અથડાયું છે. એક મોટા બરક્રનો
 પહાડ બંધો થઈ ગયો છે. તમે જણો છો કે જ્યારે બરક્રનો
 પહાડ તળિયે ધીમે ધીમે ગરમ વાતાવરણને લઈને આગળે છે, ત્યારે
 તેના શુદ્ધત્વાકર્ષણનું મધ્યભિંડુ જાંચે જાંચે આવતું જય છે. બરક્રના
 પહાડની નીચેથી બીજુ કોઈ વસ્તુનો ધક્કો લાગે છે ત્યારે પણ એમ
 બનવા પામે છે, અને એ વખતે પહાડ આખ્યાય બંધો થઈ જય
 છે. આ વખતે પણ એમ જ બન્યું છે. નોટિલસની નીચે એક
 પહાડ ધૂસી ગયો છે, અને નોટિલસને નીચેથી બંધું કરવા માંડયો
 છે; અને એટલે જ વહાણ પડખાલર થઈ ગયું છે. માણુસો ટાંકાં
 ખાલી કરીને વહાણને હળવું કરી તેને સરખું કરવા મથી રહ્યા છે,
 પણ મુશ્કેલી તો બીજુ જ છે ! આ પહાડ આમ ને આમ વહાણને
 એટલે જાંચે લઈ જશે કે જ્યાં ઉપર પણ બરક્રની છત આવશે,
 અને બંને બાળુથી બરક્રની ભીસમાં આવતાં વહાણ કયરાઈ જશે !
 કેટનાં મોઢા પર આ વાક્ય જોખતી વખતે વેદનાનો ભાવ સ્પષ્ટ
 હેખાતો હતો.

અમે બધા પણ આ વહાણનો અને સાથે સાથે અમારો વિનાશ
 સ્પષ્ટ જેઠી રહ્યા હતા. પાણીના પણો ખૂબ જોરથી કામ કરી રહ્યા
 હતા. વહાણનું વજન ઘટવાથી કે ડાણ જણે શાથી, પણ અમારું
 વહાણ જે આડું થઈ ગયું હતું તે સીધું તો થઈ ગયું, પણ તેથી
 અમારી મુશ્કેલીનો અંત આવ્યો એમ ન કહી શકાય. પેદો નીચેનો

પહાડ અંદરના પાણીની ગરમીથી ઓગળતો હતો, ને તેનું વજન ધર્તું જતું હતું. અમારે અમારો રસ્તો કઈ રીતે આગળ કરવો તે પ્રશ્ન થઈ પડ્યો.

એકાએક અમારું વહાણું અટક્યું અને સલૂનમાંની બારીઓ જિધડી, વીજળાના પ્રકાશમાં મેં નજર કરી તો અહ્લુત દશ્ય મારી નજરે પડ્યું. વહાણું આ દશ્ય જેવા માટે જ જિલ્લું રહ્યું હશે. સામે લગભગ ૩૦ ફૂટ દૂર બરફની દીવાલ હતી. તેના ઉપર વીજળાને પ્રકાશ પડતો ત્યારે તેમાંથી સામું ને તેજ છુટ્ટું એ આંખને આંજુ હ્યું હતું. દીવાનખાનાની અંદર વીજળાની બતી નહોંતી છતાં એ સામા પ્રકાશને લીધે જ આપો એરડો અગમગાટ મારતો હતો. અમારા વહાણુની ઉપર પણ બરફની છત હતી. તેમાંથી ક્રાઇઝ ક્રાઇઝ વખત જ્યારે પાણી ટપકતું ત્યારે જણે હિરા ટપકતા હોય એમ લાગતું હતું. હીરાની મોટી ખાણુની વચ્ચે જણે અમે આવી પડ્યા હોઈએ।

અમારા વહાણુને બંને પડ્યે પણ ત્રીસ ત્રીસ કૂઠને અંતરે બરફની દીવાલ હતી. નીચેનો પેદો ઓગળતો જતો પહાડ બંને બાજુની દીવાલને અડકી પડ્યો હતો. જણે આરામ જેવા સૂતો હોય તેમ તે બંને દીવાલોને ખલે ટેડા દઈને પડ્યો હતો. ઉપર બરફની દીવાલ હતી. અમે સમુદ્રતી સપાઠીથી લગભગ ૧૦૦૦ ફૂટ નીચે હતા. આ દશ્ય જેવું રમણીય હતું, તેવું જ લયંકર પણ હતું અને જ્યાલ મને આ બધું જેથા પછી આવ્યો. અમે બરફ વચ્ચેની નાની એવી નીકમાં સપડાઈ ગયા હતા. અમારું વહાણ થોડી વાર જિલ્લું રહીને નહેરમાં થઈને આગળ ચાલવા માંડ્યું. પાછી દીવાનખાનાની બારીઓ બંધ થઈ ગઈ હતી, કારણું કે આ નહેર એટલી બધી સાંકડી હતી કે વહાણું આપું જેખમમાં હતું. લગભગ અરધો કલાક ચાલ્યા પછી પાછો અમારા વહાણુને એક નાનો એવો આંચેડા લાગ્યો ને વહાણ અટક્યું; વળી બરફ આડો આવ્યો જણુંતો હતો !

વહાણું હવે પાછે પગલે ચાલવા માંડ્યું. હું સમજુ ગયો કે

આગળનો રસ્તો બંધ થઈ ગયો છે. મેનોટિરમાં ગતિની દિશા પણ દક્ષિણ હેખાતી હતી.

અમારી ચિંતા ક્ષણે ક્ષણે વધતી જતી હતી. હું એકલો ગલ-
રાવા લાગ્યો. ડાન્સીલને અને નડને મેં મારી પાસે બેલાંયા. ‘આપણે આ નહેરમાંથી સહીસવામત બહાર નીકળાયે ત્યાં સુધી
તમે બંને મારી પાસે જ રહો, આપણે ત્રણેથ સાથે જીવીએ અને
સાથે —’ આગળનું વાક્ય હું પૂરું કરી ન શક્યો.

થોડા કલાકો પસાર થઈ ગયા. કલાકના ૨૦ માઈલની ઝડપ
આવી લયંકર જગ્યાએ રાખવાની હિંમત તો કોટન નેમો જ બતાવી
શકે! અને એ પણ ખરું હતું કે જેટકી ઝડપથી આમાંથી બહાર
નીકળાય તેટકી ઝડપ રાખવી એ જ ડહાપણ હતું.

પાછો ખીને આંચેકો લાગ્યો. આ આંચેકો વહાણના પાછળના
ભાગથી આવ્યો હતો. હું લગભગ પડી ગયા જેવો થઈ ગયો.
ડાન્સીલે મને પકડી રાખ્યો. અમે ત્રણે જણ્ણા વારાફરતી એકખીજ
સામે જેતા હતા. થોડી વારે કોટન અંદર આવ્યો.

‘કુમ, દક્ષિણ બાજુને રસ્તે પણ કંઈક આડું આવ્યું?’

‘હા. એક અરક્ષનો પહાડ એ બાજુએ પણ આપણો માર્ગ
ઝંધાને પડ્યો છો.’ કોટને કણું.

‘ત્યારે આપણે પુરાઈ ગયા?’

‘એમ જ!'

‘હું : નિયમ નિયમ કિંદું હિંદું હિંદું નિયમ નિયમ
નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ
નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ
નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ નિયમ

૨૩

દૂટયા

અમારા વહાણુને બરદેશેય દિશાએથી ઘેરી લોધું. સધળા બાજુથી બરદની ભજુખૂન દીવાલો વચ્ચે અમે સપડાઈ ગયા હતા!

અમે બધા દીવાનખાનાની અંદર સ્તરથી થઈને જિલ્લા હતા. કોટન નેમો સિથર દષ્ટિએ નાચે જેતો અદળ વાળાને જિલ્લા હતો; અમે બધા કોટન તરફ જોઈ રહ્યા હતા. વહાણુ આપું સ્તરથી હતું.

કોટન થોડી વારે બોલ્યો : ‘ભાઈઓ ! હવે એ રસ્તે આપણું મરથું સરળયેલું છે.’ તેનો શાંત છતાં જરાક શ્રૂઝતો અવાજ આપા વહાણુની શાંતિમાં જણે સુર પૂરતો હતો. ‘કાં તો ચારેય બાજુથી બરદની ભીસમાં કયરાઈને આપગે મરથું, અથવા તો હવા વગર ગુંગળાઈને મરથું. ભૂખથી મરથું નિઃકા, કારણ કે વહાણુમાં ખાવાનું તો પુષ્કળ છે. ઇક્કત હવા એ દિવસ ને એ રાત ચાંદે તેઠલી જ ટાંકામાં પડો છે. તે પહેલાં આપણે આ મેતની શુદ્ધામંથી અડાર નીકળવાનો પ્રયત્ન કરવાનો રહે છે. માણુસેને લઈ હું બધી દીવાલોને બરાબર તપાસીને જે સૈથી વધારે પાતળી હશે તેને તાડીને તેમાંથી વહાણુ કાઢવાની મહેનત કરું છું. મારા માણુસે કોદાળા-પાવડા લઈને અને પાણીમાં પહેરવાનો પોશાક ચડાવીને તૈયાર છે. હું જઉં છું.’

કોટન જવાની તૈયારી કરતો હતો, ત્યાં નેડ બોલી જિઠચો : ‘હું પણ આવું છું. શું તમે એમ સમજો છો કે અમે બધા અડી ખાવા જ આવા છીએ ? મારા માટે એક પાણીનો પોશાક અને કોદાળા તૈયાર કરાવો. તમને ખાતરી થશે કે આ નેડ હારપુન ચલાવી

શકે છે, તેમ જ ડોદળી પણ ચલાવી શકે છે.' તેણે આંખો ચડાવી.

'તો ચાલો મારી સાથે.' કેપ્ટને હથું.

નેડની પાસેથી મેં આ આશા નહોતી રાણી. મારામાં ઉત્સાહ આવ્યો ને કેપ્ટનના ગયા પણ હું દીવાનખાનાની બારી ઉધાડીને બેડો. થાડી વારે મેં નીચેના અરફના ભાગ ઉપર માણુસોને ચાલતા જ્યેથાં. કેપ્ટનનું પ્રચંડ શરીર મેં સૈના સરખા પોશાક હોવા છતાં એળખી કાઢ્યું; તે સૈથી મોખરે હતો. હથમાંનો એક મોટા લોઢાનો સળિયો બરક્રમાં જુદી જુદી જગ્યા એતે જોસ્તો જતો હતો, અને કંઈક જેતો જતો હતો. છેવટે એક જગ્યા નક્કી થઈ અને કેપ્ટને ત્યાં વહાણુના આકારની જ એક મોટી હદ હોરી. માણુસો તે હદ ઉપર ડોદળી લઈ ઓદ્વા મંડી પડ્યા. લગભગ ૭૦૦૦ ધન થાઈ જેટલો ભાગ ઓદ્વાનો હતો. ત્યાં આગળ બરક્રનો થર ૩૦ કૂટજેટલો જડો હતો.

કામ તડામાર ચાલવા માંડ્યું. એક માણુસ એ માણુસ જેટલા જેરથી કામ કરતો હતો. બરક્રનાં ચોસલાં ને ચોસલાં જીવિતાં જતાં હતાં, અને ગુરુત્વાકર્ષણુના સિદ્ધાંતાનુસાર તે નહેરને મથાળે ચોટી જતાં હતાં.

એ કલાકની સતત મજૂરી પણ ને લોથ થઈને મારા ઓરડામાં આવ્યો. કામ કરનારાએની એક દુક્કડી થાડી એટલે કેપ્ટને ખીજ દુક્કડીને તરત જ રવાના કરી. અથમાં હું અને ડોન્સીલ બંને જોડાયા. આટલી સખત ઠંડી હોવા છતાં ડોદળીના તરણ ધા માર્યા ત્યાં મારા શરીરમાં ગરમી આવી ગઈ, અમારા પર ૩૦ વાતાવરણનું દાખા હોવા છતાં મારું શરીર છૂટ્યી ફરહું હતું.

હું જ્યારે કામેથી પાછો ફરીને મારા ઓરડામાં આવ્યો, ત્યારે ઓરડાની હવામાં મને વિચિત્ર ફેરફાર લાગ્યા માંદ્યો. મારે ખાસ ખૂબ જ જેરથી લેવા પડતા હતા. વહાણુની અંદર હવામાં કારોબેનિક એસિડનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. ૪: કલાકથી આ ને આ જ હવામાં અમે રહેતા હતા; તેમાંથી ઓક્સિજન-પ્રાણુનાથુ ખૂબ

જ ઘટી ગયો હતો, અને જોડાણું તો હજુ લગભગ ૬૦૦ ઘન વ્યાર્ડ
નેટલું જ થયું હતું. આ કામ પૂરું કરતા ચાર દિવસ અને પાંચ
રત હજુ લાગવાની હતી. પણ ચોથા દિવસ અમે નેથું કે કેમ તેની
કાને ખખર હતી?

તોપણું પ્રયત્નમાં પાણી ન હડવું એમ નક્કી કર્યું હતું.
મરવું તો પણ કે સુરી કુદરત સાથે લડીને કેમ ન મરવું?
અમે બધા જ મરગિયા થયા હતા. કેપ્ટન નેમો પણ કુદરતની સામે
બાંધ ચડાવી જોબો હતો.

રાતોરાત કામ ચાલતું હતું. આપી રાતમાં આપું તળ એક
વાર્ડ જાંકું જોડાયું હતું. સવારે જીડીને હું જ્યારે કામે લાગ્યો
ત્યારે મેં નેથું કે વહાણુંની પડણેની બંને દીવાલો પાસે આવતી
જતી હતી. પાણીનો બરફ બહુ જરૂરી થવા લાગ્યો હતો. બરફના
ને કુકડાઓ અમે નીચેથી કાઢતા તે તરત જ દીવાલમાં નેડાઈ
જતા; આ દીવાલો આમ ને આમ વધારે નણુક આવતી જશે તો
અમારું વહાણું એ બેની વચ્ચે કચારે ભીસાઈ જશે, તે કઢી શકાય
એમ નહોતું. પાણીનો બરફ થવાની કિયા કાઈ પણ રીતે વહેલામાં
વહેલી તક અટકાવવી નોઈએ. એક તરફથી વહાણુંમાં હવાનો સંશુદ્ધ
ખૂટવા આવ્યો હતો, બીજુ આજુથી આ મુશ્કેલી જભી થઈ હતી !
અમારી જોડાળાઓ વધારે વધારે નેરથી ચાલવા લાગ્યો. હું માટે
ભાગે કામ કરવામાં જ રહેતો હતો; તેમાં એક બીજે ઝાયદા હતો.
કેપ્ટન નેમાંએ નિયમ કર્યો હતો કે ને હવા હજુ ટાંકાઓમાં છે,
તે બહાર બરફ જોડાનારાઓને માટે જ વાપરવામાં આવશે; વહાણુંની
અંદર ને હવા છે, તેમાંથી જ અંદરનાઓએ ચકાવવાનું રહેશે. અને
એ નિયમ જ બરાબર હતો. હું ને થાડાધરો વખત વહાણુંમાં
કાઢતો, તેટલામાં તો ગૂંગળાઈ જતો હતો.

અલપત્ત પાણીમાં પ્રાણવાયુ-ઓક્સિજનનું પ્રમાણ ધણું છે,
અને તે જુદું પણ પાડી શકાય; પણ વહાણું અને આસપાસમાં

અમે કાઢેલો જે કારબેનિક એસિડ ગેસ ભરાઈ ગયો હતો તે દૂર કરવા માટે તો ડોસ્ટિક પોટાશ જોઈએ, અને તે અમારી પાસે નહોતો. અમે લાયાર હતા !

એ દિવસે સાંજે હવાની ટાંકમાંથી થોડીક હવા કુપ્ટને વહાણું ની અંદરના ઓરડાએ માટે કાઢી જે આ હવા ન કાઢી હોત તો કદાચ સવારે અમે પથારીમાંથી જિડુચા જ ન હોત।

રડમી માર્યાને દિવસે પંદર કૂટ બાંદું ખોદાયું હતું. પડેખેની બુરફની દીવાલો ધીમે ધીમે નજીક આવતી જતી હતી. મારામાં નિરાશા આવી ગઈ. આટાટલી મહેના કરવા છતાં કુદરત અમારા ઉપર જુલમ જ કરતી જય છે ? આમ દુનિયાના નિર્જન લાગમાં એક બરફ જેવી વસ્તુથી અમારું કર્મોતે મોત થાય એ વિચારે હું હતાશ થઈ ગયો. કામ પડતું મૂકીને મારા ઓરડામાં હું આવ્યો. કુપ્ટન નેમો તરત જ મારા પાણી આવ્યો. તે મારે ખલે હાથ દઈને બોલ્યો : ‘આ પાણીનો બરફ થતો જે આપણે નહિ અટકાવીએ તો થોડા જ વખતમાં ખલાસ થઈ જશું !’

‘મને કાંઈ સૂઝતું નથી.’ મેં કહ્યું.

કુપ્ટન થોડી વાર મારા સામું જોઈને પઢી નીચે જોઈ રહ્યો. એકાંગેક તે બોલી જિડુચો : ‘ગરમ જિકળતું પાણી તૈયાર કરો.’

હું પણ ચમકી જિડુચો : ‘ગરમ જિકળતું પાણી ?’

‘હા; વીજળાથી પાણી ગરમ કરીને આપણા પંપ વાટે તે ખંડાર છાંટો.’

તરત જ એંજિનના ઓરડામાં જઈને તેણે હુકમ છાડ્યો. પાણી ધડીકવારમાં ગરમ થયું અને પંપ વાટે બરફ ઉપર તેણે પોતાનું જેર અજમાવવા માંડ્યું. જે બરફ લખલલી કોદાળીઓનાં પાનાં ભૂઠાં કરી નાખે તે આ ગરમ પાણી પાસે લાયાર થઈ ગયો. આ પાણીનું પ્રમાણ જેકે ખૂબ ઓછું હતું, તો પણ તેણે એટલું તો જરૂર કર્યું

કે નવો બરફ જમતો અટકી ગયો. થરમોભિટર શુન્ય ડિયો નીચે ૬ ડિયી સુધી પહેંચ્યું હતું; એ કલાક પણ તે શુન્ય ડિયો નીચે ૪ ડિયીએ પારો હેખાડવા લાગ્યું.

‘આપણે ઝાવશું !’ કેપ્ટને ઉત્સાહથી છલ્યું.

મને પણ આશા આવવા માંડી.

રજમી તારીખે ૧૮ ફૂટ બિંદું તળ ખોદાઈ ગયું. બાર ફૂટ હળ્યું આકી હતું. હજુ એ દિવસ કામ હતું. એ દિવસ એટલે ૪૮ કલાક. હવા ખૂટવા આવી હતી. હું મારા ઓરડામાં અન્ધાનામાં ગૂંગળાતો હતો. કોન્સીલ મારી પડ્યે જ મને આશાસન આપતો એઠો હતો. તે પણ ગૂંગળાતો હતો, પણ પોતાનું દુઃખ મારા દુખમાં સમાવી દેતો હતો. મેં તેને ધીમેથી બોલતો સાંભળ્યો; ‘જે આપને વધારે હવા મળી શકતી હોય, તો હું શાસ લેવાનું જ બંધ કરું ?’

કોન્સીલની કિંમત મને સમજવા લાગી. તેનું આ વાક્ય સાંભળ્યાને મારી આંખ ભીની થઈ. હવે મારો વારો કચારે આવે ને કચારે હું બહાર ફરવા જાઉં કે જ્યાં જેઠે તટલી હવા મળે એમ થતું હતું.

થાડોક વખત તાજી હવા અને થાડોક વખત વહાણુની ઊરી હવા એમ ચાદ્યા કરતું હતું. કેપ્ટન નેમે બરાબર નિયમ પ્રમાણે જ દરેકનો વારો સરખો વખત આવે તેની કાળજી રાખતો હતો. પોતાનો વારો પૂરો થાય કે તરત જ પોતાની હવાની કોથળી ખીન્યાની આપને પોતે ઊરી હવાવાળા વહાણુમાં બેસતો હતો.

કામ રાક્ષસના અણથી થતું હતું. ખીને દિવસે ક્રક્ત નવ જ ફૂટ ખોદવાનું આકી રહ્યું હતું. પણ હવે હવાનાં ટાંકાં લગભગ સાવ ખાલી હતાં. એ થાડીધાણી હવા હતી તે ક્રક્ત કામ કરનારાંએ માટે જ હતી.

મારો શાસ હવે રંધાવા લાગ્યો; આજનો દિવસ હું માંડ કાઢીશ એની મને ખાતરી થઈ હતી. કેપ્ટન નેમાંએ પણ જેઠ લીધું કે કામ કરનારાંએ પણ આજ સાંજ સુધી જ વાપરી શકે

તેટલી હવા બાકી રહી હતી. તેના મનમાં એક નવી યોજના સરૂરી આવી. બંધા માણુસોને તેણે અંદર બોલાવી લીધા. બરફનું તળિયું હવે ફૂલ ત્રણ જ ફૂટ તોડવાનું હતું. તેણે નક્કી કર્યું કે વહાણુને જરા જાંચે લઈ જઈને એ ખોદાયેલી ખાઈની અંદર જેરથી લઈ જવું. વહાણુના જેરને લીધે જ એ ત્રણ ફૂટનું પડ તૂંઠી જશે અને વહાણ તરત જ પાણીમાં આવી પહોંચશે. આમાં સાહસ તો હતું જ, પણ મરવાને વખતે સાહસ શા માટે ન અજમાવવું?

વહાણુને થોડું ક જાંચું લીધું. ખોદાયેલી ખાઈની ઉપર તે બરાબર તોળાઈ રહ્યું. થાડી વારે કોષ્ટનના હુકમ પ્રમાણે પાણીનાં ટાંકાં જેરથી ભરાવા લાગ્યાં ને વહાણ એકદમ નીચે જિતર્યું.

હુ મારા ઓરડામાં લગભગ બેલાન અવસ્થામાં પડ્યો હતો. વહાણ નીચે જિતર્યું એની મને ખખર હતી. પણ પછીથી મને બધું સ્વપ્ન જેવું લાગ્યું. વળી વચ્ચે મને તાજી હવા મળી. મને થયું કે એમે સમુદ્રની સપાઈ ઉપર આવી પહોંચ્યા હશ્યું. પણ ના, એમ નહોતું. ડ્રાન્સીલ અને નેડની હવાની ડ્રાથળીમાં જે થોડીક હવા રહી ગઈ હતી તે પોતાને માટે નહિ વાપરતાં તઓ મને આપી રહ્યા હતા. મેં સૂતાંસૂતાં મારી ભીની આંખ તેમના તરફ ફેરવી. ડ્રાન્સીલે મારી આંખ લુણી. હું ફરી પાણો આંખ માંચી ગયો અને બેલાન થઈ ગયો.

જ્યારે આંખ ઉધારીને મેં ઘડિયાળ સામે જોયું ત્યારે ૨૮મી તારીખના સવારના અગિયાર વાગ્યા હતા. નોટિલસની ગતિ કલાકના ૪૦ માઈલની હતી. આ શું? કોષ્ટન નેમેં કચાં? આ વહાણ કચાં જય છે? મેનોમિટરમાં જોયું તો અમારું વહાણ દરિયાની સપાઈથી ફૂલ ૨૦ ફૂટ જ જાંડે હતું। એક બરફનું પાતળું પડ જ અમારી અને સમુદ્રની સપાઈ વચ્ચે આડું હતું. એ પડ નહિ તૂટે? શી ખખર પડે? પણ નોટિલસ પોતાનો બધો પ્રયત્ન ફરી છૂટવાનું હતું. તેના પાણગના ભાગમાં આવેલાં ટાંકાઓમાં

ખૂઅ પાણી ભરવામાં આવ્યું, તેથી તે ભાગ નમ્યો ને આગદો ભાગ જાંચો થયો. આવી રીત ત્રાંસું થઈને તેણે પોતાનો પંખો જેરથી ફેરવવા માંડ્યો. બરક્ક ધીમે ધીમે તૂટવા માંડ્યો. અને આખરે બરક્કના એ પડને વીધીને તીરની જેમ આખું વહાણ હવામાં જિછળાને સમુદ્રની સપાટી ઉપર આવી પછાયું !

બધા આરડાઓનાં બારણું જિધડી ગયાં, અને તાજી હવાનો ધોધ આખ્યા વહાણમાં જેતનેતામાં ફેલાઈ ગયો ।

નમોની આંખે આંસુ

મારામાં નવો પ્રાણુ આવ્યો। હું વહાણુના તૂતક ઉપર કાઈ રિતે પહોંચ્યો તેની ખખર ન પડી, પણ જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ સસુદ્ધનાં મોઝાં ઉછળા મારી રહ્યાં હતાં, અને ઠંડો પ્રાણુદાયી પવન મારાં ફેલસાંને ભરી રહ્યો હતો。

‘હવાની કિંમત અત્યારે સમજન્ય છે.’ નેડ કહ્યું.

‘નેડ! તમો બંને ન હોત તો આ હવા લેવાનું મારા નસીબમાં ન રહેત! તમારે તો જેટલો આલાર માતું એટલો ઓછો છે.’ મેં કહ્યું:

‘એમાં કાંઈ અમે મોટી વાત કરી નહોતી; એમાં સાદું ગળિત જ હતું. અમારા એ કરતાં તમારી કિંમત વધારે હતી એટલે તમને જિવાડવા જ જોઈએ ને।’ નેડ કહ્યું.

‘ના ના; હવે તો તમે એમ સાબિત કર્યું છે કે મારા કરતાં પણ તમારા જેવા ઉદાર જીવાની કિંમત વધારે છે।’ મેં કહ્યું. ‘અને ડેન્સીલ! તેં બહુ સહન કર્યું, નહિં?’

‘ના ના. આ વખતે જે હું કાંઈ ન કર્યું તો થું અમેરિકાની હોટલમાં જ તમારી – ના ના, આપની પાસે રહી મોજ માણવા માટે બંધાયેલો થું?’ ડેન્સીલ કહ્યું.

‘આપ’ ને બદલે ‘તમે’ બેલાઈ જવામાં થયેલો ક્ષોલ ડેન્સીલના મેઢા પર સ્પષ્ટ દેખાતો હતો.

‘પ્રોફેસર સાહેબ! તમે જે એમ માનતા હો કે અમે તમારા પર ઉપકાર કર્યો છે, તો મેં પણ તેના બદલા માટેનું કામ તમારા માટે તૈયાર જ રાખ્યું છે.’ નેડ કહ્યું.

‘શું?’

‘જ્યારે હું આ વહાણમાંથી નાસી છુટવાની તૈયારી કરું ત્યારે તમારે સાથે રહેવાનું છે.’

‘આહો, એ તો નક્કી જ છે ને! હા, પણ આપણે કઈ દિશામાં જઈએ છીએ? આ સ્વર્ય સામે હેખાય છે, એટલે ઉત્તર દિશા તરફ જ વહાણ જય છે, એ વાત નક્કી.’

અમારું વહાણ શિકારીના પંજમાંથી છુટેલા હરણની જેમ ઉત્તર દિશા તરફ નાસતું જતું હતું.

‘હવે કાં તા કેપ્ટન નેમોનો વિચાર ઉત્તર પ્રુવની હવા ખાવાનો લાગ છે! નેડ કહ્યું:

‘તોએ આપણાથી કચાં ના પડાય તેમ છે?’ મેં કહ્યું:

‘પણ આપણે તો વર્ચે રસ્તામાં જ વહાણને છોડી દેવું પડશે. હવે કાંઈ કેપ્ટન રણ આપે તેની રાહ જેવાશે નહિ. ’ નેડ કહ્યું:

‘આપણે તો જુદા પડવામાંથી વાંધો નથી, અને સાથે રહેવામાંથી વાંધા નથી.’ ડોન્સીલે મેતાનો નમ્ર અલિપ્રાય જણાવ્યો.

પહેલી અપ્રિલે જ્યારે અમારું વહાણ તાજી હવા લેવા માટે દરિયાની સપાઈ ઉપર આવ્યું ત્યારે અમારી નજરે જમીન હેખાઈ.

એ ‘ટેરા-ટેલન્ઝ્યુગ’નો પ્રદેશ હતો. દક્ષિણ અમેરિકા અને આ પ્રદેશ વર્ચે એક સામુદ્રધૂની વહે છે. તેનું નામ મેગેલનની સામુદ્રધૂની. મેગેલન નામના એ પ્રખ્યાત સાહસી વહાણુવરીએ લગભગ ૧૬મા સૈકામાં આની શોધ કરી હતી,

અમારું વહાણ કિનારે ચઢા. સિવાય ફોકલેન્ડના બેટા તરફ ચાલ્યું. ત્યાંથી દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારાની સાથે સાથે જ તે ઉત્તરમાં આગળ વવવા લાગ્યું. વહાણ કચાંયે કિનારે જીતરતું ન હતું. એક તા કિનારો જ ખૂબ ખરાખ હતો, અને ભીજું માણુસોની વસ્તીવાળા ભાગ જ એવો હતો કે જ્યાં ન જીતરી શકાય. અને નેમો કાંઈ માણુસની વસ્તીમાં થાડો જ જય?

‘ક્લેટ’ નહીના મુખને વટાવી ‘ઉસગાપ’ના પ્રદેશનો કિનારો અમે વટાવી ગયા. ખાજિલનો ગરમ પ્રદેશ પણ અમારી પડ્યે થઈને પસાર થઈ ગયો. ૧૧મી એપ્રિલે અમે એમેઝેનના મુખ આગળ આવી પહોંચ્યા. એમેઝેન નહી દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારાથી પૂર્વ કિનારા સુધીના ભાગને કંદ્રારાની જેમ વાંટળાઈ વેળ્ણી છે. તેનું મુખ જ સમુદ્ર જેવું છે. એમેઝેનના જેરને લીધે ત્યાં આટલાં-ટિક મહાસાગરનું પાણી પણ ડેટલાક માઈલો સુધી મીઠું રહે છે. વિષુવવૃત્ત બરાબર આ એમેઝેનના મુખમાં થઈને પસાર થાય છે.

અમે વિષુવવૃત્ત વટાવી ઉત્તર ગોળાર્ધમાં આગળ ચાલ્યા. હેંચ ગિયાનાનો કિનારો પણ અમને દૂરથી દેખાયો; તેની પડ્યે જ ડ્રાને બિટિશ ગિયાનાના પ્રદેશા આવેલા છે. આ ભાગ વટાવ્યો એટલે નાના નાના ડેટલાય બેટાની એક હાર શરૂ થઈ.

આ બેટાની હારને એક બાળુ રાખીને અમારું વહાણુ એટિલીસ ટાપુઓના સમુદ્રમાં પેહું અને દૂષકી મારી ડેઠ બાહામાના ટાપુઓ પાસે નીકળ્યું. કિનારથી ધર્યે દૂર રહ્યું રહ્યું અમારું વહાણુ અહીં બહાર હવા ખાતું હતું. નેડલેન્ડની આશાઓ એક પઢી એક બેટા. આવતાં બંધાતી, અને તે બેટા પસાર થઈ જતાં તૂટી જતી। કણ રીતે જેખમાંથી નાસી છુટાશે એમ અને ક્ષણે ક્ષણે થતું હતું. હું તરથા ડેન્સીલ તો અમારો વખત જીવનની દરિયાની સમૃદ્ધિઓ જેવામાં કાઢતા હતા, પણ નેડનું શું? તેને ખાવા અને શિકાર કરવા સિવાય એક પણ વિષયમાં રસ નહોતો.

અમારું વહાણુ એક દ્વિસ સવારમાં દરિયાના કિનારા ઉપર હવા ખાતું હતું. હું હજુ જીંધમાંથી પૂરેપૂરો જાયો નહોતો; ત્યાં મારા કાન ઉપર ‘મદ્દ! મદ્દ!’ એરી બૂમ પડી. આ શરીરે હેંચ ભાષામાં બોલાયા હતા. હું તરત જ હોડતો હોડતો તૂટક ઉપર પડેંચ્યો ગયો. હું પહોંચ્યો તેની સાથે જ કેપ્ટન નેમો, નેડ તેમ જ વહાણુના ખીજ માણુસો પહોંચ્યો ગયા હતા. તૂટક ઉપર ધમાલ હતી.

પડયે જ સમુદ્રના પાણીમાં ભારે ખગભળાટ હતો હું વસ્તુસ્થિતિ ધરીકવારમાં સમજ ગયો. ‘પોલ્પ’ નામનાં આડ પગવાળાં દરિયાઈ વિચિત્ર પ્રાણીઓએ અમારા વહાણું ઉપર હલ્લે કર્યો હતો, અને એક માણુસને તો એક પ્રાણીએ પકડયો પણ હતો.

કેપ્ટન નેમોનું સ્વરૂપ આજે જેવું રૌદ્ર હતું તેવું મેં કઢી નહિ જોયેલું. પેલા પકડાયેલો માણુસ ફ્લાન્સનો જ હતો એમ મને ખાતરી થઈ કારણું કે આકૃતને વખતે માણુસ બીજુ ગમે તેટલી ભાષાઓ જાણુંતો હોવા છતાં પોતાની માતૃભાષા જ બેલી જડે છે. આ વહાણું ઉપર મારા જ દેશનો એક માણુસ આટલા વખતથી છે એની મને આજે જ ખરાર પડી. પણ ખરાર પડી તે ધરીએ એ માણુસ મુત્યુના મુખમાં હતો! મારા હુદયમાં ભારે વિચિત્ર લાગણી જિભરાતી હતી. હું ઉશ્કેરાઈ ગયો હતો; પણ શું કરું? આ લયંકર પ્રાણીઓ પાસે મારું શું ચાલે? કેપ્ટન નેમો અને નેડ પોતાનાં શશ્વતો લઈને તેમના પર હલ્લો કરતા હતા, પણ એથી તો જલદી વધારે ચિડાઈને એ પ્રાણીઓ વહાણુના તૂતક ઉપર ચડવાનો પ્રયત્ન કરવા માંડયા. પેલા માણુસને છોડાવવો એ બની શકે તેમ જ નહેતું. મેં સાંભળેલી તેની ભૂમ એ છેલ્લી જ ભૂમ હતી. મેં આસપાસનું પાણી લોછીવાળું જોયું અને મારી આંખે તમ્મર આવી ગયાં!

નેડ પણ આજે તો રંગમાં આવી ગયો હતો; પોતાના હાર-પૂનથી તેણે ઘણ્ણાં પ્રાણીઓની આંખો જ ફૈઠી નાખી; પણ દરમિયાન તેની પોતાની જરા ગજીલતને લીધે તેનો પગ સરકચો અને તે પાણીમાં પડી ગયો. તરત જ એક લયંકર પ્રાણી પંખ્યા જેવા આડ પગ લઈને તેના ઉપર ધસી આવ્યું. નેડ તરીને તૂતક ઉપર ચડી લય તે પહેલાં તો પેલું પ્રાણી નજીક આવી પહેંચ્યું, અને પોતાના આડે પગો અથવા હાથેથી તેને પકડવાની તૈયારીમાં હતું. હું નેડને ખચાવવા માટે ઝૂની પડવા તૈયાર થયો હતો, ત્યાં તો કેપ્ટન નેમોનો ભાલો પેલા પ્રાણીના મોઢામાં પેસી ગયો. દરમિયાન નેડ પણ સાવધ

થઈ ગયો, અને તેનું હારપૂત પોદ્યની છાતીમાં લોંકાઈ ગયું.

‘હાશ !’ નેડે ખુટકારાનો દમ એંચ્યો.

લગભગ ૧૦-૧૫ મિનિટ સુધી આ પ્રાણીએ અને વહાણુના માણુસો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. આખરે કેટલાંક નાસી ગયાં ને કોઈ કોઈ તો મરી ગયાં।

કેપ્ટન લોહિથી ખરડાયેદો મૂંગો મૂંગો કેટલીયે વાર સુધી સમુદ્રનાં પાણી તરફ જેતા જેભો રહ્યો. આ સમુદ્રે તેના જીવનના એક સાથીનો બોાગ લીધો હતો।

કેપ્ટનને આજે મેં પહેલી જ વાર રડતો જેથો.

૨૫

રજન નહિ મળી શકે

તે દિવસનું દશ્ય તો હું કદી નહિ ભૂલું. પેઢી હૃદ્ય ભાષામાં પડેલી કરુણા ચીસ નિરંતર મારા કાનમાં ગુંજ્યા કરે છે. નેડ પરનો પેલો લયંકર પ્રાણીનો હલ્દો અને કેપ્ટન નેમોએ કરેલો તેનો બચાવ, એ હેખાવ હજુ મારી આંખ આગળ તર્ફાં કરે છે, અને જણે અત્યારે જ એ બનતો હોય તેમ મારાં ઇંવાડાં ઝડાં થાય છે. કેપ્ટન નેમોનું રૂધન અને આંસુ તો કદી નહિ ભુલાયા। એવા માણુસો કદી રોતા નથી, અને રુણે છે ત્યારે હૈયાક્ષાટ રુણે છે, તથા જોનારનું હૈયું પણ હલાવી હે છે!

અને આ મૃત્યુ પણ કેટલું લયંકર હતું! પોદ્યના લયંકર સકંન્દમાં સપડાયેલ, દ્રુંદાયેલ અને ફાટેલી આંખોવાળું તેવું મોઢું એક ક્ષણું જ હું જોઈ શક્યો હતો; પણ તેની છાપ મારા હૈયામાં કાયમની પડી ગઈ છે!

મારા દેશનો માણુસ પણ કેપ્ટન નેમો સાથે દુનિયા સામે બહારવહું ખેડી રહ્યો હતો! કેપ્ટન નેમો પાસે આ માણુસ કંઈ રીત આવ્યો હશે? આ લોકાનું એક મંડળ તો નહિ હોય?

આ બનાવ પછી કેપ્ટન નેમો ભાગ્યે જ બહાર હેખાતો. થોડા દિવસ તો વહાણું પણ ગાંડાની જેમ આમતેમ બટકતું, ફરતું અથવા તો પડયું રહેતું.

લગભગ દસ દિવસ આ પ્રમાણે શોકમાં પસાર થઈ ગયા. અમારું વહાણું ઉત્તર દિશા તરફ આગળ વધ્યું. અમે મેક્સિકોના અખાતમાં થઈને દુનિયા ઉપરના એક મોટા દરિયાઈ પ્રવાહમાં પેઢા. આ પ્રવાહ તેની લંખાઈ પહોળાઈ તથા વેગ માટે પ્રસિદ્ધ છે. અમારું

વહાણ આ પ્રવાહમાં પડવું એટલે તેના વેગમાં આપોઆપ તણુવા
લાગ્યું. પ્રવાહ ડેઠ ન્યુક્ઝાઉન્ડલેન્ડ સુધી ઉત્તરમાં જ જતો હતો. અમે-
રિકાનો કિનારો તો અમારે દૂરથી જ જરા જરા જેવાનો રહ્યો હતો.

નેડલેન્ડ આ દૂરથી હેખાતો અમેરિકાનો કિનારો જોઈને મનમાં
બળતો હતો. રાતદિવસ નાસી શુટવાના જ વિચારો તેના મગજમાં
ઘોળાયા કરતા હતા. ડેટલીયે યોજનાઓ તેણે મનમાં ધડી અને
પાછી તાડી નાભી અને વળી નવી ધડી; પણ દરમિયાન તો દરિયા-
માં તોઢાન વધવા લાગ્યું. આ બાજુનો દરિયો ખૂબ તોઢાની ગણ્યાય
છે. ‘ગરમ પ્રવાહ’ની અસરને લીધે અહીં દરિયા ઉપર અવારનવાર
તોઢાન થયા જ કરે છે. આ તોઢાનમાં એક નાતી હોડી લઈને
નાસી શુટવું, એટલે મૃત્યુના જ મોઢામાં પડવાનું હતું!

એક દિવસ અકળાઈને તે મારી પાસે આવ્યો. ‘પ્રોફેસર
સાહેબ! હવે આનો કંઈ અંત આવશે કે નહિ? તમારો નેમો તો
જાંધું ધાલીને ઉત્તરમાં ને ઉત્તરમાં જ અંક્યે જય છે. ડેઠ ઉત્તર
ધ્રુવમાં કચાઈક બરક્કમાં વહાણ ખૂંચી જરો, ત્યારે ભાઈની આંખ
જિધડશે! દક્ષિણ ધ્રુવ જોઈને હું તો ગળા સુધી આવી ગયો છું;
હવે ઉત્તર ધ્રુવ જેવાની મારી જરાયે ધ્યાણ નથી.’

‘હા, પણ કરવું શું?’ મેં કહ્યું.

મને એમ જ લાગે છે કે તમારે જતે ડેપ્ટન પાસે જઈને
આ વાત કરવી, અને રીતસર તેની રજ માગવી. અને તમે તે
માગતાં બીતા હો તો આ વખતે હું પોતે જ તેની પાસે જઈશ.
હવે સમુદ્ર લલે તોઢાની હોય, પણ એ મારો અખાત છે. ન્યુ-
ક્ઝાઉન્ડલેન્ડની પાસેનો અખાત એ મારો જ અખાત છે. અહીં જો
ડેપ્ટન રજ નહિ આપે તો હું દરિયામાં પડતું મુક્કિને, તરીને નાસી
છૂટીશ. હવે મારાથી રહેવાનું નથી.’ નેટ આક્ષે થયો.

નેડની ધીરજની હદ આવી ગઈ હતી, એમ મેં જેયું. તર-
વરિયો જીવ આટલા મહિના સુધી આ વહાણમાં પુરાઈ શક્યો તે

જ નવાઈ હતી. આની અસર તેના મન ઉપર ને શરીર ઉપર થઈ હતી. તે વધારે ને વધારે ચીડિયો અને ફિક્કો થતો જતો હતો. સાત મહિનાથી પૂર્થી ઉપર શું બને છે તેની અમને ખબર નહોતી.

‘કેમ?’ નેડ ફરી બોલાવવાનો પ્રયત્ન કર્યો.

‘હા; પણ તેણે એક વાર તો આપણુને ચોખ્યું સંભળાવી દીધું છે.’

‘તાથે ફરી એક વાર. આ વખતે ડેવું સંભળાવે છે તે મારે જેવું છે.’

‘પણ હમણું તે મને મળતો જ નથી.’ મેં કહ્યું.

‘તે આપણુને ન મળે; આપણે તો તેને મળી શકીએ ને?’

‘તો હું તેને પૂર્ણી જોઈશ.’

‘કચારે?’

‘એ મને મળશે ત્યારે.’

‘ત્યારે તમે નકામી વાતો ન કરો. હું જ હમણું તેની પાસે જાઉં છું.’ નેડ જિસો થયો.

‘ના ના, હું જ તેની પાસે જઈશ; કાલે—’

‘ના, આજે જ.’

‘ગીક, આજે જ જઈશ.’

નેડ ગયો. થાડી વાર હું એકલો વિચારમાં બેસી રહ્યો. કેપ્ટન પાસે કઈ રીતે જવું ને વાત ઉપાડવી, તે બધું મનમાં ગોડવવા લાગ્યો; ને નિશ્ચય કરીને જિપડયો.

‘કેપ્ટન નેમોની આરડી આગળ આવીને મેં બારણું ઢોક્કું. કંઈ અવાજ ન આવ્યો. મેં બારણાને ધજ્જો માર્યો; બારણું જિધડી ગયું. હું અંદર ગયો. કેપ્ટન નેમા જાંખું માયું નાખીને ટેખલ ઉપર કંઈક લખી રહ્યો હતો. મારા આવવાની તેને કંઈ ખબર ન પડી. હું તેની પાસે ગયો ને જિસો રહ્યો. તેણે જાંયું જેયું, અને જણે નવાઈ પાંચો હોય એમ તથા જરાક તોછડાઈથી પૂછ્યું : ‘તમે

અહીં ? શા માટે આવ્યા છો ? '

' તમારી સાચે થોડીક વાતચીત કરવી છે. '

' પણ હું અન્યારે કામમાં છું. તમને આપેલા ધૂટનો જરૂર વધારે પડતો લાભ તમે લો છો. '

શરિઆતમાં જ આવાં વેણું સાંમળવાનાં ભજ્યાં તેથી હું જરાક નિરુત્સાહ તો થયો. પણ નક્કી કરેલી વાત તેને કર્યી સિવાય ન જરૂર એવો મારા નિશ્ચય હતો. એટલે હું બોલ્યો : ' પણ મારે એક એવી વાત કરવી છે, જે અત્યારે જ કરી જોઈએ. '

' એવું તે શું છે ? તમે દરિયામાં કાઈ નવી શોધ તો નથી કરી ? ' હું તેનો જવાબ આપું તે પહેલાં ફરી તેણે ચલાવ્યું : ' જુઓ, આ હું લખ્યું છું તે પુસ્તક છે. દરિયાના મારા અધા અનુભવો મેં આમાં લખ્યા છે. આમાં હું મારા મરણની છેલ્દી ઘડી સુધીનો. મારા ધતિહાસ અને અનુભવો લખવા માણું છું. અને મરતી વખતે મારું ખરું નામ નીચે લખ્યાને આ હસ્તકિલ્લિંગિત પ્રતને એક મજબૂત પેટીમાં અંધ કરીને આ સમુદ્રમાં ડોડી મૂકીશ; જે વાંચે તે ખરો ! અને કોઈ નહિ વાંચે તો સમુદ્ર તા તેને જરૂર સંઘરશે. '

હું વિચારમાં પડ્યો. આ ભેટી માણસને ધતિહાસ મારી સામે જ પડ્યો છે—તેને પોતાને જ હાથે લખ્યાયેલો। ત્યારે તો એક દિવસ લેદ ખૂલશે ખરો.

મેં તરત જ વાત ઉપાડી લીધી. ' કેપ્ટન સાહેબ ! હવે તમે ખરાખર મારા મતને મળતા થયા. તમારું આવું ચ્યામ્પારિંગ જીવન દુનિયા ન જણે તો એક મોટી ઝોટ આવી ગણ્યાય. પણ તમે તમારું જીવન પ્રસિદ્ધ કરવાની રીત બહુ જ વિચિત્ર રાખી છો. એવી રીતે તો પેટીને રખડતી મૂકી દેવામાં જોખમ છે, એના કરતાં તો તમારા માંથી કોઈ... '

' ના ના ! ' કેપ્ટને મને વચ્ચેથી જ અટકાવ્યો.

' તો અમારા ત્રણમાંથી કોઈને પણ તે નકલ તમે આપો

અને અમને છૂટા કરો.''

' છૂટા કરવાની વાત ?'

' હા, અને તે જ વાત કરવા માટે તમારી પાસે હું આવ્યો છું. સાત મહિનાથી અમે અહીં પુરાઈ રહ્યા છીએ. હવે અત્યારે અમે તમારી પાસેથી છૂટા થવાની રજ માગીએ છીએ. તમે રજ આપવા માગો છો કે અમને અહીં પૂરી રાખવા માગો છો ?'

' પ્રોફેસર ! સાત મહિના પહેલાં મેં તમને કહ્યું હતું, તે જ અત્યારે પણ હું તમને કહ્યું છું કે મારા વહાણમાં જેક વખત આવે છે, તે કઢી પાણો નીકળતો નથી ! '

' એટલે તેનો અર્થ શુલાભી...'

' તમારે જે કહેવું તે કહો.'

' પણ શુલાભો અમુક સુદૃતે તો છૂટા થવાનો હક્ક ધરાવે છો ?'

' તો અહીં તેથી પણ ખરાબ છે, એમ માની લો.''

' જુઓ, ડેપ્ટન સાહેબ ! હું સાચી વાત જણાવી દઈ. મને પોતાને તમારી સાથેની આ સુસાઝીમાં અન્યાર સુધી જે આનંદ આવ્યો છે, તે મારી આઠથી જિંદગીમાં કચાંધે નથી આવ્યો. તમારી જેમ હું પણ આ જ સસુદ્ધમાં જીવનપર્યાત આ અદ્ભુત દર્શયો નેતો રહ્યું એમ થાય છે. પણ તમારું જીવન અને અમારું જીવન જુદાં છે. તમારી રીતભાત એ કઢી અમારી રીતભાત થઈ શકે તેમ નથી. તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થઈએ એટલા અમે સહદ્દીય છીએ. અને મારી વાત જવા હો, તોપણ નેડ આખરે માણુસ છે; માણુસની વસ્તી સિવાય ઘડીકે રહી ન શકે એવી જતનો એ માણુસ છે. એના મનમાં જિથલપાથલ મય્યી રહી હો તેનો તમને જ્યાલ —'

ડેપ્ટન નેમો જમો થઈ ગયો. હું બોલતો બંધ થઈ ગયો.

' નેડ શું વિયારે છે ને તેના મનમાં શું થાય છે એ જગુવાની મારે જરૂર નથી, મેં તેને વહાણ ઉપર બોલાવ્યો નહોતો; તેમ મને તેની

સોઅત ગમે છે એટવા માટે મેં તેને વહાણું પર રાખ્યો પણ નથી. આથી વિશેષ હું તમને કાંઈ જવાબ આપી શકું તેમ નથી. આ વિષેની આપણી આ વાતચીત પહેલી અને છેલ્લી જ છે, એમ માની કેને. હવે હું એક પણ શરૂ સાંભળતા કે બોલવા માગતો નથી.''

કુટુંબનું હતું કે કાંઈ હતું નથી. અમારે હવે એક માર્ગ બાકી હતો અને તે નાસી છુટવાનો પ્રયત્ન કરવાનો; જીવના કે મુશ્કેલા પણ આ વહાનુભાંધી બહાર નીકળવું જ. | મેં મારા સાથીઓને આ અંતી વાત જણાવી.

‘ગમે તેવું તોઝાન હોય તોય નાસી ધૂટવું, એ વાત નક્કી.’
નેરુ પોતાનો મત જહેર કર્યો.

પણ આકાશ વધારે ને વધારે ભયંકર થતું ગયું, અને સમુદ્રને
પોતાની સાથે જ ભયંકર કરતું ગયું. આલ અને દરિયો જાણે એક
થઈ ગયાં હતાં !

૨૬

નેમોનું રૌદ્ર સ્વરૂપ

અદારમી તારીખે તો તોક્ષન તેના ખરા સ્વરૂપમાં પ્રકાશી જિઠ્યું. વરસાદ અને પવન બંને સાથે શરૂ થયાં, પહોડ જેવાં મોનંઓ જિછળી જિછળી જણે આકાશને અડવા મથતાં હતાં, આકાશ ધનવોર છવાઈ ગયું હતું.

કેપ્ટન નેમો આવા તોક્ષનમાં પણ વહાણુના તૂતક ઉપર જિભો હતો. પોતાની કેડે એક દ્વારણું બાંધીને તે દ્વારડાને છેડો તૂતકના એક દાંડા સાથે તેણે બાંધી રાખ્યો હતો. હું પણ કોઈ કોઈ વાર આ રીતે વહાણુના તૂતક ઉપર આ તોક્ષન જેવા જતો હતો. સમુદ્ર આખો જણે મોનંઓનો જ બનેલો જ હતો ! મોનંઓ ઈપ ફૂટની અડપથી જિછળતાં હતાં.

રાત્રે વળી તોક્ષનનું જેર વધ્યું. રાત્રે મેં દૂર એક સ્ટીમરના દીવાઓ જેયા. આવે વખતે આ સ્ટીમર કુદરત સાથે કેટલું યુદ્ધ કરી રહી હશે ! થાડી વારમાં તો તે દેખાતી બંધ થઈ ગઈ. કાં તો ઝૂભી અથવા તો પસાર થઈ ગઈ !

રાત્રે વીજળીના ચમકારાઓ થવા લાગ્યા; જણે આકાશમાં આગ લાગી. એ ચમકારા અલિતો કેપ્ટન નેમો તો રાત્રે પણ વહાણું ઉપરના તૂતક ઉપર જિભો હતો ! વહાણું આયું જોલે ચડતું. કોઈ માણુસ વહાણુની અંદર પણ પગ માંડીને જિભો નહોતો રહી શકતો.

રાતના આશરે બારેક વાગે કેપ્ટન નેમો વહાણુની અંદર આવ્યો. પાણીનાં ટાંકાં લરવા માંચાં; વહાણું નીચે જિતરવા લાયું. વહાણું લગભગ રૂપ વામ જિડે ગયું; ત્યાં સુધી પાણી શાંત નહોતું. તોક્ષનની આટલે જિડે સુધી અસર હતી.

પણ ત્યાં કેટલી શાંતિ હતી । ક૊ણું કહી શકે કે દરિયાની સપાઈ ઉપર તોઝાન ચાલે છે ।

આ તોઝાનને લીધે અમારું વહાણું લગભગ પૂર્વ દિશા તરફ વળી ગયું હતું. અમેરિકાના કિનારા તરફ છટકીને જવું એ હવે અશક્ય હતું. નેડને તો એમ જ થઈ ગયું કે કુદરત જ પોતાની વિરુદ્ધ છે. અધૂરામાં પૂરું તોઝાનની સાથે જ ધૂમસ પણ આપે. દિવસ રહેતું. સાધારણું વહાણું કદાચ તોઝાન સાથે ટક્કર બીજે, પણ આ ધૂમસની સામે તેનું કાંઈ ચાલી શકતું નથી. કેટલાંયે વહાણું આ ધૂમસની અંદર સામસામા અથડાઈને કે ડેઈ ખડક સાથે અથડાઈને દરિયાને તળિયે બેસી ગયાં હશે !

નેતનેતામાં અમારું વહાણું ન્યુશાઉન્ડલેન્ડના દક્ષિણ કિનારાને અડયું ન અડયું અને સીધું પૂર્વમાં આયર્લ્યન્ડના દક્ષિણ કિનારાથી લગભગ ૧૨૦ માર્ટિલ દૂર નેટલે આવી ગયું.

આ વહાણું તે કચાં જતું હશે ? ઈંગ્લાંડ તથા ફ્રાંસનાં પણ અમને દર્શન કરાવવાનો આનો વિચાર નથી શું ? અમને એ અમારા વહાલા કિનારાઓ બતાવીને વધારે સત્તાવવાનો તો અનો વિચાર નથી શું ? પણ અહીંથી વહાણું પાછું દક્ષિણ દિશામાં જીતરવા લાગ્યું.

૩૧મી મેનો આપો દિવસ નોટિલસે ભમવામાં જ પસાર કર્યો. જણે દરિયામાં ડેઈ બોવાયેલી વસ્તુ હોય એમ દરિયાની અંદર તે આંટા મારતું હતું.

બીજે દિવસે સવારે એકાઓક વહાણું ઇયક્ષી મારી. વહાણું લગભગ ૪૧૮ વામે અટક્યું. દીવાનખાનાની બારીઓ બોલી નાખવામાં આવી. વીજળાને પ્રકાશ પાણીમાં છોડવામાં આવ્યો. મેં પાણીમાં શું જોયું ? એક મોટા વહાણનું હાડપિંજર । તેના ઉપર ટેરફેર નાનાંમોટાં શંખાંચ્ચા ચોંટી ગયેલાં હતાં. કેટને મારી પાસે આવીને આ વહાણું બતાવ્યું. ‘આજથી ૭૪ વર્ષ પહેલાં માલથી ભરેલું આ હેંચ વહાણું

અંગ્રેજેની સામેની લડાઈમાં હારવાની આણી ઉપર હતું ત્યારે તાખે થવાને બદલે રાજ્યભૂષિથી પોતાના ઉપર ખલાસીએની સાથે જ આ જગતાએ રૂખી ગણું હતું. તે જ આ વહાણું !

‘આહો ! ત્યારે તો આ પેલું વેન્જિયર હશે ?’ હું બોલી જિઠચો.

‘હા, એ વેન્જિયર ! એ જ અમર વહાણું !’ કેટન ધીમેથા બોલ્યો. અને કેટલીયે વાર સુધી એ છિન્નબિન્ન થઈ ગયેલા વહાણું તરફ મીટ માંડીને જોઈ રહ્યો. હું પણ આ લેટી માણુસની સામે કેટલીય વાર સુધી તાકી રહ્યો. આ માણુસ ઇકત શોખને ખાતર જ આવું વહાણું લઈને નથી નીકળી પડ્યો; પણ તેની પાછળ ડોઈ અજ્ઞાન ધતિહાસ હોવો જોઈએ, એમ મને વધારે દફતાથી લાગવા માંડયું. દુનિયાની જીત પામતી જતી પ્રભા તરફનો તનો તિરસ્કાર, અને હારેલી પ્રભા તરફનો પક્ષપાત ચોખ્યો હેખાઈ આવતો હતો.

દરમિયાન અમારું વહાણું પાછું દરિયાની સપાઠી ઉપર આવી પહોંચ્યું. થોડીક જ પણમાં ભારા કાન ઉપર એક મોટા ધડાકાનો અવાજ આવ્યો. હું ચ્યમક્યો. મેં કેટન સામે જોયું; તે કંઈ ન બોલ્યો. મેં પૂછ્યું : ‘કેટન સાહેં !’
પણ જવાબ ન મળ્યો.

હું તરત જ વહાણુના તૂટક ઉપર પહોંચ્યો. ત્યાં નેડ જમો હતો. મેં પૂછ્યું : ‘નેડ ! શાનો ધડાકો થયો ?’

‘તોપનો.’

‘કચાંથી ?’

‘જુઓ, સામે દૂર વહાણું હેખાય છે ત્યાંથી. તે ડોઈ લશકરી વહાણું હેખાય છે. થોડા જ વખતમાં આ વહાણું ઉપર હવ્યો કરી આને તે તોડી પાડશો.’

‘અરે ! આ વહાણું તે તૂટતું હશે ?’ મેં કહ્યું. ‘એ તો ધડીક વારમાં દરિયાને તળિયે જઈને બેસશો. ત્યાં એની પાછળ કંઈ પેલું વહાણું એણું જ આવવાનું છે ?’

તે વહાણું કયા દેશનું હતું એ ઓળખી નહોતું શકાતું; પણ ધીમે ધીમે તે પાસે આવતું જતું હતું. તેની નજરે અમારું વહાણું પડ્યું હતું એ વાત તો ચોક્કસ. પણ આ વહાણું છે, એની એને ખખર છે કે ડેમ તે કહી શકાય તેમ નહોતું. જે આ વહાણું પાસે આવે એને કોઈન નેમાને તેની ખખર ન રહે તો અમારે નાસી શ્રદ્ધાવાની એક સરસ તક મળી જય એવું હતું!

‘જે એક માર્છલનું અંતર એ વહાણું એને આપણી વચ્ચે રહે તો હું તો કૂદીને તરતો તરતો ત્યાં પહોંચી જવાનો! તમારે પણ તેમ જ કરવું?’ નેરે કહ્યું.

હું વહાણું તરફ જેતો જેબો જ હતો. થાડી જ વારમાં હુમાડાના ગોટા હેખાયા એને અમારી નજીકના પાણીમાં કંઈ ભારે પદ્ધાર્થ પડ્યો એને સાથે જ મેટા ધડકો થયો.

‘અરે! આ લોકો તો આપણી સામે જ તોચો ઝડપે છે!’

‘હા, પણ તેના મનમાં એમ હશે કે આ ડાઈ માટું વહેલ કે એવું પ્રાણી છે.’ કોણ્ણીલે કહ્યું.

‘ના ના, મને તો તેમાં શંકા છે. મને તો એમ લાગે છે કે અખાહમ લિંકને અમેરિકા પાણ જઈને લોકોને ખખર આપ્યા હશે કે એ ડાઈ દરિયાઈ પ્રાણી નથી પણ વહાણું છે. એને હવે તો એ વહાણુનો નાશ કરવા માટે આવાં વહાણો ડેટલાંયે લટકતાં હશે,’ મેં કહ્યું.

‘કોઈન નેમો હવે શું કરશે?’

મારા મનમાં એક લયંકર શંકા આવી ને પસાર થઈ ગઈ. ‘પેલા વહાણુને કોઈન નેમો જીવતું નહિ રહેવા હૈ! ’

દરમિયાન અમારા વહાણુની આસપાસ તોપના ગોળાનો વરસાદ વરસતો હતો. એક પણ ગોળા હજુ નોટિલસને અડ્યો નહોતો. ને વહાણું લગભગ ત્રણુંક માર્છિન દૂર હશે. કોઈન નેમો વહાણું આટલું જેખમમાં હોવા છતાં હજુ ઉપર નહોતો આવ્યો, તેમ વહાણુને

પાણીની નીચે પણ લઈ નહોતો જતો. ને એકાદ તોપનો ગોળા બરાબર વહાણું ઉપર આવ્યો, તો વહાણુનો ભુક્કો બોલી જય એમાં મને શંકા નહોતી,

નેડે મને કહ્યું : ‘પ્રોફેસર સાહેબ ! મને લાગે છે કે આપણે એ વહાણુને નિશાનીથી એમ સમજવીએ કે અમે શત્રુ નથી, મિત્ર છીએ. કેમ ?’

પણ હું જવાબ આપું તે પહેલાં તેણું જિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને હાથ ભાંચો કરી ઝ્રિડાવવાની તૈયારી કરે છે, ત્યાં તો પાણીથી વજ નેવો હાથ તેના ઉપર પડ્યો. આ હાથના આંચકાથી તેમ જ ખીંચ્યો નેડ પડી ગયો।

‘હુણ !’ કેપ્ટન બખડ્યો, ‘તારે વગર મોતે ભરવાનો વિચાર લાગે છે, કેમ ?’

કેપ્ટન નેમોનો આ અવાજ કેટલો ભયંકર હતો તેથી વધારે ભયંકર તેનો આ વખતનો સીનો હતો. તેનો ચહેરો ખૂબ કિંકો લાગતો હતો. તેનો અવાજ અત્યારે ગાજતો હતો. પ્રજ્ઞતા નેડને તેણું જરા વાંકો વાળાને હયમયાવી નાખ્યો.

પણ તરત જ તેને એક બાજુ મૂક્ખને પેલા દૂર દેખાતા વહાણું તરફ તે કહ્યો : ‘એ કમલાગી પ્રભના વહાણું । તું જાણો છે હું કોણ છું ? મારે તેને ઓળખવાની જરૂર નથી. તારે મને ઓળખવો હોય તો જો આ નિશાની !’ એમ કહીને પોતાનો કાળો વાવટો હવામાં ફરકાવ્યો. આ જ વાવટો તેણું દક્ષિણ ધ્રુવ પર પણ ફરકાવ્યો હતો.

એ જ ઘડીએ એક ખીલે ગોળા બરાબર વહાણુની નજીક આવીને પાણીમાં પડ્યો.

‘નીચે જાઓ !’ કેપ્ટન નેમોએ પોતાના ખાસ સહેજ હુલાવ્યા. ‘તમે ત્રણેથ જણ્ણા નીચે જાઓ !’

‘કેમ, પેલા વડાણું ઉપર તમે હદ્દેલા કરવાના ણો ?’ મેં પૂછ્યું.

‘હા, હું તેને ફૂલાડી દેવાનો છું :’

‘તેમ ન કરતા.’ મેં કહ્યું.

‘હું એમ જ કરીશ! મને સલાહ આપવાની જવાબદારી તમારા ઉપર ન રાખો. યુદ્ધ શર થઈ ગયું છે; સામા પણે જ શર કર્યું છે. તેથા તેનો જવાબ તેને બહુ લખાંકર મળશે. તમે નીચે જાઓ।’

‘આ વહાણુ કયા દેખનું છે?’

‘તમને ખખર નથી? બહુ ટીક થયું. તમારે જાણવાની જરૂર પણું નથી. એટલી વાત પણ તમારાથી છાતી રહી તે ટીક થયું. હવે નીચે ચાલ્યા જાઓ.’

અમારે નીચે ગયા સિવાય છુટકો નહોતો.

અમારે નીચે ગયા સિવાય છુટકો નહોતો.

અમારે નીચે ગયા સિવાય છુટકો નહોતો.

૨૭

વમળમાં

અમે નીચે ગયા. તૂતક ઉપર લગભગ ૧૫ માણસો કેપ્ટનને
વીટાઈને જલા હતા. બધાનાં મુખ ઉપર તે વહાણુ ઉપરનો વેરનો
ભાવ હેખાતો હતો. જતાં જતાં નીચેના શબ્દો મારા કાન પર પડ્યાઃ
' લગાવ, એ મૂર્ખ વહાણુ ! હજુ વધારે તોપના ગોળા લગાવ. મારે
તો ફક્ત એક જ હલ્લો કરવાની જરૂર છે. પણ હું તને અહીં નહિ
કુલ્યાદું. તારી કણર પેલા વેન્જિયરની સાથે ન જ હોય।'

હું મારા આરડામાં ગયો. વહાણુનો પંચા ચાલુ થયો અને
ઘડી વારમાં તો પેલા વહાણુને કચાંથ છેદું પાડી દીધું.

સાંજના ચાર વાગ્યા હતા. મારી ધીરજ ન રહી શકી. હું પાછો
વહાણુના તૂતક ઉપર પહોંચી ગયો. ત્યાં કેપ્ટન પીઠ પાછળ હાથ
રાખીને આવેશમાં ને આવેશમાં ફરતો હતો. મને જેયો કે તરત
જ તે બ્યાલી જિડ્યો : ' હું હજુ અને ન્યાય માટે લડનારો છું. હું
ગુલામ પ્રજનો પ્રતિનિધિ છું, અને પેલું વહાણુ ગુલામ બનાવનાર
પ્રજનું પ્રતિનિધિ છે. તે સિતમગારને લાઘે મેં બધું ખાયું છે.
મારો દેશ, મારું કુટુંબ, મારાં વહાલાં છાકરાં, માતા, પિતા, સ્ત્રી,
ને ને મને વહાલું હતું તે બધું જ. મારું બધું નાશ પામ્યું તે
અને જ લાઘે છે ! દુનિયામાં હું એને જ વિકારું છું ! '

પેલું વહાણુ પૂર જેસમાં અમારા વહાણુ તરફ આવતું હતું. હું
નીચે જિતરી ગયો. પેલું વહાણુ જેમ જેમ નજીક આવતું હતું, તેમ
તેમ તેતું મેત નજીક આવતું હતું એમ હું જેઈ શકતો હતો.
પણ એને કઈ રીતે જણાવવું કે અહીં આવવામાં જવતું જોખમ છે ?

રાત પડી. કેપ્ટન હજુ વહાણુના તૂતક ઉપર જ હતો. પેલું વહાણુ

પણ એ માઈલને અંતરે દેખાતું હતું. આકાશમાં અને સમુદ્ર ઉપર કૃટલી શાંતિ હતી અને આ ભયંકર માણુસના મોઢા પર ડેવાં તોકાનનાં ચિહ્નો હતાં! સમુદ્રના તોકાન કરતાં યે આ તોકાન મને ભયંકર લાગતું હતું.

મને થયું : ક્રાઈ પણ રિતે આ વહાણુમાંથી અત્યારે નાસી છૂટયું જેઠાં. આ વહાણુનો કૂર વિનાશ મારાથી નહિ હેઠ્યો જય!

નેડ તથા ક્રાન્સીલને પણ મેં વાત કરી. ‘દરિયામાં ઝૂઢી પડીને પણ નાસી છૂટયું. ભલે આપણે પકડાઈ જઈએ ને મોત આવે તોયે વાંધો નથી। મોત તો આ સમુદ્રમાં પડીને કિનારે પહોંચયશું ત્યાં સુધીમાં નહિ આવે તેની શી ખાતરી?’

અમે તૈયાર થઈ ગયા. અમારામાં અજળ હિંમત આવી ગઈ હતી. વહાણુની વચ્ચેના લાગમાં ને દાદર હતો, તે દાદર ઉપર થઈને અમે વહાણુના ત્રૂતક ઉપર ચડવાની તૈયારી કરતા હતા ત્યાં ઉપરનું બારણું દેવાઈ ગયું અને વહાણું થોડી વારમાં તો અંદર જિતરવા લાગ્યું.

અમે નિરાશ થઈ ગયા. કાંઈ નહિ થઈ શકે. નોટિલસ પેલા વહાણુને નીચેથા જ તોડી નાખશે! મારા વિચારો જ્ઞાને થંભી ગયા. હું એક ભયંકર આંચકાની જ વાટ જેતો હતો.

વહાણું ખૂબ જેરથી ચાલતું હતું. એકાએક વહાણુને એક નાનો અવો આંચકા લાગ્યો. મારાથી ખૂબ પડાઈ ગઈ. એક અવાજ પાણી સૌંસરો થઈને અમારા વહાણુમાં સંભળાયો. હું દોડતો દોડતો પેલા દીવાનખાનામાં પહોંચી ગયો. દીવાનખાનાની બાજુની બારી ખુલ્લી હતી. કેપ્ટન નેમો ત્યાં જિબો હતો.

મેં એ બારીમાંથી શું જેયું? પેલું મોટું વહાણ ધીમે ધીમે નીચે જિતરતું હતું. અમારું વહાણ પણ તેની સાથે સાથે જ નીચે જિતરતું હતું. પેલા વહાણુને તળિયે પડેલા કાણુમાંથી પાણી ધોધમાર વહાણમાં ભરાતું હતું. માણુસો આમથી તેમ તરફદિયાં મારતા હતા. ક્રાઈ પાટિયાને, ક્રાઈક વહાણુના મોટા સઠના થાંખલાને, કે ને કાંઈ હાથ આવ્યું તેને વળગી પડતા હતા. ક્રાઈ પરસપર એકમીજને

વળણી પડતા હતા. તેમનાં મોઢાં પર કેટલી વેદના જણુંતી હતી !

મારા રોમાંચ ખડા થઈ ગયા. સ્તળબ્ધ ચિત્તે અને સિથર દસ્તિએ હું એ જોઈ રહ્યો ! વહાણું તળિયે બેહું. કેઠ સઢની ટાચે ચેલા માણુસો પણ હવે વહાણુની સાથે દૂષ્યા; કોઈ ન બચ્યું. થાડી વારમાં બધું તળિયે અદશ્ય થઈ ગયું !

હું કેપ્ટન નેમો તરફ ફર્યો. તેની નજર હજુ પાણી તરફ જ હતી. થાડી વારે પછી તે પોતાની આરડીમાં ગયો. હું પણ તેની પાછળ થાડે સુધી ગયો.

આરડીને છેડે ભાંતને અઢેલીને એક છણી પડી હતી. તેમાં એક જુવાન લ્લી ને બેનાં બાળકો હતાં. કેપ્ટન નેમો તે ચિત્રની પાસે ઘૂંઠણું પડીને પોતાના હાથ લંબાવીને દ્વુસકે દ્વુસકે રોતો હતો.

હું એ દશ્ય વધારે વખત જોઈ ન શક્યો !

અમારું વહાણ પાણું આગળ વધ્યું પણ હવે વહાણ કલાકના ૨૫ માર્ટલની ઝડપે ઉત્તર તરફ હોડતું જતું હતું. પાણુની સપાઠીથી લગભગ ૩૦ ફૂટ તે નીચે જ રહેતું; કોઈક જ વાર તે હવા લેવા ઉપર આવતું.

ફૌન્સ અને ઈંગ્લાંડ વર્ચેની ખાડી અમે પસાર કરી ગયા એ હું નકથા ઉપરથી જોઈ શક્યો. ત્યાંથી અમે ક્યાં જશું એની મને કલ્પના નહોતી આવતી. કેપ્ટન નેમોના મગજની જેવી જ અમારા વહાણુની દિશા અચોક્સ હતી !

પંદર-વીશ દિવસ આ પ્રમાણે પસાર થઈ ગયા. આ દિવસો દરમિયાન વહાણુનો એક માણુસ, કે કેપ્ટન નેમો સુધ્યાં અમારી નજરે નહોતો પડ્યો.

એક દિવસે - મને તારીખ યાદ નથી - હું અરધી ભાંધમાં મારી પથારીમાં પડ્યો હતો ત્યાં નેરે મને જગાડ્યો, અને મારા કાનમાં કહ્યું : 'આજે આપણે નાસી છૂટવાનું છે.'

'કચારે ?'

'રાત્રે. વહાણ ઉપર હમણું કોઈ ધ્યાન આપનાર હેખાતું'

નથી. તમે તૈયાર છો ને?'

' હા. પણ આપણે કઈ જગ્યાએ છીએ?'

' એ ખબર નથી. પણ અહીંથી વિશ માઈક જમીન હેખાય છે.'

' એ જમીન કચાંની છે?'

' તે ડાને ખબર! આપણે એતું કામ પણ શું છે?'

' ભલે; આજ રાત્રે અહીંથી નાસી છૂટવું એ ચોક્કસ! બહાર પછી રૂભીએ કે તરીએ.'

' દરિયો તોઝાની છે. પવન પણ ખૂબું છે; પણ આ વહાણુંની મજબૂત હોડીમાં ૨૦ માઈક કાપવા એટલે કંઈ નથી. વળી મેં એ હોડીમાં ખાનગી રીતે થોડું ક મીઠું પાણી અને ખાવાનાં સાધનો મૂકી રાય્યાં છે.'

' બસ, હું તૈયાર છું.' મેં ઉત્સાહથી કહ્યું, ' અને જો હું પકડાઈ જઈશ તો મરી જઈશ એ કખૂલ, પણ તાબે નહિ જ થાઉં.'

' આપણે બધાય સાથે મરશું.'

' મેં મનથી નિશ્ચય કરી જ લીધો હતો. હું બિડ્યો. વહાણુના ઉપરના ભાગ ઉપર ગયો, પણ ત્યાં દરિયાનાં ભયંકર મોઝાં આગળ જિલા રહી શકાય તેમ નહોતું. આવા તોઝાનમાં નાસી છૂટવું એમાં છેટલું જેખમ છે, તેને મને તે વખતે વિચાર જ ન આવ્યો. હું ત્યાંથી જિતરીને દીવાનખાનામાં ગયો, મારી છંચા કેપ્ટન નેમોને મળવાની યે હતી. તેની સામે, તેના ભયંકર ચહેરા સામે હું સ્વસ્થ રીતે જિલો રહી શકીશ? ના ના, તેને મોઢમોઢ તો ન જ મળવું. તેને હું ભૂલી જઈશ. પણ...'

આજના જેવો લાંબો દિવસ મને અત્યાર સુધીમાં એક્ષેય નહોતો લાગ્યો. હું એકદો જ હતો. શાંકા પડે એ ખીડે અમે ત્રણું જણ્ણા તે દિવસે એકઢા જ થયા નહિ.

પાછા સાંજે સાડા છ વાગે નેડ મારી ઓરડીમાં આવ્યો. તેણે કહ્યું: ' હવે આપણે ઠેડ અહીંથી નીકળવાના સમય સુધી મળશું'

નહિ. દસ વાગે હોડી રાખવાની જરૂરાએ આવી પડોયને.' ને ચાદ્યો ગયો. તે મારા જરૂરાની રાહ જેવા પણ જેબો ન રહ્યો.

મેં દીવાનખાનામાં જઈને જેયું તો અમારું વહાણું નૈતર્ય દિશામાં દરિયાની સપાઠીથી ૨૫ વામનીયે ખૂબ ઝડપથી હોડી રહ્યું હતું.

મેં દીવાનખાનામાં સંગ્રહસ્થાન તરફ એક નજીર નાખી - છેલ્લી નજીર નાખી. દુનિયાની આ અમૃત્ય સમૃદ્ધિ આમ ને આમ સમુદ્રને તળિયે દટાઈ જશે, એ વિચારે મને કંપારી છૂટી. એક કલાક સુધી હું દીવાનખાનામાં બધું જેતો ફર્યો. પછી હું મારી ઓરડીમાં ગયો.

મેં મારો દરિયામાં પહેરવાનો પોશાક ચાઢ્યો, અને મારી નાંધીનાં કાગળિયાંતું બંદ્લ બાંધીને તૈયાર કર્યું. મારું હુદ્દ્ય જેરથી ધર્યકર્તું હતું; તેને ધર્યકર્તું હું અટકાની શકું તેમજ નહેતું. આવી સ્થિતિમાં કેપ્ટન નેમેને તે કઈ રીતે હું મળી શકું?

કેપ્ટન અત્યારે શું કરતો હશે? મેં તેની ઓરડી પાસે જઈને કાન માંડ્યા. અંદર ભારે પગદાંનો અનાજ આવનો હતો. 'હજુ જાગતો લાગે છે! અમે લાગવાના ધીયે એની શંકા પડવાથી તે તે નહિ જાગતો હોય?'

તેની ઓરડીમાં જઈને તેને મળવું જ જોઈએ! મારા મગજમાંથી એક વિચાર ઝડપલેર પસાર થયો. ના ના; એ તો આવેશ જ છે. એમ તે થાય?

હું થાકી ગયો. પથારીમાં સુતો. સૂતા પછી જરાએક શાંતિ વળી. પણ મારા મગજમાં તો શાનતંતુંએ જાણે તૂટી જશે એમ લાગતું હતું. મારી નજીર સમક્ષ વહાણુંની મારી સુસાદીનો ધતિ-હાસ ખડો થઈ ગયો. વહાણું ઉપરના એકેએક અનાવની સાથે કેપ્ટન નેમે મારી નજીર આગળ ખડો થતો. ધીમે ધીમે તે મને ખૂબ મોટો લાગવા માંડ્યો. તે હવે માણુસ કરતાં પણ દરિયાનો ડોંડ મહાન સાણાટ હોય તેવો મને લાગવા માંડ્યો.

સાડા નવ થયા. મારું માથું હમણું જાણે ફાટી જશે એમ

લાગ્યું. એ હાથ વરચે તેને પકડીને હું તે પથારીમાં દાખીને પડ્યો હતો. હવે વિચાર ન કરવા એમ નક્કી કર્યું. અરધો કલાક જ બાકી છે; હવે જે અરધો કલાક હું વિચારે ચરીશ, તે ગાંડા જ થઈ જઈશ !

એ જ ઘડીએ મારે કાને દૂર દૂરથી આવતા ઓર્ગનના સુર પડ્યો. કેટલા કરુણ તે સુરો હતા ! દુનિયામાંથી શ્રી જ્ઞા મથતા ડાઈ આત્માની વેદનાની જણે ચીસો હોય !

ઘડીભર આ સુરોએ મને દુનિયા લુલાની દીધો.

તરત જ એક વિચારે હું ગભરાઈ જિડ્યો. કેપ્ટન નેમો અત્યારે આ દીવાનખાનામાં આ ઓર્ગન વગાડતો હતો. વહાણું ઉપર બાંધેલી હોડી ઉપર જવાનો મારો માર્ગ આ દીવાનખાનામાં થઈને જતો હતો. હવે શું કર્યું ? તે મને જેણો, મને કદાચ પૂછશો, અને જે તેને ખખર પડી ગઈ તો ?...

દસ વાગવાની તૈયારી હતી. મારે જવું જ જોઈએ. હું જિડ્યો. મેં બારણું ઉધાડ્યું. અહું જ કાળજીથી ઉધાડ્યું, જ્તાં જણે મોટા ધડકા થયો હોય એમ મને લાગ્યું. એ કલ્પનાનું ભૂત જ હતું. હું એસરીમાં ચાલીને દીવાનખાના પાસે આવી પહોંચ્યો. દીવાનખાનામાં અંધારું હતું. કેપ્ટન નેમો હજુ અંધારામાં ઓર્ગન વગાડતો હતો. તે મને જોઈ ન શક્યો. તે એટલો બધો તલ્લીન હતો. કે કદાચ એરડામાં અજવાણું હોત તોયે મને હેખત નહિ !

હું બિલાડીની જેમ પગલાં મૂકતો મૂકતો દીવાનખાનું પસાર કરી ગયો. પસાર કરતાં લગભગ મને પાંચ મિનિટ લાગી. દીવાનખાનાનું સામેનું બારણું મેં ઉધાડ્યુંત્યાં પાછળ મેં કેપ્ટન નેમોને નિઃશ્વાસ સાંભળ્યો. હું થંલી ગયો. હું સમજ ગયો કે તે ઉમ્મે થતો હતો. મેં તેને જેણો : કારણું પડેણા પુસ્તકાલયના એરડામાંથી થાડોક પ્રકાશ અંદર આવતો હતો. તે અદ્ય વાળાને ધીમે પગલે મારા તરફ જ આવતો હતો. તે પોતે જ આવતો હતો. કે તેવું

ભૂત ? તેનાં દૂસરાં મારા કાન ઉપર પડ્યાં : ‘આ પ્રભુ ! બસ, હવે બહુ થયું; બહુ થયું !’

હું મરણિયો થઈને પુસ્તકાલયમાં પેસી ગયો. ત્યાથી સીડી ઉપર થઈને પેલી હોડી બાંધવાના પાંજરામાં જવાનો માર્ગ આગળથી મારા સાથી આએ ખોલી રાખ્યો હતો.

‘ચાલો, જલદી કરો !’ હું ખોલી શક્યો.

‘તૈયાર છીએ.’ નેડ કહ્યું.

હોડીના પાંજરામાં જવાનો દરવાને બંધ કરી દીધે અને હોડીને પાંજરામાંથી બડાર કાઢવાનો માર્ગ, તેના પેચ ખોલીને ખોલી નાખવામાં આવ્યો. નેડ હોડીને છોડવા માંડ્યો ત્યાં અંદરના ભાગમાંથી કંઈક બોંઘાટ થતો અમારા કાન ઉપર પડ્યો.

‘બસ ! ખબર પડી ગઈ !’

નેડ અંધારામાં મારા હાથમાં અંજર મૂક્યું, ને હોડી છોડવાનું કામ બંધ કર્યું.

‘માલસ્ટ્રોમ ! માલસ્ટ્રોમ !’* અંદરથી ભૂમે આવી.

હવે ? અમારી હોડી જે વખત છૂટવાની તૈયારીમાં હતી તે જ ઘડીએ આ વહાણું આ વમળમાં પેડું ! કેપ્ટન નેમોએ જાણી નેઈને કે અન્નાણુતાં પણ પોતાના વહાણુને આ સમૃદ્ધની નાલિ ગણ્યાતા ભાગમાં નાખ્યું, આખું વહાણું ગોળ ચક્કર ફરતું હતું. મને ફેર ચડવા લાગ્યા.

વહાણું એ વમળમાંથી છૂટવા માટે કંઈ ઓછો પ્રયત્ન નહોતું કરતું. વહાણુના સંધેસાંધા આ યુદ્ધમાં ઢીલા થવા લાગ્યા હતા.

‘હવે આ વમળમાંથી વહાણું બહાર ન નીકળે ત્યાં સુધી આ હોડીને છોડવી એમાં જવનું જોખમ છે. આપણે હવે હોડીને હમણું છોડવી

*માલસ્ટ્રોમ એટલે વમળ. નેર્વના કિનારા આગળ દરિયામાં લયંકર વમળો થડે છે. દરિયામાં આ જગ્યા વહાણો માટે સૌથી ખરાખ ગણ્યાય છે. આ વમળમાંથી વહાણું લાગ્યે જ બચે છે.

૦૮ નહિ.' નેડે કહ્યું.

'કદાચ હવે તો આ વહાણુને વળગી રહેવામાં જ...' વાક્ય
પૂરું થાય તે પહેલાં તો એક કડકો થયો અને હોડીના વહાણ સાથે
જરૂરાં સ્કૂલ તૂટી ગયા.

ધતુષ્યમાંથી છુટેલા તીરની જેમ અમારી હોડી એ વમણમાં
થઈને છૂટી. આંચેકો એટલા જેરથી લાગ્યો કે મારું માથું હોડીના
પતરા સાથે જેરથી અથડાયું. હું બેલાન થઈ ગયો.

અને એટલા જેરથી લાગ્યો કે મારું માથું હોડીના
પતરા સાથે જેરથી અથડાયું. હું બેલાન થઈ ગયો.

અને એટલા જેરથી લાગ્યો કે મારું માથું હોડીના
પતરા સાથે જેરથી અથડાયું. હું બેલાન થઈ ગયો.

* * *

અને એટલા જેરથી લાગ્યો કે મારું માથું હોડીના
પતરા સાથે જેરથી અથડાયું. હું બેલાન થઈ ગયો.

અને એટલા જેરથી લાગ્યો કે મારું માથું હોડીના
પતરા સાથે જેરથી અથડાયું. હું બેલાન થઈ ગયો.

૨૮

અમારી આ વિચિત્ર સુસાક્ષરી પૂરી થઈ. રાત્રે શું બન્યું
તેની મને કશી ખખર નથી. અમે એ વમળમાંથી કહી રીતે નીકળ્યા
તેની હજુ પણ મને ખખર નથી પડી. જ્યારે હું ભાનમાં આવ્યો,
ત્યારે એક માધીમારના ઝુંપડામાં સ્કોતો હતો. મારા બંને ભિત્રો
મારા હાથપગ દાખના હતા. હું તેમને બેઠી પડ્યો.

અમે લોઈડાનના એટો ઉપર હતા. ફાન્સ જવા માટે મહિનામાં
એ વાર એક સ્ટીમર અહીંથી પસાર થાય છે. તે સ્ટીમર આવે
ત્યાં સુધી અમારે રોકાવું પડ્યું.

*

*

*


મારી વાત પણ હું અહીં પૂરી કરું છું. આ વાર્તા આખી
સાચી છે. હું એક પણ વાત અંદરથી ભૂલી નથી ગયો; તેમ મેં
એક બનાવ છોડી પણ નથી દીધ્યો. સમુદ્રના ગર્ભમાં રહેતી અપાર
સમૃદ્ધિનો એક ભાગ જે મેં જેયો, તેનું આ આપું વર્ણન છે.

મને કદાચ તમે સાચો નહિ માનો. શી ખખર! અને ન માનો
તો કંઈ નહિ; પણ એટલું તો હું કહું છું કે લગભગ હસ મહિનામાં
સમુદ્રની અંદર ₹૦,૦૦૦ માર્ઘલ સુધી હું ફર્યો છું, એટલે મને તે
વિષે બોલવાનો તો પૂરો અધિકાર છે.

પણ નોટિલસનું શું થયું એમ કદાચ તમે પૂછશો. તે પેલા
વમળમાં નાશ પાયું? કોપ્ટન નેમો હજુ જીવતો હશે? કોપ્ટન નેમોની
પોતાની લખેલી ‘આત્મકથા’ દુનિયામાં ઢોર્ને હાથ લાગશે? કોપ્ટન
નેમો કયા દેશનો હતો એની કંઈ ખખર પડશે? મને આશા છે કે
મળશે. મને તો એમ પણ આશા છે કે કોપ્ટન નેમો આ વમળમાંથી

પોતાના વહાણને બચાવીને હજુ દરિયાને અગાધ તળિયે ધૂમતો હશે,
 અને વિશાળ સાગર ઉપર પોતાનું અખંડ સામ્રાજ્ય લોગવતો હશે.
 તે જેટલો અગમ્ય-રહસ્યપૂર્ણ છે, એટલો જ તે ભવ્ય છે; તે જેટલો
 કૂર છે, એટલો જ તે સુકોમળ છે : મહાસાગરનો જણે ડોઈ ભવ્ય
 સંમ્રાટ !

● ●





અમારું અભિનવ બાલસાહિત્ય

શૂદ્રમજીવ પરિચયમાળા

લે. બાળભાઈ અવરાહુ

આવી સરળ, રુચિકર અને સચિવ આ શ્રેણી તૈયાર કરવામાં આવી છે. રસિક વિદ્યાર્થીઓને તે ગમશે અને તેમને પ્રોત્સાહને, જ્ઞાનવૃક્ષદાયક અને સ્વયંશિક્ષણ તરફ લઈ જવા પ્રેરશે એવા અદ્ધા છે. દસ પુસ્તિકાઓ, સેટનું મૂલ્ય રૂ. ૧૫-૦૦

શરીર પાચયમાળા

લે. બાળભાઈ અવરાહુ

બાળક પ્રથમથી જ આસપાસની સમગ્ર જ્ઞાનિનાં અંગઉપાંગોને વૈજ્ઞાનિક દ્વારા જેતાં, જાણુતાં અને માણુતાં શીખે અને તેનામાં સહજ રીતે જ્ઞાનવૃક્ષ થતી રહે તે આવશ્યક છે. તેથી આવી સરળ રુચિકર અને સચિવ આ શ્રેણી તૈયાર કરવામાં આવી છે. ૧૦ પુસ્તિકાનો સેટ. મૂલ્ય રૂ. ૧૫-૦૦

ખગોળ પરિચયમાળા

લે. બાળભાઈ અવરાહુ

જ્ઞાનના વિસ્તરેસ્ટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. સાથે કદમ્બ મિલાલવા માટે શાળાના અભ્યાસકુભમાં પણ વિજ્ઞાનને આગામું અને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. સેટનું મૂલ્ય ૧૫-૦૦

કુલ પરાગ ચંચમાળા

લે. હરીશ નાયક

કુલપરાગ એટલે કુલોની સુગંધ. કુલોની સુગંધ ડાને નથી ગમતી ? આપણે માણુસે તો ઠીક પણું નાનકડાં પંખીડાંઓ પણ કુલ-પરાગ મેળવીને મીઠાં ગાં ગાઈ જેઠે છે. સેટનું મૂલ્ય ૧૦-૦૦

શ્રી રમણુલાલ સેનાની

પ્રસ્તુત કરે છે ભૂલકાંઓમાં સાહસ, શૌર્ય, બુદ્ધિ-યાત્રી અને યારિય પ્રેરતી વિકાસલક્ષી મનોરંજનથી ભરપૂર વાર્તાઓની નવી શ્રેણીઓ.

સુમંગલ બાળવાર્તાવલિ

પુ. ૧ થી ૧૦ રૂ. ૧૨-૫૦

યોગેદાય બાળવાર્તાવલિ

પુ. ૧ થી ૧૦ રૂ. ૧૨-૫૦

ચિત્તરંજન બાળવાર્તાવલિ

પુ. ૧ થી ૧૦ રૂ. ૧૨-૫૦

શિશુવિકાસ બાળવાર્તાવલિ

પુ. ૧ થી ૧૦ રૂ. ૧૫-૦૦

આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મુખ્યાંક ૪૦૦૦૦૨ : અમદાવાદ ૩૮૦૦૦૧



1dollarscan.com (zLibro, Inc.)
1723 Rogers Avenue Suite G,
San Jose CA 95112

I agree with the following things:

- 1) I am using 1dollarscan.com services based on my own request.
- 2) I agree to Terms and Conditions at 1dollarscan.com, <http://1dollarscan.com/terms.php> and my use of 1dollarscan's services will be within the scope of the Fair Use Policy (<http://www.copyright.gov/fls/fl102.html>). Otherwise, meet at least one of the following;
 - a) I am the copyright holder of this content.
 - b) I have the permission from copyright owner.
- 3) I understand that 1dollarscan shall have no liability to me or any third party with respect to their services.

NAME : Rajesh Mashruwala

Signature:

Date: 2 March 2019

This sheet should be inserted at the last page of each file generated by 1dollarscan.com scanning services.